

11584

9 JUN 1974

૧-૨

11584  
સિદ્ધ, અષ્ટાવીર્ણ, અસ્તેચી, અસ્તેચી  
એવી વિનિરોગ કરે નિયમ  
નિયાગિય જણો. પૂર્વસુદેશનાં કાગિયાં  
પૂર્વસુદેશ વાળો એવી જાણ  
જુદુલો. ખાદ્યાની નિયમો બેચો,  
નહીં નિયમો બેચો તો એ વિનિ  
કરીએ જણો એવી નિયમો, એ  
એવી નિયમો જાણ. એવી એવી જો  
એવી વિનિરોગ જાણો. એવી એવી  
એવી જાણારું નિય. એવી એવી નિય  
જુદુલો નિયરું હોય. એવી એવી  
(એવી એવી નિય) એ એવી એવી  
એવી એવી એવી એવી એવી એવી  
જુદુલો એવી એવી એવી એવી  
એવી એવી એવી એવી એવી એવી  
એવી એવી એવી એવી એવી.  
બન્ધુનો, એવી એવી એવી એવી  
એવી એવી એવી એવી એવી.

ચાંદીજીનો



અધ્યાત્મ

anandhi Heritage Portal

## ગાંધીજીનો અક્ષરહેઠ

“આ ચુગણા સૌથી મહાન પુરુષ”ના ઉછેર, વિકાસ અને કાર્યપદ્ધતિની પ્રેરણાદાયી કથાને, તેમાં જે લખાણો અને ભાવણોના રૂપમાં સુલભ કરી આપે છે. આ અંથમાળા, આજની અને આવતી કાલની પેરની માટે, રાષ્ટ્રપિતાની વિકસતી અને વિસ્તરતી જતી વિચારસ્થાનો પરિચય પામવા માટે એક અમૂલ્ય દસ્તાવેજ છે.

**પ્રથમ પુસ્તક** એમનાં પ્રારંભિક અને ઘડતરનાં વર્ણને આવરી લે છે. એનાં પાનામાં ગાંધીજીના અનેક અંગત અનુભવો અને “એક પ્રાચીન જાતના લોકોને અન્યાયી જુલમોમાંથી બચાવવા” માટે “રંગદેખના હુર્ગ” — દક્ષિણ આશ્રિકામાં એમણે આદરેલા પ્રયંક પુરુષાર્થનો પમરાટ છે. બેરિસ્ટર ગાંધી લોકસેવક ગાંધીમાં પરિવર્તન પામવાનો શુલારંભ પણ આ પૃષ્ઠોમાં જોઈ શકાય છે.

દક્ષિણ આશ્રિકાની અખખારી આત્મ પરની એમની પત્રધારા, ધારાસલાએને તેમ જે એ સભાએની અહારના યુરોપિયનોને સંઝોધાયેલી એમની હૃદયસ્પર્શી અપીલો, દક્ષિણ આશ્રિકા, ઈંગ્લાંડ તથા હિન્દના હાડેમો પરનાં એમનાં વિનયી છતાં સ્પષ્ટભાષી વિનંતીપત્રો — એ બધાંમાં વાચકને ખુદ દક્ષિણ આશ્રિકાના કલ્યાણ માટે હિન્દી અને યુરોપિયન સમાજ વચ્ચેના સંબંધો ન્યાય અને સહિષ્ણુતાના પાયા પર જ રચાવા જોઈએ, એવી એમની અડાલ નિષ્ઠાનાં દર્શાન થાય છે.


**દીન પુસ્તકમાં** ગાંધીજીની ગાથા એક નવા અને નાળુક તથક્કામાં પ્રવેશે છે. એમની સ્થીમરને ચાર અઠવાડિયાં ક્રોરેન્ટીનમાં રાખ્યા બાદ ડરખન બંદરે જાતરતાં એક અંગ્રેજ ટોળાએ એમને મારેલા ભરણુતોલ મારનું — સત્યને ખાતર પોતાના પ્રાણુને હોડમાં ભૂકવાના એમના પ્રથમ સાહસનું — એમાં વર્ણન છે.

[—પાછલા કુલોધ પર ચાઢું


ગાંધીજીનો અક્ષરદેહ


૧ અને ૨

[ ૧૮૮૪-૧૮૯૬ : ૧૮૯૬-૧૯૦૭ ]



26 OCT 1967





गांधीजी — हांडनमां विद्यार्थी तरीके

# ગાંધીજીનો અક્ષરહેતુ

[ મહાત્મા ગાંધીનાં લખાણો, લાખણો, પત્રો વગેરેનો સંચાહ ]

૧ અને ૨

[ ૧૮૮૪-૧૮૯૬ : ૧૮૯૬-૧૯૦૭ ]

૧

1974



નવજીવન પ્રકાશન મંદિર

અમદાવાદ-૧૪

Gandhi Heritage Portal

નવજીવન

૧૯૭૬  
GAR

© નવજીવન ટ્રસ્ટ, ૧૯૯૭

પહેલી આવૃત્તિ, મે ૧૯૯૭, પ્રતિ 3,000

11584



મુદ્રક અને પ્રકાશક: જીવસુજી ડાયાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪

Gandhi Heritage Portal


# ગાંધીજનો અક્ષરદેહ

[ મહાત્મા ગાંધીનાં લખાણૂા, ભાષણૂા, પત્રો, વગેરેનો સંચાહ ]

૧

[ ૧૮૮૪-૧૮૯૬ ]

19 JUN 1974



## અંગરલિ

જીવનનું કોઈક વિશિષ્ટ દર્શનશાખ ખીલવવાનો અથવા કોઈક ખાસ માન્યતાઓ કે આદર્શોની એવી જ પદ્ધતિ રચવાનો આશય રાખી મહાત્મા ગાંધીએ પોતાનું જીવનકાર્ય આરંભ્યુનહોતું. સંભવ છે કે તેમની એવી વૃત્તિ જ નહોતી અને તેમને એટલો વખત પણ નહીં હોય. તેમને જોકે સત્ય અને અધિકા વિષે દુઢ શક્કા હતી, અને પોતાના જીવનકાળ દરમિયાન પોતાની સામે જે જે સવાલો ખડા થયા તે બધાના ઉકેલને માટે તેમણે એ બે સિદ્ધાન્તોના વહેવારમાં કરેલા અમલમાં તેમની બધીએ શીખ ને હિલસૂઝી સમાઈ જાય છે.

રાજકીય, સામાજિક, ધાર્મિક, ઘેતીવાડી અગર જમીનને લગતો, મજૂરો અગર ઉદ્યોગોને લગતો અથવા બીજો કોઈ એવો સવાલ ભાગ્યે જ હોય કે જે તેમની પ્રવૃત્તિના કોત્રમાં સમાપ્તો નહીં હોય અને જે સિદ્ધાન્તોને પોતે પાયાના તેમ જ મૂળભૂત માન્યા હતા તેમના ચોકઠામાં રહીને જેમના ઉકેલનો તેમણે પોતાની રીતે પ્રયત્ન કર્યો નહીં હોય. આહાર, પહેરવેશ, રોજબરોજનાં કામકાજ વગેરે વ્યક્તિગત જીવનની જીણું જીણું વિગતોથી માંડીને તે છેક જેને છેડવાની કે તોડવાની વાત સરખી ન થઈ શકે એવા જ નહીં પણ ધર્મની દૃષ્ટિથી અત્યંત પવિત્ર મનાતા જ્ઞાતિવ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા સૈકાંઓથી જીવનવ્યવસ્થાના અંગભૂત બનેલા મોટા મોટા સામાજિક સવાલો સુધીનું હિંદના જીવનનું એક પણ પાસું એવું ભાગ્યે જ હોય કે જેના પર તેમણે પોતાના આદર્શ મુજબની અસર પાડી નહીં હોય કે જેને તેમણે ધાટ આપો નહીં હોય.

તેમના વિચારો તેમ જ જ્યાલો ચોંકાવી મૂકે તેટલી હદ સુધી નવા લાગતા; પરંપરા અથવા ચાલુ રૂઢિ તેમાં આડે આવતાં નહીં. તેવી જ રીતે નાનામોટા સવાલોનો ઉકેલ કાઢવાની તેમની રીત તદ્દન નવી માલૂમ પડતી, દેખાવમાં તે જરાએ પ્રતીનિકર લાગતી નહીં ને છતાં આખરે સફળ નીવડતી. દેખીતી રીતે સ્વભાવથી જ તેઓ હું કહું તે જ પૂર્વ દિશા એવો જુલમી મમત રાખનારા નહોતા. નવા નવા પ્રયોગોમાંથી મળતાં અનુભવના નવા નવા જ્ઞાનથી તેઓ અળગા રહી શકતા જ નહીં. વળી, તે જ કારણસર ઉપરછલ્લી સુસંગતતાનો મમત પણ તેમનામાં નહોતો. હકીકતમાં, ગાંધીજીના વિરોધીઓને અને કેટલીક વાર તો તેમના અનુયાયીઓને પણ તેમના કાર્યોમાં વિસંગતતા દેખાતો. સામાની વાત સમજવાને તેઓ એટલા તત્પર રહેતા અને તેમનામાં એવી અસાધારણ મોટી નેતિક હિમત હતી કે પોતાનું કોઈ એક કામ ખામીવાળું લાગતાંની ખાતરી થતાંવેંત, પોતાની વાતને સુધારી લેતાં તેઓ કદી ખચકાતા નહીં અને પોતાની ભૂલ હતી એવું જહેર રીતે સ્વીકારવામાં પાછા પડતા નહીં. પોતે કરેલા નિર્ણયો અને ઉપાડેલાં કામોની નિષ્પક્ત તેમ જ વસ્તુલક્ષી આલોચના કરતા તેમને આપણે ઘણી વાર જોઈએ છીએ. એટલે, તેમના કામોથી ઘણી વાર તેમના પ્રશંસકો ગુંચવણુમાં પડી જતા દેખાતા અને તેમના ટીકાકારો મૂંજાઈ જતા તેમાં નવાઈ પામવા જેવું નથી... .

આવા પુરુષની સાચી સમજ મેળવવાને માટે તેની એકંદર શીખ અને તેના જીવનની ઘટનાઓને સમગ્રપણે એકત્રિત જેવાનું જરૂરી છે. તેના જીવનની કથાનો બાબુ રૂપરેખા પૂરતો અથવા નૂઠક અભ્યાસ સરવાળે જોરરસ્તે દોરનારો બન્યા વગર નહીં રહે. એનાથી તે મહાપુરુષ વિષેની અને વાચકની પોતાની સમજ પણ અધૂરો રહે. આવા મોટા પાયા પર ગાંધીજીનાં

લખાણોના સંગ્રહનું કામ ઉપાડવાનું મૂળ કારણ આ છે. એ સંગ્રહનાં પચાસથીએ વધારે પુસ્તકો થશે એવું મને જણાવવામાં આવ્યું છે. અને એનું પ્રયોજન મહાત્મા ગાંધીની ખૂદ આ ખાસિયતમાં રહેલું છે.

આ ગ્રંથક્ષેપી પ્રસિદ્ધ કરવાનું કામ ઉપાડી હિંદ સરકારના માહિતી અને રેઝિયો ખાતાએ મહાત્મા ગાંધીના, તેમની શીખના, તેમની માન્યતાઓના અને તેમના જીવનદર્શનના અભ્યાસ માટેનો ખૂબ જ મહત્વનો આધાર પૂરો પાડ્યો છે. મહાત્મા ગાંધીએ જે કરવાની કોણ્ઠિશ સરખી નથી કરી તે હવે અભ્યાસકોએ અને વિચારકોએ કરવાનું રહે છે. આં રીતે એકત્ર કરીને મેળવી આપવામાં આવેલી સામગ્રીમાંથી એ બધા જાણે કે વ્યવસ્થિત નિબંધને તેમની જીવનની હિલસૂઝી, તેમની શીખ, તેમના જ્યાલો ને કાર્યક્રમો, અને જીવનમાં ઊભા થતા અસંખ્ય સવાલો વિષેના તેમના વિચારો તર્કશુદ્ધ અને તાત્ત્વક રીતે જુદા જુદા વિષયવાર વર્ગોકરણ કરી રજૂ કરી શકશે. એમની એકંદર વિચારની તેમ જ કાર્યની યોજનામાં નાનીમોટી અનેક બાબતોને, આખી હુનિયાને માટે મહત્વના એવા સવાલોથી માંડીને વ્યક્તિના અંગત જીવનને લગતા મર્યાદિત સવાલોને સ્થાન રહેતું હતું. પોતાના લગભગ આખા જીવન દરમિયાન તેમને વ્યાપક રાજકીય મુદ્દાઓ સાથે કામ પાડવું પડવું હતું, છતાં તેમનાં લખાણોનો ઘણો મોટો ભાગ સામાજિક, ધાર્મિક, કેળવણીના, આર્થિક અને ભાષાઓના સવાલોને લગતો છે.

પત્રવહેવારમાં તેઓ બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાર્નાંગી સવાલોને લગતા કાગળો અનેક માણસો. તેમને લખતા, તેમના પત્રવહેવારનો ઘણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જતના સવાલોથી મુંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શોટ્ટિંગનાર અથવા ટાઈપિસ્ટની મંદદીરીથી નથી, પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓ પોતાને હાથે જ લખતા અને એવી જતની મદદ લીધા વગર ચાલે નહીં એવી સ્થિતિમાં પણ તેમણે ઘણું લખાણ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું. એવા પ્રસંગો પણ આવ્યા હતા જ્યારે આંગળાં અને હાથ અકડાઈ જવાથી તેમનાથી, જમણે હાથે લખવાનું બનતું નહીં અને જીવનમાં કંઈક મોટેથી તેમણે ડાઢે હાથે લખવાની આવડત કેળવી હતી. કાંતવાના કામમાં પણ તેમણે એવું જ કર્યું હતું. તેમની આ રીતે લખવાની પ્રવૃત્તિ મોટે ભાગે ખાનગી પત્રવહેવારને અંગે થતી અને સામાન્ય માણસના રોજિદા જીવનના ખાસ સવાલોને લગતી તેમની એ જતના પત્રવહેવારમાં અપાયેલી સંલાઘ તેમની એકંદર શીખનો મહત્વનો ભાગ છે.

જીવનને સમગ્રપણે જોનાર અને માનવજાતની સેવા કાને પોતાનું જીવન સમર્પલ કરનાર કોઈ પુરુષ થઈ ગયો હોય તો અવશ્ય તે ગાંધીજી હતા. તેમના વિચારના એકંદર ઘાટને શાલ્ય તેમ જ સેવાના ઊંચા આદર્શોમાંથી, પોષણ મળતું હતું તો તેમનાં કાર્યો તેમ જ તેમની પ્રત્યક્ષ શીખ પર હુમેશ નીતિ તેમ જ મુખ્યપણે વહેવારુપણાની વિચારણાની અસર રહેતી હતી. જહેર સેવા કરનાર આગેવાન તરીકેની લગભગ સાઠ વર્ણની લાંબી કારકિદી દરમિયાન તાત્કાલિક ગમે તેમ કામ પાર પાડવાની વાતની પોતાના વિચારો પર તેમણે અસર થવા દીધી નથી. બીજી રીતે કહીએ તો સારા હેતુઓ પાર પાડવાને તેમણે ખોટાં સાધનો વાપરવાની છૂટ કદી લીધી નથી. સાધનોની પસંદગીની બાબતમાં તેમની કાળજી તેમ જ ચીવટ એવાં હતાં કે ધ્યેયની સિદ્ધિની

વાતને પણ વાપરવાનાં સાધનોના પ્રકારની વિચારણામાં ગૌણ બેખવામાં આવતી, કેમ કે તેઓ દૃઢપણે માનતા હતા કે ખોટાં સાધનો વડે કદી સારું ધ્યેય પાર પાડી શકાય નહીં અને ખોટાં સાધનો વડે જે કંઈ સિદ્ધિ મળેલી દેખાય તે સારા ધ્યેયની વિકૃતિ સિવાય બીજું કંઈ હોય નહીં.

તેમનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહનું નિઃશંક તેમ જ કાયમ ટકી રહેનારું મૂલ્ય દેખીનું છે. કંઈ નહીં તો છ દાયક પર ફેલાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરેલા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે. એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ધડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી; આસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપો; નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો; આધ્યાત્મિક અને શાશ્વત, સ્થળ અને કાળથી પર અને સમગ્ર માનવઅતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિષે આગ્રહ કેળવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે.

માનવના માનવ વિષેના શાશ્વત વિશ્વાસના દિલને પણ હલાવી મૂકનારા વિધાનમાં અને માનવમાત્રની આધ્યાત્મિક સંપત્તિમાં નીતિની ભાવના સ્વભાવગત રહેલી છે એ શાલ્યામાં તેમની કાર્યપદ્ધતિ સમાયેલી છે. એમના આ વિચારમાં રહેલી સ્વતંત્રતા કેવળ કાયદાકાનૂનથી કે સત્તા-ધારીઓની આજ્ઞાથી સિદ્ધ થઈ શકે એવી નથી; કે કેવળ વિજ્ઞાનની અથવા યંત્રવિદ્યાની પ્રગતિથી મળી શકે એવી નથી. કોઈ પણ સમાજે ખરેખર સ્વતંત્ર રહેવાને માટે પોતાની વ્યવસ્થા સ્વતંત્રતાને કાજે યોજવી જોઈએ અને તે વ્યવસ્થાની યોજનાની શરૂઆત ખુદ વ્યક્તિએ પોતે કરવી જોઈએ. ભારતીય રાષ્ટ્રજીવન જેટલા પ્રમાણમાં તેમના વિચારોમાંથી પ્રેરણા બેનું રહેશે અને તેમના વિચારોને આધારે ધડાશે તેટલા પ્રમાણમાં તે માનવસમાજની મુક્તિની પ્રેરણાનું સાધન બનશે. જેટલા પ્રમાણમાં સ્વતંત્ર હિંદ તેમના વિચારો ને આદર્શોનો અમલ કરી વધારે ને વધારે પૂર્ણ જીવન સિદ્ધ કરતું જશે તેટલા પ્રમાણમાં તે સંસ્કૃતિની સીમા વિસ્તારવામાં અને નવો રસ્તો ઉજળવામાં સફળ થતું જશે.

તેમના ધરા વિચારો જેકે હજુ પૂરા પંચાવવાના બાકી છે. કોઈ પણ સમાજવ્યવસ્થા સ્વતંત્રતા સ્થાપવામાં કેટલો ફાળો આપે છે તે વાતની નુલના તે પોતાનાં અંગભૂત ઘટકોને પ્રત્યક્ષ કેટલી સ્વતંત્રતા આપે છે તેના પ્રમાણ પરથી કરવી જોઈએ એ બાબતમાં સૌ કોઈ સંમંત છે છતાં ઔદ્યોગિક, સામાજિક કે રાજક્રારી સ્વરૂપના કેન્દ્રિત સંગઠનમાં તેના કેન્દ્રિતપણાના પ્રમાણમાં વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ પડયા વગર રહેતો નથી એ હકીકત હજુ પૂરતા પ્રમાણમાં સમજાઈ નથી. એ બાબતમાં સોનેરી મધ્યમ માર્ગ હજુ શોધાવો ને સ્વીકારાવો બાકી છે. ગાંધીજીના અર્થવ્યવસ્થાના ઝ્યાલને તંગીના નહીં તોએ સખત કરકસરના ઝ્યાલની સાથે ધણી વાર બેળી દેવામાં આવે છે. તેમના સંયમના આદર્શોનો વિવિધતા કે સૌંદર્ય વગરના કડક નીતિના પાલનના લૂખા આદર્શ સાથે ગોટાળો કરવામાં આવે છે, તેમની જરૂરિયાતો થોડી અને મર્યાદિત હોવા છતાં તેમનું જીવન પરિપૂર્ણ અને સમૃદ્ધ હતું અને આજની ધસાઈને પાતળી પડી ગયેલી શાલ્યાની ભૂમિકામાં સારું ન લાગે એટલા એ ઉદાત્ત જીવનમાં તેમણે પોતાની માન્યતા, આદર્શો અને શાલ્યાની સચ્ચાઈની પ્રત્યક્ષ સાબિતી પૂરી પાડી હતી. તેમના આક્રામના વાસીઓ સવારની તેમ જ સાંજની પ્રાર્થનામાં અહિસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શરીરક્ષમ, અસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ અને સ્વદેશી એ બધાં પોતાનાં જે વ્રતોનો નિત્યપાઠ કરતા તેમને આપણે આ રીતે સમજવાં જોઈશે.

ગાંધીજી અને તેમના શબ્દોને અંજલિકૃપ આ બે બોલ પૂરા કરતાં હું ખાતરી આપું છું કે આ ગ્રંથક્રોણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારથે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો ધૂપો ખજાનો સંધરાયેલો છે કે નેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શક્તા અને શક્તિ પ્રમાણે લઈ શકશે.

રાષ્ટ્રપતિ ભવન  
નવી દિલ્હી  
જાન્યુઆરી ૧૬, ૧૯૭૮

રાજેન્ડ્રપ્રસાદ

## પુરિચય

ગાંધીજીના દેહાન્તને એક મહિના પછી દસ વરસ થશે. તેમની ઉંમર પાકટ થઈ હોવા છતાં તેમની જીવનશક્તિ જેવી ને તેવી અને તેમની કામ કરવાની શક્તિ આપાર હતી. ખૂનીને હાથે તેમના જીવનનો એકાએક અંત આવ્યો. હિંદને તેથી ભારે આધાત લાગ્યો, દુનિયા આખી શોકમાં ગરકાત થઈ ગઈ અને આપણામાંથી જેમને તેમની સાથે વધારે નિકટનો સંબંધ બંધાયો હતો તેમને લાગેલો આધાત અને થયેલું દુઃખ સહન ન થાય તેવાં હતાં. અને છતાં એમ લાગે છે કે એક ભવ્ય રીતે સમૃદ્ધ કારકિર્દી એ રીતે સમાપ્ત થઈ તે તદ્દન ઉચિત ગણાવું જોઈએ, કેમ કે જે રીતે જીવનમાં તે જ રીતે મરણથી પણ તેમણે પોતાની જતને જે કાર્યને સમર્પિત કરી હતી તેને આગળ વધાર્યું હતું. વધતી જતી ઉંમરની સાથે તેમનાં શરીર ને મનની શક્તિ આસ્તે આસ્તે ક્ષીણ થતી જતી, જોઈ રહેવાનું આપણને કોઈને સારું લાગે ઓનું નહોનું. અને તેથી એમ જ કહેવું જોઈએ કે આશા ને સિદ્ધિના એક તેજસ્વી સૂર્ય અને એક આખી અધી સદી સુધી જે રાષ્ટ્રને તેમણે ઘડયું ને કેળવ્યું તેના જનક તરીકે તેઓ જેમ જીવા તેમ જ મરણ પામ્યા.

તેમની અનેકમાંની થોડી પ્રવૃત્તિમાં તેમની સાથે જોડાઈને કાર્ય કરવાનો આણમોલ વહાવો જેમને જેમને મળ્યો હતો તે સૌને માટે તેઓ હમેશા યુવાનીના જેમની પ્રત્યક્ષ મૂર્તિકૃપે રહેવાના છે. આપણે તેમને એક વૃદ્ધ તરીકે નહીં પણ નૂતન ભારેતના જનમને વસંતની નવજીવનની શક્તિથી પ્રત્યક્ષ કરનાર તરીકે યાદ રાખીશું. તેમની સાથે જેને અંગત સંપર્ક થયો નથી તેવી તેમની પાછળની પેઢીને માટે તેઓ પરંપરાથી ઊતરી આવેલી દંતકથાની વાર્તાકૃપે હોઈ તેમના નામની અને તેમની પ્રવૃત્તિઓની આનુભાજુ અનેક કથાઓ રચાઈને ગુંથાઈ ગઈ છે.

તેમનાં લખાણો અને ભાષણોના સંપૂર્ણ સંગ્રહની સંપાદિત આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું હિંદી સરકારે માણે લીધું છે તેથી હું રાજી થયો છું. તેમણે જે કંઈ લખ્યું છે અને કલ્યું છે તેનો સંપૂર્ણ પ્રમાણભૂત સંગ્રહ તૈયાર થાય તે ધાર્યું જરૂરી છે. તેમની પ્રવૃત્તિઓ આગણિત હતી અને તેમનાં લખાણોનો કંઈ પાર નથી તેથી તેમનો સંગ્રહ કરવાનું એક ભગીરથ કાર્ય હોઈ તે પૂરું થતાં ધાર્યાં વરસ સહેજે લાગશે. પણ આપણે પોતાને કાંજે અને આપણી ભાવિ પેઢીઓને કાંજે આ ધર્મ-જ્ઞાન આદા કરવું જોઈએ.

આવા પ્રકારના સંગ્રહમાં જેને મહત્ત્વનાં કહી શકાય અને જેને મહત્ત્વ વગરનાં એટલે કે પ્રસંગોપાતા કે સહજ કહી શકાય એવાં વચ્ચનો કે લખાણોનું મિશાણ થયા વગર રહે નહીં. અને છતાં કેટલીક વાર વધારે વિચારપૂર્વક કરવામાં આવેલા લખાણના કરતાં અથવા તેવા જ ભાષણના કરતાં પ્રસંગોપાતા સહજભાવે ઉચ્ચારાયેલો શબ્દ માણસના વિચારને વધારે સારો રીતે પ્રગટ કરે છે. એ બધી વાત ગમે તે હો, તેમનાં વચ્ચનોમાંથી આ મહત્ત્વનું ને આ નહીં એવી પસંદગી કરનારા આપણે કોણ? તેમને જે કંઈ કહેવાનું છે તે તેમને પોતાને જ આપણે કહેવા દઈએ તે વધારે ઉચિત થાય. તેમને માટે જીવન એક પરિપૂર્ણ અખંડ વસ્તુ હતી, ઘરું વણાટના પોતવાજું વિવિધરંગી વખત હતું, એક બાળકને કહેલો એકાદ શબ્દ, વ્યાખ્યથી પીડાતા કોઈક

દર્દીને સાંજે કરવાને કરેલો રૂપર્ણ એ બધું બ્રિટિશ સરકારને પડકાર આપવાને ઘડેલા ઠરાવના નેટલું જ મહત્વનું હતું.

પોતાના જ્ઞાનના પ્રકાશથી આપણી પેઢીની સમજને અનજવાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વતંત્રતા અપાવનાર જ નહીં, માણસને વધારે ઉદાત્ત કરનારા તેની પ્રકૃતિના ઊંડણમાં રહેલા ગુણોની આપણને વધારે ઊડી સમજ પણ આપનારા આપણા આ વહાલા આગેવાનને વિષે હવે પછીની આપણી પેઢીઓને ઓછીવત્તી જાંખી થતી રહે તેટલા સારુ આ કાર્ય આપણે પૂર્ણ પૂજયભાવથી ઉપાડીએ. આવો એક પુરુષ આપણી ભારતીય ભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમની અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો આક્ષર્ય પામતા રહેશે.

આ હું દાર્નિલિંગમાં બેઠો બેઠો લખ્ય છું. ત્યાં ભવ્ય ને સમર્થ કાંચનજંધાનું શિખર આપણા પર નજર રાખે છે. આને સવારે મને એવરેસ્ટનું દર્શન થયું. મને એવું લાગ્યું કે એવરેસ્ટ અને કાંચનજંધાના, નિર્વિકાર શાંત સામર્થ્ય અને શાશ્વતપણાની છટા ગાંધીજીમાં પણ આપણે અનુભવી હતી.

દાર્નિલિંગ,  
ડિસેમ્બર ૨૭, ૧૯૫૭

જવાહરલાલ નેહારુ



## સામાન્ય પ્રતીવના

પોતાની સ્વતંત્રતાના ઘડવૈયા પ્રત્યેનું રાખ્ણનું જરૂર આદા થયું જેઈએ એટલી જ બુદ્ધિથી નહીં, ભાવી પ્રજાના હિતને ખાતર પણ મહાત્મા ગાંધીનાં લખાણો, ભાષણો અને પત્રો બેગાં એક જ ઠેકાણેથી મળી શકે એવી રીતે સંઘરાવાં જેઈએ એવી પ્રતીતિને કારણે તે બધાંને એકઠાં કરી ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાની આ યોજના ભારત સરકારે ઉપાડી છે.

દિવસાનુદિવસ અને વર્ષાનુવર્ષ ગાંધીજીએ જે કાંઈ કષ્ટું અને લખ્યું તે બધું આ ગ્રંથ-શ્રેણીમાં એકત્ર કરવાનો ઈરાદો રાખવામાં આવ્યો છે. તેમનું કાર્ય એક આખા અર્ધા સૈકા પર ફેલાયું હતું અને આપણા પોતાના દેશ ઉપરાંત બીજા દેશો પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. દુનિયાભરમાં થઈ ગયેલા ઘણા ઓછા મહાપુરુષોએ જીવનના અનેકવિધ સવાલોમાંથી આટલા બધા વિધવિધ સવાલોમાં પોતાનું ધ્યાન પરોબું હશે. પોતે જે માનતા તેનો વહેવારમાં અમલ કરવાને પ્રતિકાણ મથામણ કરતા નેમણે તેમને આ પૃથ્વી પર દેહ ધરીને વિચરતા જોયા છે તે લોકોની, નેમને તેમનાં પ્રત્યક્ષ દર્શન તેમ જ ઉદાહરણથી જાણવા-શીખવાનો લહાવો મળી શકે એવો નથી એવી ભાવિ પેઢીઓને, તેમની એકંદર શીખનો સમૃદ્ધ વારસો નેવો હોય તેવો અણિશુદ્ધ અને બની શકે તેટલા પ્રમાણમાં પૂરેપૂરો અકંધ સોંપવાની ફરજ છે.

૧૮૮૪થી ૧૯૪૮ના લાંબા ગાળામાં અને લગભગ સાઠ વરસના ઉગ્ર કર્મશીલ જહેર જીવન દરમિયાન ગાંધીજીએ લખાણો, અને ભાષણો કર્યા છે અને પત્રો લખ્યા છે. તે બધાં દુનિયાભરમાં અને ખાસ કરીને હિંદુસ્તાન, ઇંગ્લાંડ અને દક્ષિણ આફ્રિકા એ ત્રણ દેશોમાં વેરાયેલાં પડ્યાં છે.

એ બધાં લખાણ અને ભાષણ પોતાના જીવનકાળમાં તેમણે જે પુસ્તકો લખ્યાં અથવા જે પ્રસિદ્ધ થયાં તેમાં સંઘરાયેલાં પડ્યાં છે એટલું ને નથી, ધૂળ ખાતી ફાઈલોમાં, સરકારી દફુતરોમાં તેમ જ પ્રકાશનોમાં અને અંગ્રેજી, ગુજરાતી તેમ જ હિંદી ભાષાનાં જૂનાં વર્તમાન-પત્રો ને સામયિકોના ઢગલાઓમાં પણ છે. તેમનાં પત્રો ઊંચી ઝાંચે નીચી ગણ્ણાતી, તવંગર અને ગરીબ, દરેક જાતિની અને ધર્મની અગાહિત વ્યક્તિઓની પાસે આખી દુનિયામાં છે. આવી બધી સામગ્રી નાશ પામે અગર રવડી જાય તે પહેલાં એકઠી કરી લેવાનું જરૂરી છે.

તેમનાં લખાણો અને ભાષણોના કેટલાક સંગ્રહો અથવા વધારે સાચી રીતે ઓળખાવીએ તો સંપાદિત પુસ્તકો બેશક મોજૂદ છે. તેમાંનાં ઘણાં ખાસ કરીને ખૂદ ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટના વહીવટમાં ચાલતા અમદાવાદના નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યા છે. એ બધાં પ્રકાશનો કીમતી એટલે કે ઉપયોગી છે એ સાચું, પણ તેમાંનાં ઘણાંખરાં ગાંધીજીએ જે દરમિયાન હિંદુસ્તાનમાં કાર્ય કર્યું તે સમય પૂરતાં અને મુખ્યત્વે તેમનાં પોતાનાં નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન સાથે સંકળાયેલાં અઠવાડિકોમાં જે પ્રસિદ્ધ થતું તેટલાં પૂરતાં મર્યાદિત છે. વળી, મોટે ભાગે એ બધાં લખાણો તેમ જ ભાષણોની ગોઠવણી જુદા જુદા વિષયવાર થયેલી હોવાથી કેટલીક વાર જે તે વિષયને પ્રસ્તુત હોય તેવાં લખાણ કે ભાષણમાંના ઉતારા બદ્ધ તેના બીજા ભાગ તેમાં છોડી દેવામાં આવ્યા છે.

પત્રોની બાબતમાં એવું બન્યું છે કે પોતાનાથી મેળવી શકાય તેટલા એકઠા કરી તેમની છબી ઉતારી લઈ ગાંધી સ્મારક નિધિએ ઘણી ઉપયોગી કામગીરી બજાવી છે, પણ તે હજુ પ્રસિદ્ધ

થયા નથી. અત્યાર સુધીમાં નિધિઓ એકઠા કરેલા પત્રોની સંખ્યા હજરોની થવા જય છે, પણ હજુ તેથીયે વધારે સંખ્યાના કાગળો મેળવવાના અને પ્રસિદ્ધ કરવાના બાકી છે.

આમ, ગાંધીજીના જીવનના ગમે તે ગાળાનાં લખાણો, ભાપણો અને પત્રો જ્યાંથી મળે ત્યાંથી શોધીને મેળવી તે બધાંને જેવાં ને તેવાં આખાં ને આખાં કાળકમે ગોઠવીને પ્રસિદ્ધ કરવાનો હજુ સુધી કોઈ પ્રયાસ થયો નથી. ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓના ગજ બહારનું એ કામ હતું. એટલું સાધન તેમાંથી કોઈની પાસે હોય નહીં. તેથી હિંદી સરકારે તે કામ માથે લીધું છે.

ગાંધીજીએ કરેલાં ભાપણો, લખેલાં લખાણો તેમ જ મોકલેલા પત્રોનો જથ્થો તેમના દક્ષિણ આદ્રિકાના વસવાટનાં તેમના કાર્યની શરૂઆતનાં વર્ષોમાં પણ અસાધારણ મોટો હતો. એટલા જ ગાળાની એ પ્રકારની સામગ્રીને સમાવવાને આશરે બાર પુસ્તકો થશે. તેમનાં બધાંયે લખાણો, ભાપણો અને પત્રોની કુલ સામગ્રીને સમાવવાને આમ આખી શોખીનાં સાધારણ અંદાજે ચારસો ચારસો પાનાંનાં તેમનાં સાર્વનનિક જીવનનાં વર્ષોની સંખ્યા જેટલાં પુસ્તકો થશે.

વળી, તેમણે એક જ ભાપામાં ભાપણો કર્યી નથી. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાપામાં લખતો અને બોલતા. તેથી એ બધી સામગ્રીના સંપાદકનું કામ કેવળ તેને એકઠી કરવા પૂરતું જ ન રહેતાં ગુજરાતી ને હિંદીમાંથી અંગ્રેજીમાં અને ગુજરાતી ને અંગ્રેજી-માંથી હિંદીમાં ચોકસાઈથી તરજુમા કરવાનું પણ રહેશે કેમ કે આ શોખી એ બે એટલે કે અંગ્રેજી અને હિંદી ભાપામાં પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે. ઉપરાંત, તેમના જીવનનાં તેમણે દક્ષિણ આદ્રિકામાં ગાળેલાં શરૂઆતનાં વર્ષોના ગાળાની સામગ્રી લાંડનની સંસ્થાનોની કચેરીન દફ્તરોમાં અને ખુદ દક્ષિણ આદ્રિકામાં હિંદુસ્તાનની બહાર પડેલી હોવાથી કામ વધારે આટપટું બન્યું છે. દક્ષિણ આદ્રિકામાં પડેલી સામગ્રી સુધી પહોંચી તેને મેળવવાનું કામ પ્રમાણમાં વધારે મુશ્કેલ છે. અમલદારોને સંબોધીને કરેલાં લખાણો ઉપરાંત ત્યાં ગાંધીજીએ ઇન્ડિયન ઓપીનિયનમાં બહોળા પ્રમાણમાં લખ્યું હતું. યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજનમાં પાછળથી છપાયેલા તેમના લેખો જેમ તેમની સહીથી પ્રસિદ્ધ થયા તેવું ઇન્ડિયન ઓપીનિયનમાંના તેમના લેખોનું નથી; તેમના પર તેમની સહી નથી. ગાંધીજીનાં તે લખાણો તેમનાં તરીકે પ્રમાણભૂત રીતે ઓળખાવવાના કામમાં આ શોખીના સંપાદકોને એકલા ઇન્ડિયન ઓપીનિયનના કામમાં જ નહીં પણ દક્ષિણ આદ્રિકામાં ગાંધીજીની બીજી પ્રવૃત્તિઓ સાથે ગાડ રીતે સંકળાયેલા શ્રી ઓચ. એસ. એલ. પોલાક અને શ્રી છગનલાલ ગાંધી એ બન્ને તરફથી કીમતી મદદ મળી છે.

ખુદ આ કામનો પ્રકાર એવો છે કે આ સંગ્રહને માટે એ પરિપૂર્ણ છે અથવા છેવટનો છે એવો દાવો થઈ ન શકે. હવે પછી સંશોધન થાય તેમાંથી હમણાં ન મળી શક્યાં હોય તેવાં નવાં લખાણો મળી આવેયે ખરાં. સંગ્રહને અધિશુદ્ધ સંપૂર્ણ કરવાને ખાતર અનિશ્ચિત સમય સુધી થોલી જવાનું સલાહભરેલું ન થયું હોત. આ કામમાં સુધારોવધારો કરવાનું ભવિષ્ય પર છોડતું સારું. હાલે પૂરતું જેકે જેટલી મળી શકે તેટલી બધી સામગ્રી એકઠી કરવાની, તેની સચ્ચાઈની ખાતરી કરી લેવાની અને મૂળ લખાણ સમજવામાં વાચકને મદદ થાય તેવી ટૂંકી નોંધો સાથે પ્રસિદ્ધ કરવાની થાય તેવી બધી કોશિશ કરવામાં આવે છે. એકાદ પુસ્તકમાં લેવાલાયક સામગ્રી મેળવતાં મોડું થાયું તો તેને અલગ પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે.

પહેલાં કહેવામાં આવ્યું છે તે મુજબ બધી સામગ્રીની ગોઠવણી કાળકમે રહેશે અને કોઈ પણ એક તારીખના લેખ, અગર ભાપણ અગર પત્રને એકસાથે રાખવામાં આવશે. જુદા વર્ગની શર્દુસામગ્રીને અલગ અલગ શોખીમાં પ્રસિદ્ધ કરવાને બદલે આ પ્રકારની ગોઠવણી

પસંદ કરવાનું કારણ એ છે કે તે બધીને એ ઢબે અલગ પાડવામાં કૃત્રિમપણું આવી ગયા વગર રહે નહીં. ઘણી વાર ગાંધીજી એક જ વિષયની અથવા મુદ્દાની ચર્ચા થોડા દિવસ દરમિયાન કચાંક એકાદ લેખમાં તો કચાંક એકાદ ભાષણમાં કે કચાંક કોઈકને લખેલા પત્રમાં કરતા. તેઓ જીવનને અલગ અલગ ખંડ પાડીને નહીં પણ એક અંદર વસ્તુ તરીકે જોતા. પોતાના વિચારો તેઓ લેખ, ભાષણ અગર પત્રમાં એમ ગમે તે ઢબે વ્યક્ત કરતા તોએ તેમાં ખાસ કથો ફરક પડતો નહોતો. એ બધાં એક જ પુસ્તકમાં ચોક્સાઈથી કણકમે પાસે પાસે રાખવામાં આવ્યાં હોય તો ગાંધીજી કેવી રીતે કાર્ય કરતા અને જુદા જુદા મુદ્દાઓ એક પછી એક સામા આવતા જાય તેમ તેમનો કઈ રીતે વિચાર કરી નિકાલ કરતા તેનો વાચકને વધારે સાચો ને સ્પષ્ટ ઝાલ આવે. એ રીતે આ પુસ્તકોમાં ગાંધીજીના માનસની સમૃદ્ધિ સોળે કળાએ પ્રગટ થશે કેમ કે તેઓ એક બાળુથી સાર્વજનિક જીવનની દૃષ્ટિથી ઘણા મહાત્વની બાબતોની ચર્ચા કરતા હોય તે જ વખતે બીજી બાળુથી વ્યક્તિઓના અંગત જીવન સાથે ઘણો સંબંધ ધરાવતા સવાલોમાં તેટલી જ ચીવટથી પોતાનું ચિત્ર પરોવતા હોય એવું જેવા મળે છે. જહેર જીવનના સવાલોની ચર્ચા કરનારાં લખાણો અગર ભાષણોની વચ્ચે વચ્ચે વ્યક્તિઓને અંગત લખેલા પત્રો રાખવાથી તે બધાને અલગ પુસ્તકશ્રોણીમાં પ્રસિદ્ધ કરવાથી મળે તેના કરતાં ગાંધીજીના વ્યક્તિત્વનું વધારે સાચું અને વધારે પૂર્ણ પ્રતિબિમ્બ નીરખવાનું મળશે.

આ પુસ્તકશ્રોણીનો આશય ગાંધીજીના અસલ શબ્દોને બની શકે તેટલા પ્રમાણમાં જેવા ને તેવા આપવાનો હોવાથી તેમનાં ભાષણો, તેમની મુલાકાતો અને વાતચીતોના જે હેવાલો પ્રમાણભૂત સાચા ધ્યાયા નથી તેમને છોડી દેવામાં આવ્યા છે અને તેવી જ રીતે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા હેવાલો પણ એમાં બેવામાં આવ્યા નથી. ભાષણોની બાબતમાં જોકે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા તેમના હેવાલની પ્રમાણભૂત સચ્ચાઈ વિષે શંકા ન હોય અથવા પ્રત્યક્ષ નિવેદનને રૂપે તેમનો હેવાલ મળે એમ ન હોય, અથવા બીજી રીતે મળી ન શકે એવી માહિતી તેમાંથી મળતી હોય તો તે રૂપમાં તે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે ગાંધીજીએ વકીલ તરીકે કેવળ પોતાના વ્યવસાય પૂરતા લખેલા દસ્તાવેજ અગર પત્રો અને જે માત્ર શિરસ્તા મુજબ લખાયેલા તેમ જ જે તેમના ચરિત્રની દૃષ્ટિથી પ્રસ્તુત ન હોય તેવા કાગળો પણ આમાં સમાવવામાં આવ્યા નથી. વળી, જેને લખાયો હોય તેને જ જાણવાને લાયક ખાનગી પ્રકારના અથવા હાલ જીવતાં માણસોને જેમની પ્રસિદ્ધિથી મૂઽંવણ થવાનો સંભવ હોય તેવા પત્રોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.

હિંદી ને, ગુજરાતીમાંથી અંગ્રેજી તરજુમા કરવાનું અને અંગ્રેજી ને ગુજરાતીમાંથી હિંદી તરજુમા કરવાનું કામ સંભાળથી પસંદ કરવામાં આવેલા અનુભાવી અનુવાદકોના મંડળને સોંપાયું છે. શૈલીમાં એકધારાપણું જળવાય તેટલા ખાતર બની શકે ત્યાં સુધી એક જ પુસ્તકમાં સમાવવામાં આવેલાં લખાણોના તરજુમાનું કામ એક જ અનુવાદક કરે છે.

મળેલાં લખાણો વગેરેની સામગ્રીને પુસ્તકશ્રોણીમાં આપતાં પહેલાં અસલને વળગી રહેવાની ચીવટ રાખવામાં આવી છે. છાપકામની દેખીતી ભૂલો સુધારી બેવામાં આવી હોઈ જે શબ્દો મૂળમાં ટૂંકાવીને આપ્યા હોય તેમની સામાન્યપણે પૂરી જોડણી આપવામાં આવી છે.

અખબાર અથવા સામયિકોમાંનો લેખ ન હોય એવા લખાણની અથવા ગાંધીજીએ આપેલા ભાષણની તારીખ બધે ઠેકાણે એક જ રીતે શરૂઆતમાં મથાળે જમણી બાળુને ખૂસે સામાન્ય રીતે ટપાલના કાગળોમાં લખવાનો રિવાજ છે તે મુજબ આપવામાં આવી છે. કોઈ કોઈ

દાખલામાં મૂળમાં એ તારીખ છેવટે આપવામાં આવી હોય તોપણ અહીં ઉપર જણાવેલી રીત જ અખત્યાર કરવામાં આવી છે. જ્યાં મૂળમાં તારીખ આપવામાં આવી ન હોય ત્યાં અંદાજે તારીખ નક્કી કરી તે ચોરસ કૌંસમાં આપી છે અને જરૂરી જણાયું છે ત્યાં તે ઠરાવવાનાં કારણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. લખાણને અંતે મૂકવામાં આવેલી તારીખ તેના પ્રસિદ્ધ થયાની છે. અંગત પત્રની બાબતમાં જેને સંબોધીને તે લખાયો હોય તે વ્યક્તિનું નામ બધે એક જ ફેને મથાળે મૂકવામાં આવ્યું છે. જે સાધનમાંથી આપવામાં આવેલી બાબત બેવામાં આવી હોય તેનો ઉલ્લેખ તેને છેડે કરવામાં આવ્યો છે. નામોની જુદી જુદી જેહણી મૂળમાં જેવી હોય તેવી રહેવા દીધી છે.

મૂળ લખાણના પરિચયની શરૂઆતની ઈટાલિક અક્ષરમાં આપવામાં આવેલી નોંધ,<sup>૧</sup> પાનાને તળિયે આપેલી ફૂટનોટ, તેમ જ મૂળ લખાણની વચ્ચે ચોરસ કૌંસમાં મૂકેલા શબ્દો સંપાદકોનાં છે. લખાણની વચ્ચે ગોળ કૌંસમાં આવતું વસ્તુ મૂળમાંનું છે. જ્યારે જ્યારે મૂળમાં ગાંધીજીએ બીજાં સાધનોમાંથી અથવા કેટલીક વાર પોતાનાં લખાણો કે હેવાલો કે નિવેદનોમાંથી ઉતારાંલીધા છે ત્યારે તે બધા ફકરા નાના અક્ષરનાં બીબાંમાં થોડા અંદરથી છાપવામાં આવ્યા છે.<sup>૨</sup>

પાનાને તળિયે મૂકવાની નોંધ બને તેટલી ઓછી કરવાના હેતુથી સ્થળોને લગતી નોંધ, વ્યક્તિઓની ઓળખની નોંધ, કાયદાઓને લગતી નોંધ, વધારે વિસ્તારવાળા ઉલ્લેખો અને બિનઅંગેજ શબ્દોની યાદી<sup>૩</sup> પુસ્તકને અંતે આપવામાં આવ્યાં છે. દરેક પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણો જે ગાળામાં થયાં હોય તેને લગતી એક કાલાનુકમણિકા તેમાં આપી છે. લખાણ પ્રાપ્તિનાં સાધનોને લગતી નોંધ પણ પુસ્તકમાં સમાવી બેવામાં આવી છે.

આ યોજનાનો અમલ ઓગણીસસો છાપનની સાલના ફેબ્રુઆરી માસમાં શરૂ થયેલો. તેનો મૂળ ખ્યાલ કરવાનું શ્રેય હિંદી સરકારનું માહિતી અને રેઝિયો ખાતાના મંત્રી શ્રી પી. એમ. લાડને ફાળે જાય છે. ઓગણીસસો સત્તાવનની સાલના માર્ય માસમાં તેમનું અકાંગે અવસાન થયું તે પહેલાં આ યોજનાના કામને સારા પાયા પર ગોઠવી દેવામાં તેઓ સહાયભૂત થયેલા.

આ પુસ્તકશેષીની રચનાનું નિયમન કરવાનું અને તેને ઘટતે રસ્તે બેવાનું કામ એક સલાહકાર મંડળને સોંપવામાં આવ્યું છે. તેના મૂળ સભ્યો શ્રી મોરારજી ર. દેસાઈ (અધ્યક્ષ), શ્રી કાકસાહેબ કાલેલકર, શ્રી દેવદાસ ગાંધી, શ્રી ખારેલાલ નથીર, શ્રી મગનભાઈ પ્ર. દેસાઈ, શ્રી જી. રામચંદ્રન, શ્રી શ્રીમન્નારાયણ, શ્રી જીવાણ ડા. દેસાઈ અને શ્રી પી. એમ. લાડ હતા. ગાંધીજીના જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ રીતે સંબંધમાં આવેલા લોકોની સલાહ તેમ જ તેમના અનુભવનો લાભ યોજનાને મળે તે હેતુથી આ સલાહકાર મંડળ રચવામાં આવ્યું હતું.

લખાણો, ભાષણો અને પત્રો વગેરે બધી સામગ્રી એકઢી કરવાની અને પુસ્તકોના સંપાદનની વ્યવસ્થા એક મુખ્ય સંપાદકને સોંપવામાં આવી છે. શ્રી ભારતન કુમારપણે મુખ્ય સંપાદક નીમવામાં આવ્યા હતા અને પાછળથી તેમને સલાહકાર મંડળમાં પણ બેવામાં આવ્યા હતા. ઓગણીસસો સત્તાવનની સાલના જૂન માસમાં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે અસાધારણ ભક્તિભાવથી કાર્ય કર્યું. તેમના અવસાન પછી આ યોજના મુજબનું પહેલું પુસ્તક

૧. અક્ષરદેહમાં આ નોંધ માત્ર મોટા કેંસમાં મૂળ છે.

૨. અક્ષરદેહમાં અક્ષરો સરખા જ રાખ્યા છે.

૩. અક્ષરદેહમાં આ ચાદી રાખ્યી નથી.

છાપવાને માટે છાપખાનામાં મોકલવાની તૈયારી પૂરી થઈ તે અરસામાં સલાહકાર મંડળે શ્રી જ્યયરામદાસ દોલતરામને મુખ્ય સંપાદકનું કામ સંભાળવાને નિમંત્રણ આપ્યું અને તેમની મંડળના સભ્ય તરીકે પણ નિમણૂક કરવામાં આવી.

મુખ્ય સંપાદકની મદદમાં સંપાદકોનું એક મંડળ છે. તેમાંથી શ્રી યુ. આર. રાવ લખાણોને લગતું, શ્રી આર. કે. પ્રભુ ભાષણોને લગતું, શ્રી પી. જી. દેશપાંડે પત્રોને લગતું, શ્રી દીક્ષિત હિંદીને લગતું અને શ્રી એમ. કે. દેસાઈ તેમ જ શ્રી રત્નિલાલ મહેતા ગુજરાતીને લગતું કામ સંભાળે છે.

[મૂળ અંગ્રેજ]

11574

JUN 1974



## આ પુસ્તકની પ્રસ્તાવના।

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે ગાંધીજીના જીવનનો તદ્દન પ્રારંભનો સમય સંપાદકોની દૃષ્ટિ કઠણમાં કઠણ છે. તે ગાળાના પાછલા અને પ્રમાણમાં વધારે પ્રવૃત્તિમય ભાગ દરમિયાન ગાંધીજી હિંદુસ્તાનની બહાર હતા અને તેથી તે સમયની તેમનાં લખાણો વગેરેની અસલ સામગ્રી તેઓ જ્યાં વિદ્યાર્થી તરીકે રહ્યા હતા ત્યાં ઈંગ્લાંડમાંથી અને જ્યાં શરૂઆતમાં વકીલ તરીકે ગયેલા ત્યાં દક્ષિણ આફ્રિકામાંથી મેળવવાની હતી.

આપણે સારે નસીબે એ ગાળાને લગતી થોડી સામગ્રી ગાંધીજીએ સાચવી રાખી હતી અને તેઓ તે હિંદુસ્તાન લેતા આવ્યા હતા. પોતાના પત્રવહેવારની કાર્બન કાગળથી કાઢેલી કોઈ કોઈ નકલો, પત્રોના તેમ જ જહેર ફરિયાદોના નિકાલ માટે કરેલી નિવેદનરૂપ અરજીઓના હાથના લખેલા મુસ્દા, અરજીઓની. અને પોતે તૈયાર કરેલાં ચોપાનિયાંઓની છાપેલી નકલો, દક્ષિણ આફ્રિકાનાં છાપાંઓમાંથી કાઢેલી કાપલીઓ અને પોતાના થોડા પત્રો, થોડી અરજીઓ અને થોડાં નિવેદનો જેમાં પ્રસિદ્ધ થયેલાં તેવાં થોડાં દક્ષિણ આફ્રિકાની સરકારનાં પ્રકાશનો એવું બધું તે સામગ્રીમાં છે.

ગાંધીજીએ જોકે પોતાનાં બધાં લખાણો સંધરી રાખ્યાં નહોતાં. હિંદુ ધર્મનાં મૂળતાવો પર પોતે તૈયાર કરેલા લખાણનો ઉલ્લેખ કરી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ (૧૯૮૬, પા. ૨૫૫)માં તેમણે લખ્યું છે, “આવી વસ્તુઓ તો ધાર્યો મેં મારી જિદગીમાં નાખી દીધી છે કે બાળી નાખી છે. એ વસ્તુઓને સંધરી રાખવાની આવશ્યકતા મને જેમ જેમ ઓછી જણાતી ગઈ અને જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ, તેમ મેં આવી વસ્તુઓનો નાશ કર્યો. મને તેનો પશ્ચાત્તાપ નથી. એ વસ્તુઓનો સંગ્રહ મને બહુ બોજારૂપ અને ખરચાળ થઈ પડત. તેને સાચવવાનાં સાધન મારે ઉત્પન્ન કરવાં પડત, એ મારા આપરિગ્રહી આત્માને અસંઘ થાત.”

લંડનમાં અને દક્ષિણ આફ્રિકામાં મળી શકે એવાં સરકારી તેમ જ અન્ય દફ્તરોમાંથી મદદ-નીશ સંશોધકો અમારે માટે સામગ્રી એકઠી કરે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન જે સામગ્રી લેતા આવ્યા હતા તેમાં એથી ઉમેરો થયો છે.

દક્ષિણ આફ્રિકાની સામગ્રીમાં હિંદી કોમની વતી ગાંધીજીએ ત્યાંની સરકાર આગળ રજૂ કરેલી ધારી અરજે અને અરજનાં નિવેદનો છે. તેમના પર તેમની નહીં પણ કોમનું પ્રતિનિધિત્વ ખરાવનારા આગેવાનો અંથવા નાતાલ ઈન્ડિયન ટેંગ્રેસ કે ટ્રોન્સપાલ બ્રિટિશ ઈન્ડિયન ઓસો-સિયેશન જેવી સંસ્થાના હોદદારોની સહી છે. ૧૮૮૮ના સાટેમ્બરની ૨૫મી તારીખના તેમના પત્ર (જે આ પુસ્તકમાં પા. ૧૮૦ પર પ્રસિદ્ધ કર્યો છે તે)માંના તેમના પોતાના વિધાન પરથી સ્પષ્ટ દેખાય છે કે એ અરજે તેમણે ધરી હતી. તે પત્રમાં તેમણે લખ્યું છે, “... અનેક અરજીઓના ખરડા ધડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારે શર છે.” ૧૮૮૪ની સાલના જુલાઈ માસમાં લોડ રિપનને મોકલવામાં આવેલી અરજીના દાખલા પરથી આ વાતની સાબિતી મળે છે. તેના પર તેમની સહી નથી, બીજા લોકોની છે; પણ તેને વિષે આત્મકથા (૧૮૫૮ની આવૃત્તિ, પા. ૧૪૨)માં તેઓ લખે છે, “અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી. હાથ આવ્યું તે બધું સાહિત્ય મેં વાંચી લીધું.”

૧૯૮૪ની સાલ પછી થોડાં વરસ ગાંધીજી નાતાલમાં રહ્યા હતા છતાં પાછળથી જે ટ્રાન્સવાલ નામથી ઓળખાયું તે સાઉથ આફ્રિકન રીપબ્લિક એટલે કે દક્ષિણ આફ્રિકાના પ્રભાગની અરજીઓને પણ આ પુસ્તકમાં લઈ લીધી છે. એ અરજીઓને ગાંધીજીના લખાણમાં ગણાવવાનું કારણ એવું છે કે દક્ષિણ આફ્રિકામાં પોતાનું પહેલું વર્ષ એટલે કે ૧૯૮૩ની સાલનો કંઈક અને ૧૯૮૪ની સાલનો થોડો ભાગ તેમણે ટ્રાન્સવાલની રાજ્યાની પ્રિટોરિયામાં ગણ્યો હતો અને તે દરમિયાન તેમને ત્યાંના હિંદીઓનો અને તેમના સવાલોનો ધાડો પરિચય થયો હતો. પોતાની આત્મકથામાં (પા. ૧૨૬ પર) તેઓ લખે છે, “... પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હોય જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહીં થયો હોઉં.” વળી (પા. ૧૨૮ પર) તેઓ જણાવે છે, “ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાઉમારીઓનો ઈલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચયું, ને તેમાં મને મળે તેટલો વખત વગર વેતને આપવાનું મેં જણાયું.” ત્યાર બાદ તેમણે નાતાલમાં રહી કાર્ય કર્યું એ ખરું, છતાં ટ્રાન્સવાલના હિંદીઓ પોતાની અરજીઓ તૈયાર કરાવવાને તેમની પાસે પહેંચ્યો જતા હોય એવો પૂરો સંભવ છે. નાતાલમાં કે ટ્રાન્સવાલમાં ગમે ત્યાં રહ્યા હોય, પણ આખાયે દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલમાં તેમને ઊંડો રસ હોઈ દક્ષિણ આફ્રિકાના ઓરેનજ ફ્રી સ્ટેટ અને કેપ કોલોની જેવા ભાગોમાં અને રોડેશિયામાં પોતે નહોતા રહ્યા તોપણ તે બધા ભાગોમાં રહેતા હિંદીઓના સવાલો વિષે તેમણે હમેશ લખ્યાનું જેવા મળે છે.

છતાં એટલું કહેનું જોઈએ કે હિંદીઓએ અમલદારોને અગર સરકારમાં કરેલી બધી અરજીઓ ગાંધીજીએ ઘડી નહોતી; તેઓ દક્ષિણ આફ્રિકામાં પહેંચ્યા તે પહેલાં પણ એવી કેટલીક અરજીઓ આપવામાં આવી હતી. એ અરજીઓ તેમને યુરોપિયન વકીલોએ પોતાના ધંધાની રાહે ઘડી આપી હતી એ સહેલે દેખાય. એવું છે. તેમ છતાં ગાંધીજી એ ઠેકાણે પહેંચ્યા તે પણી અને હિંદીઓના સવાલોમાં તેમણે ઊંડો રસ લેવા મંડયો તે પછી સામાન્યપણે હિંદીઓએ તેમની પાસેથી જ પોતાની અરજીઓ ઘડાવવા માંડી હોય એવો પૂરો સંભવ છે. શ્રી છગનલાલ ગાંધી અને શ્રી પોલાક બન્નેએ લગભગ ૧૯૮૪ની સાલથી માંડીને ગાંધીજી સાથે કાર્ય કર્યું અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના બાકીના વખતના વસવાટ દરમિયાન જે બન્ને તેમની સાથે જોડાયેલા રહ્યા તેમનો પણ એવો જ અભિપ્રાય છે.

બીજાં બે લખાણો પર ગાંધીજીની સહી નથી છતાં તે બન્ને આ પુસ્તકમાં લેવામાં આવ્યાં છે. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસનું બંધારણ અને તેના કામકાજનો પહેલો હેવાલ એ બે તે લખાણો છે. ગાંધીજીએ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી અને તેઓ તેના પહેલા મંત્રી હતા. ગાંધીજીએ પોતાને હાથે લખેલો એ બંધારણનો એક ખરડો મળી આવ્યો છે.

મળી આવતા પુરાવા પરથી સૃપણ થાય છે કે ગાંધીજીએ પહેલી અરજી ૧૯૮૪ની સાલના જૂન માસમાં ઘડી હતી. ત્યાર બાદ, તેમણે અવિશ્વાનતપણે એક પછી એક જપાટાબંધ અરજીઓ તૈયાર કરી હોય એમ લાગે છે. પોતાના સાર્વજનિક કાર્યમાં આ તબક્કે અન્યાયો દૂર કરાવવાને તેમણે હીકક્કો મેળવીને પ્રસિદ્ધ કરવાની અને દલીલો રજૂ કરી તંકબુદ્ધિને તેમ જ અંતઃકરણને એટલે કે ધર્મબુદ્ધિને અપીલ કરવાની રીત આખત્યાર કરી હતી. બાર વર્ષથીએ વધારે સમય સુધી દક્ષિણ આફ્રિકામાં આ કાર્યપદ્ધતિનો પ્રયોગ કર્યા પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે સ્થાપિત

હિતો દલીલને નમતું ન આપે ત્યારે સત્યાગ્રહ કરવાની અથવા કોઈક પ્રકારનું સીધું પગલું ભરવાની જરૂર ઊભી થાય છે.

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે દરમિયાન ગાંધીજીની ઉંમર માત્ર વીસથી ત્રીસની વચ્ચેની હતી એ બીના વાચકે ખ્યાલમાં રાખવા જેવી છે. એ બધાં લખાણો તેમ જ ભાષણો સહેજે નજરે ચડે તેવો સંયમ અને અતિશયોજિતનો અભાવ, સત્યને વળગી રહેવાની ચીવટ, અને સામાની દૃષ્ટિને પૂરો ન્યાય કરવાની આકંસા એ બધાં તેમના આખાયે જીવન દરમિયાન તેમનામાં રહેલાં લક્ષણો બરાબર પ્રગટ કરે છે.

૧૮૮૩ની સાલથી માંડીને ૧૯૧૪ની સાલ સુધીના ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યને બગતી વિગતો સમજવામાં સામાન્યપણે ઉપયોગી થાય તેટલા ખાતર દક્ષિણ આફ્રિકાના રાજબંધારણના માળખા પર એક નોંધ, દક્ષિણ આફ્રિકાની તવારીખ, ત્યાંના ઈતિહાસની ભૂમિકા, અને એક નાતાલનો ને બીજે દક્ષિણ આફ્રિકાનો એમ બે નકશા પુસ્તકમાં આપવામાં આવ્યા છે.

ગાંધીજીનું જીવનચરિત્ર ટૂંકમાં આપવાનું કાર્ય આ પુસ્તકશોલીના કાર્યની મર્યાદામાં ન હોવાથી પુસ્તકમાં આપવામાં આવેલી કાલાનુકમળિકમાંથી જન્મથી માંડીને આ પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણોની છેલ્લામાં છેલ્લી તારીખ સુધીના ગાંધીજીના જીવનનો તેમ જ કાર્યનો વાચકને ખ્યાલ આવે તેવી કોશિશ કરવામાં આવી છે.

આ પુસ્તકમાં બેવામાં આવેલી સામગ્રી સારુ પોતાનાં પુસ્તકો તેમ જ ગાંધીજીના પત્રો ને બીજાં પ્રસિદ્ધ ન થયેલાં ગાંધીજીનાં લખાણોની છબીઓના સંગ્રહવાળા ઉપયોગી પુસ્તકાલય તેમ જ સંગ્રહાલર્યનો અમને ધૂટથી ઉપયોગ કરવા દેવાને માટે નવી દિલ્હીમાં આવેલા ગાંધી સમારક નિધિના અમે આભારી છીએ. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકાનાં ધાર્યાંઓની કાપલીઓ, ત્યાંની સરકારનાં પ્રકાશનો, અને તે ઉપરાંત ગાંધીજીના પત્રો અને તેમણે દક્ષિણ આફ્રિકામાં વખતોવખત બહાર પાડેલાં લખાણો જેવી મૂલ્યવાન સામગ્રીનો ઉપયોગ કરવા દેવાને માટે અમે સાબરમતી આકાશ સંરક્ષણ અને સમારક ટૂસ્ટના ઋણી છીએ.

જરૂરી સામગ્રી મેળવવાને પોતાનાં પુસ્તકાલર્યોમાં તેમ જ. જૂનાં દફ્તરો સંઘરવાના ખંડોમાં અમારા લંડનમાં કાર્ય કરતા મદદનીશને સંશોધન કરવાની સગવડ આપવાને માટે લંડનની સંસ્થાનોની કચેરી, બ્રિટિશ મ્યૂઝિયમ, અને લંડન વેન્જિટેરિયન સોસાયટીની ઓફિસનો પણ અમારે આભાર માનવાનો છે.

સામગ્રી એકત્ર કરવામાં જરૂરી સગવડ આપવાને માટે અમે કલકત્તાની નેશનલ લાઈબ્રેરીના અને કલકત્તા, મુંબઈ ને મદ્રાસમાં આવેલી ધાર્યાંઓની ઓફિસોના ઋણી છીએ.

અમદાવાદમાં આવેલું ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, નવી દિલ્હીમાં આવેલી એ.આઈ.-સી.સી.ની લાઈબ્રેરી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્ક ઓફ્સર્સ લાઈબ્રેરી, દિલ્હી યુનિવર્સિટી લાઈબ્રેરી (ડિપાર્ટમેન્ટ ઓફ આફ્રિકન સ્ટડીઝ), દિલ્હીમાં અને મુંબઈમાં આવેલી યુ.એસ.આઈ.એસ. લાઈબ્રેરીઓ, મુંબઈમાં આવેલી યુનિવર્સિટી લાઈબ્રેરી અને એશિયાટિક સોસાયટી લાઈબ્રેરી એ બધી સંસ્થાઓએ અમને માહિતી અને મેંદદ મેળવવામાં સગવડ આપી તે માટે અમે તેમના આભારી છીએ.

પુસ્તકમાંની બાબત નં. ૩, ૫, ૬ અને ૧૩ અને પા. ૮૭ની સામેની છબીને માટે અમે શ્રી ડી. જી. તેન્ડુલકર અને મહાત્માના પ્રકાશકોના અને લખાણોની છબીઓ માટે ગાંધી સમારક નિધિના ઋણી છીએ.

## દક્ષિણ આંધ્રિકાના હિંદીએના સવાલની ઐતિહાસિક ભૂમિકા

૧૯૮૮ની સાલમાં ગાંધીજી દક્ષિણ આંધ્રિકા ગયા ત્યારે તેમાં નાતાલ, કેપ, ટ્રાન્સવાલ અને ઓરેનજ ફ્રી સ્ટેટ એમ ચાર સંસ્થાનોનો સમાવેશ થતો હતો. દંતકથાઓમાં ગવાયેલા હિંદને માર્ગે જતાં કેવળ અક્સમાતથી દક્ષિણ આંધ્રિકાની શોધ કરવારા યુરોપિયનોના વંશને આ સંસ્થાનોનો રાજવહીવટ ચલાવતા હતા. શરૂઆતમાં પૂર્વના મુલકોના માર્ગમાં મુકામ કરવાના સ્થળ તરીકે અને પાછળથી પોતાના વતન તરીકે તેમણે ત્યાં વસવાટ આરંભ્યો અને તેની જિલવણી કરી.

૧૯૮૮ની સાલમાં એ મુલકમાં વર્ચસ ધરાવનારા ઉચ અથવા બોઅર અને બ્રિટિશ લોકો હતા. તેમાંથી ટ્રાન્સવાલ ને ઓરેનજ ફ્રી સ્ટેટમાં ઉચ લોકોનું અને નાતાલ ને કેપમાં બ્રિટિશ લોકોનું વર્ચસ હતું. બ્રિટિશ લોકોએ એ પ્રદેશમાં આવી ઉચ લોકો પાસેથી ૧૯૦૬ની સાલમાં કેપનો અને ૧૯૪૭ની સાલમાં નાતાલનો કબજો પડાવી લીધો ત્યાં સુધી આથરે બસો વરસ લગી ત્યાં ઉચ લોકોનું લગભગ બિનતકરાર રાજ્ય ચાલતું હતું. આ બે બનાવો બન્યા પછી ધણાખરા ઉચ લોકોએ દેશના અંદરના ભાગમાં જઈ ટ્રાન્સવાલ અને ઓરેનજ ફ્રી સ્ટેટનો કબજો કર્યો. આમ છતાં ઉચ લોકોના પ્રદેશમાં બ્રિટિશોનો અને બ્રિટિશોના પ્રદેશોમાં ઉચ લોકોનો વસવાટ હતો ખરો.

આ બન્ને પ્રજાઓ વચ્ચે કાયમ ધર્ષણ રહેતું. બન્નેને મુલકમાં પોતાની સરસાઈ સ્થાપવી હતી; આખરે બોઅર યુદ્ધ (૧૯૮૮-૧૯૦૨)માં ધર્ષણ છેલ્લી હદે પહોંચી ગયું. તે યુદ્ધને અંતે દક્ષિણ આંધ્રિકાનો આખોએ મુલક બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યો. ઉચ પ્રજાના કબજાના વિસ્તારોમાં વસવાટ કરીને રહેલા બ્રિટિશ તેમ જ હિંદી પ્રજાજનોના વાજબી હકો તેમને મેળવી આપવાને અસલમાં અમે આ યુદ્ધ જેડયું છે એવો બ્રિટિશ લોકોનો દાવો હતો.

ગાંધીજી દક્ષિણ આંધ્રિકામાં પહોંચ્યા તે વખતે ચારે સંસ્થાનો એકબીજાથી સ્વતંત્ર હતાં અને સૌ પોતપોતાની નીતિને અનુસરતાં. પોતાના પ્રજાજનોના હિતનું રક્ષણ કરવાને લાંડનની બ્રિટિશ સરકાર એ વખતે પોતાના એજન્ટ એ સંસ્થાનોમાં રાખતી અને કંઈક અંશે તેમની સરકારોની નીતિરીતિ પર કાબૂ ધરાવતી. પણ પાછળથી ૧૯૧૦ની સાલમાં બ્રિટિશ નેજા નીચે દક્ષિણ આંધ્રિકાનું સંઘરાજ્ય રહ્યેને આ સંસ્થાનો એકત્ર થયાં અને તેમને સ્વરાજના પૂરા અધિકાર મળ્યા ત્યારે લાંડનની શાહી સરકારે તેમની બાબતમાં તેમ જ દક્ષિણ આંધ્રિકાની સંઘ સરકારની બાબતમાં દખલ ન કરવાની નીતિ અખત્યાર કરી. દક્ષિણ આંધ્રિકા હવે ડેમિનિયનના દરજાનું સંસ્થાન છે, તેથી બ્રિટિશ કોમનવેલ્થનું સ્વરાજના અધિકાર ભોગવતું સહ્ય છે અને પોતાનો વહીવટ પોતાની રીતે પોતાની હંચા મુજબ ગોઠવવાને સ્વતંત્ર છે એવી શાહી સરકારની એ નીતિ અખત્યાર કરવા માટેની દલીલ હતી. લાંડનની શાહી સરકારના એશિયાઈ પ્રજાજનોની ફરિયાદોના નિકાલનો વિષય દક્ષિણ આંધ્રિકાના સંઘરાજ્યના ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલને હસ્તક ગયો અને એ બાબતમાં દક્ષિણ આંધ્રિકાની સરકારની નીતિ પર પ્રભાવ પાડવાની બ્રિટિશ શાહી સરકારની થક્કિ રહી નહીં. પણ ગાંધીજીના દક્ષિણ આંધ્રિકાના વસવાટના ધસ્તા મોટા ભાગ દરમિયાન એવી સ્થિતિ નહોતી.<sup>1</sup>

દક્ષિણ આંધ્રિકાના મુલકમાં જેતીની જિલવણીને માટે અને તેની ખનિજસંપત્તિનો ઉપયોગ કરવાને માટે ત્યાંના સંસ્થાનોના ગોરાઓને મજૂરોની જરૂર હતી, મજૂરો તરીકે આંધ્રિકાવાસી તેમને

સિથર અને આધાર રાખવા લાયક જણાયા નહોતા કેમ કે પોતાની જમીનમાંથી જે કંઈ આદૃતું પાતળું મળે તેના પર દહાડા કાઢવામાં તેમને સંતોષ હતો અને તેમાંના મોટા ભાગના રોજ પર કામ કરવાને હેતેજાર નહોતા. બ્રિટિશ સંસ્થાનોએ તેથી હિંદના બ્રિટિશ રાજકર્તાઓ સાથે હિંદી મન્જૂરોને કરારથી બાંધી દક્ષિણ આફ્રિકામાં મંગાવવાની વ્યવસ્થા કરી. ૧૮૬૦ની સાલમાં એવા મન્જૂરોની પહેલી ટુકડી દક્ષિણ આફ્રિકા પહોંચી. પોતાના કરારની મુદ્દત પૂરી થયે આ મન્જૂરો કાં તો હિંદ પાછા ફરી શકતા અથવા ફરી પાંચ વરસની મુદ્દતને માટે નવા કરારથી બંધાઈ દક્ષિણ આફ્રિકામાં રહી શકતા અથવા પોતાને હિંદ પાછા ફરવાને માટે આગબોટના ભાડાની રકમ જેટલી ડિમતની જમીન સરકાર તેમને આપે તેના પર સ્વતંત્ર નાગરિકો તરીકે ત્યાં રહી શકતા.

આ મન્જૂરો સામાન્યપણે હિંદના ગરીબમાં ગરીબ લોકોમાંથી આવતા, તંદુરસ્તીને પોપક સ્વચ્છ રહેણીકરણીની તાલીમ વગરના અને ઘણી બાબતોમાં પછાત હતા. તેમની પાછળ તરત જ તેમની જરૂરિયાતો પૂરી પાડવાને હિંદી વેપારીઓ આવ્યા. દક્ષિણ આફ્રિકાની હિંદી વસ્તીની મૂળ શરૂઆત આ રીતે થઈ.

આવી જતના બીજા મન્જૂરોને દક્ષિણ આફ્રિકા મોકલવાને માટેનો નવો કરાર કરતી વખતે ૧૮૬૮ની સાલમાં હિંદુસ્તાનની સરકારે ચોખ્ખી શરત કરાવી હતી કે પોતાના કરારની મુદ્દત પૂરી થયા બાદ એ મન્જૂરોને સમાન દરજાને મળશે, તેમને રાજ્યના સામાન્ય કાનૂનો લાગુ પડશે અને તેમની સાથે કાયદાની બાબતમાં અથવા વહીવટના અમલની બાબતમાં બેંદભાવ રાખવામાં નહીં આવે. આવા મન્જૂરોની માગણી કરનારી નાતાલની સરકારે આ શરત મન્જૂર રાખી હતી અને ત્યાર બાદ "૧૮૭૦ની સાલમાં લંડનની બ્રિટિશ સરકારે પણ તે વાત મન્જૂર રાખી હતી. વળી પોતાના ૧૮૮૮ની સાલના ઢંઢેરામાં બ્રિટિશ રાણીએ "અમારા હિંદી મુલકના વતનીઓને" "અમારા બીજા પ્રજાજનોના અધિકાર જેવા જ અધિકારો" રહેશે એવી બાંધકારી આપી હતી.

પણ ઉચ્ચ લોકો હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં ટકી પડે તે વાતનો પહેલેથી એકસરખો વિરોધ કરતા આવ્યા હતા. ચીની સમેત બીજા ઓણિયાવાસી મન્જૂરોને દરાવવામાં આવેલી મુદ્દતને માટે લાવવામાં આવે અને તે પૂરી થયે તરત જ તેમને પોતપોતાના મુલકમાં પાછા મોકલી દેવામાં આવે એવી તેમની ઈચ્છા હતી. આફ્રિકાવાસી કાળા લોકોને તેમને માટે નક્કી કરી આપવામાં આવેલા વિસ્તારોમાં અલગ રાખી પોતાનાં સંસ્થાનો કેવળ ગોરાં રહે એવું તે ઈચ્છા હતા.

ત્યાં વસવાટ કરીને રહેલા બ્રિટિશ લોકોની પણ એવી જ ઈચ્છા હતી કેમ કે બીજા યુરોપિયન ધાંધાદારીઓની માફક જેતીમાં તેમ જ વેપારમાં હિંદીઓ તેમને પણ ભયંકર હરીફો જણાયા હતા. હિંદી જેડૂતે એ મુલકમાં નવાં ફળો અને શક્કભાજી દાખલ કરી તેમને ઓછે ખરચે ને મોટા જથ્થામાં પેદા કરવા માંડ્યાં અને તેથી ગોરા જેડૂતને મળતા ભાવ ઊતરી ગયા. હિંદી વેપારી ઓછે ખરચે રહેતો, દુકાન ચલાવવાને સાધનો કે માણસોમાં નહીં જેવો ખર્ચ કરતો એટલે બ્રિટિશ કે ઉચ્ચ વેપારીઓનાંકરતાં ઓછે ભાવે પોતાનો માલ વેચી શકતો. તેથી ગોરાઓને એવી બીક લાગી કે હિંદીઓને મુલકમાં છૂટથી આવવા દેવામાં આવશે અને ફર્ખે તે રીતે વેપારમાં કે જેતીમાં જમી જવા દેવામાં આવશે તો તે બધા મળીને પોતાને લાચાર કરી મૂકશે.

તે મુજબ હિંદીઓ પર અસંખ્ય નિયંત્રણો ને અંકુથો મુક્યાં. એમાંનો સૌથી પહેલો નિયંત્રણો કાયદો ઉચ્ચ પ્રજાસત્તાક ટ્રાન્સવાલનો ૧૮૮૮ની સાલનો જીજો કાનૂન હતો. તેનાથી

એવું કરાવવામાં આવ્યું કે એશિયાવાસીઓ ઉચ્ચ નાગરિકત્વના અધિકાર મેળવી નહીં શકે. તેનાથી એવી ફરજ પાડવામાં આવી કે “જાહેર તંદુરસ્તીને ખાતર” હિંદીઓને માટે ખાસ અલગ કાઢવામાં આવેલા લતાઓમાં જ તેમણે રહેવું, તેવા લતાઓ સિવાય બીજે તેઓ સ્થાવર મિલકત રાખી નહીં શકે, તેમનામાંના જે વેપારને સારુ રાજ્યમાં પ્રવેશ કરે તેમનું લવાન્જમ લઈ એક રન્જિસ્ટર રાખવામાં આવે અને ધંધો કરવાને તેમણે પરવાનો મેળવવો જોઈએ.

ઈંડિયાની નામદાર રાષ્ટ્રી અને ટ્રાન્સવાલ ઉચ્ચ પ્રાંતીની વર્ષે ૧૮૮૪ની સાલમાં થયેલી સમજૂતીની ચૌદમી કલમનો જોકે આ કાનૂન છદેચોક ભંગ કરતો હતો કેમ કે તે કલમમાં જાહેર કરવામાં આવ્યું હતું કે “આદ્રિકાના અસલ વતનીઓ સિવાયનાં” બધાં માણસોને ટ્રાન્સવાલના પ્રાંતીના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરવાની, મુસાફરી કરવાની, રહેવાની, મિલકત રાખવાની અને પોતાનો વ્યવસાય ચલાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા રહેશે અને તેમના પર ઉચ્ચ નાગરિકો પર નાખવામાં નહીં આવ્યા હોય એવા કોઈ કરવેરા નાખવામાં નહીં આવે. એ સંસ્થાનમાં વસતા બ્રિટિશ પ્રાંતીનોનાં હિતની સંભાળ રાખવાને બ્રિટિશ હાઈ કમિશનર વાં રહેતો હતો. પણ શું ઉચ્ચ કે બ્રિટિશ, સંસ્થાનમાં “થઈ રહેલા એશિયાવાસીઓના આકમણના જોખમની” વાતો કરનારા ટ્રાન્સવાલના બધાયે ગોરાઓની ચલાવણના દબાલથી તેણે લંડનની સરકારને એ કાનૂનનો વિરોધ ન કરવાની સલાહ આપી અને તેને અનુસરીને લંડનની બ્રિટિશ સરકારે આ હિંદી વિરોધી ધારાની સામે કોઈ પણ જતનો વાંધો ન ઉછાવવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી.

બીજા બ્રિટિશ પ્રાંતીનોની સાથે હિંદીઓને સરખા હક રહેશે એવી શાહી સરકારની આગળની જાહેરાતો છતાં દક્ષિણ આદ્રિકામાંના હિંદીઓને લગતી પોતાની નીતિ તેણે આ રીતે ફેરવી નાખી તેને પરિણામે ઉચ્ચ તેમ જ બ્રિટિશ એમ બંને હકૂમત હેઠળના પ્રદેશોમાં શાહી સરકારને પોતાના પ્રાંતીનોનું સંરક્ષણ કરવાની પૂરી સત્તા હતી, તે વખતે સુધ્યાં એકલા ઉચ્ચ હકૂમત નીચેના ટ્રાન્સવાલમાં જ નહીં, બ્રિટિશ હકૂમત હેઠળના નાતાલમાં પણ હિંદીઓ અને બીજાઓ વર્ષે બેદભાવ કરનારા કાયદાઓને માટે રસ્તો મોકાં થઈ ગયો.

આખાયે દક્ષિણ આદ્રિકામાં હિંદીઓની સામે રેલવે ગાંધીઓમાં, બસોમાં, નિશાળોમાં અને હોટલોમાં તેમની નીતિને કારણે બેદભાવથી વહેવાર રાખવામાં આવતો હોઈ તેમને પરવાનો કફાયા વગર એક સંસ્થાનમાંથી બીજામાં જવા દેવામાં આવતા નહોતા. ૧૮૮૪ની સાલમાં જ્યાં હિંદીઓની વસ્તી વધારેમાં વધારે હતી તેવા નાતાલ જેવા બ્રિટિશ સંસ્થાનમાં તેમનો દરજાનો ઉતારી નાખનારો અને તેમને પોતાના રાજકીય અધિકારોનો અમલ કરવામાં રોકનારો તેમનો મતાધિકાર રદ કરનારો કાયદાનો ખરડો મંજૂર થવાની આણી પર હતો.

૧૮૮૫ની સાલના મે માસમાં ગાંધીજી વકીલ તરીકે પોતાના ધંધાને લગતું એક કામ વઈને દક્ષિણ આદ્રિકા ગયા હતા. ૧૮૮૫ની સાલમાં કાયદાને લગતું પોતાનું કામકાજ પતાવી તેઓ દક્ષિણ આદ્રિકા છોડવાની તૈયારીમાં હતા તેવાંમાં અખભારોમાં એ કાયદાના ખરડાનો ઉલ્લેખ તેમના જોવામાં આવ્યો. એ ખરડાનો અર્થ પોતાના દેશબાંધવો કે જેમાંના મોટા ભાગના અભય હતા તેમને માટે કેવો થશે એ બીજા તરફ ગાંધીજીએ તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે તે લોકો પોતાને મદદ કરવાને ત્યાં રોકાઈ જવાને ગાંધીજીને સમજાવી શક્યા. આ અને હિંદીઓની એવી બીજી ફરિયાદોમાં તેમને ન્યાય મેળવી આપવાના કામમાં ગાંધીજીને એકવીસ વરસ સુધી એટલે કે ૧૮૯૪ની સાલ સુધી તે દેશમાં રોકાનું પડ્યું.

## અનુક્રમણિકા

અંજલિ	ડૉ. રાજેન્દ્રપ્રસાદ	૭
પરિચય	જવાહરલાલ નેહરુ	૧૧
સામાન્ય પ્રસ્તાવના		૧૩
આ પુસ્તકની પ્રસ્તાવના		૧૯
દક્ષિણ આદ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા		૨૩
<b>૧. પિતાને પત્ર</b>		<b>૧</b>
૨. રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ		૧
૩. લક્ષ્મીદાસ ગાંધીને પત્ર		૨
૪. લંડન ડાયરીમાંથી		૩
૫. મિ. લેલીને પત્ર		૧૫
૬. કર્નલ જે. ઉભલ્યુ. વોટ્સનને પત્ર		૧૭
૭. હિદના શાકાહારીઓ		૧૮
૮. કેટલાક હિંદી તહેવારો		૨૮
૯. હિદના ખોરાક		૩૩
૧૦. લંડનની બોન્ડ ઓફ મર્સી — જીવદ્યા મંડળીને આપેલું ભાષણ		૩૮
૧૧. હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ		૩૮
૧૨. પોતે ઈંગલંડ શા સાચુ ગયા		૪૦
૧૩. ઓડવોકેટ તરીકે નોંધાવા માટે અરજી		૪૭
૧૪. હિદ ભાણી વતનને રસ્તે		૪૮
૧૫. પટવારીને પત્ર		૫૪
૧૬. ઓળખનો સવાલ		૫૫
૧૭. હિંદી વેપારી		૫૫
૧૮. નવા ગવર્નરને આવકાર		૫૮
૧૯. હિંદીઓના મત		૫૮
૨૦. શાકાહારના સિલ્જાંત માટે કાર્ય		૬૧
૨૧. પ્રાણપોષક ખોરાકનો અખતરો		૬૨
૨૨. ઈંગલંડમાં રહેતા હિંદીઓને		૬૫
૨૩. શાકાહાર અને બાળકો		૬૭
૨૪. ધર્મ વિષે સવાલો		૬૭
૨૫. નાતાલ એસેમ્બ્લીને અરજી		૬૮
૨૬. નાતાલના વડા પ્રધાનને મળેલું પ્રતિનિધિમંડળ		૭૩
૨૭. ધારાસભાના સભ્યોને માટે સવાલો		૭૫
૨૮. નાતાલના ગવર્નરને મળેલું પ્રતિનિધિમંડળ		૭૬

૨૯. નાતાલ કાઉન્સલને અરજી	૭૮
૩૦. દાદાભાઈ નવરોજીને પત્ર	૭૯
૩૧. નાતાલ કાઉન્સલને બીજી અરજી	૮૦
૩૨. હિંદીઓ અને મતાધિકાર	૮૩
૩૩. નાતાલના ગવર્નરને પત્ર	૮૫
૩૪. દાદાભાઈ નવરોજીને પત્ર	૮૬
૩૫. લોર્ડ રિપનને અરજી	૮૭
૩૬. દાદાભાઈ નવરોજીને પત્ર	૮૮
૩૭. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ	૮૯
૩૮. 'રામીસામી'	૯૦૦
૩૯. નાજરને પત્ર	૯૦૨
૪૦. ધિ એસોટેરિક કિશ્ચિયન યુનિયન	૯૦૩
૪૧. વેચાણ માટે પુસ્તકો	૯૦૪
૪૨. ખુલ્લી પત્ર	૯૦૫
૪૩. યુરોપિયનોને પત્ર	૯૨૩
૪૪. ભૌતિકવાદનું અધૂરાપણું	૯૨૪
૪૫. દાદાભાઈ નવરોજીને પત્ર	૯૨૭
૪૬. વેચાણ માટે પુસ્તકો	૯૨૭
૪૭. મુસ્લિમ કાનૂન	૯૨૮
૪૮. પ્રિટોરિયાના એજન્ટને અરજી	૯૩૨
૪૯. નાતાલ ધારાસભાને અરજી	૯૩૩
૫૦. કમરૂદીનને કાગળ	૯૩૬
૫૧. શાકાહારી મિશનરીઓની મંડળી	૯૩૬
૫૨. લોર્ડ રિપનને અરજી	૯૪૨
૫૩. લોર્ડ એલિજનને અરજી	૯૬૦
૫૪. નાતાલ કાઉન્સલને અરજી	૯૬૩
૫૫. મિ. ચેમ્બરલેનને અરજી	૯૬૫
૫૬. લોર્ડ એલિજનને અરજી	૯૭૬
૫૭. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસનો પહેલો હેવાલ	૯૭૮
૫૮. હિંદી મતાધિકાર (ધિ નાતાલ મર્ક્યુરીને પત્ર)	૯૮૪
૫૯. હિંદી મતાધિકાર (ધિ નાતાલ મર્ક્યુરીને પત્ર)	૯૮૬
૬૦. ઈન્ડિયન કોંગ્રેસ (ધિ નાતાલ એડવર્ટાઇઝરને પત્ર)	૯૮૮
૬૧. ઈન્ડિયન કોંગ્રેસ (ધિ નાતાલ મર્ક્યુરીને પત્ર)	૯૮૦
૬૨. ઈન્ડિયન કોંગ્રેસ (ધિ નાતાલ મર્ક્યુરીને પત્ર)	૯૮૧
૬૩. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સભામાં ભાષણ	૯૮૨
૬૪. હિંદીઓનો પ્રશ્ન (ધિ નાતાલ એડવર્ટાઇઝરને પત્ર)	૯૮૨
૬૫. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ	૯૮૩

૬૬. મિ. ચેમ્બરલેનને અરજી	૧૯૬
૬૭. હિંદી મતાધિકાર	૧૯૮
૬૮. નાતાલમાં શાકાહાર	૨૧૧
૬૯. શાકાહારનો સિલ્ફાંત	૨૨૪
૭૦. નાતાલના ગવર્નરને અરજી	૨૨૬
૭૧. હિંદીઓ અને પરવાના	૨૨૮
૭૨. જૂલુલોન્ડ માટેના હંગામી સેકેટરીને પત્ર	૨૩૨
૭૩. જૂલુલોન્ડ માટેના સેકેટરીને પત્ર	૨૩૩
૭૪. દાદાભાઈ નવરોજીને પત્ર	૨૩૩
૭૫. વેડરબનને પત્ર	૨૩૪
૭૬. મિ. ચેમ્બરલેનને અરજી	૨૩૫
૭૭. હિંદી મતાધિકાર (ધિ નાતાલ વિટનેસને પત્ર)	૨૩૮
૭૮. નાતાલ ઓસેમ્બલીને અરજી	૨૪૨
૭૯. દાદાભાઈ નવરોજીને તાર	૨૪૮
૮૦. નાતાલ ઈન્ડિયન કેંગ્રેસ (નાતાલના વડા પ્રધાનને પત્ર)	૨૪૯
૮૧. નાતાલ ઈન્ડિયન કેંગ્રેસ	૨૫૦
૮૨. મિ. ચેમ્બરલેનને અરજી	૨૫૧
૮૩. હિંદ જતાં પહેલાંની મુલાકાત	૨૬૮
૮૪. હિંદીઓનો મેળાવડો	૨૭૦
આધારરૂપ સાહિત્ય	૨૭૧
તારીખવાર વૃત્તાંત	૨૭૨
દક્ષિણ આસ્ટ્રેલિના રાજ્યબંધારણનું માળખું	૨૭૫
દક્ષિણ આસ્ટ્રેલિનું ટ્રેક્ટ વૃત્તાંત	૨૮૪
નાંધો	૨૮૧
સૂચિ	૨૮૭

## ચિત્રસૂચિ

ગાંધીજી - લંડનમાં વિદ્યાર્થી તરીકે	મુખ્યપૃષ્ઠ
ગાંધીજીનું જન્મસ્થળ - પોરબંદરનું ઘર	૮
રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્ક્યુલ જ્યાં ગાંધીજી ભણેલા	૯
૧૮૯૦ની સાલમાં લંડન વેજિટેરિયન સોસાયટીના	
બીજા સભ્યો સાથે ગાંધીજી	૧૧
નાતાલ ઈન્ડિયન કેંગ્રેસના સ્થાપકો, ૧૮૮૧	૧૨
નાતાલ ઈન્ડિયન કેંગ્રેસના બંધારણનું પહેલું પાનું	૧૩
નાજરને પત્ર	૧૪
 નક્શા	
નાતાલ	૨૦૧
દક્ષિણ આફ્રિકા	૨૮૦

ગાંધીજીનો અક્ષરદેહ

Gandhi Heritage Portal

## અર્થાતી પ્રત્યે

મારાં લખાણોના ઉધમી અભ્યાસીને તેમ જ એમાં રસ વેનાર બીજાઓને કહેવા હશ્છું છું કે મને સર્વકળે એકરૂપ જ દેખાવાની કથી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઈ, પણ મારો આંતરિક વિકાસ થતો અટકયો છે. અથવા દૃષ્ટિ પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષાલું સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડલાપણ વિષે શાબ્દા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-'૩૩

— ગાંધીજી

## ૧. પિતાને પત્ર

[ગાંધીજીએ પહેલવહેલા લખેલા પત્રમાંના એકને વિષે આ ઉલ્લેખ છે. મૂળ લખાણ મળી થકે એમ ન હોવાથી તેમની આત્મકથામાંથી તેમનું પોતાનું આપેલું વર્ણન આહી ઉત્તારવામાં આવ્યું છે. પંદર વરસની ઉમરે પોતાના ભાઈએ કરેલું નાનું સરખું કરજ ફેડવાને માટે ભાઈના સોનાના નક્કર કહામાંથી એકાદ તોલાનો સોનાનો કકડો તેમણે કાપી લીધો હતો. પોતાના કામથી તેમને એટલું બધું હોણ્યું લાગ્યું કે પિતાની પાસે વાત કબૂલ કરી દેવાનો તેમણે નિશ્ચય કર્યો. કંઈ પણ કથા વગર પિતાએ મૂર્ગે મોઢે આંસુ ઢાળી માફી આપી. આ બનાવની તેમના મન પર કાપમની છાપ રહી ગઈ. ગાંધીજીએ પોતે કહ્યું છે કે 'મારે સારુ આ અર્હિસાનો પદાર્થપાઠ હતો.']

[૧૮૮૪]

મેં ચિઠ્પી લખીને હાથોહાથ આપી. ચિઠ્પીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજ માળી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી કે એવી આજીજીપૂર્વક વિનંતી કરી; ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

[મૂળ ગુજરાતી]

આત્મકથા, ૧૯૫૨, પા. ૨૬

## ૨. રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ

[બોરિસ્ટરની પરીક્ષા માટે અભ્યાસ કરવાને માટે ગાંધીજ વિલાયત જવાની તૈયારીમાં હતા ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમની સાથે ભાલુનાશ વિદ્યાર્થીઓએ તેમને વિદાય આપવાને કરેલા મેળાવડામાં તેમણે પોતાનું પહેલવહેલું ભાષણ ૧૮૮૮ની સાલના જુલાઈ માસની રથી તારીખે કર્યું લાગે છે. પોતાની આત્મકથામાં તેઓ કહે છે, 'જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યે વાંચી શક્યો. માણું ફરતું હતું, શરીર ધૂંજતું હતું એટલું મને યાદ છે' (પા. ૩૮). એ વખતે તેમની ઉમર અધાર વરસની હતી. તેમણે, ને કહેલું તેનો છાપાનો હેવાલ નીચે આપ્યો છે.]

જુલાઈ ૪, ૧૮૮૮

રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલના એક વિદ્યાર્થી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ને સામનદાસ કોલેજમાં ભાવુનગર પહેલા વર્ષનો અભ્યાસ કરતા હતા તે હાલમાં વિલાયત બારિસ્ટરનો અભ્યાસ કરવાને જય છે તેના માનમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો એક મેળાવડો તા. ૪ જુલાઈ, ૮૮ના રોજ હાઈસ્કૂલમાં થયો હતો. તે વખતે શ્રી મોહનદાસ ગાંધીને આપેલા માનપત્રના જવાબમાં તેણે કહ્યું હતું કે—

'હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઈંગલંડથી પાછા આવ્યા બાદ હિદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગુંથાશે.'

પા.-૧

હાઈસ્કુલના પહેલા આસિસ્ટન્ટ માસ્ટર ડૉક્ટરે કણ્ઠું કે હાઈસ્કુલનો એક વિદ્યાર્થી ઈંગ્લિંગ વધુ અભ્યાસ કરવા જાય છે તેને માટે આપણે ખુશી થવા જેણું છે. હું ઈચ્છા છું કે તેના કામમાં ફિલે થાય.

[મૂળ ગુજરાતી]

કાઠિયાવાડ ટાઇમ્સ, ૧૨-૭-૧૯૮૮

### ૩. લક્ષ્મીદાસ ગાંધીને પત્ર

મુલાંડન તા. ૮-૧૧-૮૮ શુક્રવાર

કૃપાસાગર મુરબ્બી વડીલ ભાઈશ્રી મુ. લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીને. સે. મોહનદાસ કરમચંદના શિર સાણ્ટાંગ દંડવત્ત સેવામાં માન્ય રાખશો. બે કે ત્રણ અઠવાડિયાં થયાં આપનો પત્ર બિલકુલ નથી એ ઘણી જી તાજુબીની તથા બેદજનક વાત છે. કારણ કંઈ સમજાતું નથી. તો પણ વચ્ચમાં થોડા દિવસ મારા પત્રો નહીં પહોંચતા હોય તેને લીધે આમ થયું હોશે. તો લાંડન પહોંચતાં સુધીમાં કાગળ લખવા નાખવાના મુકામ ન હોવાથી એમ થયું. પણ તેથી આપે કાગળ ન લખવા એ તાજુબીની વાત છે. આ દૂર દેશમાં તો માત્ર કાગળથી જ મેળાપ થાય. તો આ આપને શું સ્ન્યુયું એ ખબર પડતી નથી. ઘણી જ ચિંતા થાય છે. ઘરના ખુશખબર અઠવાડિયે સાંભળવાની જે ખરી તક તે પણ ન મળે એ થોડી દિલગીરી નથી. આખો દિવસ નવરો બેસું છું ત્યારે એ જ હિકરમાં જાય છે. તો મને લાગે છે કે હવે પછી આપ આપ આમ નહીં જ કરો. અઠવાડિયે એક પત્રું લખવા કૃપા કરશો તો પણ બસ છે. પણ આવી રીતે જે આપ મુદ્દલ પત્ર જ નહીં લખો તો શી દશા થશો એ કહી શકાતું નથી. આપને હેકાણાની ખબર ન હોત તો મને બિલકુલ હિકર ન જ થાત. પણ આપના બે પત્રો મળ્યા પછી બંધ રહ્યા એ જ બેદજનક વાત છે. મંગળવારે હું ઈન્નર ટેમ્પલમાં દાખલ થયો છું. આવતે અઠવાડિયે આપનો પત્ર આવશે એમ ઘારી આ [અ]ઠવાડિયે વિગતવાર પત્ર નથી લખ્યો. આપનો પત્ર વાંચી તમામ ખબર લખીશ. ટાઈ ઘણી જ સખત પડવા માંડી છે. આથી વધારે ટાઈ પડવાનો સંભવ ઘણો થોડો. અલબત્તા, પડે ખરી પણ જવલ્યે જ. પણ આ સખત ટાઈમાં ઈશ્વરકૃપાથી માંસમદિરાની જરા પણ જરૂર જણાતી નથી એથી હું ઘણો જ ખુશાલીમાં રહું છું. મારી તબિયત હમેથાં ઘણી જ સારી રહે છે. હાલ એ જ. માતુશ્રીની સેવામાં શિરસા દંડવત્ત પહોંચાડશો. મારી ભાભીને દંડવત્ત.

લિ. મો.

[મૂળ ગુજરાતી]

ડી. જી. તેન્ડુલકર: મહાત્મા, પૃ. ૧; મૂળ ગુજરાતી લખાણની છબી પરથી.

## ૪. લંડન ડાયરીમાંથી

[ પોતાના સગા અને સહકાર્યકર શ્રી છગનલાલ ગાંધી ૧૯૦૮ની સાલમાં લંડન જવાને નીકળ્યા ત્યારે તેમને રસ પણ્ણે અને વહેવાતુ ઉપયોગની નીવડણે એવું વિચારી ગાંધીજીએ પોતાની લંડનની ડાયરી તેમને આપી હતી.

એ રોજનોથીનાં આશરે ૧૨૦ પાનાં હતાં. શ્રી છગનલાલ ગાંધીએ તે ૧૯૨૦ની સાલમાં મહાદેવ દેસાઈને આપેલી. પણ તેમ કરતા પહેલાં તેમણે મૂળમાંનું આશરે ૨૦ પાનાંનું લખાણ એક નોટબુકમાં કાળજીથી બરાબર ઉતારી લીધેલું. બાકીનાં ૧૦૦ પાનાંનું લખાણ એકધારું ચાલુ લખાણ ન હોઈ ૧૮૮૮ની સાલથી ૧૮૯૧ની સાલ સુધીના ગાંધીજીના લંડનના વસવાટ દરમિયાનના બનાવોની માત્ર તવારીઝી નોંધ જેવું હતું.

મૂળ લખાણની ચોપડી આને કચાં છે તે જડતું નથી. શ્રી છગનલાલની ઉતારી લીધેલી નકલ અહીં આપતી વખતે સંપાદકોએ દેખીતી જેડાણીની ભૂલો સુધારી છે, વિરામથિલ્દનો ઉમેર્યા છે, કચાંક કચાંક કોઈક ખૂટતો શબ્દ મૂક્યો છે અને વાંચવામાં સરળતા રહે તેટલા ખાતર ચાલુ લખાણમાં ફૂરાઓ પાડ્યા છે.

ગાંધીજી ઓગણોસ વરસના હતા ત્યારે આ ડાયરી તેમણે અંગ્રેજમાં લખેલી અને તેથી તેમનું અંગ્રેજ હજી કેળવાતું જાય છે.]

લંડન,  
નવેમ્બર ૧૨, ૧૮૮૮

લંડન જવાની વાત શામાંથી નીકળી? વાતની શરૂઆત એપ્રિલની આખરના અરસામાં થઈ. અભ્યાસ કરવાને માટે લંડન આવવાનો ઈરાદો પાકો થયો તે પહેલાં મારા મનમાં લંડન શું છે ને કેવું છે તે જાણવાને પેદા થયેલું કુતૂહલ સંતોષવાને અહીં આવવાનો છૂપો વિચાર હતો. ભાવનગરમાં હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારે જ્યશંકર બૂચ સાથે વાત થયેલી. તેમાં તેણે મને સલાહ આપેલી કે તું મૂળ સોરઠનો વતની છે એટલે લંડન જવાને સારુ જૂનાગઢ રાજ પાસેથી સ્કોલરશિપ મેળવવાને અરજી કર. તે દિવસે તેને મેં શો જવાબ આપેલો તે મને પૂરું યાદ નથી. હું માનું છું કે એવી શિષ્યવૃત્તિ મળવાની મને અશક્યતા લાગેલી. તે [વખત]થી મારા મનમાં આ મુલકમાં આવવાનો ઈરાદો પેદા થયેલો.

૧૮૮૮ની સાલના એપ્રિલ માસની ૧૩મી તારીખે રજ ગાળવાને હું ભાવનગરથી રાજકોટ આવ્યો. રજના પંદર દિવસ પૂરા થયા પછી મારા મોટા ભાઈ અને હું પટવારીને મળવા ગયા. ત્યાંથી પાછા ફરતાં મારા ભાઈએ કહ્યું, “ચાલ, આપણે માવજી જોશીને<sup>૧</sup> મળી આવીએ,” એટલે અમે તેમને ત્યાં ગયા. માવજી જોશીએ પહેલાં હેમેથની જેમ મારી તબિયતનું પૂછ્યું. પછી ભાવનગરમાં ચાલતા, મારા અભ્યાસ બાંબતમાં થોડા સવાલ કર્યા. મેં તેમને ચોખ્યું જણાવ્યું, પહેલે વણે પરીક્ષામાં પાસ થવાણે એવું લાગતું નથી. વધારામાં મેં કહ્યું કે અભ્યાસક્રમ મને બહુ અધરો લાગે છે. આ સાંભળી તેમણે મારા ભાઈને સલાહ આપી કે બોરિસ્ટર થવાને માટે બને તેટલું જલદી આને લંડન મોકલી આપો. તેમના કહેવા પ્રમાણે ખર્ચ માત્ર ૫,૦૦૦

૧. ગાંધી પરિવારના ગોર, મિત્ર અને સલાહકાર.

રૂપિયા થાય. “એને થોડી અડદની દાળ અને એવું બીજું લઈ જવા દેણે. ત્યાં જોતે રાંધીને ખાશે એટલે ધર્મની બાબતમાં મુશ્કેલી નહીં આવે. આ વાત કોઈને કરશો નહીં. કોઈક સ્કોલરશિપ મેળવવાની તજવીજ કરો. જૂનાગઢ ને પોરબંદર રાજને અરજી કરો. મારા દીકરા કેવળ-રામને<sup>૧</sup> મળો. તે છતાં પેસાની મદદ ન મળો અને તમારી પાસે પેસા ન હોય તો તમારું રાચર્ચીલું વેચો કાઢો. પણ મોહનદાસને તો કોઈ પણ ખિસાને લંડન મોકલો જ મોકલો. તમારા મરહૂમ પિતાની આભર્ણ ચાલુ રાખવાનો એટલો જ રસ્તો છે.” અમારા કુટુંબનાં બધાં માણસોને માવજી જોશી કહે તે વાત પર ભરોસો ઘણો. અને મારા ભાઈ સ્વભાવે સાંભળેલું જટ માનીને ચાલવાવાળા હોવાથી તેમણે માવજી જોશીને વચન આપ્ય કે હું મોહનદાસને લંડન મોકલીશ. હવે મારે મહેનત કરવાનો વખત આવ્યો.

આ વાત છાની રાખવાનું વચન આપેલું હોવા છતાં તે જ દિવસે મારા ભાઈએ તે ખુશાલભાઈને<sup>૨</sup> કરી. તેમણે અલબત્ત, હું મારો ધર્મ સાચવી શકું તો વાંધો નહીં કહી એ વાતને મંજૂરી આપી. તે જ દિવસે વળી એ વાત મેધજીભાઈને<sup>૩</sup> કાને નાખવામાં આવી. તેમણે એ દરખાસ્તને પૂરી સંમતિ આપી અને મને રૂ. ૫,૦૦૦ આપવાનું કલ્યું તેમાં મને થોડો ભરોસો હતો ખરો. અને મેં મારી વહાલી માને વાત કરી ત્યારે તેણે મને એ બધું માની લેવા જેટલું ભોળપણું બતાવવાને સારુ ઠપકો આપ્યો ને વધારામાં કલ્યું કે વખત આપુંથે ત્યારે એની પાસેથી તને પેસો પણ મળવાનો નથી અને તે વખત આવવાનો પણ નથી.

તે દિવસે મારે કેવળરામની પાસે [જવાનું] હતું. તે મુજબ હું તેમને મળ્યો. ત્યાં કંઈ સંતોષકારક વાત ન થઈ. તેમણે કલ્યું કે તારો આશય સારો છે પણ “ત્યાં તને ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ખરચ થશે.” આ મને ભારે ફિટકો પડ્યો. વળી તેમણે કલ્યું, “તારે કોઈ ધાર્મિક આગ્રહ હશે તે બધા તારે છોડી દેવા પડશે. તારે માંસ ખાનું પડશે, દાડ પીવો પડશે. તેના વગર તારાથી ત્યાં રહેવાશે નહીં. જેટલા વધારે પેસા ખરચશે તેટલો તું વધારે હોશિયાર થવાનો. આ બહુ મહાત્વની વાત છે. હું તો ભાઈ તને ચોખ્ખી વાત કરું છું. માહું ન લગાડીશ, પણ જો, તું હજુ તદ્દન જુવાન છે, લંડનમાં પ્રલોભનોનો પાર નથી. તું તેમાં ફસાયા વગર રહે નહીં.” આ વાતથી હું થોડો નિરાશ થયો. પણ એક વાર એક વાત મન પર લીધા પછી જટ છોડી દઈ એવો માણસ હું નથી. તેમણે મને મિ. ગુલામ મહમદ મુનશીનો દાખલો આપ્યો. મેં તેમને પૂછ્યું કે, સ્કોલરશિપ મેળવી આપવામાં તમે કોઈ રીતે મને મદદ કરી શકો ખરા કે નહીં? તેમણે ના પાડી. તેમણે કલ્યું કે એ વગર બીજું કંઈ હશે તો હું ખુશીથી કરીશ. મેં બધી વાત મારા ભાઈને જણાવી.

પછી મને મારી વહાલી માની સંમતિ મેળવવાનું કામ સોંપાયું. મને એ કામ બહુ અધૃતું લાગતું નહોતું. બેએક દિવસ પછી મારા ભાઈ ને હું કેવળરામને મળવા ગયા; તે વખતે તેઓ બહુ કામમાં હતા છતાં અમને મળ્યા. બેએક દિના પહેલાં મારે તેમની સાથે વાત થયેલી તેવી જ વાત ફરી તેમણે અમને બનેને કરી. મારા ભાઈને તેમણે મને પોરબંદર મોકલવાની સલાહ આપી. એ સલાહ અમે સ્વીકારી. પછી અમે ઘેર આવ્યા. મેં મજાકમાં મારી વાત મારી મા

૧. કાંકિયાવાડના આગેવાન વક્તીલ.
૨. ગાંધીજીના પિતરાઈ ભાઈ અને દક્ષિણ આસ્ક્રિકામાં તેમની સાથે કામમાં નોડાનાર છગનલાલ અને મગનલાલ બન્નેના પિતા.
૩. ગાંધીજીના પિતરાઈ ભાઈ.

આગળ મૂકવા માંડી. બહુ થોડી વારમાં વાત મજાકમાંથી સાચી બની ગઈ. એટલે મારે પોરબંદર જવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો.

બેન્ટ્રલ વાર હું જવા તૈયાર થયો પણ કંઈ ને કંઈ વિધન આવ્યું. મારે અવેરચંદ સાથે જવાનું એક વખત નક્કી થયું ત્યારે મારે નીકળવાના એક કલાક આગળ એક ગંભીર અક્સમાત થયો. મારા મિત્ર શેખ મહેતાબ<sup>૧</sup> સાથે મારે હમેશા તકરાર થયા કરતી. નીકળવાને દિવસે એ તકરારોના વિચારોમાં હું ડૂબી ગયો હતો. રાતે સંગીતનો જલસો હતો. મને તેમાં બહુ મજા ન આવી. સાડા દસને સુમારે જલસો પૂરો થયો ને અમે બધા મેધજીભાઈ અને રામીને મળવા ગયા. આએ રસ્તે એક બાજુથી હું લંડનના ગાંધાઘેલા વિચારોમાં અને બીજી બાજુથી શેખ મહેતાબના વિચારોમાં ડૂબેલો રહ્યો. વિચારમાં ને વિચારમાં અજાણતામાં હું એક ગાડીની સાથે અથડાયો. મને થોડું વાગ્યું. છતાં ચાલવામાં મેં કોઈની મદદ લીધી નહીં. મને લાગે છે મને ખૂબ તમ્મર આવતાં હતાં. પછી અમે મેધજીભાઈના ઘરમાં ગયા. ત્યાં વળી અજાણતામાં હું એક પથ્થર સાથે અફ્ઝાયો ને. મને વાગ્યું. હું છેંક બેભાન થઈ ગયો. તે [વખત]થી શું થયું તેની મને ખબર ન પડી અને મને પાછળથી કહેવામાં આવેલું કે પછી હું થોડાં ડગલાં ચાલીને લેંય પર ચાતોપાટ ગબડી પડયો હતો. પાંચ મિનિટ સુધી મારું ભાન જતું રહ્યું હતું. મારી સાથેવાળા બધાઓ માની લીધેલું કે હું મરી ગયો છું. પણ મારે સારે નસીબે જે લેંય પર હું પડી ગયેલો તે તદ્દન સુંવાળી હતી. આખરે હું ભાનમાં આવ્યો એટલે બધા રજી રજી થઈ ગયેલા. મારી માને બોલાવવામાં આવી. મારી વાત જાણીને તે બહુ ગમગીન થઈ ગઈ. એથી મારું જવાનું ઢીલમાં પડ્યું, જેકે હું સૌને કહેતો રહ્યો કે હું તદ્દન સાંજે છું ને મને હવે કંઈ નથી. પણ કોઈ મને જવા દેવા તૈયાર નહોનું. પાછળથી જેકે મને માલૂમ પડ્યું કે મારી હિમતવાળી ને વહાલી મા મને જવા દેવાને તૈયાર હતી. પણ તેને બીજા લોકો વાતો કરે તેનો ઊર હતો. આખરે ઘણું મુશ્કેલીએ થોડા દિવસ બાદ મને રાજકોટથી પોરબંદર જવાની પરવાનગી મળી. રસ્તે પણ મને થોડાં વિધન નડયાં.

છેવટે હું પોરબંદર પહોંચ્યો ને સૌ રજી થયાં. લાલબાઈ<sup>૨</sup> અને કરસનદાસ<sup>૩</sup> મને ઘેર લઈ જવાને ખાડી પુલ સુધી લેવા આવ્યા હતા. હવે પોરબંદરમાં મારે જે કરવાનું [હતું તે] એ કે મારા કાકાની સંમતિ મેળવવાની હતી, બોજું, મને નાણુંની મદદ કરવાને મિ. લેલીને<sup>૪</sup> અરજી કરવાની હતી, અને છેલ્લું, રાજ તરફથી સ્કોલરશિપ ન મળે તો પરમાનંદભાઈને<sup>૫</sup> મને થોડાં નાણાં આપવાને કહેવાનું હતું. પહેલું કામ મેં એ કર્યું કે હું કાકાને મળ્યો અને મેં તેમને પૂછ્યું કે હું લંડન જાઉં તે તમને ગમે કે નહીં? પછી કુદરતી રીતે જ મેં ધાર્યું હતું તેમ લંડન જવાના ફાયદા ગણાવવાને તેમણે મને જણાવ્યું. તે મેં મને આવડયું તેવા ગણાવ્યા. એટલે તેમણે કહ્યું, “અલબાટા, આ પેઢીના લોકોને એ ઘણું ગમે પણ મને પોતાને એ ગમતું નથી. છતાં આપણે આગળ ઉપર વિચાર કરીશું.” મને આવા જવાબથી નિરાશા ન થઈ. કંઈ નહીં તો એટલું

૧. ગાંધીજીનો બાળપણનો મિત્ર. તેને સુધારવાને તેમણે ધણાં વરસ ફોટો મહેનત કરેલી.
૨. ગાંધીજીના પિતરાઈ.
૩. ગાંધીજીના તેમનાથી મોટા ભાઈ.
૪. પોરબંદરના રાજકુમારની સગીર ઉમર દરમિયાન પોરબંદર રાજનો વહીવટ કરનાર બ્રિટિશ સરકારનો એજન્ટ.
૫. ગાંધીજીના પિતરાઈ.

જાણવાનું મને સમાધાન મળ્યું કે ગમે તેમ પણ તેમને અંદરખાને એ વાત પસંદ હતી અને પાછળથી તેમણે જે કરી બતાવ્યું તે પરથી મેં જે ધર્મ હતું તે ખોટું નહોતું એમ સાભિત થયું.

મારે કમનસીબે મિ. બેલી પોરબંદરમાં નહોતા. વિધનો એકલાં નથી આવતાં, સામટાં આવે છે એ તદ્દન સાચું છે. પોતે સવારીએ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા બાદ તે તરત રજ પર જવાના હતા. મારા કાકાએ મને રવિવાર સુધી રાહ જોવાનો સલાહ આપી. અને તેમણે મને કષ્ટું કે ત્યાં સુધીમાં પાછા નહીં આવે તો તે જ્યાં હશે ત્યાં હું તને મોકલી આપીશ. પણ આહી લખતાં મને ઘણી ખુશી થાય છે કે રવિવારે તે સવારીએથી પાછા ફર્યા. એટલે મારે તેમને સોમવારે મળવું એવું નક્કી થયું. તેમ હું તેમને મળવા ગયો. અંગ્રેજ સદ્ગુહસ્થ સાથે મારે જિદગ્યોમાં પહેલી વાર મુલાકાત બેવાનો પ્રસંગ હતો. પહેલાં તેમની સામે ઊભા રહેવાની મારામાં હિમત નહોતી. પણ લંડનના વિચારથી હું હિમતવાળો બન્યો. મારે તેમની સાથે ગુજરાતીમાં થોડી વાત થઈ. તેમને ઘણી ઉતાવળ હતી. પોતાના બંગલાના ઉપલા માળ પર જવાને દાદરે ચડતાં ચડતાં તે મને મળ્યા. તેમણે કષ્ટું કે પોરબંદર રાજ ઘણ્યું ગરીબ છે અને નાણાંની મદદ મને કરી શકે એમ નથી. છતાં, તેમણે કષ્ટું, પહેલાં તમે હિમતસ્તાનમાં ગેંજયુએટ થાઓ અને પછી મારાથી તમને કંઈ મદદ થઈ શકે એવી છે કે નહીં તે હું જોઈશ. બેશક, તેમના આવા જવાબથી મને નિરાશા થઈ. તેમની પાસેથી આવો જવાબ મળશે એવું મેં નહોતું ધાર્યું.

હવે મારે પરમાનંદભાઈને ૫,૦૦૦ રૂપિયા આપવાને કહેવાનું રહ્યું. તેમની પાસે માગતાં તેમણે મને જવાબ આપ્યો કે તારા કાકા તારી લંડન જવાની વાતને મંજૂર રાખે તો એટલાં નાણાં હું તને ખુશીથી આપીશ. એ કામ મને જુદા કશણ લાગ્યું, પણ કાકા પાસેથી મંજૂરી લાવવાનો મેં નિશ્ચય કર્યો. તેઓ કંઈક કામમાં હતા ત્યારે હું તેમને જઈને મળ્યો ને મેં તેમને આ પ્રમાણે કષ્ટું: “કાકા, મારા લંડન જવાને વિષે તમે શું ધારો છો તે હવે મને કહો. આહી આવવાનો મારો મુખ્ય હેતુ તમારી પાસેથી એ વાતની મંજૂરી બેવાનો છે.” એટલે તેમણે જવાબ આપ્યો: “હું એ વાતને મંજૂરી ઓંપી શકું તેમ નથી. હું જાત્રાએ જવાનો છું તે તું જાણે છે ખરો કે નહીં? અને તેથી લોકો લંડન જાય તે મને ગમે છે એવું કહું તો મારી નામોથી થાય કે નહીં? છતાં, તારી મા ને તારા ભાઈને એ વાત પસંદ હોય તો મને તેમાં જરાયે વાંધો નથી.” એટલે મેં કષ્ટું, “તો પછી તમે જાણતા લાગતા નથી કે મને લંડન જવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી તમે પરમાનંદભાઈને મને નાણાંની મદદ કરતા રોકો છો.” આટલું કહેતાંની સાથે તેમણે રોષભર્યા અવાજમાં કષ્ટું: “વાત એમ છે? ભલા માણસ, તે એમ શું કામ કહે છે તે તું જાણતો નથી. તે જાણે છે કે તારા જવાની વાતને હું કદી સંમતિ આપવાનો નથી. અને તેથી તે એ બહાનું આગળ ધરે છે. પણ સાચી વાત એવી છે કે તે તને એવી જતની કોઈ મદદ કરવાનો નથી. હું કંઈ તેને મદદ કરતો રોકતો નથી.” આમ અમારી વાત પૂરી થઈ. પછી હું રંગમાં આવી ગયો ને દોડતો પરમાનંદભાઈ પાસે પહોંચ્યો ગયો. ત્યાં જઈ મારે ને કાકાને વાત થયેલી તે શબ્દેશબદ મેં તેમને કહી સંભળાવી. એ સંભળીને તે પણ બરાબર ગુસ્સે થઈ ગયા અને તરત જ તેમણે મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું વચ્ચન આપ્યું. તેમણે આપેલા વચ્ચનથી હું રાજી રાજી થઈ ગયો અને વધારે ખુશીનું કારણ તો એ હતું - કે તેમણે તેમના દીકરાના સોગન ખાધા. ત્યારથી મેં માની લીધું કે હવે હું જરૂર લંડન જવાનો. પછી હું થોડા દિવસ પોરબંદર રોકાયો અને જેમ વધારે રોકાયો તેમ મને આપવામાં આવેલા વચ્ચનની મને વધારે ખાતરી આપવામાં આવતી ગઈ.

હવે હું નહોતો તે દરમિયાન રાજકોટમાં બન્યું તે જોઈએ. મારે કહેવું જોઈએ કે મારો મિત્ર શેખ મહેતાબ ધણો અડપલાંખોર છે. તેણે મેધજીભાઈને તેમનું વચન યાદ દેવડાયું અને એક કાગળ લખી તેના પર મારી ખોટી સહી કરી તેમાં જણાયું કે મારે ૫,૦૦૦ રૂપિયાની જરૂર છે વગેરે. તે કાગળ તેમને બતાવવામાં આવ્યો અને તે ખરેખર મારા કાગળ તરીકે ચાલી ગયો. એથી પછી એ તદ્દન કુલાઈ ગયા અને મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું તેમણે ગંભીર વચન આપ્યું. હું રાજકોટ પહોંચ્યો ત્યાં સુધી મને આ વાતની ખબર આપવામાં આવી નહોતી.

હવે પોરબંદર પાછા ફરીએ. છેવટે મારે નીકળવાનો દિવસ ઢરાવવામાં આવ્યો. મેં મારા કુટુંબીઓની વિદાય લીધી અને હું મારા ભાઈ કરસનદાસ તેમ જ મેધજીના ખરેખર કંજુસાઈના અવતાર જેવા પિતા સાથે રાજકોટ જવા ઉપડ્યો. રાજકોટ જતા પહેલાં મારું રાચરચીલું વેચી કાઢવાને અને ધરનું ભાડું ચડનું રોકવાને હું ભાવનગર જઈ આવ્યો. આ કામ મેં એક જ દિવસમાં પતાવ્યું અને આડોશપાડોશના મિત્રોથી અને મારાં માયાળું ધરમાલિક બહેનથી હું છૂટો પડ્યો. એ લોકેને મને વિદાય આપતાં આંખમાં જળજળિયાં આવી ગયાં. તેમનું તેમ જ અનુપરામનું અને બીજા લોકોનું માયાળુપણું હું કદી નહીં વીસરું. આમાંથી પરવારીને હું રાજકોટ પહોંચ્યો.

પણ ત્રણ વરસ સુધી રાજકોટથી બહાર જતા પહેલાં મારે કર્નિલ વોટ્સનને મળવાનું હતું. ૧૮૮૮ની સાલના જૂન માસની ૧૮મી તારીખે તેમનું રાજકોટ આવવાનું થવાનું હતું. આ સાચે જ મારે માટે બહુ લાંબો ગાળો હતો કેમ કે હું રાજકોટ મેની શરૂઆતમાં પહોંચી ગયેલો. પણ એમાં મારું કંઈ ચૂલે એવું નહોતું. મારા ભાઈ કર્નિલ વોટ્સન પાસે મોટી આશા રાખતા હતા. એ દિવસો કાઢવા ખરેખર “કપરા હતા. રાતે મને બરાબર” ઉંઘ આપતો નહીં અને સ્વર્ણાનો હુમલો હમેશ થતો. કેટલાક લોકો મને લંડન ન જવાને સમજાવતા તો બીજા વળી જવાની સલાહ આપતા. કોઈ કોઈ વાર મારી મા પણ મને ન જવાનું કહેતી અને સૌથી વધારે નવાઈની વાત તો એ કે મારા ભાઈ પણ વારંવાર પોતાનો વિચાર હેરવતા. આમ મારું મન દ્વિધામાં રહેતું. પણ બધાં જાણતાં હતાં કે એક વાર એક વાત થર્ડ કર્ચ પછી હું તેને છોડું એવો નહોતો એટલે ચૂપ રહેતાં. એ દરમિયાન મેધજીભાઈના વચનને વિષે તેમને પૂછી જોવાનું મારા ભાઈએ મને કહ્યું. અલબત્તા, જવાબ તદ્દન નિરાંશાજનક મળ્યો અને ત્યારથી તેણે હમેશ દુશ્મનનો ભાગ ભજવવા માંડ્યો. જેની ને તેની આગળ તેણે મારું ભૂંડું બોલવા માંડ્યું. પણ તેનાં મહેણાંટોણાંની હું પૂરી અવગાણના કરી શક્યો. મારી વહાલી મા આથી તેના પર ખૂબ ગુસ્સે થઈ અને તે કેટલીક વાર બેચેન પણ થતી. પણ હું તેને સહેલાઈથી સાંત્વન આપી રજી કરી શકતો અને મારી વહાલી મા મારે ખાતર દુઃખી થઈ આંસુ સારતી હોય ત્યારે તેને સમજાવી રજી કરી ખડકાટ હસાવવામાં હું ધણી વાર સહૃદ થયો છું તે વાતથી મને ધણું સમાધાન છે. આખરે કર્નિલ વોટ્સન આવ્યા. હું તેમને મળ્યો. તેમણે કહ્યું: “હું એનો વિચાર કરીશ,” પણ મને તેમની પાસેથી કદી કોઈ જતની મદદ મળી નહીં. મને કહેતાં દિલગીરી થાય છે કે ધણી મહેનતે તેમની પાસેથી પરિયયની નજીવી ચિઠ્પી હું મેળવી શક્યો. અને તે આપતી વખતે તેમણે દમામથી કહેલું કે એ ચિઠ્પીની કિમત એક લાખ રૂપિયા છે. એ વાત યાદ આવે છે ત્યારે આને મને હસવું આવે છે!

હવે મારો નીકળવાનો દિવસ મુકુર કરવામાં આવ્યો. પહેલાં તે ઓગસ્ટની ચોથી હતી. પણ વાત હવે છેવટની હદે પહોંચ્યો. હું ઈંગ્લાંડ જવાનો હું એ વાત છાપાંઓમાં જહેર થઈ. મારા ભાઈને કોઈ ને કોઈ મારા જવાની વાત પૂછતું જ હોય. આ ધંડીએ તેમણે મને જવાનું

માંડી વાળવાને કહ્યું. પણ મેં તેવું કર્યું નહીં. એ પછી તે રાજકોટના હિઝ હાઈનેસ ટાકોર-સાહેબને<sup>૧</sup> મળ્યા અને તેમને મને નાણાંની મદદ કરવાની વિનંતી કરી. પણ ત્યાંથી કશી મદદ મળી નહીં. પછી હું છેવટનો એક વાર ટાકોરસાહેબને અને કર્નચ વોટ્સનને મળ્યો. કન્લિ મને પરિયયનો કાગળ આપ્યો ને ટાકોરસાહેબે પોતાની છબી આપી. અહીં મારે નોંધવું જોઈએ કે આ ગાળા દરમિયાન ત્રાસી જવાય એવી જે ખુશામત મારે કરવી પડી તેથી મને બહુ ગુસ્સો આવતો. ગમે તે વાત માની બેનારા મારા ભોળા વહાલા ભાઈનો વિચાર મારે કરવાનો ન હોત તો હું આવી હડહડતી ખુશામતમાં પડ્યો ન હોત. આખરે ઓગસ્ટની દસમી તારીખ આવી અને મારા ભાઈ, શેખ મહેતાબ, શ્રી નાથુભાઈ, ખુશાલભાઈ અને હું રાજકોટ છોડીને નીકળ્યા.


રાજકોટથી મારે મુંબઈ જવાનું હતું. તે શુક્રવારની રાત હતી. નિશાળમાં મારી સાથે ભણનારા વિદ્યાર્થીઓએ મને માનપત્ર આપ્યું. માનપત્રનો જવાબ આપવાને હું ઉલ્લો થયો ત્યારે મને બહુ ગભરાટ થયો.<sup>૨</sup> મારે જે કહેવાનું હતું તે કહેતાં હું અડયે આવ્યો ત્યારે ધૂજવા માંડ્યો. હિદ પાછો ફર્યા બાદ હું ફરી એવું નહીં કરું એવી મને આશા છે. પણ આગળની વાતની ચર્ચા છોડી મારે જે નોંધવાનું છે તે જ લખવું સારું. તે રાતે મને વિદાય આપવાને ઘણા લોકો આવ્યા હતા. તેમાં ભાઈઓ કેવળરામ, છગનલાલ (પટવારી), વ્રજલાલ, હરિશંકર, અમૂલભ, માણેકચંદ, લતીબ, પોપટ, ભાણજી, ખીમજી, રામજી, દામોદર, મેધજી, રામજી કાણીદાસ, નારણજી, રણછોડદાસ, મણિલાલ હતા. જટાશંકર વિશ્વનાથ અને બીજા પણ હતા. પહેલું સ્ટેશન ગેંડાળ આવ્યું. ત્યાં ડૉ. ભાઉને મળ્યા ને ત્યાંથી કપૂરભાઈને સાથે લીધા. નાથુભાઈ જેતપુર સુધી સાથે રહ્યા. ધોળા સ્ટેશને ઉસમાનભાઈ અમને આવી મળ્યા અને વઢવાણ સુધી સાથે આવ્યા. ધોળા સ્ટેશને ભાઈઓ નારણદાસ, પ્રાણશંકર, નરભેરામ, આણંદરાય અને વ્રજલાલ વિદાય આપવાને આવ્યા હતા.

એકવીસમી તારીખને દિવસે મારે મુંબઈથી નીકળવાનું હતું. પણ મુંબઈમાં મને જે વિધન નડ્યાં તેનું વર્ણન કર્યું જાય એમ નથી. મારા ન્યાતીલાઓએ મને આગળ જતો રોકવાને થાય તે બધું કર્યું. તેમાંના લગભગ બધા જ સામે હતા. અને આખરે મારા ભાઈ ખુશાલભાઈ અને ખુદ પટવારીએ સુધ્યાં મને ન જવાની સલાહ આપ્યો. પણ મેં તેમની સલાહ કાને ન ધરી. પછી દરિયાના તોફાનની વાતને બહાને મારું નીકળવાનું લંબાયું. એ પછી મારા ભાઈ અને બીજા બધા પાછા ગયા. પણ ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની રથી તારીખે મેં એકાએક મુંબઈ છોડ્યું. એ વખતે ભાઈઓ જગમોહનદાસ, દામોદરદાસ અને બેચરદાસનો મારા પર બહુ ઉપકાર થયો. શામળજીનો તો હું પાર વગરનો ઋંણી છું અને રણછોડલાલે<sup>૩</sup> મારે સારુ જે કરેલું તે તો હું જાણતો પણ નથી. તે ઉપકાર કરતાં પણ કંઈક વિશેષ હતું. ભાઈઓ જગમોહનદાસ, માનશંકર, બેચરદાસ, નારણદાસ પટવારી, દ્વારકાદાસ, પોપટલાલ, કાશીદાસ, રણછોડલાલ, મોદી, ટાકોર, રવિશંકર, ફિરોજશાહ, રતનશાહ, શામળજી અને બીજા થોડા સ્ટીમર કલાઇડ પર મને વળાવવાને આવ્યા. એમાંથી પટવારીએ મને પાંચ રૂપિયા આપ્યા, શામળજીએ પણ એટલા જ આપ્યા, મોદીએ બે આપ્યા, કાશીદાસે એક આપ્યો, નારણદાસે બે આપ્યા, અને બીજા થોડા લોકોએ

૧. રાજકોટના રાન.

૨. પાછળ પા. ૧ જોખું.

૩. રણછોડલાલ પટવારીને ગાંધીજ સાથે ધોળા ધાડો સંબંધ હતો. અને તેમની સાથે ગાંધીજને પત્રવહેવાર ચાલતો. પટવારીના પિતાએ તેમને હજ્યાં જવાને નાણાંની મદદ કરેલી.



ગાંધીજિનું જન્મસ્થળ — પોરબંદરનું ધર



રાજકોટની બાંદેડ હાઇસ્ક્વિલ જ્યાં ગાંધીજી ભણેલા

પણ આખ્યા પણ તેમનાં નામ મને યાદ રહ્યાં નથી. ભાઈ માનશંકરે મને ચાંદીનો છેડો આખ્યો અને તે સૌ મને ત્રણ વરસને માટે વિદાય આપીને પાછા ફર્યા. આ પૂરું કરતા પહેલાં મારે નોંધવું જોઈએ કે હું ને સ્થિતિમાં હતો તેમાં કોઈ બીજો હોત તો મને ખાતરી છે કે તે વિલાયતનું બાદું જોવા પામ્યો ન હોત. મારે જે મુશ્કેલીઓ પાર કરવી પડી તેમને લીધે એમ ને એમ બનત તેના કરતાં ઈંગલાંડ મને વધારે ખાંધું બન્યું.

૪થી સઢ્યે., ૧૮૮૮. દરિયાની સફર. આગબોટે લંગર ઉપાડયું ત્યારે સાંજના પાંચ વાગ્યાનો સુમાર હતો. સફરમાં મને શું થશે, ફાવશે કે નહીં તેની મને ઘણી ફિકર રહેતી હતી. પણ સારે નસીબે મને દરિયાની સફર ફાલી ગઈ. આખીયે સફરમાં મને દરિયાઈ માંદગી ન નડી અને ઊલટીઓ પણ ન થઈ. મારી નિદગીમાં આગબોટની આ મારી પહેલવહેલી મુસાફરી હતી. સફરમાં મને બહુ મજા આવી. આશરે છ વાગ્યાને સુમારે ભોજનનો દાંત વાગ્યો. આગબોટ પર ખાણીપીણી વગેરેની વ્યવસ્થા સંભાળનારા સ્ટુઅર્ડ મને જમવાના ટેબલ પર જવાને કલ્યું. પણ ત્યાં જઈને જમવાને બદલે મેં હું મારી સાથે જે લઈ આવ્યો હતો તે ખાંધું. મિ. મજનુદાર પહેલી જ રાતે મારી સાથે જે છૂટથી વન્યા તેથી મને ઘણી નવાઈ થઈ. એમે જાણે બહુ જૂની ઓળખાણવાળા હોઈએ તેવી રીતે તેમણે મારી સાથે વાતો કરી. તેમની પાસે કાળો કોટ નહોતો. તેથી ભોજનમાં જવાને માટે મેં મારો તેમને આખ્યો. તે પહેરીને તે ટેબલ પર ગયા. તે રાતથી તે મને બહુ ગમી ગયા. તેમણે પોતાની ચાવીઓ મને સોંપી દીધી અને તે જ રાતથી હું તેમને મારા મોટા ભાઈ ગણીને ચાલવા લાગ્યો. એડન સુધી અમારી સાથે એક મરાઠા દાક્તર હતા. એકંદરે તે સારા માણુસ લાગતા હતા. આમ બે દિવસ સુધી બોટ પર હું જે મીઠાઈ ને ફળફળાઈ લઈ ગયો હતો તેના પર મેં ચલાયું. તે પછી બોટ પરના થોડા નોકરો સાથે મિ. મજનુદારે અમારે માટે રસોઈની ગોઈવણ કરી. મારાથી તો આવી કોઈ સમજૂતી થઈ જ ન શકત. અમારી સાથે એક અબદુલ મજૂદ કરીને ભાઈ હતા તે પહેલા વર્ગના મુસાફર હતા, જયારે એમે સલૂનના હતા. પેલા નોકરે કરેલી રસોઈનું ભોજન અમને ફાલી ગયું.

હવે થોડી આગબોટ વિષે વાત. આગબોટ પરની વ્યવસ્થા મને ઘણી ગમી. આપણે કેબિનોમાં અગર સલૂનમાં બેસીએ છીએ ત્યારે કેબિનો કે સલૂન સ્ટીમરના ભાગ છે એવો જ્યાલ આપણને રહેતો નથી. કેટલીક વાર તો આગબોટની ગતિ પણ આપણને જરાયે વરતાતી નથી. કમદારો અને ખારવાઓની ચૃપળતા વખાણવા લાયક હતી. આગબોટ પર સંગીતનાં વાદ્યો હતાં. હું વારંવાર પિયાનો વગાડતો. બોટ પર પણ, શેતરંજ અને ડ્રાઇટ્સની રમતોની વ્યવસ્થા હતી. પુરોપિયન મુસાફરો રાતે કેટલીક રમતો રમતા. નૂતકોથી મુસાફરોને ઘણી રાહત રહે છે. સામાન્યપણે કેબિનોમાં બેસી રહેવાનો આપણને કંટાળો આવે. નૂતકો પર આપણને તાજી હવા મળે. તમારામાં હિમત હોય ને આગળ પડવાનો ગુણ હોય તો તમારી સાથેવાળા બીજા મુસાફરોમાં તમે ભળી શકો ને તેમની સાથે વાતોમાં ઊતરી શકો. આંકાશ ચોખ્યું હોય ત્યારે દરિયાનો દેખાવ મજાનો હોય છે. એક અજવાળી રાતે હું દરિયો નીરખંતો હતો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ મને દેખાતું હતું. મોઝાંઓ હાલતાં તેથી જાણે ચંદ્ર આમથી તેમ જોલાં ખાતો હોય એવું લાગતું હતું. એક અંધારી રાતે આકાશ નિર્મળ હતું ત્યારે તારાઓનાં પ્રતિબિંબ પાણીમાં પડતાં હતાં. તે વખતે અમારી આન્જુભાજુનું દૃશ્ય ઘણ્યું મનોહર હતું. પહેલાં તો એ શું છે તેની મને કલ્યાના ન આવી. તે પ્રતિબિંબો જાણે બધા હીરા વેરાયેલા પડવા હોય એવાં લાગતાં હતાં. પણ હીરો પાણીમાં તરે નહીં એ હું જાણતો હતો. પછી મને લાગ્યું કે માત્ર રાત્રે દેખી શકાય એવાં આગિયા જેવાં

એ જંતુઓ હશે. આવા વિચારોમાં આકાશ તરફ નજર જતાં હું તરત સમજયો કે એ બધું બીજું કંઈ નથી પણ પાણીમાં પડેલાં તારાઓનાં પ્રતિબિંబ છે. મને મારી મૂર્ખાઈ પર હસવું આવ્યું. તારાઓના આ પડછાયા આપણને આતથબાળજીનો ઘ્યાલ આપે છે. કેમ જાણે આપણે બંગલાના માળ પર ઉભા ઉભા આપણી સામે આતથબાળ ઉડતી ન જોતા હોઈએ! હું ઘણી વાર એ દૃશ્યની મજા ભોગવતો.

કેટલાક દિવસ સુધી મારી સાથેવાળા કોઈ મુસાફર સાથે મારે કથી વાત થઈ નહોતી. રોજ સવારે હું આઈ વાગ્યે ઉઠતો, દાંત સાહુ કરી જાજુ જતો અને પછી નાહી લેતો. અંગ્રેજી જનરૂઓમાંની વ્યવસ્થાથી દેશી મુસાફરોને અચરજ થતું. તેમાં આપણને પાણી આપવામાં આવતું નથી ને કાગળના કકડા વાપરવા પડે છે.

પણેક દિવસની દરિયાની સહ્ર ભોગવી અમે એડન પહોંચ્યા. એ દિવસોમાં જરા સરખી જમીન કે કોઈ હુંગર અમારા જોવામાં ન આવ્યા. મુસાફરીમાં કાયમ એકધારું પાણી જોઈ જોઈને અમે કંટાળી ગયા હતા અને તેથી જમીનનું દર્શન કરવાને જંખતા હતા. આજરે છઠા દિવસની સવારે અમને જમીન જોવાની મળી. બધા આનંદમાં ને ઉત્સાહમાં આવી ગયા. સવારના અંગ્રેજાર વાગ્યાને સુમારે અમે એડનના બારામાં લંગર નાખ્યું. ત્યાં થોડા છોકરા નાની નાની હોડીમાં આવ્યા. એ બધા પાવરથા તરવૈયા હતા. કેટલાક યુરોપિયનોએ પાણીમાં થોડા સિક્કા નાખ્યા. છોકરાઓ પાણીમાં ઊડે સુધી જઈ તે શોધી લાવતા. મને થયું હું પણ આનું કરી શકું તો કેવું! એ દેખાવ મજાનો હતો. અધોએક કલાક આ દેખાવની મોજ કરી લઈ અમે એડન જોવા ગયા. અહીં મારે જણાવી દેવું જોઈએ કે અમે માત્ર છોકરાઓને પાણીમાંથી સિક્કા શોધી લાવતા જોયા હતા; અમારામાંથી કોઈએ એક પણ પાઈ પાણીમાં નાખી નહોતી. આ દિવસથી વિલાયતમાં ખરચ કેવો થશે તેનો અમને અનુભવ થવા લાગ્યો. અમે ત્રણ જ્રણ હતા ને અમારે હોડીના ભાડાના બે રૂપિયા આપવા પડ્યા. બોટથી કિનારો ભાગે જ એક માઈલ આધો હશે! કાંકે અમે ગંદર મિનિટમાં પહોંચ્યી ગયા. પછી અમે ગાડી ભાડે કરી. પાણીની ટાંકી અને તેની વ્યવસ્થા જોવા જવા અમે માગતા હતા કારણ કે એડનમાં જોવા જેવી જગ્યા એટલી જ હતી. પણ દુર્ભાગ્યે વખત પૂરો થઈ જવાથી અમારાથી ત્યાં ન જવાયું. અમે એડનની લશકરી છાવણી જોઈ આવ્યા. બત્તો સારો હતો; મકાનો સારાં હતાં. એ ઘણીખરી દુકાનો હતી. મકાનોની રચના ઘણીખરી રાજકોટમાં આવેલા બંગલાઓના જેવી અને ખાસ કરીને પોલિટિકલ એજન્ટના નવા બંધાપેલા બંગલા જેવી હતી. ત્યાં કોઈ કૂંઠો કે મીઠા પાણીનું સ્થળ અમને જોવાનું ન મળ્યું. મને ડર છે કે કદાચ તળાવોમાં જ મીઠું પાણી હશે. સૂરજનો તાપ અતિશય પડતો હતો. હું પરસેવાથી રેબ-ઝેન્ટ થઈ ગયો. રાતા સમુદ્રથી અમે બહુ દૂર નહોતા તે આનું કારણ હતું. વધારે અચંબો તો એ થયો કે એકે જાડ અગર લીલો છોડ મને જોવાનો ન મળ્યો. માણસો ગણેડા પર કે ખરચર પર સવારી કરી ફરતા. અમને પણ બેસવાને જોઈએ તો ખરચર ભાડે મળે એમ હતું. છાવણી એક ટેકરી પર આવેલી છે. પાછા ફરતી વખતે હોડીવાળાએ અમને માહિતી આપી કે ઉપર મેં જે છોકરાઓની વાત લખી છે તેમને કેટલીક વાર ઈજ થાય છે. દરિયાનાં જનવરો કોઈકના પગ તો કોઈકના હાથ કરતી ખાય છે. અને છતાં એ છોકરાઓમાંનો એકેએક આપણી તો બેસવાની હિમત પણ ન ચાલે તેવી પોતાની નાનકડી હોડીમાં બેઠો હતો કેમ કે તે બધા બહુ ગરીબ હતા. ગાડીના ભાડાનો અમારે દરેકે એક એક રૂપિયો આપવો પડ્યો. બપોરે બાર વાગ્યે લંગર ઉપડયું અને અમે એડન છોડ્યું. 'પણ એ દિવસ પછી જમીન અમારી નજર બહાર ગઈ નહીં.'

સાંજે અમે રાતા સમુદ્રમાં પ્રવેશ કર્યો. અમને ગરમી લાગવા માંડી. પણ કેટલાક લોકો મુંબઈમાં કહેતા હતા તેવી એ દાડે એવી નહોતી એમ મને લાગે છે. અલબત્તા, કેબિનમાં તો સહન થાય એવી નહોતી. વળી, માથે સીધો તડકો તમારાથી લેવાય નહીં. તમારી કેબિનમાં તો તમને પાંચ મિનિટ પણ રહેવાનું ગમે નહીં. પણ તૂતક પર હો તો તાજી હવાવાળો મજાનો પવન તમને મળે. કંઈ નહીં તો હું તો એ મજા લેતો. લગભગ બધા મુસાફરો તૂતક પર સૂતા અને હું પણ તેમ જ કરતો. સવારના તરતના ઊગેલા સૂરજનો તડકો પણ ખમાય નહીં એવો હોય. પણ તૂતક પર હો ત્યાં તમે હમેશ સલામત. આવી આકરી ગરમી આપણને ગ્રાસ દહાડા લાગે. પછી ચોથી રાતે અમે સુઅેઝની નહેરમાં પેઠા. દૂરથી સુઅેઝના દીવા અમે જોઈ શકતા. રાતો સમુદ્ર કચાંક પહોળો તો કચાંક છેક સાંકડો હતો. કચાંક કચાંક તો એટલો બધો કે બંને બાજુની જમીન દેખાય. સુઅેઝની નહેરમાં દાખલ થતાં પહેલાં અમે હેલ્સ ગેટ[નરકના દરવાજા]માંથી પસાર થયા. હેલ્સ ગેટ પાણીની ઘણી સાંકડી નાળ છે ને તેની બંને બાજુ ટેકરી-ઓ આવેલી છે. એમાંથી પસાર થતાં ઘણાં વહાણ અથડાઈને ભાંગી જાય છે તેથી એનું એવું નામ પડેલું છે. અમે રાતા સમુદ્રમાં એવું ભાંગેલું વહાણ જોયું. સુઅેઝમાં અમે અધીએક કલાક રોકાયા. હવે કહેવામાં આવ્યું કે તમને ટાઢ વાવા માંડશો. કોઈ વળી કહેતા કે એડન છોડયા પછી તમારે દાડની જરૂર પડશો. પણ એ વાત ખોટી હતી. હવે મેં મારી જેડેવાળા મુસાફરો સાથે થોડી થોડી વાત કરવા માંડી હતી. તેમણે કષ્ટું કે એડન છોડયા પછી તમારે માંસના ખોરાકની જરૂર પડવાની; પણ તેવું નહોનું. જિદગીમાં પહેલી વાર અમારી બોટને માથે મેં વીજળીની બત્તી જોઈ. તે ચાંદરણા જેવી લાગતી હતી. વહાણનો આગલો ભાગ ઘણો મજાનો દેખાતો હતો. નેમ બીજે માણસ આપણા કરતાં આપણા શરીરની સુંદરતા વધારે સારી રીતે જોઈ શકે તેમ મને લાગે છે કે બહાર બીજી જગ્યા પર ઊભેલા માણસને તે વધારે સુંદર લાગતો હોવો જોઈએ. સુઅેઝ નહેરની રચના હું સમજી શકતો નથી. તે અદ્ભુત છે એમાં શંકા નથી. જેણે તેની થોથ કરી હશે તેની પ્રતિભા કેવી જબરી હશે તેની હું કષ્ટપના કરી શકતો નથી. તેણે એ બધી રચના કેવી રીતે કરી હશે તેની મને ખબર પડતી નથી. તેણે કુદરત સાથે હરીકાઈ કરી છે એટલી વાત સાચી. બે સમુદ્રને જેડી આપવાની વાત કંઈ જેવીતેવી નથી. નહેરમાંથી એકી વખતે એક જ વહાણ પસાર થઈ શકે છે. તેને માટે વહાણ ચલાવવાની ભારે આવડત જોઈએ. નહેરમાં આગબોટ બહુ ધીમી ચાલે છે. આપણને તે ચાલે છે એવું વરતાનું નથી. નહેરનું પાણી તદ્દન મેલું છે. મને તેની ઊડાઈનું માપ યાદ રહ્યું નથી. રામનાથ આગળ આજની<sup>૧</sup> છે તેટલી જ તેની પહોળાઈ છે. બંને બાજુ પર ફરતા માણસો જોઈ શકાય છે: નહેરની પાસેનો પ્રદેશ વેરાન છે. નહેરની માલકી ફ્રેચ લોકોની છે. વહાણને દોરવાને સારુ ઈસ્માઈલિયાથી બીજે સુકાની આવે છે. નહેરમાંથી પસાર થતા દરેક વહાણ માટે ફ્રેચ લોકો અમુક રુમ વસૂલ કરે છે. એ આમદની ઘણી મોટી થતી હોવી જોઈએ. વહાણ પરની વીજળીની બત્તી ઉપરાંત બંને બાજુ પર આશરે વીસ ફૂટ દૂર બીજા દીવાઓ દેખાય છે. એ દીવાઓ જુદા જુદા રંગના હોય છે. વહાણને દીવાની આ બંને હાર વચ્ચેથી જવાનું હોય છે. વહાણને નહેરમાંથી પસાર થતાં આશરે ચોવીસ કલાક લાગે છે. ત્યાંના દૃશ્યનું વર્ણન કરવાનું મારા ગજ બહારનું છે. તમે જાઓ નહીં ત્યાં સુધી તમને તે જોવાથી આવતી મજાનો જ્યાલ નહીં આવે. પોર્ટ સૈયદ નહેરનું બીજું નાકું છે. પોર્ટ

૧. રાજકોટ પાસેની નથી.

સૈયદ સુઅરેઝ નહેરને લીધે હસ્તીમાં આવ્યું છે. અમે સાંજે પોર્ટ સૈયદમાં લંગર નાખ્યું, વહાણ ત્યાં એક કલાક રોકાવાનું હતું, પણ પોર્ટ સૈયદ જેવાને એક કલાક પૂરતો હતો. હવે અંગ્રેજી ચલણ શરૂ થયું. હિન્દુસ્તાનનું નાણું અહીં બિલકુલ કામ આવતું નથી. દરેક હોડીનું ભાડું છ પેન્સ છે. એક પેનીની કિમત એક આનો થાય. પોર્ટ સૈયદમાં મકાનોની રચના ફ્રેન્ચ ડ્રબની છે. અહીં આપણું ફ્રેન્ચ રહેણીકરણીનો ખ્યાલ મળે છે. અહીં અમે કેટલાંક કોફી રેસ્ટોરાં જોયાં. પહેલાં મને લાગ્યું કે એ નાટકનાં થિયેટર છે. પણ એ તો કોઈની હોટલ હતી. ત્યાં બેસીને તમે એક બાન્યુથી કોફી કે સોડા કે ચા કે બીજું કોઈ પીછું પીઓ અને બીજી બાન્યુથી સંગીત સાંભળો. કેટલીક લીઓ ફિડલ બેન્ડ બજાવે છે. આ જગ્યાઓ ને કાઢે નામથી ઓળખાય છે તેમાં મુખ્યમાં લોમનેડની એક બાટલી આપણું એક પેનીથીયે ઓછામાં મળે છે તેની બાર પેન્સ કિમત આપવી પડે છે. ઘરાકોને સંગીત મહત્વ સાંભળવાનું મળે છે એમ કહેવાય છે. પણ ખરેખર એવું નથી. સંગીત પૂરું થાય એટલે તુમાલથી ઢાંકેલી એક થાળી હાથમાં લઈ એક છીં ફરીને દરેક ઘરાકની આગળ ધરે છે. એનો અર્થ એ કે તમારે તેને કંઈક આપવું જોઈએ અને આપણું આપવાની ફરજ પડે. અમે કાફેમાં ગયા ત્યાં અમે તેવી લીને છ પેન્સ આપ્યા. પોર્ટ સૈયદ કેવળ મોજમજ ઉડાવવાનું સ્થળ છે. ત્યાંનાં પુરુષો ને લીઓ બડાં ચાલાક હોય છે. તમને જુદી જુદી જગ્યાઓ બતાવવાને દુભાષિયો તમારી પાછળ પાછળ ફરે છે. પણ તમારે હિમતથી તેને કહેવું કે તારી જરૂર નથી. પોર્ટ સૈયદ રાજકોટના પરાથી મોટું નથી. સાંજે સાત વાગ્યે અમે પોર્ટ સૈયદ છોડ્યું.

અમારી સાથેના સફરીઓમાંના એક મિ. જ્વેન્ઝિસ મારી સાથે બહુ માયાળુપણે વર્ત્યા. તે હમેશ મને કહેતા કે ટેબલ પર જ ને તે પરથી કંઈક ખા. પણ હું ન જતો. તેણે મને વળી કલ્યું કે બ્રિન્ડિસી છોડ્યા પછી તને ટાઢ લાગશે. પણ તેવું નહોનું. ત્રણ દિવસ બાદ રાત્રે અમે બ્રિન્ડિસી પહોંચ્યા. બ્રિન્ડિસીનું બારું રણ્યામણું છે. આગબોટ છેક કિનારાને ચાડીને ઊભી રહે છે અને ત્યાં રાખવામાં આવેલી એક નિસરણથી તમે કાંઠે ઊતરી પડો છો. [અંધારું] હોવાથી બ્રિન્ડિસી હું જાગું જોવા ન પામ્યો. ત્યાં બધા ઈટાલિયન બોકે છે. બ્રિન્ડિસીના રસ્તા પર પદ્ધતર જડેલા છે. તેના મહોલ્લા ઢાળવાળા છે. તે પર પણ પદ્ધતર જડેલા છે. દીવાબત્તીને માટે ગેસ વપરાય છે. અમે બ્રિન્ડિસીનું રેલવે સ્ટેશન જોયું. બી. બી. એન્ડ સી. આઈ. રેલવેનાં સ્ટેશનો જેટલું તે સુંદર નહોંનું. પણ રેલવે ગાડીના ડબા આપણા ડબાઓ કરતાં ઘણા મોટા છે. વાહન-વહેવાર અને અવરજનર સારાં હતાં. તમે બ્રિન્ડિસી ઊતરો અને કાળા માણસ હો તો કોઈ માણસ તમને આવીને કહેશો: “સાહેબ, ત્યાં ચૌદ વરસની સુંદર છોકરી છે. મારી પાછળ આવો એટલે હું તમને ત્યાં લઈ જઈશ; દામ કંઈ વધારે નથી, સાહેબ!” આથી તમે એકદમ ગુંચ-વાડામાં પડી જાઓ છો. પણ એ વખતે શાંત રહી હિમતથી જવાબ આપવો કે મારે તેની જરૂર નથી. વળી તે માણસને ચાંદી જવા જણાવવું એટલે તમે સલામત રહેશો. તમને કોઈ મુશ્કેલી આવે. તો તમારી પાસેનાં પોલીસ સિપાઈને એકદમ મળવું અથવા પાસે જ ને મોટું મકાન તમારા જોવામાં આવ્યા વગર નહીં રહે તેમાં જઈને પૂછવું. તેમાં પેસતાં પહેલાં જેકે મકાન પરનું નામ વાંચી કેવું અને તે સૌને માટે ખુલ્લું છે કે નહીં તેની ખાતરી કરી બેવી. આની તમને એકદમ ખબર પડી જશે. ત્યાં ઊભેલા દરવાનને તમે મુશ્કેલીમાં છો એટલું જણાવશો કે તાબડતોબ તે તમને તમારે શું કરવું તે જણાવશો. તમારામાં જરૂરી હિમત હોય તો દરવાનને તમારે તમને વડા અમલદાર પાસે લઈ જવાને કહેવું અને તેને તમારી મુશ્કેલી જણાવવી. મોટું

મકાન મેં કલ્યાણ તેનો આર્થિ એ સમજવાનો છે કે ટોમસ કૂક, અથવા હેનરી કિગ કે એવા જ કોઈક એજન્ટનું છે. તે લોકો તમારી સંભાળ લેશે. આવે પ્રસંગે કંજૂસાઈ ન કરવી. દરવાનને કંઈક આપવાને ચૂકવું નહીં. પણ તમને કંઈક જોખમ જેવું લાગે ત્યારે જ આ રસ્તો લેવો. આવાં મકાનો જોકે માત્ર કાંઠા પર તમારા જોવામાં આવશે. કાંઠથી દૂર અંદર હો તો તમારે પોલીસના સિપાઈને શોધી કાઢવો સારો અને તે ન જરૂર તો તમારું અંતર કહે તેમ કરવું. સવારમાં વહેલા અમે બ્રિન્ડિસી છોડવું.

ત્રૈસેક દિવસ બાદ અમે માલ્ટા પહોંચ્યા. બપોરે આશરે બે વાગ્યે વહાણે લંગર નાખ્યું. ત્યાં તેને લગભગ ચાર કલાક રોકવાનું થવાનું હતું. મિ. અબદુલ મજ્જુદ અમારી સાથે આવનાર હતા. પણ કોણ જાણે કેમ તે બહુ મોડા પડયા. મને નીકળવાની તાલાવેલી લાગી હતી. મિ. મજમુદારે કલ્યાણ, “મિ. મજ્જુદને માટે થોભ્યા વગર આપણે એકલા નીકળી જઈશું?” મેં કલ્યાણ: “જેવી તમારી મરજી. મારે વાંધો નથી.” એટલે પછી અલબત્તા, અમે એકલા નીકળી પડયા. અમે પાછા આવ્યા ત્યારે અબદુલ મજ્જુદ અમને મળ્યા અને તેણે કલ્યાણ કે તમે લોકો ચાલી ગયા તેથી મને દુઃખ થયું. એટલે મિ. મજમુદારે કલ્યાણ: “આ ગાંધીને જવાની અધીરાઈ હતી ને તેણે મને તમારે માટે ન થોભવાને કહેલું.” મિ. મજમુદારના આવા વર્તનથી મને ઘણ્યું માટું લાગ્યું. પણ મારા પર થયેલો આક્ષેપ ધોઈ કાઢવાનો પ્રયત્ન કરવાને બદલે મેં તે બોલ્યા વગર ઓઢી લીધો. હું જોકે જાણતો હતો કે અબદુલ મજ્જુદને મેં એટલો જ ઈશારો કર્યો હોત કે, “મિ. મજમુદારને ખરેખર જ તમારે માટે થોભવું હતું તો મેં કલ્યાણ તેમ તેમણે કરવું નહોતું,” તો મારા પરનો આક્ષેપ ધોવાઈ જત. અને મને લાગે છે કે અમે વહેલા ચાલી ગયા તેમાં મારો કંઈ હાથ નહોતો એવી મિ. અબદુલ મજ્જુદને ખાતરી કરાવવાને એટલો ઈશારો તદ્દન પૂરતો થાત. પણ તે વખતે મારો એવું કંઈ કરવાનો વિચાર નહોતો. તે દિવસથી જોકે મિ. મજમુદારને માટે મારા મનમાં હલકો અભિપ્રાય બંધાઈ ગયો અને તેમને વિશે મને સાચો આદર રહ્યો નહીં. વળી, બીજી પણ બેત્રણ વાતો એવી બની કે જેથી મજમુદાર તરફનું મારું આકર્ષણ દિવસે દિવસે ઘટનું ગયું.

માલ્ટા જોવાલાયક સ્થળ ગણાય છે. ત્યાં જોવા જેવી ચીજે ઘણ્યો છે. પણ અમારી પાસે વખત પૂરતો નહોતો. પહેલાં હું કહી ગયો તેમ મિ. મજમુદાર અને હું બંને કાંઠા પર ગયા. અહીં અમને એક મોટો ઠગ આવી મળ્યો. અમારે મોટી ખોટ ખમવી પડી. અમે હોડીનો નંબર લઈ લીધો અને શહેર જોવાને ગાડી ભાડે કરી. પેલો ઠગ અમારી સાથે હતો. અધીએક કલાક ગાડી હંકારી બાદ અમે સેંટ જુઆનના દેવળે પહોંચ્યા. દેવળની બાંધણી મજાની છે. ત્યાં અમે કેટલાક ઊંચા દરેજાના લોકોના હાડપિંજર જોયાં. તે ઘણાં પ્રાચીન હતાં. દેવળ ફરીને બતાવનાર મિત્રને અમે એક શિલ્બિંગ આપ્યો. દેવળની બરાબર સામે સેંટ જુઆનનું પૂતળું હતું. ત્યાંથી શહેરમાં ગાડી હંકારી. રસ્તાઓ પર પથ્થર જડેલા હતા. રસ્તાની બંને બાજુ માણસોને ચાલવાને માટેની પથ્થર જડેલી પગથીઓ હતી. બેટે ઘણાં સુંદર છે. તે પર ઘણી આલીશાન ઈમારતો છે. અમે આર્મરી હૉલ [શાખાગાર] જોવા ગયા. એ હૉલ સરસ શાખાગારેલો હતો. ત્યાં અમે ઘણાં પ્રાચીન ચિત્રો જોયાં. એ ચિત્રો પૌંછીથી ચીતરેલાં નહોતાં, પણ વખ્ય પર ભરતકામ કરીને બનાવેલાં હતાં. કોઈ કહે નહીં તો અજાણ્યા માણસને ખબર પણ ન પડે કે આ ભરતકામથી તૈયાર કરેલાં ચિત્રો છે. લોકમાં પ્રાચીન લડવેયાઓનાં શાલો હતાં. તે બધાં જ જોવાલાયક હતાં. નોંધ રાખી નહોતી તેથી તે બધાં મને યાદ રહ્યાં નથી. ત્યાં એક શિરખાણ ત્રીસ રતલ વજનનું હતું.

નેપોલિયન બોનાપાર્ટની ઘોડાગાડી ઘણી સુંદર હતી. હોલમાં બધે ફરીને બતાવનાર માણસને છ પેન્સ બેટ આપી અમે પાછા ફર્યા. દેવળ અને આર્મરી હોલ [શાખાગાર]માં જોવાને ફરતી વખતે આદરની નિશાની તરીકે અમારે અમારી ટોપી ઉતારવી પડી હતી. પછી અમે પેલા ઠગની દુકાને ગયા. તેણે કંઈ ને કંઈ અમારે માથે મારવાનો પ્રયત્ન કર્યો. પણ અમે કંઈ ખરીદી ન કરી. છેવટે મિ. મનમુદારે માલ્ટાનાં દૃષ્યોની ચોપડી અંદી શિલ્પિગમાં લીધી. અહીંથી પેલા ઠગ જાતે અમારી સાથે આવવાને બદલે અમને એક દુભાષિયાને ભળાવ્યા. દુભાષિયો ઘણો ભલો માણસ હતો. તે અમને નારંગીના બગીચા તરફ લઈ ગયો. બગીચો અમે જોયો. તે મને જરાયે ન ગમ્યો. તેના કરતાં તો અમારો રાજકોટનો જાહેર બાગ મને વધારે ગમે છે. મારે સાચુ જોવા લાયક ત્યાં માત્ર પાણીના એક તળાવમાં રાની ને સોનેરી માછલીઓ હતી. ત્યાંથી અમે શહેરમાં પાછા ફર્યા ને એક હોટલમાં ગયા. મિ. મનમુદારે ત્યાં થોડા બટાટા ને ચા લીધા. રસ્તે અમને એક હિંદી ભાઈ મળ્યા. મિ. મનમુદાર ઘણા ધીટ હોવાથી તેમણે તેની સાથે વાત કરી. તેની સાથે વધારે વાતો કરતાં માલૂમ પડ્યું કે માલ્ટામાં દુકાન ચલાવનાર એક દુકાનદારના તે ભાઈ હતા. એટલે અમે તરત તે દુકાને ગયા. મિ. મનમુદારને દુકાનદાર સાથે સારી પેઢે વાતો થઈ. અમે ત્યાંથી થોડી ખરીદી કરી ને દુકાનમાં બે કલાક ગાળ્યા. એટલે માલ્ટા અમારાથી જાંનું કંઈ જોવાયું નહીં. અમે એક બીજું દેવળ કેલ્યું. તે પણ ઘણું સુંદર ને જોવાલાયક હતું. અમારે ઓપેરા હાઉસ [નાટકનું થિયેટર] જેવું હતું પણ તે માટે વખત રહ્યો ન હતો. અમે એ ભાઈની રજ કેતાં તેણે મિ. મનમુદારને પોતાના લંડનમાં રહેતા ભાઈને આપવાને પોતાનો એક પરિચય કર્ડ આપ્યો. પાછા ફરતાં પેલો ઠગ અમને પાછો મળ્યો અને સાંજે છ વાગ્યે અમારા લેગો થયો. કંઈ આવીને પેલા ઠગને, પેલા ભલા દુભાષિયાને અને ગાડીવાળાને ભાડું વગેરે ચૂકવી દીધું. હોડીવાળાની સાથે ભાડાની બાબતમાં અમારે તકરાર થઈ. પરિણામ અલબજ્ઞ હોડીવાળાને ફાવતું આવ્યું. અહીં અમે સારી પેઢે છેતરાયા.

સ્ટીમર કલાઈડે સાંજે સાત વાગ્યે માલ્ટા છોડ્યું. ત્રણ દિવસની સહ્ર બાદ અમે બપોરે બાર વાગ્યે નિબ્રાલ્ટર પહોંચ્યા. વહાણ, ત્યાં આખી રાત રોકાયું. નિબ્રાલ્ટર જોવાનો મારો પાકો વિચાર હોવાથી હું મળસકે વહેલો ઊઠથો અને મનમુદારને ઉઠાડી તેને મેં પૂછ્યું કે મારી સાથે કંઈ આવવું છે? તેણે કહ્યું આવવું છે. પછી મિ. મજદુદ પાસે જઈ તેમને મેં ઉઠાડ્યા. અમે ત્રણ જાણ કંઈ ગયા. અમારી પાસે માત્ર દીઢ કલાકનો વખત હતો. મળસકું હતું એટલે દુકાનો બધી બંધ હતી. કહેવાય છે કે નિબ્રાલ્ટર મુક્ત બંદર હોવાથી ત્યાં તમાકુ પીવાનું બહુ સસ્તું પડે છે. નિબ્રાલ્ટર એક ખડક પર બાંધિલું છે. ખડકને છેક મથાળે કિલ્લેબંધી કરેલી છે પણ તે અમને જોવાની ન મળી અને તેથી અમે દિલગીર થયા. ત્યાંના ઘર બધાં હારબંધ આવેલાં છે. એક હારમાંથી બીજમાં જવાને આપણે થોડાં પગથિયાં ચડવાં પડે છે. એ મને ઘણું ગમ્યું. રચના ઘણી સુંદર હતી. રસ્તા પથ્થર જડેલા હતા. વખત ન હોવાથી અમારે પાછા ફરવું પડ્યું. આગબોટે સવારે ૮-૩૦ કલાકે લંગર ઉપાડ્યું.

ત્રણ દિવસમાં અમે રાત્રે અગિયાર વાગ્યે ખીમથ પહોંચ્યા. હવે ખરો ટાઢનો વખત આવ્યો. એકેએક મુસાફર કહેતો હતો કે હવે આપણે માંસ ને દ્રાકુ વગર મરી જવાના. પણ એવું અમને કંઈ થયું નહીં. અલબજ્ઞ, હંડી સારી સરખી હતી. અમને દરિયાના તોફાનની વાત પણ મળી હતી પણ તે અમારા જોવામાં ન આવ્યું. હું ખરેખર તે જોવાને ઘણો ઈંતેજર હતો પણ જેઠી ન શક્યો. રાત હોવાથી ખીમથનું પણ અમે કંઈ જોવા ન પામ્યા. ત્યાં ધૂમસ ઘાડું

હતું. આખરે વહાણ લંડન જવાને નીકળ્યું. ચોવીસ કલાકમાં અમે લંડન પહોંચી ગયા, અને સ્ટીમર છોડી ૧૮૮૮ની સાલના ઓક્ટોબર માસની ૨૮મી તારીખે બપોરે ચાર વાગ્યે ટિલબરી સ્ટેશન થઈને વિક્ટોરિયા હોટલમાં પહોંચી ગયા.

૨૮મી ઓક્ટોબર, ૧૮૮૮ શનિવારથી ૨૩મી નવેમ્બર, શુક્રવાર.

મિ. મજમુદાર, મિ. અબદુલ મજફદ અને હું વિક્ટોરિયા હોટલે પહોંચ્યા. મિ. અબદુલ મજફદ ઘણા રુઆબથી વિક્ટોરિયા હોટલના દરવાનને અમને લઈ આવનાર ગાડીવાળાને રીતસરનું ભાડું આપી દેવાને જણાયું. મિ. અબદુલ મજફદને પોતાને વિષે ઘણો ઊંચો ઝ્યાલ હતો, પણ મારે અહીં નોંધવું જોઈએ કે તેમનો પહેરવેશ કદાચ દરવાનના પહેરવેશ કરતાંથે બદતર હતો. તેમણે સામાનની પણ પરવા ન કરી અને લાંબા વખતથી લંડનમાં રહેતા હોય તેવી આદાથી હોટલમાં પગ મૂક્યો. હોટલના ભપકાથી હું છેક અંજાઈ ગયો. આવો ભપકો મારી જિંદગીમાં મે જેયો નહોતો. મારું કામ માત્ર ચૂપચાપ મારા બે મિત્રોની પાછળ પાછળ જવાનું હતું. આખીયે હોટલમાં વીજળીના દીવા હતા; અમને એક ઓરડામાં દાખલ કરવામાં આવ્યા. મિ. મજફદ તેમાં એકદમ ગયા. મેનેજરે તેમને એકદમ પૂછ્યું, તમે બીજી માળ પર રહેવાનું પસાંદ કરશો કે? પોતાના મોભાને શોલે નહીં એમ ગણીને મિ. મજફદ ભાડા વિષે પૂછ્યા વગર હા કહી કે બીજે માળે ફીવર્શે. મેનેજરે અમને દરેક જણને રોજના ૬ શિલ્વિંગના ભાડાનું બિલ આપ્યું અને અમારી સાથે નોકરને મોકલ્યો. આખો વખત મને મનમાં ને મનમાં હસલું આવતું હતું. બીજે માળે અમારે લિફ્ટમાં જવાનું હતું. મને લિફ્ટ શું તેની જાઝી ખબર નહોતી. નોકરે કશાકને પોતાની આંગળી અડકાડી એને હું સમન્યો કે એ બારણાનું તાજું છે. પણ પાછળથી મને જાણવા મળ્યું કે એ ઘંટોનું બટન હતું અને તેણે તે વેઈટરને લિફ્ટ નીચે લાવવાનું જણાવવાને વગાડી હતી. બારણાં ઉધાડવામાં આવ્યાં અને હું સમન્યો કે એ ઓરડામાં અમારે થોડો વખત બેસવાનું છે. પણ મારા ભારે અચંબા વચ્ચે અમને બીજે માળે પહોંચ્યોડી દેવામાં આવ્યા.

[અધ્યક્ષ]

[મૂળ અંગ્રેજ]

### ૫. મિ. લેલીને પત્ર<sup>૧</sup>

લંડન,  
ડિસેમ્બર, ૧૮૮૮

વહાલા સાહેબ,

આપને મારે મળવાનું થયેલું ત્યારે આપે. મને કહેલું કે ચિઠ્પી હું સાચવી રાખીશ. તે ચિઠ્પી જેશો એટલે આપ મને ઓળખી શકશો.

તે વખતે મારાથી ઈંગ્લાંડ જવાનું. બની શકે તેના સાધન તરીકે થોડી નાણાંની મદદ આપવાની મ આપને વિનાંતી કરેલી; પણ કમભાગે આપ બહાર જવાની ઉતાવળમાં હતા; તેથી મારે આપને જે કહેલું હતું તે કહેવા જેટલો વખત મને મળ્યો નહોતો.

૧. ગાંધીજીએ પોતાના વડીલ ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને મિ. લેલી પર લખવાના પત્રનો મંલૂરી માટે મોકશાવેલો મુસદી.

તે વખતે વિલાયત જવાને નીકળવાને હું અધીરો થઈ ગયો હતો. તેથી ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની રૂથી તારીખે તે વખતે મારી પાસે જે થોડી રકમ હતી તે લઈ મેં હિંદ છોડ્યું. મારા પિતા અમ ત્રણ ભાઈઓ માટે જે મૂકી ગયા હતા તે ખરેખર બહુ થોડું હતું. તેમ છતાં મહામુસીબતે મારા ભાઈ મારે માટે જે ફાજલ પાડી શક્યા તે આથરે પાઉન્ડ ડફફની આખીએ રકમ લંડનના મારા ત્રણ વરસના વસવાટને માટે પૂરતી થઈ રહેશે એ ભરોસે હંગાંડમાં કાપદાનું શિક્ષાલુ બેવાને હું હિંદુસ્તાનથી નીકળી આવ્યો. હિંદમાં હતો ત્યારનો હું જાણતો હતો કે વિલાયતમાં રહેવાનું અને ભાણવાનું બંને ઘણાં ખરચાળ છે. પણ હવે લંડનના બે મહિનાના અનુભવ પછી હું જોઉં છું કે હિંદમાં રહ્યે રહ્યે લાગતાં હતાં તેના કરતાં પણ તે બંને વધારે ખરચાળ છે.

આહી સગવડથી રહેવાને અને સારું શિક્ષાલુ મેળવવાને મને બીજ પાઉન્ડ ૪૦૦ની જરૂર રહેશે. હું પોરબંદરનો વતની હોઈ આવી મદદને સારુ તે સ્થળેથી જ અપેક્ષા રાખી શકું.

હિંજ હાઈનેસ રાણાસાહેબના ભૂતકાળના અમલ દરમિયાન કેળવણીને બહુ ઓછું પ્રોત્સાહન આપવામાં આવતું હતું. પણ અંગ્રેજ વહીવટમાં કેળવણીને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અપેક્ષા કુદરતી રીતે અમને રહે છે. એવા પ્રોત્સાહનનો લાભ લઈ શકનારો હું એક છું.

તેથી મને આશા છે કે મને થોડી નાણાંની મદદ કરવાની આપ મહેરબાની કરશો અને તે રીતે મારા પર અત્યંત જરૂરી એવો મોટો ઉપકાર કરશો.

મારા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને [તિ] મદદ સ્વીકારવાને મેં જણાવ્યું છે અને હું તેમને જરૂર જણાય તો આપને જતે મળી જવાને કાગળ વખ્યું છું.

મારી વિનંતી સ્વીકારવાને આપનું મન અનુકૂળ થશે એવા વિશ્વાસથી  
પૂરા આદર સાથે,

હું છું આપનો,  
મો. ક. ગાંધી

### [મૂળ અંગ્રેજ]

આ પ્રમાણે મેં ત્રણ અઠવાડિયાં થયાં લખી રાખ્યું છે અને વિચાર કર્યું છું. પણ વિચાર કરતાં આ પત્રનો જવાબ નહીં મળશે એમ ધારી આ મુસદો આપને મોકલ્યો છે. એમાં મેં બધી મદદની માગણી નથી કરી કેમ કે તે ગેરવાજબી ગણાય. તેમ જ તે પણ ધારે કે જે તેની આશા ઉપર ગયા હોત તો તો મદદ મળ્યા વિના જત નહીં. પણ આહી આવ્યા બાદ વધારે પેસા જેણે એમ ધારી બાકીના પેસાની મદદ માગી છે. બંધાવા વ.ની વાત લખી જ નથી કેમ કે તેમ લંખવાની કંઈ જરૂર નહોતી. થોડી મદદને વાસ્તે બંધાવું તે ઠીક નહીં. તેમ જ જે . . .<sup>૧</sup>

### [અધ્યુતું]

#### [મૂળ ગુજરાતી]

મહાત્મા પુ. ૧; મૂળ લખાણની છબી પરથી.

૧. ઉપરના મુસદાની સાથેના આ કાગળનું મૂળ લખાણ ગુજરાતીમાં છ ને તેની સાથે લદ્ભીદાસ ગાંધીને મોકલવામાં આંદોલન હતો.

૧૯૮૪

## દ. કર્ણલ જે. ઉભલુ. વોટસનને પત્ર

[ડિસેમ્બર, ૧૯૯૮]

કર્ણલ જે. ઉભલુ. વોટસન  
પોલિટિકલ એજન્ટ  
કાઠિયાવાડ

વહાલા સાહેબ,

આ દેશમાં ઉત્તરનિ મને છ કે સાત આઠવાંથિયાં થયાં છે. હવે હું ઈક ઈક હીઠમ થયો છું અને મારો અભ્યાસ પણ સારી રીતે શરૂ થઈ ગયો છે. મારો કાયદાના ભાગતરનો અભ્યાસ-ક્રમ પૂરો કરવાને હું ઈનર ટેમ્પલમાં જોડ્યો છું.

આપ તો બરાબર જાણો છો કે ઈંગ્લાંડમાં જીવન ધાર્યું ખરચાળ છે અને આહીં આવ્યા બાદ મને તેનો જે થોડો અનુભવ થયો છે તે પરથી હું જોઉ છું કે હિંદમાં હું હતો ત્યારે મેં મારા મનને મનાવેલું તેના કરતાં પણ તે વધારે ખરચાળ છે. આપ જાણો છો કે મારાં સાધન ધાર્યાં ટૂંકાં છે. બહારથી વધારાની કંઈક મદદ મેળવ્યા વગર હું નથી ધારતો, હું ત્રણ વરસનો અભ્યાસક્રમ સંતોષકારક રીતે પૂરો કરી શકું. મારા પિતાની બાબતમાં આપ ધાર્યો રસ વેતા અને આપે તેમને આપના મિત્ર માન્યા હતા એ વાત મને યાદ છે અને તેથી મને જરાયે શંકા નથી કે તેમના હિતની જે કંઈક બાબત હોય તેમાં આપ તેવો જ રસ લેશો અને મને વિશ્વાસ છે કે આ દેશમાં મારે પૂરા કરવાના અભ્યાસમાં સરળતા કરી આપવાને કંઈક સંગીન મદદ મેળવી આપવામાં પૂરો પ્રયત્ન કર્યા વગર રહેશો નહીં. એમ કરી આપ મારા પર મોટો અને આત્માંત જરૂરનો ઉપકાર કરશો.


ડૉ. બટલરને હું થોડા દિવસ પર મળ્યો હતો. તેઓ મારા પર ધણી માયા રાખે છે અને બની શકે તેવી બધી મદદ આપવાને તેમણે મને કહ્યું છે.

આહીની હવા હજી બહુ સખત ઠંડીની જાણાઈ નથી. મારી તબિયત ધણી સારી છે. પૂરા આદર સાથે,

હું છું, વહાલા સાહેબ,  
આપનો વક્ષાદાર  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

મહાત્મા, પુ. ૧; મૂળ લખાણની છંબી પરથી.



## ૭. હિંદના શાકાહારીઓ

[ગાંધીજીએ ધાર્યું ખરું પહેલવહેલા લખેલા આ લેખો વિ વેજિટેરિયનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.]

૧

જુદી જુદી ન્યાતોના અને જુદા જુદા ધર્મેના બસો પચાસ લાખ<sup>૧</sup> લોકો હિંદુસ્તાનમાં વસે છે. જે અંગેઝે હિંદુસ્તાન ગયા નથી અથવા જેમને હિંદની વાતોમાં જાઓ રસ નથી તેમની બહુ સામાન્ય માન્યતા એવી છે કે હિંદીમાત્ર જન્મના શાકાહારી હોય છે. હવે, આ વાત માત્ર થોડે અંશે સાચી છે. હિંદના લોકો ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે: હિંદુ, મુસ્લિમાન અને પારસ્પી.

હિંદુઓમાં વળી ચાર મુખ્ય વણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બધામાંથી સિદ્ધાંતની રૂપે માત્ર બ્રાહ્મણો અને વૈશ્યો શુદ્ર શાકાહારી છે. વહેવારમાં જોકે લગભગ બધા હિંદીઓ શાકાહારી હોય છે. એમાંના કેટલાક સ્વેચ્છાએ શાકાહારી છે તો બીજા ફરજિયાત તેવા છે. આ ફરજિયાત શાકાહારીઓ હમેશ માંસ ખાવાને રાજુ હોવા છતાં એટલા ગરીબ છે કે તે ખરીદી શકતા નથી. હિંદમાં હજારો એવા લોકો છે જેમને રોજના એક પેસા (કું પેની) પર ગુજારો કરવો પડે છે એ બીના પરથી એ વાતની સાબિતી મળે છે. આ બધા લોકો રોટલો ને મીઠા પર જીવે છે અને મીઠા પર ભારે કરવેરો નાખવામાં આવેલો છે. એટલે ગરીબીમાં સબડતા હિંદ જેવા મુલકમાં પણ કું પેનીમાં ખાવાલાયક માંસ મેળવવાનું છેક અશક્ય નહીં તોયે અન્યાંત મુશ્કેલ છે.

હિંદમાં શાકાહારીઓ કોણ છે એ સવાલની આ સમજ સ્પષ્ટ થયા પછી બીજે કુદરતી સવાલ એ ઊભો થાય કે એ લોકો શાકાહારનો સિદ્ધાંત વહેવારમાં કઈ ઢબે અમલમાં મૂકે છે. પહેલું તો એ કે હિંદી શાકાહારના આચારમાં વી. ઈ. એમ.<sup>૨</sup> આહારની વાત આવતી નથી. હિંદીઓ એટલે કે શાકાહારી હિંદીઓ મચ્છી, જનવરોનું માંસ, અને પંખીઓનું માંસ એ ત્રણ ઉપરાંત હીડાં પણ વેતા નથી. તેમની દલીલ એવી છે કે હીડું ખાવું એ જીવની કંતલ કર્યા બરાબર છે કેમ કે હીડાને છેડવામાં ન આવે તો તેનું સામાન્યપણે પંખી બને. પણ અહીંના કેટલાક શાકાહારી અંતિમવાદી દૂધ અને માખણને પણ વર્જય માને છે તેમ તે લોકો નથી માનતા એટલું જ નહીં, તેમને 'ફળાહારના દિવસો'એ લઈ શકાય એટલાં પવિત્ર માને છે. એવા દિવસો દર પખવાટિયે આવે છે અને ઊંચ વર્ણના ધાર્યાભરા હિંદુઓ સામાન્યપણે પાળે છે. તેમની દલીલ એવી છે કે ગાયનું દૂધ તેની પાસેથી લેવામાં અમે તેની કંતલ કરતા નથી. અને ખરેખર, ગાયને દોહવાની કિયા જેને ચિત્રોનો અને કાવ્યોનો વિષય બનાવવામાં આવ્યો છે તે

૧. દેખીતી જ આ. છાપકામની ભૂલ લાગે છે. પચાસો લાખ એટલે કે પચીસ કરોડને બહાલે અઠી કરોડ એમ છધાઈ ગયું છે.

૨. વી. ઈ. એમ.નો અર્થ ધાર્યું કરીને વેજિટેરિયનિયમ એક્સક્લુઝિન્સ મિલ્ક એટલે કે દૂધ વગરના શાકાહારનો સિદ્ધાંત એવા થાય છે.

તેની કલબની જેમ માણસની નાજુકમાં નાજુક લાગણીઓ પર આધાત પહેંચાડી થકતી નથી. સાથે સાથે અહો જણાવવું જરૂરી છે કે ગાય હિંદુઓમાં પૂજય મનાય છે અને કલબને માટે ગાયોને પરદેશ લઈ જવાને વહાણોમાં ચડાવાતી અટકાવવાને શરૂ કરવામાં આવેલું આંદોલન અપાટાબંધ આગળ વધતું જાય છે.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૭-૨-૧૯૬૧

૨

હિંદુ શાકાહારીઓ જે ભાગોમાં રહે છે તે મુજબ તેમના આહારમાં ફેર હોય છે. જેમ કે બંગાળમાં ખોરાકમાં મુખ્ય અનાજ ચોખા છે જ્યારે મુખ્ય ઈલાકમાં ઘઉં છે.

સામાન્યપણે બધા હિંદુઓ અને તેમાંથે મોટી ઉમરનાં માણસો અને તેમાં વળી ઊંચ વર્ણના હિંદુઓ દિવસમાં બે વખત ભોજન કરે છે અને તરસ લાગે ત્યારે તે બે સમયની વર્ષેના ગાળામાં એકાદ બે ખાલા પાણી પીએ છે. પહેલું ભોજન તે લોકો સવારના દસ વાગ્યાના અરસામાં લે છે. તેને અંગ્રેજેના ડિનર સાથે સરખાવી શકાય. બીજું ભોજન સાંજે આઠના અરસામાં લે છે અને તેને અંગ્રેજ સપર સાથે સરખાવી શકાય કારણ કે તેને રોતનું ભોજન અથવા વાળું કહે છે; જેકે એ સરખામણી નામ પૂરતી જ થાય કારણ કે હકીકતમાં વાળું રીતસરનું ભોજન, હોય છે. ઉપરના વર્ણન પરથી માલૂમ પડશે કે એ લોકો સવારમાં નાસ્તો લેતા નથી. હિંદુઓ "સામાન્યપણે સવારના ઇ વાગ્યે ઉઠે છે, અને થોડા તો વળી ચાર કે પાંચ વાગ્યા જેટલા વહેલા ઉઠે છે એ જોતાં તેમને સવારના નાસ્તાની જરૂર રહેવી જોઈએ. તેઓ બપોરનું સામાન્ય ભોજન પણ લેતા નથી; કેટલાક વાચકોને બેશક નવાઈ થશે કે પહેલા ભોજન બાદ હિંદુઓ નવ કવાક સુધી કરી પણ ખાધા વગર કેવી રીતે ચલાવતા હોય! બે રીતે આ વાતનો ખુલાસો મળી શકે. એક તો આદત સ્વભાવ જેવી બની જાય છે. કેટલાકને ધર્મની આશા હોય છે તેથી અને બીજા કેટલાકને રોજગારના રોકાણને લીધે અથવા રિવાજને લીધે એક દિવસમાં બે વખતથી વધારે વાર ભોજન ન કરવાની ફરજ પડે છે. એ ટેવનું બીજું કારણ એ કે હિંદની આબોહવા થોડા ભાગો બાદ કરતાં ઘણી ગરમ છે. અહો ઈંગ્લિઝમાં પણ અનુભવ થાય છે કે શિયાળામાં જેટલા ખોરાકની જરૂર રહે છે તેટલાની ઉનાળામાં રહેતી નથી. અંગ્રેજે જેમ દરેક વાની અલગ અલગ જમે છે તેમ હિંદુઓ જમતા નથી પણ ઘણી વાનીઓનું મિશાણ કરે છે. હિંદુઓમાંના કેટલાકને તો ધર્મની આશા મુજબ પોતાને જમવાની બધીયે વાનીઓ એકઠી કરી દેવી પડે છે. વળી, ભોજનની એક એક વાનગી ઘણી સંભાળથી જીણી જીણી વિગતોનું ધ્યાન રાખીને રંધાય છે. હકીકતમાં એ લોકો સાદા બાફેલા શાકમાં માનતા નથી પણ તેમને તે હરેકેમાં મરી, મરચાં, મીઠું, લવિંગ, તજ, રાઈ, અને એવા બીજા ઘણા મસાલાં કે જે બધાંનાં અંગ્રેજ નામો ઔષધિઓની યાદીમાંથી લઈએ તે સિવાય મળે નહીં તે નાખવાને જોઈએ છે.

પહેલા ભોજનમાં સામાન્યપણે રોટલા અથવા કહો કે રોટલી હોય છે. એ રોટલી વિષે પાછળથી વધારે લખ્ય છું. તે ઉપરાંત થોડું કઢોળ જેમ કે વાલ, વટાણા, ચણા વગેરે, જેગાં અથવા છૂટાં રંધીલાં બે કે જ્રણાશાક, તે પછી પાણીમાં રંધીલા ચોખા એટલે કે ભાત અને

અનેક મસોલાથી સ્વાદિષ્ટ કરેલી દાળ હોય છે. એ પછી કેટલાક લોકો દૂધ અને ભાત અથવા ઓકલું દૂધ, અથવા દહી અથવા ખાસ કરીને ઉનાળામાં છાશ પણ કે છે.

બીજા ભોજનમાં એટલે કે વાળુમાં પહેલા ભોજનના જેવી જ ઘણીખરી વાનીઓ હોય છે. પણ તેમનું પ્રમાણ ઓછું હોય છે. આ ભોજનમાં શાક પણ પહેલાના કરતાં ઓછાં હોય છે. વાળુમાં દૂધનો વપરાશ વધારે છૂટથી થાય છે. અહીં વાચકને યાદ કરાવણું જરૂરી છે કે હિંદીઓ અનિવાર્યપણે હમેશા, આ જ આહાર કે છે એવું નથી અને હિંદુસ્તાનભરમાં અને બધા વર્ગોના લોકોમાં ઉપર ગણ્યાવેલી અસલ વાનીઓ જ હોય છે એવું પણ નથી. જેમ કે નમૂના તરીકે વર્ણવવામાં આવેલા ભોજનમાં મીઠાઈનો ઉલ્લેખ કર્યો નથી પણ સારી સ્થિતિવાળા વર્ગોના લોકો અઠવાડિયામાં ઓકાદ ટંક તેનો ઉપયોગ કરે જ છે. વળી, ઉપર કષ્ટું છે તેમ મુંબઈ ઈલાકામાં ચોખાના કરતાં ધર્ઝિનો વપરાશ વધારે છે તો બંગાળમાં ધર્ઝિના કરતાં ચોખાને વધારે મહત્ત્વ અપાય છે. તેવું જ ત્રીજા અપવાદનું છે, ને મૂળ નિયમને સિદ્ધ કરી આપે છે કે ઉપર જણાવવામાં આવેલા આહારના કરતાં મજૂરી કરનારા વર્ગોનો આહાર જુદો હોય છે. બધીં જુદી વાનગીઓ ગણ્યાવવા જતાં મોટાં મોટાં થોથાં ભરાય ને તેમ કરવા જતાં આ લેખમાંથી રસ ઊરી જાય એવો ડર રહે છે.

દુંગલાંડમાં અથવા સંભવ છે કે યુરોપમાં વપરાય છે તેના કરતાં રસોઈને માટે માખણું અથવા તમારે જોઈએ તો કહો કે તાવેલા માખણું એટલે કે ધીનો ઉપયોગ ઘણો વધારે થાય છે. અને કંઈક અધિકારથી વાતાં કરી શકે એવા એક દાક્લરના કહેવા પ્રમાણે હિંદુસ્તાનના જેવી ગરમ આબોહવામાં માખણું વધારે વપરાશ, ફાયદો નહીં કરતો હોય તોહે, દુંગલાંડના જેવી ઠંડી આબોહવામાં કરે તેવું નુકસાન નહીં કરે.

વાચકને સહેલે ધ્યાનમાં આવશે કે ઉપર ગણ્યાવેલી નમૂનાદ્વારા આહારની વાનીઓમાં ફળોનો અને બેશક સર્વ રીતે ખોરાક તરીકે, મહત્ત્વનાં ફળોનો દુઃખ સાથે કહેવું પડે છે કે ઉલ્લેખ નથી તેથી તેમનો અભાવ તરત વરતાય છે. તેનાં અનેક કારણોમાં થોડાં એ છે કે હિંદીઓને આહાર તરીકે ફળોનું ઘટનું, મૂલ્ય સમજાયું નથી અને મોટાં શહેરો સિવાય સારાં ફળો હિંદમાં બધે મળી શકતાં નથી. અલબત્તા, અહીં જોવામાં નથી આવતાં એવાં કેટલાંક ફળ હિંદમાં બધા વર્ગોના લોકો વાપરે છે; પણ અફ્સોસ ! તે વધારાની ખાવાની ચીજે તરીકે વપરાય છે અને પોષક તત્ત્વોના રસાયણની ફરજિથી તેમનું મૂલ્ય કોઈ સમજાયું નથી કેમ કે તેમનું તે ફરજિથી પૃથક્કરણ કરવાની ઓઈ મહેનત કરનું નથી.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૧૪-૨-૧૮૮૧

### ૩

આની પહેલાંના લેખમાં રોટલીની બાબતમાં ‘હવે પછી વધારે’ જણાવવાનું વચ્ચે આપ્યું હતું. આ રોટલી સામુન્યપણે ધર્ઝિના લોટમાંથી બનાવવામાં આવે છે. ધર્ઝિને પહેલાં ધોટીમાં દળવામાં આવે છે. આ ધાંટી હાથથી ફેરવવાની હોય છે અને તે અનાજનો લોટ દળવાને માટેની સાઢી રચના હોઈ તેમાં સંચાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. ધર્ઝિના આમ દળેલા લોટને મોટાં કાણણુંવાળી ચાળણુંમાં ચાળવામાં આવે છે જેથી જાડું થૂલું ચાળણુંમાં રહી જાય છે.

અને ગરીબ વર્ગના લોકો તો ખરેખર ઘંટીમાં દળેલા ઘઉને ચાળતાયે નથી. આમ જોકે અહીંના શાકાહારીઓ વાપરે છે તેવો એ લોટ હોનો નથી એ ખરું છતાં ખૂબ વગોવાયેલી સહેદ ઉબલ રોટી અથવા પાંઠને માટે જે સામાન્ય પ્રકારનો લોટ અહીં વપરાય છે તેના કરતાં એ ઘણો ચિયાતો હોય છે. માખણ તદ્દન ચોપણું હોય તો જે હિયા કેટલીક વાર નકામી હોય છે તે તેના પર કરી એટલે કે તાવી, ગળણીથી ગાળી, ઠંડું પાડી, હરવા દઈ શુદ્ધ કરેલું માખણ અથવા ધીનું શેરે એક મોટા ચમચાને હિસાબે લોટમાં મોણ નાખવામાં આવે છે, અને પછી તેના પર જરૂર જોગું પાણું રેડી બે હાથે મસળી, કેળવી કષુકનો લૂંઝો તૈયાર કરવામાં આવે છે. આ મોટા લૂઆમાંથી લીંબુના જેવડા એકસરખા નાના નાના લૂઆ પાડવામાં આવે છે. એ દરેક નાના લૂઆની વેલાણીથી આશરે છ ઈંચ વ્યાસની ગોળ રોટલી વણાય છે. આ વેલાણ લાકડાની ટૂંકી લાકડી જેવું હોઈ આ કામ માટે ખાસ સંઘાડા પર ઉતારવામાં આવે છે. પછી વણાયેલી દરેક રોટલીને તાવી પર બરાબર શેકવામાં આવે છે. એક રોટલીને બરોબર શેકતાં અથવા ચુડી રહેતાં પાંચથી સાંત મિનિટ થાય છે. આવી રોટલી માખણ એટલે કે ધી સાથે ગરમ ગરમ ખાવાની હોય છે. તેનો સ્વાદ બહુ મજાનો હોય છે. એ રોટલી તદ્દન ઠડી પણ ખાઈ શકાય છે અને ખવાય છેયે ખરી. સામાન્ય અંગ્રેજને સારુ નેવું ખોરાકમાં માંસ હોય છે તેવી શાકાહારી કે માંસાહારી હિદીને માટે આહારમાં આ રોટલી હોય છે. આનું કારણ એવું છે કે આ વેખકના અભિપ્રાય મુજબ હિદમાં માંસાહાર કરનારો માણસ પોતે ખાય છે તે માંસને ખોરાક તરીકે તદ્દન આવશ્યક માનતો નથી પણ કહો કે રોટલીની સાથે ખાવાની એક વાની ગણે છે.

સારી સ્થિતિના હિદી શાકાહારીના ખોરાકની આવી આં રૂપરેખા અને માત્ર રૂપરેખા છે. હવે, એવો સવાલ પૂછવામાં આવે કે, “હિદી લોકોની રહેણીકરણીની ટેવોમાં બ્રિટિશ અમલને લીધે કોઈ ફેર નથી પડ્યો?” ખાવાપીવાની ટેવોને વણિવળગે છે ત્યાં સુધી આ સવાલનો જવાબ છે “પડ્યો છે” અને “નથી પડ્યો”. નથી પડ્યો કહેવાનું કારણ એ કે સામાન્ય સ્લીઓ અને પુરુષો પોતાના અસલ ખોરાકને અને ભોજનની બે ટંકને વળગી રહ્યાં છે. પડ્યો છે કહેવાનું કારણ એ કે જે લોકો થોડું અંગ્રેજ શીખી નીકળ્યા છે તેમણે કચાંક કચાંક આમ કે તેમ અંગ્રેજ ખ્યાલો આપનાવવા માંડયા છે. આ ફેરફાર સુધારો છે કે કુધારો તેનો નિર્ણય કરવાનું વાચકને સૌપી. એટલું કહેવું જોઈએ કે એ ફેર બહુ નજરે પડે એવો નથી.

પાછળથી ગણાવેલા એટલે કે થોડું અંગ્રેજ શીખી નીકળેલા વર્ગો સવારના નાસ્તાની વાત માનવા માંડી છે અને તે નાસ્તો સામાન્યપણે ચાના એકાદ બે ખાલા હોય છે. આ પરથી આપણે પીણાંની વાત પર આવવાનું થાય છે. હવે, મુખ્યન્યે બ્રિટિશ અમલની અસરને પરિણામે ભણેલા કહેવાતા હિદીઓએ ચા અને કોઝી પીવાનું શરૂ કર્યું છે તેની વાત બહુ ટૂંકમાં પતાવી શકાય એવી છે. ચા અને કોઝીથી બહુ થાય તો ખરથમાં થોડો વધારો થાય અને વધારે પડતાં પિવાય તો તબિયતમાં, સામાન્ય નબળાઈ આવે. પણ બ્રિટિશ અમલનાં વધારેમાં વધારે વરતાતાં અનિષ્ટેમાંનું એક માણસજાતનાં દુશ્મન અને સંસ્કૃતિના શાપ સમાં મધ્યાર્કવાળાં પીણાંઓની એક અથવા બીજે રૂપે હિદમાં થયેલી આયાત છે. પારકા પાસેથી વહેરી લીધેલાં આ અનિષ્ટનાં બૂયાઈના પ્રમાણનું માપ વાચક એટલી એક બીજા પરથી બરાબર કાઢી શક્યો કે એ દુશ્મનનો ફેલાવો ધર્મની મનાઈ હોવા છતાં હિદમાં એક છેદેથી બીજે છેડે સુધી થયો છે; પોતાના ધર્મના ફરમાન મુજબ મુસ્લિમને મધ્યાર્કની બાટલીનો સ્પર્શ સુધ્યાં અપવિત્ર કરે છે અને હિદુનો

ધર્મ તેને મધ્યાર્કનો કોઈ પણ રૂપે ઉપયોગ કરવાની સખત મનાઈ ફરમાવે છે; અને છતાં અફ્સોસની વાત છે કે સરકાર જાણે કે મધ્યાર્કવાળાં પીણાંઓનો ફેલાવો અટકાવવાને બદલે તે ફેલાવવાના ગુનાને પ્રોત્સાહન આપે છે ને સહાય કરે છે. બીજાં સર્વ સ્થળોની જેમ હિદમાં પણ એથી ગરીબ લોકોને વધારેમાં વધારે સોસવાનું આવે છે. પોતે જે કંઈ થોડી રોજ કમાય છે તે સારો ખોરાક અને બીજી જરૂરિયાતો ખરીદવામાં વાપરવાને બદલે દાડ જેવાં મધ્યાર્કવાળાં પીણાંઓ ખરીદવામાં તે વાપરી નાખે છે. એ કુમબખ્ત ગરીબ માણસને જ દાડ પીને પોતાની જત પર દુઃખ તેમ જ અકાળ મૃત્યુ વહેરી લેવાને માટે પોતાના કુટુંબને ભૂખે મારવું પડે છે અને પોતાનાં બાળકો હોય તો તેમને સંભાળવાની ટ્રસ્ટર્સ્પી પવિત્ર ફરજનો ભંગ કરવો પડે છે. અહીં એટલું કહેવું જોઈએ કે બેરો મતવિભાગના પાર્લિમેન્ટના માજી સભ્ય મિ. કેર્લને એ અનિષ્ટના ફેલાવવાની સામે જે પ્રશંસનીય લડત હજી નીડરપણે ચાલુ રાખી છે તે સારુ તેમને ધન્યવાદ ધરે છે; પણ ગમે તેવા શક્તિશાળી એકલદોકલ માણસનું જોર હેયાસૂની ઊંઘતી સરકારની નિષ્ક્રિયતાની સામે કેટલુંક ચાલવાનું હનું!

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૨૧-૨-૧૯૮૧

#### ૪

હિદમાં શાકાહારીઓ કોણ છે અને સામાન્યપણે તે લોકોનો આહાર શું હોય છે તે જાણું લીધા પછી નીચે આપવામાં આવેલી હકીકતો પરથી વાચક શાકાહારી હિદુઓના શરીરના બંધારણની કુમજોરી અંગે કેટલાક લોકો તરફથી આગળ ધરવામાં આવતી દલીલો પોકળ અને પાયા વગરની છે તેનો નિર્ણય બાંધી-શકશે.

હિદી શાકાહારીઓને વિષે એક એવી વાત વારંવાર કહેવામાં આવે છે કે તે બધા શરીરના બહુ નબળાં હોય છે અને તેથી શાકાહારના સિદ્ધાંતનો શરીરબળની વાત સાથે મેળ ખાતો નથી.

હવે, હિદમાં સામાન્ય રીતે શાકાહારીઓ હિદી માંસાહારીઓ કરતાં વધારે મજબૂત નહીં તોયે તેમના જેટલા જ અને વળી અંગ્રેજેના જેટલા પણ મજબૂત છે એવું સાબિત કરી શકાય અને વધારામાં એવું પણ બતાવી શકાય કે જ્યાં નબળાઈ છે ત્યાં તેનું કારણ નિરામિશાહાર નથી પણ બીજાં ઘણાં છે તો જેના પર ઉપરની દલીલ ઊભી કરવામાં આવી છે તે આખુંયે માળખું બોંધાલેગું થઈ જાય છે.

શરૂઆતમાં જ સ્વીકારવું જોઈએ કે સામાન્યપણે હિદુઓ નબળાં શરીરને માટે નામીયા થયેલા છે; પણ પૂર્વગ્રહ વગરનો કોઈ પણ માણસ જે માંસાહારી હોય અને જે હિદને તેમ જ તેના લોકોને માત્ર ઉપર ઉપરથી જાણતો હોય તે પણ તમને કહેશો કે બહુ ગવાયેલી આ કુમજોરીને માટે સતત કાર્ય, કરતાં બીજાં અનેક કારણો જવાબદાર છે. એમાંનું સૌથી મહત્ત્વનું એક જ નહીં તોયે મહત્ત્વનાં ચેકીનું એક કારણ બાળલગ્નનો-કમનસીલ રિવાજ અને તેની સાથેનાં બીજાં અનિષ્ટો છે. સાધારણ રીતે બાળકો નવ વરસની ઘણી મોટી ઊમરે પહોંચી જાય એટથે તેમના પર લગ્નની જેડીનો ભાર લાદવામાં આવે છે! ઘણા દાખલાઓમાં તો એથી પણ નાની ઊમરે તેમને પરણાવવામાં આવે છે અને કેટલાક દાખલાઓમાં તો જન્મ થાય તે

પહેલાં તેમનાં વેવિશાળ ગોડવી દેવાય છે. દાખલા તરીકે એક બાઈ બીજી સાથે એવી બોલીથી બંધાય છે કે મારે દીકરી આવશે ને તમને દીકરો આવશે અથવા મારે દીકરો આવશે ને તમને દીકરી આવશે તો તેનો વિવાહ કરીશું. બેશક, આવા કિસ્સાઓમાં લગ્ન બાળકો દસ કે અગિયાર વરસનાં થાય તે પહેલાં કરવામાં આવતાં નથી. બાર વરસની ઉમરની પત્નીને સોળ કે સત્તર વરસની ઉમરના પતિથી બાળક થયાના દાખલાઓ નોંધાયા છે. મજબૂતમાં મજબૂત શરીરના બંધારણ પર આવાં લગ્નોની માકી અસર થયા વગર રહે ખરો કે?

હવે આવાં લગ્નોની સંતતિ કેવી નભળી પેઢા થાય તેનો વિચાર કરો. પછી એવાં જોડાને જે ફિકરચિના વેઠવી પડે તે નુઝો. અગિયાર વરસના વરસનાં આશરે એટલી જ વયની કન્યા સાથેનાં લગ્નનો દાખલો લઈએ. આમ જે સમયે પતિ હોવું એટલે શું એ વાતથી છોકરો અજ્ઞાન હોવો જોઈએ અને હોય છે તે જ સમયે પત્ની તેને માથે મારવામાં આવે છે. તે અલબજા, નિશાળે જાય છે. નિશાળના અભ્યાસની મહેનત ઉપરાંત, જે તેની બાળપત્નીની સંભાળ રાખવાની આવે છે. પત્નીનું .ભરણપોષણ, કરવાનું સાચેસાચ તેને માથે આવતું નથી કેમ કે હિંદુસ્તાનમાં દીકરો પરણે એટલે તેનાં માબાપની સાથે મેળ ન હોય તે સિવાય તેનાથી અવશ્યપણે અલગ રહેવા માંડતો નથી; પણ ભરણપોષણ કરવા સિવાયનું બાકીનું બીજું બધું જ કરવાની જવાબદારી તેને માથે પડે છે. ત્યાર બાદ છાએક વરસના અરસામાં તેને બાળક થાય છે. હજુ ધાણુંખરું તેનો અભ્યાસ પૂરો થયેલો હોતો નથી અને તેને એકલા પોતાના જ નહીં, પોતાની પત્ની અને બાળકના ભરણપોષણને માટે કમાણી કરવાનું વિચારાનું પડે છે કેમ કે પોતાના પિતાની સાથે આખી જિંદગી કાઢવાની અપેક્ષા તે રાખી શકે નહીં; અને ધારો કે તે તેમ કરી શકે તોયે પોતાની પત્ની અને બાળક બન્નેના ભરણપોષણના ખર્ચમાં કંઈ ફાળો આપવાની અપેક્ષા તો તેની પાસે અવશ્ય રાખવી જોઈએ. પોતાની આ ફરજના ખાલી ભાનનો બોલે તેના મન પર રહેશે ખરો કે નહીં? અને એ રીતે તે ફિકર તેની તંદુરસ્તીને કોરી ખાશે કે નહીં? આનાથી ગમે તેવું મજબૂત શરીરનું બંધારણ પણ ખખડી નહીં જાય એવું કહેવાની હિમત કોઈ કરી શકશે કે? એવો દલીલ જેકે સહેલે થઈ શકે કે આ દાખલામાંનો છોકરો માંસાહારી હોત તો શરીરમાં રહ્યો તેના કરતાં વધારે પુષ્ટ રહી શક્યો હોત. આવો દલીલનો જવાબ માંસાહાર કરવા છતાંયે પોતાની અતિ વિષયસેવનની આદતથી નભળા રહેતા ક્ષત્રિય રાજાઓના દાખલામાંથી મળી રહે છે.

વળી, બિનતંદુરસ્તીનાં બીજાં વિરોધી કારણો કાર્ય ન કરતાં હોય તો હિંદી શાકાહારી શરીરથી કેટલો. મજબૂત હોઈ શકે તેનો સરસ દાખલો હિંદુના પશુપાલક ભરવાડો પૂરો પાડે છે. હિંદી ભરવાડ ભીમકાય એવો ઉત્તમ બાંધાનો આદમી હોય છે. પોતાની જરી મજબૂત કડિયાળી ડાંગથી તલવારવાળા સામાન્ય પુરોપિયનનો તે ખુશીથી બરોબરીનો સામનો કરી શકશે. પોતાની એ કડિયાળી ડાંગથી ભરવાડોએ. વાધ અને સિહને માર્યાના અથવા હાંકી કાઢ્યાના દાખલાઓ નોંધાયેલા છે. પણ એક દિવસ, એક મિત્રે દલીલ કરી કે ‘આ તો આણઘડ કુદરતી અવસ્થામાં જીવન ગાળનારાં માણસોનો દાખલો થયો. સમાજની આજની અત્યંત અકુદરતી અવસ્થામાં તમારે કેવળ શાકપાંદડાં ને કઠોળ ઉપરાંત બીજું કંઈ જોઈએ જ જોઈએ. તમારા ભરવાડમાં બુલ્લિનો અભાવ હોય છે, તે પુસ્તકો વાંચતો નથી વ. વ. વ.’ આ દલીલનો

૧. અહીં અંગેજુમાં એંડ વેરાયન્સને બાદલે એંડ સિક્સિશ એન્ડ સેક્ન્સ એવો પ્રયોગ ગાંધીજીએ કરેલો. છ જેનો સંભવ છે કે તેઓ આવો અર્થ કરતા હોય. બાકી એ પ્રયોગનો અર્થ જોયાણો એવો થાય છે.

એકમાત્ર જવાબ એ હતો અને છે કે શાકાહારી ભરવાડ માંસાહારી ભરવાડથી શરીરબળમાં ચંડિયાતો નહીં હોય તોએ તેનો બરોબરિયો તો હોય જ છે. આમ એક વર્ગના શાકાહારી સાથે તે જ વર્ગના માંસાહારીની સરખામણી થાય. અને આ સરખામણી એક પ્રકારના અને બીજા પ્રકારના જેર વચ્ચેની અને નહીં કે એક બાજુ પર ખાલી જેર અને બીજી બાજુ પર બુદ્ધિબળ સમેતના જેર વચ્ચેની થાય છે કેમ કે અત્યારે મારો પ્રયાસ માત્ર હિંદી શાકાહારીઓ પોતાના શાકાહારને કારણે શરીરના કમજોર હોય છે એ વાતને ખોટી સાબિત કરવાનો છે.

ખોરાક તમે ફાવે તેવો લો પણ એમ લાગે છે કે કોઈક વિરલ દાખલાંઓ બાદ કરતાં શરીરબળ અને બુદ્ધિબળ બન્ને સાથે સાથે કેળવવાનું અશક્ય છે. અવેજી વળતરના નિયમ મુજબ બુદ્ધિની શક્તિમાં ને મેળવાય તે શરીરની શક્તિથી ભરી કાઢવાનું થયા વગર રહે નહીં. સેમસનને કદી ગ્લેડસ્ટનને થઈ શકે નહીં.

હવે હિંદની લડાયક કહેવાતી ક્ષત્રિય દ્રોમનો દાખલો લો. એ લોકો અલબત્ત માંસાહારી છે પણ તેમાંના તલવાર ચલાવનારા કેટલા થોડા છે! એક કોમ તરીકે તેઓ કમજોર લોકો છે એવું કહેવાનો મારો મુદ્દલ આશય નથી. પ્રાચીન જમાનાની વાત છોડી દઈ આજના જમાનાના પૃથ્વીરાજ અને બીમ બાણાવળીની અને તેમના જેવા બીજા બધાની સ્મૃતિ કાયમ છે ત્યાં સુધી એ કોમ કમજોર છે એમ મનાવનારો મૂરખામાં ખપે. પણ હમણાંના એ લોકો ઉત્તરી ગયા છે એ હુંઘદ હકીકત છે. બીજાઓની સાથે ખરેખર લડાયક ગણે શકીય એવી કોમ વાયવ્ય સરહદ પ્રાંતના બૈયાઓની છે. તેમનો આહાર માત્ર ઘઉં, કઠોળ, અને સબજી છે. તેઓ શાંતિના રક્ષાલુહાર હોઈ તેમાંના મોટા ભાગનાની દેશી લશ્કરમાં ભરતી કરવામાં આવે છે.

ઉપરની હકીકતો પરથી સહેલે સ્પષ્ટ થાય છે કે શાકાહાર શરીરબળને નુકસાન કરનારો નથી એટલું જ નહીં, તેને પોષક છે અને શાકાહારને હિંદુઓની શારીરિક દુર્બળતાનું કારણ ગણ્યાવનારી દલીલ તદ્દન ભ્રામક પાયા પર રૂચાયેલી છે.

[મૂળ અંગેજ]

વિ વેજિટેરિયન, ૨૮-૨-૧૯૮૭

#### ૫

છેલ્લા દેખમાં આપણે જોઈ ગયા કે હિંદી શાકાહારીના શરીરના દુર્બળપણાનું કારણ તેમનો આહાર નથી, તેનાં કારણો બીજાં છે. વળી, આપણે એ પણ જોઈ ગયા કે ભરવાડો જે શાકાહારી છે તે માંસાહારીઓના જેટલા જ શરીરે સથકાં હોય છે. આ ભરવાડ શાકાહારીનો ઉત્તમ નમૂનો હોઈ આપણે તેની દિનર્યા અને તેનું જીવન નીરખી ઘણો લાલ મેળવી શકીએ; પણ એ વાતમાં આગળ વધતા પહેલાં વાચકને જણાવણું જોઈએ કે હવે પછી જે વર્ણન આવે છે તે હિંદી ભરવાડમને લાગુ પડતું નથી. હિંદના અમુક એક ભાગના ભરવાડોનું જ એ વર્ગન છે. જેમ સ્કોટલોન્ડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવો ઈંગ્લાંડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવોથી જુદી હોય તેવી જ રીતે હિંદના એક ભાગમાં રહેતા લોકોની રીતરસમો બીજા ભાગમાં રહેનારા લોકોની ટેવોથી જુદી હોય.

૧. પ્રચ્યંડ શરીરબળના નમૂનાનું બાધખલમાં આવતું એક પાત્ર.

૨. ઈંગ્લાંડનો એક વખતનો અત્યંત બુદ્ધિમાન લેખાયેલો વડો પ્રધાન.

હવે હિંદુ ભરવાડની વાત આગળ ચલાવીએ. તે ધાણુંખરું સવારના પાંચ વાગ્યે ઉઠે છે. તે જો ધાર્મિક વૃત્તિનો હોય તો ઉઠીને પહેલી પોતાના દેવની ગ્રાર્થના કરશે. પછી શરીરની સ્વચ્છતા સંભાળશે. તેમાં તે પોતાનું મેં અંદરથી અને બહારથી બરાબર ધુએ છે. આહી વાચકની પરવાનગીથી થોડું વિષયાન્તર કરી હું એક હિંદુ પોતાના દાંત સાફ્ કરવાને જે બ્રશ એટલે કે પીછી વાપરે છે તેનો તેને પરિચય કરાયું. એ બ્રશ માત્ર બાવળ નામના કાંટાળા જાડની ડાંખળી હોય છે અને તે દાતણ કહેવાય છે. એક ડાંખળીના દસથી બાર આંગળના માપના કાપીને કકડા કરવામાં આવે છે. અલબજન, તેમ કરતાં પહેલાં ડાંખળી પરના બધા કાંટા ઉતારી લેવામાં આવે છે. પછી આપણો હિંદુ એ દાતણની લાકડીનો એક છેડો ચાવી દાંત પર ધસવાને કામ આવે એટલો નરમ કૂચો બનાવે છે. આમ તે રોજ રોજ નવું ધરનું તૈયાર કરેલું બ્રશ બનાવી લે છે. પોતાના દાંતને બરાબર ધસી મોતી જેવા ચકચકતા સફેદ બનાવી પછી તે દાતણની એટલે કે પેલા બ્રશની બે ચીરી કરે છે અને તેમાંની એકને વચ્ચેથી વાળી તેનાથી જ્ઞાન પરથી ઓલ ઉતારી લે છે. સામાન્ય હિંદુ માણસના મજબૂત સુંદર દાંત ધાણુંખરું દાતણ કરવાની આ કિંયાને આભારી છે. તે દંતમંજનની કોઈ ભૂકી વાપરતો નથી એટલું ઉમેરણું કદાચ બિનજરારી હોય. દાતણનો છેડો ચાવી નરમ કૂચો કરવા જેટલા પોતાના દાંત મજબૂત રહ્યા નહીં હોય ત્યારે વૃદ્ધ હિંદીઓ તે માટે નાની હથોડી વાપરે છે. આ આખી કિયામાં વીસ કે પચીસ મિનિટથી વધારે વખત જતો નથી.

આપણા ભરવાડની વાત પર પાછા આવીએ. પછી તે સવારનો નાસ્તો અથવા શિરામણ કરે છે. તેમાં મિલેટ જે બાકુરીનું ઓંગ્લો-ઇન્ડિયન નામ છે. તેનો એક જ્ઞાન રોટલો હોય છે. આ બાજરી હિંદમાં મોટે ભાગે ઘઉંની સાથે વધારામાં અગર તેને બદલે વપરાય છે. રોટલા સાથે નાસ્તામાં ધી અને ગોળ હોય છે. સવારના આઠથી નવ વાગ્યાના અરસામાં તે તેની સંભાળમાં રાખવામાં આવેલાં ઢોર ચરાવવાને ચરણમાં જાય છે. ચરણનું સ્થળ ધાણુંખરું તેના કસબાથી બે કે ત્રણ માઈલને અંતરે હોય છે. એ કુંગરાળ જમીનનો ભાગ હોઈ તેના પર હરિયાળી વનસ્પતિ પૂરા બહારમાં પથરાયેલી હોય છે. આમ તેને તાજમાં તાજ હવાની સાથે કુદરતી રણિયામણા દૃષ્ટિનો ઉપભોગ કરવાનો અનન્ય લાભ મળે છે. ઢોર આજુભાજુ ચરતાં ફરતાં હોય ત્યારે તે પોતાનો વખત ગાવામાં અથવા પોતાના સોબતી કે જે તેની વહુ, ભાઈ. અગર બીજું સગું હોય તેની સાથે વાતો કરવામાં ગાળે છે. બાર વાગ્યાના અરસામાં તે સાથે આણેલું બપોરણું ભોજન લે છે. આ ભોજન ઢોર ચરાવવા આવતી વખતે સાથે લેતા આવવાનો તેનો રિવાજ છે. આ ભોજનમાં હમેશના રોટલાં, ધી, એક શાક અથવા કઠોળ, તેની સાથે વધારામાં અથવાં તેની અવેજીમાં કંઈક અથાણું અને ગાયનું ત્યાં જ તાજું દોહેલું દૂધ હોય છે. ત્યાર બાદ તે ધાણુંખરું હમેશા બે કે ત્રણ વાગ્યાના અરસામાં અપેણેએક કલાક સુધી કોઈ ઘેરી છાયાવાળા જાડ નીચે ઊંઘ કાઢી લે છે. બપોરના આકરા તડકામાંથી આ ઊંઘમાં તેને રાહત મળે છે. છ વાગ્યે તે ઘેર પાછો વળે છે, સાત વાગ્યે વાળું કરે છે, તેમાં ગરમ રોટલા, કઠોળ અથવા શાક જમે છે અને છેવટે ભાત અને દૂધ અથવા ભાત અને છાશથી પૂરું કરે છે અને થોડું ધરનું કામકાજ જે સામાન્યપણે પોતાના કુંભની સાથેની હસીભુથીની વાતો હોય છે તે પતાવીને દશ વાગ્યે સૂઈ જાય છે. તે કાં તો ખુલ્લી હવામાં આકાશ નીચે અથવા કેટલીક વાર ભીડથી ભરેલા છાપરામાં સૂવાનું રાખે છે. શિયાળાની ઠંડીની અથવા વરસાદની મોસમમાં તે છાપરાનો આકાશ લેલે છે. આહી એટલું જલ્દાવી લેવું જેઈએ કે આ છાપરા

દેખાવમાં કંગાળ હોય છે ખરાં અને ધારું વાર તો બારીઓ વગરનાં હોય છે છતાં હવાને રોકી રાખનારાં હોતાં નથી. આલુઘડ રીતે બાંધિલાં એ છાપરાંનાં બારણાં પવન અથવા વરસાદનાં જાપટાંની સામે નહીં પણ ચોરની સામે બચાવમાં મૂકવામાં આવે છે. આ બધું સાચું પણ એ છાપરાંઓમાં સુધારાને ધારું અવકાશ છે એ વાતનો ઈન્કાર થાય એવું નથી.

સારી સિથિતિના ભરવાડની રહેણીકરણી આવી હોય છે. તે ધારું રીતે આદર્શ છે. તેની ટેવો ફરજિયાત નિયમિત હોય છે, પોતાનો જાઓ વખત તે ઘર બહાર ગાળે છે, બહાર ફરતાં ફરતાં તેને તાજમાં તાજી હવા સહેને મળે છે, તેને જરૂરી કસરત મળી રહે છે, સારો પૌષ્ટિક આહાર મળે છે અને જેકે છેલ્લી ગણાવેલી વાત હોવા છતાં મહત્ત્વમાં છેલ્લી નહીં એવી શરીરની નભળાઈના કારણરૂપ થનારી ધારું ફિકરચિતામાંથી તે મુક્ત હોય છે.

[મૂળ અંગેજ]

વિ વેજિટેરિયન, ૭-૩-૧૯૮૧

#### ૬

આપણા ભરવાડની રહેણીમાં જે એક ખામી જેવાની મળે છે તે એ છે કે તે રોજ નાહતો નથી. ગરમ આબોહવામાં સ્નાન ધારું ઉપયોગી હોય છે. એક બાજુથી એક બાલાલ દિવસમાં જે વાર સ્નાન કરશે, વેશ્ય એક વાર કરશે તો બીજી બાજુથી ભરવાડ અઠવાડિયે એક વાર નાહશે. અહીં હું ફરી એક વાર થોડું વિષયાન્તર કરી એક હિંદી કેવી ઢબે સ્નાન કરે છે તે સમજવી લાઉ. સામાન્ય રીતે તે પોતાના કસબાની પાસેથી વહેતી નદીમાં સ્નાન કરે છે પણ નદીએં જવાનું તેને આપસ હોય, અથવા પાણીમાં ડૂબી જવાની બીક હોય, અથવા તેના ગામ પાસે નદી ન હોય તો તે ઘર આગળ નાહી લે છે. બાથનું ટબ અથવા જેમાં પડીને સ્નાન કરી શકાય એવું વાસણ તે, રાખતો નથી. પાસે રાખેલી એક મોટી પાણીની કુંડી-માંથી કળશા વડે તે પાણી લઈ શરીર પર રડે છે કેમ કે તેનું માનવું એવું હોય છે કે બંધિયાર પાણીમાં પડીને નાહવાથી પાણી અપવિત્ર થાય છે અને પછી વપરાશને લાયક રહેનું નથી. એ જ કારણસર તે બેસિન અંથવા કુંડમાં પોતાના હાથ ધોતો નથી પણ કોઈકની પાસે હાથ પર પાણી રેડાવે છે અથવા બન્ને હાથ વચ્ચે લોટો પકડી જાતે પાણી રેરી લે છે.

પણ પાછા આપણી મૂળ વાત પર આવીએ. ઓછું નાહવાથી આપણા ભરવાડની તંદુરસ્તી પર માઠી અસર થતી હોય એવું લાગતું નથી, પણ બ્રાલાસ પોતાનાં રોજનાં જે સ્નાન કરવાનું એક જ દિવસ માંડી વાળે તો તેને ધારું બેચેની થયા વગર રહે નહીં, અને એથીયે વધારે દિવસ સુધી તેને સ્નાન કરવાનું ન મળે તો તે ખરેખર માંદો પડી જાય એ ઉધાડું છે.

હું ધારું છું કે જે ધારું વાતનો બીજી રીતે ખુલાસો મળી શકતો નથી અને જેને આદત ગણવાથી તેનું કારણ સમજાય છે તે પેકીનો આ એક દાખલો છે. જેમ કે એક ભંગી ગંદવાડ સાહી કરવાના પોતાના વ્યવસાયમાં રોકાયેલો છતાં પોતાની તંદુરસ્તી જાળવી શકે છે. પરંતુ કોઈ પણ સામાન્ય માલાસ તેં ધધો કરવા જાય તો મરણને મોઢે પહેંચી ગયા વગર રહે નહીં. નાજુકાઈમાં ઊછલેલો : 'ઉમરાવ લંડનના ઈસ્ટ એન્ડ જેવા મજૂર લતાના મજૂરની નકલ કરવા જાય તો યમરાજ તેનું બારાણું ઠેકયા વગર રહે નહીં.'

આ મુદ્રો બરાબર સ્પષ્ટ કરી બતાવતી એક વાર્તા અથવા કિસ્સો અહીં આપ્યા વગર હું રહી શકતો નથી. એક રાજ રતિ જેવી રૂપસુંદરી એક દાતણવાળીના પ્રેમમાં પડ્યો. પછી

સહેને અપેક્ષા રખાય તેમ તેને રાજના મહેલમાં રાખવાનો હુકમ થયો. હીકતમાં તો તે મોજશોખના ધામમાં પહોંચી ગઈ. ઉત્તમમાં ઉત્તમ ખાવાપીવાનું, ઉત્તમમાં ઉત્તમ કપડાંલતાં, ટૂંકમાં બધુંયે ઉત્તમમાં ઉત્તમ તેને સારુ આવી મળ્યું. પણ અરે! જે પ્રમાણમાં મોજમજની ચીજે તેને મળતી થઈ તે જ પ્રમાણમાં તેની તબિયત કથળવા માંડી. કોઈબંધ વૈદોને તેની તહેનાતમાં રજૂ કરવામાં આવ્યા પણ નિયમિતપણે આપવામાં આવેલી ઘણી ઔષધિમાંની એકે કામ ન આવી. દરમિયાન એક ચતુર વૈદ બાઈની માંદગીનું સાચું કરાણ પામી ગયો. તેણે કદ્યું કે બાઈને વળગાડ છે. તેથી બાઈને વળગેલાં ભૂતપ્રેતને સંતોષવાને તેણે બાઈને રહેવાના આલીશાન ઓરડાઓમાંના દરેકમાં ફળફળાદિની સાથે વાસી રોટલાના કકડા રાખવાનું ફરમાન કાઢ્યું. યોજના એવી હતી કે જેટલા ઓરડા હતા તેટલા દિવસમાં પેલાં ભૂતપ્રેત નાસી જાય. અને તેણે કદ્યું કે એ બધાં નાસી જણે તેની સાથે માંદગી પણ ગઈ જાણો. અને બન્ધુંયે તેવું જ. અલબર્ટા, પેલા વાસી રોટલાના ટુકડા ગરીબ બિચારી રાણીને કામ લાગ્યા હતા.

હવે આ પરથી માણુસો પર ટેવનો કાબૂ કેવો જબરો હોય છે તે જોવાનું મળે છે. તેથી મને લાગે છે કે ભરવાડ સ્નાન પૂરતાં કરતો નથી તેથી તેને ખાસ કથું નુકસાન થતું નથી.

છેલ્લા લેખમાં આપણે આ પ્રકારની રહેણીનું કેવું સારું પરિણામ આવે છે તે જોયું હતું. તે પરિણામ એ છે કે શાકાહારી ભરવાડ શરીરે સબધો હોય છે. તે આવરદા પણ લાંબું ભોગવે છે. ૧૮૮૮ની સાલમાં જેની ઊમર સો વરસ વટાવી ગઈ હતી એવી એક ભરવાડણને હું ઓળખું છું. છેલ્લો હું તેને મળેલો ત્યારે તેની નજર સાખૂત હતી. તેની યાદદાસ્ત તાજી હતી. પોતાના બથપણમાં જે જોપેલું તેને તે બરાબર સંભારી શકતો. લાકડીને ટેકે તે ચાલતીયે ખરી. હું આશા રાખ્યું છું કે તે હજી જીવતી હશે.

વળી, ભરવાડની શરીરકૃતિ સપ્રમાણ સુંદર હોય છે. તેનામાં ખોડાંપણ જવલ્યે જ જોવામાં આવે છે. વાધના જેવો વિકરાળ નથી છતાં તે તેના જેટલો જ સશક્ત હોય છે, શૂરો હોય છે અને છતાં ઘેટાના લવારા જેટલો નરમ ને નિર્દેખ હોય છે. તેના કદ્થી ઝર લાગતો નથી પણ તે પ્રભાવશાળી હોય છે. શોકદરે હિદી ભરવાડ શાકાહારીના ઉત્તમ નમૂનો હોઈ શરીરભળની વાતને લાગેવળગે છે ત્યાં સુવી કોઈ પણ માંસાહારીની સરખામણીમાં પાર, ઉતરે એવો છે.

[મૂળ અંગ્રેજી]

ધિ વેજિટેરિયન, ૧૪-૩-૧૮૯૧

## ૮. કેટલાક હિંદી તહેવારો

૧

આ ઈસ્ટરના ઉત્સવી વખતે મારો વિચાર ઈસ્ટરના ગાળામાં આવતા તહેવારોને વિષે વખવાનો હતો; પણ એ તહેવારોની સાથે સંકળાયેલાં સ્મરણો દુઃખદ હોઈ તેમ જ તે હિંદુઓનો સૌથી મોટો ઉત્સવ ન હોઈ તેના કરતાં મહત્વમાં અને ઉજવણીની ભવ્યતામાં કચાંગે ચડિયાતા દિવાળીના તહેવારોનું વર્ણન તેમના વર્ણનને બદલે કર્યું એ વધારે ઉચિત છે.

દિવાળીને હિંદુઓની નાતાલ કહી શકાય. તે હિંદુ વિકિમ સંવત્સરને અંતે એટલે કે નવેમ્બર માસ દરમિયાન આવે છે. એ સામાનિક તેમ જ ધાર્મિક એમ બન્ને પ્રકારનો તહેવાર છે. એ લગભગ એક આખા મહિના પર ફેલાયેદો હોય છે. હિંદુ વિકિમ સંવત્સરના બારમા આસો માસની પહેલી તિથિએ. એ ભવ્ય ઉત્સવ આત્મી પહેલાંચાની જહેરાત બાળકો પહેલવહેલા ફટાકડા ફોડાને કરે છે. પહેલા નવ દિવસો નવરાત્રી એ નામે ઓળખાય છે. એ નવ દિવસો મુખ્યત્વે ગરબીઓથી વરતાઈ આવે છે. વીસ, ત્રીસ કે તેથીયે વધારે માણસો મોટાં કૂંડળાં બનાવે છે, તેમની વચ્ચે એક મોટો થાંબલો રોપી સુંદર રીતે શાણગારી તેના પર ચારે બાજુ દીવા ગોડવામાં આવે છે અને ત્યાં જ તે કૂંડળાની વચ્ચે લોકરુચિને અનુકૂળ ગીતો ગાતો એક આદમી બેસીને ઢોલક વગાડે છે. કૂંડળે વળેલા માણસો તાળીથી તાલ આપી એ ગીતો જીવે છે. ગીતની કડીઓ જીલતાં જીલતાં તે બધાએ દીપમાળની આસપાસ હરે છે અને સાથે તાલ આપતાં આપતાં કેડમાંથી વાંકા વળી પાછા ટટાર થતા જાય છે. આ ગરબીઓ સાંભળવામાં ઘણી વાર બલું આનંદ આવે છે.

અહીં જાણવણું જોઈએ કે છોકરીઓ અને તેમાંથી મોટી ઊમરની લીઓ આ ગરબી રમવામાં કદી સામેલ થતી નથી. અલબતા, તેઓ પોતાની અલગ ગરબી રાખે છે અને તેમાંથી પુરુષોને બાદ રાખવામાં આવે છે. કેટલાંક કુટુંબોમાં આ દિવસોમાં અર્ધો ઉપવાસ કરવાનો રિવાજ હોય છે. આખા કુટુંબમાંથી એક જાણ એવું વ્રત કરે તો ચાલે. એ ઉપવાસ કરનાર માણસ દિવસમાં એક જ વાર અને તે પણ સાંજે જ જમે છે. વળી તે અનાજ કે કઠોળ નહીં પણ માત્ર ફળફળાદિ, દૂધ અને બટારા જેવાં કંદમૂળ લઈ શકે છે.

દસમા દિવસને દસેરો કહે છે. અને તે દિવસે મિત્રો બેગા મળી એકબીજાને જહ્યતો આપે છે. એ દિવસે મિત્રોને અને તેમાંથે આશ્રયદાતાઓને કે ઉપરો અમલદારોને મીઠાઈઓ બેટ તરીકે મોકલવાનો પણ રિવાજ છે. એક દસેરાનો દિવસ બાદ કરતાં નવરાત્રીમાં બધી આનંદપ્રમોદની પ્રવૃત્તિ રાતને વખતે ચાલે છે અને રોજેરોજની સામાન્ય નિત્ય પ્રવૃત્તિ દિવસે પૂરી કરવામાં આવે છે. દસેરા પછી એક પખવાદિયા સુધી બધું પ્રમાણમાં શાંત થઈ જાય છે. માત્ર લીઓ તે દરમિયાન આવી રહેલા મોટા તહેવારની ઉજવણી સારુ મીઠાઈની અને બીજી ખાવાની વાનગીઓ રંધવામાં ને તૈયાર કરવામાં રોકાય છે કેમ કે હિંદુસ્તાનમાં ઊંચામાં ઊંચા

૧. ઈશ્વર કબરમાંથી બાક્યા તે દિવસની ઉજવણીનો ખિસ્તી ધર્મનો તહેવાર. દર વંચે માર્યે માસની ૨૧મી અને એપ્રિલ માસની ૨૬મી તારીખ વર્ષેના રવિવારે આવે છે.

વળની ખીઓ જે રસોઈ કરવામાં નાનમ માનતી નથી. ઉલટું, હકીકતમાં દરેક ખીએ રસોઈની કળા સિલ્ફ કરેલી હોવી જેઈએ એમ મનાય છે.

આમ રાતને વખતે ભોજન અને ગોતગરબાની મજા કરતાં કરતાં આપણે આસો મહિનાની વદ તેરસ સુધી પહોંચીએ છીએ. (હિંદમાં દરેક માસના કૃષ્ણ પક્ષ અથવા વદ અને શુક્લ પક્ષ અથવા સુદ એવા બે ભાગ પાડવામાં આવે છે અને પૂર્ણિમા પછીના તેમ જ અમાવાસ્યા પછીના પડવાથી તે બન્નેની થરઘાત ગણાય છે; આમ પૂનમ પછીનો પડવો વદ અથવા અંધારિયાનો અને અમાસ પછીનો સુદ અથવા અજવાળિયાનો પહેલો દિવસ ગણ્ણાતો હોઈ તિથિની ગણુતરી એ રીતે આગળ ચાલે છે.) તેરસનો દિવસ અને તે પછીના ત્રણ દિવસ આખા ને આખા ઉજવણીમાં અને આનંદપ્રમોદમાં જાય છે. આ તેરમા દિવસને અથવા તેરસને ધનતેરસ કહેવામાં આવે છે એટલે કે એ તેરસ સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજાને માટે જુદી રાખવામાં આવેલી છે. તવંગર લોકો તે દિવસે જુદી જુદી જતનું હીરા મોતી અને બીજનું ઝવેરાન, નાણાંના સિક્કા વગેરે લેણું કરી સંબાળથી એક પેટીમાં મૂકે છે. પૂજા સિવાય એનો તેઓ બીજો ઉપયોગ કરતા નથી. દર વરસે આ સંધરામાં કંઈ ને કંઈ ઉમેરવામાં આવે છે. અને થોડા વિરલ અપવાદ બાદ કરતાં કોણું લક્ષ્મીનો લોલ નથી રાખતું એટલે કે તેને નથી ભજતું? એથી તે ભજન એટલે બહારની પૂજા સિક્કા વગેરેને પાણીથી અને દૂધથી ધોઈને તેના પર કંકું ને ફૂલ ચડાવીને કરવામાં આવે છે.

ચૌદમો દિવસ કાળી ચૌદસ કહેવાય છે; પણ કાળી ચૌદસ હોવા છતાં તે દહાડે લોકો મળસકે ઊઠે છે અને એદીમાં એદી માણસને પણ બરાબર નાહવાની ફરજ પડે છે; માતાઓ શિયાળો હોવા છતાં તે દિવસે વહેલી સવારના પોતાનાં નાનાં બાળકોને પણ નવડાવ્યા વગર રહેતી નથી. કાળી ચૌદસની રાતે સમથાનમાં ભૂતો ટોળે વળે છે એનું મનાય છે. ને લોકો ભૂતપ્રેતની વાતમાં શક્ખા રાખે છે તે પોતાના એ મિત્રોને મળવાને એ સ્થળો પર જાય છે અને બીકણું માણસો ભૂત કચાંક નજરે ન પડી. જાય એવી બીકનાં માર્યા ધરમાંથી બહાર પણ હુંકતાં નથી.

[મૂળ અંગ્રેજી]

વિ વેજિટેરિયન, ૨૮-૩-૧૯૮૧

૨

પણ જુઓ! હવે પંદરમા દિવસનું સવાર પડયું ને દિવાળી આવી પહોંચી. આ દિવાળીને દહાડે ભારી ભારી દાઢખાનું ફેડવામાં આવે છે. આ દિવસે કોઈ પણ પોતાની પાસેનું નાણું છોડવા માગતું નથી. કોઈ પેસા ઉછીના બેશે નહીં કે આપણે નહીં. ને કંઈ ખરીદી કરવાની તે બધી આગલે દિવસે થઈ ગયેલી ગણાય છે.

હવે તમે એક જહેર રસ્તાનાં ખૂલ્ણે ઊભા છો. જુઓ, ધોળાં દૂધ જ્યેવાં કપડાં પહેરી પેલો ભરવાડ સામે ચાલ્યો આવે છે, એ કપડાં ઓણે પહેલી જ વાર પહેર્યાં છે. તેની લાંબી દાઢી તેણે ચહેરા પર બે બાજુ ઊંચી લઈ પોતાના ફળિયાની નીચે દબાવી છે અને તે કોઈક ગોતની તૂટક કડીઓ લલકારે છે, લાલ રંગે ને લીલા રંગે રંગેલાં અને આણી પર ચાંદીની ખોળીઓવાળાં શીંગડાંવાળી ગાયોનું ધણ તેની પાછળ વહું આવે છે. તેની પાછળ નાની નાની

મહિયારીઓનું ટોળું માથે ઊઢણ પર ગોઠવેલી નાની નાની મટુકીઓ લઈ થોડી વારમાં ચાલી આવતું તમારી નજરે પડે છે. તમને થાય છે કે આ મટુકીઓમાં શું હોય! પેલી બેપરવા મહિયારીની મટુકીમાંથી છલકાતું દૂધ જોતાવેંત તમારી શાંકા દૂર થાય છે. પછી ધોળા થોલિયાવાળો, ધોળી પાઘડી માથે મૂકી તેમાં બરુની લાંબી કલમ ખોસી ચાલ્યો આવતો પેલો પડછંદ આદમી જુઓ. તેણે કેદે લાંબું ફાળિયું વીટાળયું છે અને તે ફાળિયામાં રૂપાનો શાહીનો ખડિયો ગોઠલ્યો છે. તમારે જાણો લેવું જોઈએ કે એ મોટો શરાફ છે. આમ જુદી જુદી જતનાં માણસો આનંદ અને મસ્તીભર્યી રસ્તેથી ચાલ્યાં જતાં તમને જોવાનાં મળશે.

પછી આવી રાત. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી જળાંજળાં થઈ રહી છે; અલબત્તા, જેણે લંડનના રિઝન્ટ સ્ટ્રીટ અથવા ઓક્સફર્ડ સ્ટ્રીટ જેયા નથી તેને જ એ આંજી નાખનારી લાગે અને તેની સરખામણી કિસ્ટલ પેંબેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહીં; મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પોતાનાં સારામાં સારાં વળો પહેરી કરવા નીકળે છે, એ વખોના રંગોની વિવિધતાનો પાર નથી, તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વલો એકઠાં મળી સુમેળવાણું અખંડ રંગબેરંગી સુંદર દૃશ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વબ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોક બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે છે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દાર્ઢ્યાનું ફોડવા મંડી પડે છે; અને આ પૂજાનું મહુરત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફૃટકડાઓના અને બીજી દાર્ઢ્યાનાના ફૂટવાના ફૃટકડ અને સૂસૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંથે આ રાતે તો આનંદ અને ઉત્સાહ, આંજી નાખનારી રોશની અને જતજતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

ત્યાર પછીનો એટલે કે બેસતા વરસનો દિવસ મુલાકાતો બેવા જવાનો અને મુલાકાતોએ આવનારાઓને મળવાનો દિવસ છે. રસોડાનો ચૂલ્હો તે દિવસે ટાકો રહે છે અને તેથી આગળના દિવસોએ તૈયાર કરેલી વાનીઓથી ચલાવી બેવામાં આવે છે. પણ ખાઉધરને ભૂખે મરંણું પડતું નથી કરણું કે ખાવાની વાનીઓ એટલી બધી હોય છે કે તે વારે વારે ખાય છે તોયે પૂરી થતી નથી ને કેટલુંયે વધે છે. સારી સ્થિતિના વર્ગના લોકો હરેકે પ્રકારનાં શાકભાજી, અનાજ અને કઠોળ ખરીદી રાંધે છે અને બેસતે વરસે તે દરેકનો ચાખીને સ્વાદ લે છે.

‘નવા વરસનો બીજો દિવસ પ્રમાણમાં ધમાલ વગરનો શાન્ત હોય છે. રસોડાના ચૂલ્હા ફરી સળગે છે. આગલા દિવસોનાં ભારી ભોજનો પછી આ દિવસે સાધારણ રીતે હલકો ખોરાક બેવાય છે. કોઈક તોફાની છોકરાં ફોડે તે સિવાય દાર્ઢ્યાનું પણ હવે ફૂટતું નથી. રોશનીનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ બીજાની સાથે દિવાળીના તહેવારો લગભગ પૂરા થાય છે.

આ ‘તહેવારોની સમાજ’.. પર કેવી અસર થાય છે ને અજાણપણે પણ લોકો કેવાં કેવાં કેટલાંક કરવા લાયક કામો કરે છે તે જોઈએ. સામાન્યપણે આ નહેવારોને માટે કુટુંબનાં બધાં માણસો પોતાના રહેઠાણના મુખ્ય સ્થળ પર એકઠાં મળવાને કોશિશ કરે છે. આગણું આખું વરસ ધંધાના રોકાણને લીધે પતિને બહાર રહેવાનું થયું હોય તોપણું તે પત્નીને મળવા આવવાને હમેશે ઘેર પહોંચવાની કોશિશ કર્યા વગર રહેતો નથી. પોતાનાં બાળકો બેગા થવાને પિતા

લાંબી સફર એડીને પણ આવે છે. દીકરો ભાષુવાને બહારગામ ગયો હોય તોયે પોતાની નિશાનેથી આ તહેવારોમાં ઘરબેંગો થાય છે અને આમ હમેશ કુટુંબને એકઠા મળવાનો પ્રસંગ મળે છે. વળી, જેમને પરવડે તે સૌ નવાં કપડાંલતાં વસાવે છે. તવંગર વર્ગોમાં ખાસ આ પ્રસંગને માટે નવાં ઘરેણાં ઘડાવવામાં આવે છે. કુટુંબના જૂના કનિયા પતાવવામાં આવે છે. કંઈ નહીં તો તે માટે પૂરો પ્રયાસ અવશ્ય થાય છે. ઘરો સમરાવવામાં ને ધોળાવવામાં આવે છે. લાકડાની પેટીમાં બંધાઈને પુરાઈ રહેલા જૂના રાચરચીલાને બહાર કાઢી સાફ કરી પ્રસંગ પૂરતું ઓરડાઓ શાલુગારવાને કામમાં લેવામાં આવે છે. જૂનાં દેવાં હોય તો બને ત્યાં લગી પાછાં વાળવામાં આવે છે. દરેક જણ નવું ધાતુનું વાસણ કે એવું જ કંઈક રાચ બેસતા વરસને માટે ખરીદે એવી અપેક્ષા રહે છે. છૂટે હાથે દાન આપાય છે. પ્રાર્થનાપૂજા કરવાની અથવા મંદિરોએ દરશને જવાની જાજી પરવા ન રાખનાર લોકો આ પ્રસંગે બન્ને વાનાં ખસૂસ કરે છે.

બીજાઓ સાથે વાતવાતમાં ટંટોફિસાદ અને ગાળાગળી કરવાની ભૂંડી આદત ખાસ કરીને સમાજના નીચલા વર્ગોમાં ખૂબ ફેલાયેલી છે પણ તહેવારોમાં કોઈએ બીજ સાથે તેવું કરવાનું હોય નહીં. ટૂંકમાં બધુંયે શાન્તિભર્યું ને આનંદભર્યું હોય છે. જિંદગી બોંજરૂપ ન રહેતાં પૂરી ઉલ્લાસભરી બને છે. આવા તહેવારોને જોકે કેટલાક લોકો વહેમના અવશેષ અને નકામી ધિગામસ્તી કહીને વખોડી કાઢે છે છતાં તેમાંથી સારાં લાંબા ગાળા સુધી અસર કરનારાં ફળ નીપળ્યા વગર રહેતાં નથી એ બીજા સહેંજે જણાઈ આવે છે. વળી, સાચું જેતાં આવા તહેવારો માણસજાતને આશીર્વાદ જેવા છે કેમ કે મજૂરી કરીને જીવનારાં કરોડેની જિંદગીના કંટાળાજનક એકુદ્ધારાપણામાં તે રાહતરૂપ બને છે.

દિવાળીના તહેવાર આખાયે હિંદુસ્તાનમાં ઊજવાય છે છતાં ઊજવણીની વિગતોમાં જુદા જુદા ભાગમાં ફેર હોય છે. વળી, હિંદુઓના સૌથી મોટા ઉત્સવનું આ બ્યાન અધ્યૂરું ગણાય. અને કોઈએ એવું માની લેવાનું નથી કે આ તહેવારોનો ખોટો ઉપયોગ નથી થતો. બીજ બધી વસ્તુઓની માફક આ ઉત્સવની કાળી બાજુ હોવાનો સંભવ છે અને ધાણુંખરું હોય છેયે ખરી. પણ તેની વાત અહીં છેડવાની જરૂર નથી. એટલું ચોક્કસ છે કે તેનાં જે ઈષ્ટ પરિણામ આવે છે તે અનિષ્ટના કરતાં કચાંયે વધારે હોય છે.

[મૂળ અંગ્રેજી]

દિવાળીના તહેવારોથી મહત્વમાં બીજ નંબરના હોળીના છે અને તેમનો ઉલ્લેખ ૨૮મી માર્ચના દિવિજિટેરિયનના અંકમાં થઈ ગયો છે.

વાયકને યાદ હુશે કે હોળીના તહેવાર ઈસ્ટરના અરસામાં આવે છે. હિંદુ વિક્રમ સંવત્સરના ફાગણ મહિનાની પૂનમે હોળી થાયે છે. આ બરાબર વસંત ઋતુનો સમય છે. જાડોને નવી કુપળો ફૂટે છે. લોકો ગરમ કપડાં બાજુઓ મૂકે છે. હલકાં જીણાં કપડાંની ફેશન શરૂ થાય છે. વસંતના આગમનની વાત મંદિરમાંથી એકાદને જેતાં વળી વધારે સ્પષ્ટ થાય છે. મંદિરમાં (તમે હિંદુ હો તો જ તેમાં પ્રવેશ કરી શકો) પેસતાંવેંત તમને ફૂલોની મીઠી સુગંધ વગર બીજી, કોઈ ગંધ આવતી નથી. ધાર્મિક વૃત્તિના લોકો મંદિરના ઓટલા પર બેસી ઠાકોરજીને

માટે માળા ગુંથે છે. કુદ્દોમાં તમને ગુલાબ, ચંપેલી, મોગરો વગેરે જોવાનાં મળે છે. દર્શનને માટે બારસુાં ખોલી નાખવામાં આવે છે ત્યારે પુરબહારમાં ઊડતા પાણીના હુંવારા તમારી નજરે પડે છે. તમને મંદ સુગંધી વાયુની મોજ પણ ભોગવવાની મળે છે. ઠાકેરજીએ જીણા કાપડનાં ખુલ્લા રંગનાં વખો સંજયાં છે. તેમની આગળ ઢગલાબંધ ફૂલો છે અને તેમના ગળામાંના હારની વચ્ચમાંથી તેમનું દર્શન માંડ થઈ થકે છે. તેમને હિડેળ જુલાવવામાં આવે છે અને હિડેળાને પણ લીલાં પાનથી શાણગારી તેના પર સુગંધી જળનો છંટકાવ કરવામાં આવેલો છે.

માંદિરની બહારનું દૃષ્ટિ નીતિપોષક નથી. હોળીની આગળના એક પખવાડિયા દરમિયાન અહીં અશ્વલીલ ભાષા સિવાય બીજું કંઈ તમારે કાને પડ્યે નહીં. નાનાં ગામોમાં લીઓને ધરબહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે અને નીકળે છે તો કાદવથી છંટાયા વગર રહેતી નથી. વળી, તેમને ઉદ્દેશીને અશ્વલીલ સંબોધનો પણ થાય છે. પુરુષો તરફ પણ કોઈ પ્રકારનો લેદ કર્યા વગર એવી જ જતનું વર્તન રાખવામાં આવે છે. લોકો નાની નાની ટોળીઓ બાંધે છે. પછી એક ટોળી બીજાની સાથે અશ્વલીલ ગાળો બોલવાની અને તેવાં જ અશ્વલીલ ગીતો ગાવાની હરીફાઈએ ચેડે છે. લીઓને સિવાય બધાં જ, પુરુષો અને બાળકો સુધ્ધાં આ ધૃણાજનક ચડસાચડસીમાં ભાગ લે છે.

અરે, આ મોસમમાં અશ્વલીલ શબ્દો વાપરવામાં સુરુચિનો ભંગ થયેલો પણ ગણ્ણાતો નથી! જે સ્થળોમાં લોકો અજાનમાં ડૂબેલા હોય છે ત્યાં તેઓ એકબીજા પર કાદવ વગેરેની ફૈકફૈક પણ કરે છે. તમારાં કપડાં પર તેઓ અશ્વલીલ શબ્દો ચીતરી વળે છે અને સફેદ કપડામાં બહાર નીકળો તો પાછા ઘેર આવતાં કાદવથી સારી પેઠે ખરડાયા વગર રહો જ નહીં. આ બધાની હોળીને દિવસે હદ થઈ જાય છે. તે દિવસે ધરમાં હો કે બહાર, અશ્વલીલ બોલો તમારા કાન પર અથડાયા જ કરે છે. મિત્રને મળવા ગયા હો તો જેવું સ્થળ હોય તે પ્રમાણે કાં તો મેલા પાણીથી અથવા સુગંધી જળથી ખાસા તરબોળ થયા વગર રહેવાના નહીં.

સંધ્યાકાળે લાકડાંનો અથવા છાણાંનો મોટો ઢગ રચી તેને સળગાવવામાં આવે છે. આ ઢગ ધણી વાર વીસ ફૂટ કે તેથીએ વધારે ઊંચો હોય છે અને લાકડાંના ટોલા એવા જાડા હોય છે કે સાત આઠ દિવસ સુધી ઓલવાતા નથી. બીજે દિવસે હોળીના દેવતા પર લોકો પાણી ગરમ કરી તેનાથી નહાય છે.

અત્યાર સુધી હોળીના તહેવારનો કેવો દુરુપ્યોગ થાય છે તેની વાતો મે કરી. એટલું જણાવતાં રાહતનો અનુભવ થાય છે કે કેળેવણી તેમ જ સારા સંસ્કારની પ્રગતિની સાથે આવાં દૃષ્ટ્યો ધીમે ધીમે પણ ચોક્કસ નાખૂંદ થતાં જાય છે. પણ તલંગર અને સુધરેલા લોકો આ તહેવારોનો બહુ શિષ્ટ ઉપ્યોગ કરે છે. કાદવને બદલે તે લોકો રંગીન અને સુગંધી જળ વાપરે છે. બાલદીઓ ભરીને કોઈના પર પાણી ઢોળવાને બદલે અહીં માત્ર નામનો છંટકાવ કરી સંતોષ માનવામાં આવે છે. આ દિવસોમાં ધાઢુંખરું કેસરિયા રંગનું પાણી વપરાય છે. કેસુડાનાં સૂકાં ફૂલ, જે કેસરિયા રંગનાં હોય છે તેમને પાણીમાં ઉકળવામાં આવે છે. જ્યાં લોકોને પરવડે ત્યાં તેઓ ગુલાબજળા પણ વાપરે છે. મિત્રો ને સગાંવહાલાં એકઠાં મળી એકબીજાને જમાડે છે અને એ રીતે વસંતનો આનંદ માણે છે. દિવાળીના તહેવારોની ધણે મોટે ભાગે અપવિત્ર હોળીના તહેવારો સાથે સરખામણી કરતાં ધણી બાબતોમાં મળનો વિરોધ જોવાનો મળે છે. દિવાળીના તહેવારો ચોમાસાની મોસમ પૂરી થતાં તરત જ આવે છે. અને ચોમાસું

ઉપવાસની ઋતુ છે તેથી દિવાળીના ઉત્સવ દરમિયાન થતી જફ્નો વિશેષ આનંદ અપાવનારી બને છે. એથી ઊલટું હોળી હરેક પ્રકારના સંગીન આહારને લાયકની શિયાળાની ઋતુ પછી તરત જ આવે છે તેથી એવો આહાર હોળીના તહેવારોમાં રાખવામાં આવતો નથી. હોળીમાં વપરાતી અશ્વલીલ ભાપા દિવાળીનાં અન્તંત પવિત્ર ગીતો પછી આવે છે. વળી, દિવાળીમાં લોકો શિયાળાને લાયકનાં ગરમ કપડાં પહેરવાં થરુ કરે છે, જ્યારે હોળીમાં તેને છોડી દેવામાં આવે છે. ખુદ દિવાળીનો દિવસ આસો માસના અંધારિયાનો છેલ્લો પંદરમો આમાસનો દિવસ હોય છે અને તેથી ખૂબ રોશની કરવામાં આવે છે; એથી ઊલટું હોળી પૂનમને દિવસે આવતી હોવાથી તે દિવસે રોશની કરવાનો કશો આર્થ રહેતો નથી.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૨૫-૪-૧૯૮૧

## ૬. હિંદના ખોરાક

[લંડનના ઘિ વેજિટેરિયનના ૧૯૮૧ની સાલના મે માસની દ્વિતી તારીખના અંકમાં નીચે મુજબનો ઉતારો છે: “શનિવાર, મે ૨૪, બ્લૂમબર્ગ હોલ, હાર્ટ સ્ટ્રીટ, બ્લૂમબર્ગ . . . મિસિસ હેરિસન પછી મિ. એમ. કે. ગાંધી (મુંબઈ ઈલાકામાંથી આવેલા એક બ્રાહ્મણ)નો વારો હતો. પોતાની આગળ બોલી યથેલા વક્તાને અભિનંદન આપી પોતાના નિબંધની બાબતમાં ક્ષમા માગી લીધા બાદ તેમણે તે વાંચવોનું થરુ કર્યું. તેમના નિબંધનો વિષય ‘હિંદના ખોરાક’ હતો. થરુઆતમાં તેમને થોડો સલભાસ્કોભ થયેલો લાગતો હતો.” અહીં લેવામાં આવેલો નિબંધનો પાઠ પોર્ટસમથમાં થયેલો વેજિટેરિયન સોસાયટીની સભામાં ફરી વાર વાંચાયેલો અને ૧૯૮૧ની સાલના જૂન માસની ૧લી તારીખના ઘિ વેજિટેરિયન મેસેન્જરના અંકમાં પ્રસિદ્ધ થયેલો તે છે.]

મારા ભાષણના વિષય ઉપર આવું તે પહેલાં આ કામ માથે બેવાની મારી લાયકાત કેટલી છે તે જાણાવું. પોતે હિંદ કદી ગયો ન હતો અને હિંદની ભાષાઓનું પોતાને જ્ઞાન નહોતું છતાં હિસ્ટરી ઓફ ઇન્ડિયા (હિંદનો ઇતિહાસ) નામનું પુસ્તક લખવાની પોતાની લાયકાત શી હતી તે મિલે તે પુસ્તકની ઘણી રસિક પ્રસ્તાવનામાં દર્શાવ્યું છે. તેથી મને લાગે છે કે તેનો દાખલો લઈને ચાલવામાં મારે જે કરવા યોગ્ય છે તે જ હું કરું છું. અલબટા, કોઈક વક્તા કું લેખક કોઈક કામને માટેની પોતાની પાત્રતાનો ઉલ્લેખ કરે તેમાં તેની કોઈક પ્રકારની આપાત્રતાની વાત આવી જાય છે અને હું કબૂલ કરું છું કે ‘હિંદના ખોરાક’ વિષ બોલવાને લાયક અસલ વક્તા હું નથી. આ વિષય પર બોલવાને મારી પૂરેપૂરી લાયકાત તેમ જ આવડત છે, તે કારણથી હું આ ભાષણ આપવા તૈયાર થયો નથી પણ એ ભાષણથી હું જે કાર્ય તમારા અને મારા બંનેના દિવિમાં વસેલું છે તેને ઉપયોગી થઈશ એમ મને લાગ્યું તેથી તૈયાર થયો છું. મારું નિવેદન મેં મોટે ભાગે મારા મુંબઈ ઈલાકાનાં અનુભવ પરથી કર્યું છે. હવે તમે સૌ જાણો છો કે લિન્દુસ્તાન સારી અણાવીસ ક્રોડ માણસોની વસ્તીવાળો વિશાળ ટ્રીપકદ્ય છે. યુરોપમાંથી રથિયાનો મુલક બાદ કરો તેટલો મોટો તેનો વિસ્તાર છે. આવા વિશાળ દેશમાં જુદા જુદા ભાગમાં અવશ્ય જુદા જુદા રીતરિવાજે હોવાના એટલે હું જે કહું તેનાથી

કંઈ જુદું તમારા સાંભળવામાં આવે તો ઉપર કહેલી હકીકત ધ્યાનમાં રાખવા મારી તમને સૌને વિનંતી છે. સામાન્યપણે મારું નિવેદન આખાયે હિંદુસ્તાનને લાગુ પડે છે.

મારા વિષયને હું ત્રણ ભાગમાં વહેંચી નાખીશ. પહેલું, આ ખોરાક પર રહેનારા લોકો વિષે કંઈક પ્રાસ્તાવિક મારે કહેવાનું થશે; બીજું, હું તે ખોરાકનું વર્ણન કરીશ; અને ત્રીજું, તેમના ઉપયોગ વર્ગેની વાત કરીશ.

સામાન્યપણે મનાય છે કે હિંદુસ્તાનના બધા રહેવાસીઓ શાકાહારી હોય છે, પણ એ વાત બરાબર નથી; અને આમ તો બધા હિંદુઓ પણ શાકાહારી હોય છે એવાં નથી. પણ હિંદુસ્તાનના મોટા ભાગના વતનીઓ શાકાહાર કરે છે એ વાત તદ્દન સાચી છે. તેમાંના કેટલાક ધર્મને કારણે, માંસાહાર કરતા નથી અને બીજાને માંસ ખરીદવાનું પોસાનું નથી તેથી ફરજિયાત નિરામિય આહાર પર ગુજરો કરવો પડે છે. હું તમને જણાનું કે હિંદમાં કરોડો માણસોને રોજના એક પૈસા મૂર એટલે કે એક પેનીના ત્રીજા ભાગ પર ગુજરો કરવો પડે છે તો એ બીજા સ્પષ્ટ સમજશે કેમ કે હિંદ જેવા ગરીબ મુલકમાં પણ એટલી નજીવી રકમમાં ખાવા લાયક માંસ તેમને મળી શકતું નથી. આ ગરીબ લોકોને દિવસમાં એક જ ટંક ખાવાનું મળે છે. અને તેમાં વાસી રોટલા ને મીઠું એટલું જ હોય છે, અને એ મીઠા પર પણ ભારે વેરો લેવાય છે. પણ હિંદી શાકાહારીઓ તેમ જ હિંદી માંસાહારીઓ અંગ્રેજ શાકાહારીઓ અને અંગ્રેજ માંસાહારીઓ કરતાં તદ્દન જુદા હોય છે. અંગ્રેજ માંસાહારીઓ માને છે કે પોતે માંસ વગર મરી જાય તેવું હિંદી માંસાહારીઓ નથી માનતા. મારી ખબર પ્રમાણે તે લોકો (હિંદી માંસાહારીઓ) માંસને જીવનની એક જરૂરિયાતની નહીં પણ કેવળ થોખની ચીજ ગણે છે. તેમને રોટલો મળી જાય તો તેમને માંસની ખોટ લાગતી નથી. પણ એહી આપણા અંગ્રેજ માંસાહારીને જુદો; મારે મારું માંસ જોઈએ જ જોઈએ એવું તે માને છે. રોટી તો માત્ર તેને માંસ ખાવાને કામમાં આવે છે જ્યારે હિંદી માંસાહારીને લાગે છે, કે માંસ મને મારી રોટી ખાવામાં કામ લાગશે.

આહારની નીતિ વિષે પેલે દિવસે મારે એક અંગ્રેજ બાનું સાથે વાત ચાલતી હતી તેમાં હું તેને તે પોતે પણ કેવી સહેલાઈથી શાકાહારી થઈ શકે તે સમજાવતો હતો તે સાંભળીને તે પોકારી ઊઠી, “તમારે જે કહેવું હોય તે કહો. મારે તો મારું માંસ જોઈએ જ જોઈએ. આહા! તે મને કેટલું બધું ભાવે છે! અને મને ચોક્કસ લાગે છે કે મારાથી તે વગર જિવાય જ નહીં.” મેં કશ્યું, “પણ બ્રાનું, ધારો કે તમને કેવળ શાકાહાર પર રહેવાની ફરજ પાડવામાં આવે તો તમે કેવી રીતે ચલાવો?” તેણે જવાબ આપ્યો, “ઓહ! એની વાત ન કરશો. હું જાણ્યું છું કે મને એવી ફરજ પડે જ નહીં એને ધારો કે ફરજ પડે તો મને ધણી જોયેની લાગે.” અલબત્તા, આવું કહેવાને સારુ એ બાનુનો વાંક કાઢવા જેવું નથી. સમાજની સ્થિતિ અત્યારે એવી છે કે કોઈ પણ માંસાહારી ભારે અગવડ વેઠયા વગર માંસનો આહાર છોડી નહીં શકે.

એવી જ રીતે હિંદી શાકાહારી પણ અંગ્રેજ શાકાહારીના કરતાં તદ્દન જુદી જતનો છે. હિંદી શાકાહારી જેમાં જીવની અધ્યાત્મા, જીવ બને તેવી વસ્તુની હિંસા સમાયેલી હોય તેવી બધી વાતોથી આધો રહે છે અને ત્યાંથી આગળ વધતો નથી. તેથી તે ઈંડાં નહીં ખાય કારણું કે તે માને છે કે ઈંડું ખાવામાં જેમાંથી જીવ બની શકે એવી વસ્તુની હિંસા થાય છે. (મને જણાવતાં દિલગીરી થાય છે કે દોઢેક માસથી હું ઈંડાં ખાઉં છું) પણ દૂધ તેમ જ માખણું લેવામાં તેને જરાયે આંચકો આવતો નથી. એહી જેને પ્રાણિજ પદાર્થો કહીને ઓળખાવવામાં આવે છે તેવી આવી બધી ચીજે દર પખુંવાડિયે આવતા ફળાહારના દિવસોએ સુધ્યાં તે વાપરે છે. એ દિવસે ધરુ,

ચોખા વગેરે ધાન્યની તેને મનાઈ છે પણ દૂધ ને માખણ તે ફાવે તેટલાં ઉપયોગમાં લઈ શકે છે; ઊલટું, અહીં શાકાહારીઓમાંના કેટલાક દૂધ અને માખણનો ત્યાગ કરે છે, કેટલાક રાંધવાનું માંડી વાળે છે તો બીજા કેટલાક ફળ અને મગફળી ને બદામ વગેરે જેવા કાણલિયાળા મેવા પર ગુજરો કરવાની કોણિશ કરે છે.

હવે હું અમારા જુદા જુદા ખોરાકના વર્ણન પર આવું. મારે કહી દેવું જોઈએ કે માંસના બનેલા ખોરાકની વાત હું બિલકુલ છેડવાનો નથી કેમ કે એ બધી વાનીઓ વપરાય છે ત્યારેયે આહારની મુખ્ય વસ્તુ હોતી નથી. હિદુસ્તાન મુખ્યન્યે જેતીવાડીનો મુલક છે અને ઘણો વિશાળ મુલક છે. તેથી તેની પેદાશની ચીજે અનેક અને ભાતભાતની છે. હિદુસ્તાનમાં બ્રિટિશ અમલનો પાયો છેક ઈસ્વી સન ૧૭૪૬ની સાલમાં નંખાયો અને અંગ્રેજ લોકોને તેનો પરિચય ૧૭૪૬ની સાલથી કેટલાયે વખત આગળનો છે છતાં ઈંગલાંડમાં હિદુસ્તાનના ખોરાક વિષે નહીં જેવી જ માહિતી છે એ બીજા દિલગીર થવા જેવી છે. આનું કારણ સમજવામાં બહુ ઊંડા ઊતરવું પડે એવું નથી. હિદમાં જનારા લગભગ બધા અંગ્રેજો પોતાની અસલ રહેણીકરણીને ચુસ્તપણે વળગી રહે છે. ઈંગલાંડમાં પોતાને જે ચીજે મળતી હતી તે બધી હિદમાં મેળવી વાપરવાનો એટલું જ નહીં, તેમને પોતાની અસલ પદ્ધતિથી રંધાવવાનો પણ તેમનો આગ્રહ હોય છે. આ બધું કેમ અને શાથી બને છે તેની ચર્ચા કરવાનું અત્યારે મારં કામ નથી. કંઈ નહીં તો કુતૂહલના માર્યા પણ તેઓ લોકોની રહેણીકરણીની ટેવો જાણવાનેવાનો પ્રયાસ કર્યા વગર ન રહે એવું સહેલે લાગે, પણ તેમણે એવો કશો જ પ્રયાસ કર્યો નથી અને તેમની જક્કી ઉપેક્ષાને પરિણામે ખોરાકના સવાલનો અભ્યાસ કરવાની સારામાં સારી કેટલીયે તક ધણાખરા એંગલોઇઝિયનો એટલે કે હિદમાં વસતા અંગ્રેજોને જતી કરતા આપણે જોઈએ છીએ. પણ ખોરાકની મૂળ વાત પર પાછા વળીએ; હિદમાં એવાં ધળાં ધાન્ય પેદા થાય છે જેને વિષે અહીં બિલકુલ કશી જાણું નથી.

ધઉં જોકે અલબત્તા અહીંની માફક ત્યાં પણ સૌથી મહત્વનું અનાજ છે. પણી બાજરી છે (જેને એંગલોઇઝિયનો મિલેટ કહીને ઓળખાવે છે), જુવાર છે, ડાંગર છે અને બીજાં છે. આ બધાને હું રોટીધાન્ય કહું કેમ કે તેમનો મુખ્ય ઉપયોગ રોટી ને રોટલા બનાવવામાં થાય છે. ધઉનો વપરાશ અલબત્તા ધળો છે પણ તે પ્રમાણમાં મોંધા હોવાથી ગરીબ વર્ગોમાં તેને બદલે બાજરી અને જુવાર વપરાય છે. આ સ્થિતિ દક્ષિણાના અને ઊત્તરના પ્રાંતોમાં ધણે મોટે ભાગે છે. દક્ષિણાના પ્રાંતોની વાત કરતાં સર ઊભયુ. ઊભયુ. હંટર પોતાના હિદના ઈતિહાસમાં કહે છે, “સામાન્ય લોકોના ખોરાકમાં મોટે ભાગે જુવાર, બાજરી અને રાગી જેવાં હલકાં અનાજ આવે છે.” ઊત્તરને વિષે તે કહે છે, “છેલ્લાં બે (એટલે કે જુવાર અને બાજરી) આમજનતાનો ખોરાક છે કેમ કે ડાંગર પીતની જમીનમાં થતી હોઈ તવંગર લોકોમાં વપરાય છે.” જુવાર જેમણે ચાખી ન હોય એવાં માણસોઃ ધળાં જેવાનાં મળે છે. જુવાર ગરીબ લોકોનો ખોરાક હોવાથી કેમ જાણે ન હોય પણ તેને માટે પૂજયભાવ રાખવામાં આવે છે. વિદાય વખતે છૂટા પડવાના નમસ્કારમાં હિદમાં ગરીબ લોકો એકબીજાને ‘જુવાર’ કહે છે જેનો વિસ્તાર કરી તરજુમો કરીએ તો મારી સમજ મુજબ “તમને કદી જુવારની ખોટ ન પડજો,”<sup>9</sup> એવો અર્થ

૧. અહીં ગાંધીજીએ એક અનાજને માટે વપરાતો શાખ ‘જુવાર’ અને હિદની ભાષાઓમાં નમસ્કારને માટે વપરાતો શાખ ‘જુહાર’ એ બનેનો ગોટાળો કર્યો લાગે છે.

થાય. ડાંગર એટલે કે ચોખાનો પણ ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં ઉપયોગ થાય છે. બંગાળીઓ ઘઉંના કરતાં ચોખા વધારે વાપરે છે. બીજા ભાગોમાં રોટલારોટલી બનાવવામાં ચોખા વપરાતા હું તોથે જવલ્લે જ વપરાય છે. ઓંગલોઈડિયનો જેને ગ્રામ કહીને ઓળખાવે છે તે ચણાનો પણ એવો જ ઉપયોગ કાં તો ઘઉંના લોટ સાથે બેળવીને અગર તે વગર થાય છે. ચણા સ્વાદમાં તેમ જ દેખાવમાં પીજ એટલે કે વટાણાને ઘણા મળતા આવે છે. આ પરથી મારે જુદી જુદી જતનાં કઠોળ જે દાળ બનાવવામાં વપરાય છે તેની વાત પર આવવાનું થાય છે. દાળ બનાવવાને કામમાં આવતાં મુખ્ય કઠોળ ચણા, વટાણા, લાંગ, મસૂર, વાલ, તુવર, મગ, મઠ ને અડદ છે. એ બધાંમાંથી હું માનું છું કે તુવર દાળ માટેના વપરાશમાં અને લોકપ્રિયતામાં પહેલે નંબરે છે. આ બંને પ્રકારના ખોરાક સૂક્ષ્મા પછી ઉપયોગમાં લેવાય છે. હવે હું લીલાં શાકભાજની વાત પર આવું. બધાં લીલાં શાકનાં નામ તમારી આગળ ગણાવી જવાનો અર્થ નથી. તે એટલાં બધાં છે કે તેમાંના ઘણાં હું પણ જાણતો નથી. હિંદુસ્તાનની જમીન એવી સમૃદ્ધ છે કે તમને ફાંચે તે લીલાં શાક તમે તેમાં ઉગાડી શકો. તેથી આપણે ખુશીથી કહી શકીએ કે જેતીનું બરાબર જ્ઞાન થાય તો હિંદની જમીનમાંથી પૃથ્વી પર થતું કોઈ પણ શાક પેદા કરી શકાય.

હવે રહી ફળો અને કાછલિયાળાં ફળોની વાત. મને જણાવતું દિલગીરી થાય છે કે ફળોની ખૂબી અથવા કિમત હિંદુસ્તાનમાં હજુ સમજઈ નથી. ફળનો ઉપયોગ હિંદમાં ખૂબ થાય છે એ સાચું પણ બીજાં કોઈ કારણસર નહીં, શોખને ખાતર થાય છે. ફળો તંદુરસ્તીની દૃષ્ટિથી વપરાય છે, તેના કરતાં તેમના રુચિકર સ્વાદને ખાતર વધારે વપરાય છે. તેથી આપણું હિંદમાં આરોગ્યની દૃષ્ટિ કીમતી ગણાય એવાં નારંગી, મોસંબી, સફ્રજન વગેરે ફળો ભરપણે મળતાં નથી; અને તેથી તે બધાં માત્ર તવંગર લોકોને મળી શકે છે. પણ ત્યાં મોસમી ફળો અને સૂકાં ફળ જોઈએ તેટલાં મળે છે. બીજાં બધાં સ્થળોની માફક હિંદમાં ઉનાઓ મોસમી ફળોને માટે સારામાં સારી જગતું છે. એમાં કેરી સૌથી મહત્વનું ફળ છે. મારા ખાવામાં હજુ એથી વધારે સ્વાદિષ્ટ ફળ આવ્યું નથી. કેટલાક લોકો અનનસને પહેલો નંબર આપે છે; પણ કેરી જેણે ચાખી છે તેમાંના ઘણા મોટા ભાંગના લોકો તેને વધારે પસંદ કરે છે. તેની મોસમ ત્રણ મહિનાની હોય છે, તે દરમિયાન તે ઘણી સસ્તી મળે છે અને તેથી ગંરીબ ને તવંગર બન્ને તેની મજા લઈ શકે છે. બેશક, મોસમમાં મળતી હોય ત્યારે મેં એવું સાંભળ્યું છે કે કેટલાક લોકો તો એકલી કેરી પર ગુજરો કરે છે. પણ કમનસીબે કેરીનું ફળ લાંબો વખત સારી સિથિતિમાં ટકતું નથી, ઉત્તરી જાય છે. તે સ્વાદમાં પીચને મળતું આવે છે અને ગોટલાવાનું છે. ઘણી વાર કેરી નાના તરબૂચ અથવા નાની ટેટી જેટલી મોટી હોય છે. આહી આપણે તરબૂચ અને ખરબૂચની જતનાં ફળની વાત પર આવીએ. તે બધાં ઉનાળામાં પુષ્કળ પ્રમાણુમાં મળે છે. આહી મળે છે તેના કરતાં ત્યાં હિંદમાં ઘણાં વધારે સારાં મળે છે. હવે જેકે ફળોનાં વધારે નામો ગણાવી મારે તમને કંટાળો નથી આપવો; એટલું જણાવું તો બસ છે કે હિંદમાં ઘણી જતનાં મોસમી ફળો થાય છે પણ તે લાંબો વખત ટકતાં નથી અને અમુક મુદ્દતમાં ઉત્તરી જાય છે. એ બધાં ફળ ગરીબ લોકોને પણ મળી શકે છે; દિલગીરીની વાત એટલી જ છે કે તે લોકો કદી તેમનું એકલાનું આખું ભોજન બનાવતા નથી. સામાન્યપણે અમારે ત્યાં એવું મનાય છે કે ફળના આહારથી તાવ આવે છે અને મરડો વગેરે થાય છે. ઉનાળામાં અમારે ત્યાં હમેશા કોલેરા ફાટી નીકળવાનો ઊર રહે છે ત્યારે ઘણા દાખલાઓમાં

યોગ્ય રીતે તરબૂચ અને એવાં જ બીજાં ફળોના વેચાણની આમલદારો મનાઈ કરે છે. તરેહ-તરેહનાં સૂકાં ફળ અથવા સૂકા મેવાની જતો અહીં કેટલી મળે છે તેટલી લગભગ બધી ત્યાં પણ મળે છે. હવે કઠળ કાચલાંવાળાં ફોડીને અંદરથી જેનો ગર કાઢીને ખાવામાં આવે છે તેવાં નટ કહેવાતાં કાછલિયાળાં ફળોની વાત રહી. તેમાંની કેટલીક જતો જે અમને હિદમાં મળે છે તે અહીં મળતી નથી અને બીજી બાજુથી અહીં જે કેટલીક જતો મળે છે તે ત્યાં જોવાની મળતી નથી. આ જતનાં ફળ હિદમાં ખોરાક તરીકે કદી વપરાતાં નથી અને તેથી ખરું જોતાં તેમને 'હિદના ખોરાક'માં સમાવવાં ન જોઈએ. હવે મારા વિષયના છેવટના ભાગની વાત પર આવું તે પહેલાં ખોરાકની બાબતમાં મેં જે નીચે મુજબના ભાગ પાડ્યા છે તેમનો જ્યાલ રાખવાની તમને સૌને વિનંતી કરું છું: પહેલાં અનાજ, જે રોટલીરોટલા બનાવવાના કામમાં આવે છે તે જેવાં કે ઘઉં, બાજરી વગેરે; બીજાં કઠોળ, જે દાળ બનાવવાને વપરાય છે; ત્રીજાં લીલાં શાકભાજુ; ચોથાં ફળ; અને છેલ્લાં ને પાંચમાં, કાછલિયાળાં ફળ.

અલબજા, ખોરાકની જુદી જુદી વાનીઓ બનાવવાને માટેની સૂચનાઓ હું અહીં આપવા માગતો નથી. એ મારા ગજ બહારનું કામ થાય. એ વાનગીઓ કેમ રંધાય છે અને તેમનો બરાબર ઉપયોગ કેમ કરવો તેની વાત હું સામાન્ય ધોરણે કરીશ. આહારચિકિત્સા અથવા આરોગ્ય-શાખની શોધ ઈંગ્લાંડમાં પ્રમાણે નવી છે. હિદમાં અમે તેનો અમલ જેની સ્મૃતિ પણ નથી એટલા સમયથી કરતા આવ્યા છીએ. દેશી વૈદો બેશક ઔષધોનો ઉપયોગ કરે છે પણ પોતે જે ઔષધો આપે છે તેમની રોગ દૂર કરવાની શક્તિ પર રાખે છે તેના કરતાં ખોરાકના ફેરફાર પર વધારે આધાર રાખે છે. કેટલાક દાખલાઓમાં તેઓ, તમને કહેશે કે મીઠ ન ખાશો; બીજા ઘણામાં કહેશે કે ખાયશવાળા ખોરાક ફોડી દેજે વગેરે. દરેક ખોરાકનો કંઈક ને કંઈક ઔષધ જેવો ગુણ હોય છે. રોટલીરોટલા બનાવવાને કામમાં આવતું અનાજ ખોરાકનો મુખ્ય પદાર્થ છે. સગવડને ખાતર લોટની બનાવટને મેં રોટી અથવા રોટલા કદ્યા છે પણ રોટલી તેને ઓળખાવવાને માટે વધારે સારું નામ છે. તેની બનાવટની આખી કિયા હું અહીં વર્ણવવા બેસતો નથી પણ એટલું કહું કે થૂલું અમે નાખી. દેતા નથી. આ રોટલી હમેશા તાજી બનાવવામાં આવે છે અને ધીની સંથે ગરમ ગરમ ખવાય છે. અંગેજને જેનું માંસ તેવી હિદીને માટે આ રોટલી છે. માણસ કેટલું ખાય છે તેનું માપ તે કેટલી રોટલી ખાય છે તે પરથી કાઢવામાં આવે છે. કઠોળ કે શાકને ગણુતરીમાં વેવામાં આવતાં નથી. તમે દાળ વગર જમી શકો, શાક વગર જમી શકો પણ રોટલી વગર કદી જમ્યા ન ગણ્યાઓ. અનાજમાંથી બીજી તરેહતરેહની વાનીઓ તૈયાર થાય છે પણ તે બધી એક યા બીજે રૂપે રોટલી જ હોય છે.

દાળ બનાવવામાં વપરાતાં વટાણા, મસૂર વગેરે જેવાં કઠોળની વાત લઈએ. તેમને કેવળ પાણીમાં ઉકળવામાં આવે છે. પણ તેમાં અનેક મસાલા ઉમેરવાથી તે આહારની બહ સ્વાદિષ્ટ વાની બને છે. આ ખોરાકોમાં રસોઈની કળા સોણે કળાએ ખીલે છે. વટાણામાં મીઠું, મરી, તજ, લવિંગ, એલચી અને એવા મસાલા નાંખાયેલા મેં જેયા છે. દાળનો ખરો ઉપયોગ તે રોટલીની સાથે ખાવાનો છે. તબિયતની દૂષિષ્ઠી વધારે પડતું કઠોળ ખાવું સારું ગણ્યાતું નથી. ચોખા વિષે અહીં જ કંઈક કહી લેવું સારું. પહેલાં હું કહી ગયો તેમ ચોખા ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં વપરાય છે. કેટલાક દાક્તરો બંગાળીઓને ઘણી વાર મધુપ્રમેહ અથવા મીઠી પેશાબની બીમારી લાગુ પડે છે તેનું મૂળ તેમના ચોખાના આહારમાં જરૂર છે. ચોખાને હિદમાં કોઈ પૌષ્ટિક ખોરાક કહેતું નથી. તે તવંગર એટલે જે લોકો મજૂરી કરવા નથી માગતા

તેમનો ખોરાક છે. મજૂરી કરનારા લોકો ચોખા જવલે જ ખાય છે. તાવમાં પડેલા પોતાના દરદીને દાક્તરો ચોખાના આહાર પર રાખે છે. હું પણ તાવમાં સપડાયો છું (બેશક, ડૉ. એલિન્સન કહેશે તેમ આરોગ્યના નિયમોનો ભંગ કરવાથી) અને તે વખતે મને ભાત અને મગના પાણી પર રાખવામાં આવ્યો હતો. હું જરૂર સાજે થયેલો.

હવે લીલાં શાકભાજીની વાત લઈએ. કઠોળની વાનીઓ જે રીતે રંધાય છે તે જ રીતે શાક પણ રંધાય છે. શાક રંધવામાં તેલ અને ઘી ઘણાં કામમાં આવે છે. ઘણી વાર તેમાં ચણાનો લોટ નાખવામાં આવે છે. કેવળ ઉકળેલાં કે બાફેલાં શાક કદી ખવાતાં નથી. હિંદમાં બાફેલો બટાટો કદી મારા જેવામાં આવ્યો નહોતો. ઘણી વાર તે લોકો બે, ત્રણ કે તેથીયે વધારે શાક લેગાં કરીને શાકની વાની બનાવે છે. શાકની મજાની વાનીઓ તૈયાર કરવામાં હિંદ ફ્રાંસને કચ્ચાયે ટપી જાય છે એ જણાવવાની પણ જરૂર નથી. તેમનો ખરો ઉપયોગ દાળના જેવો જ છે. તેમનું મહત્ત્વ તેનાથી બીજે નંબરે છે. શાક ઘણુંખું શોખની ચીજે ગણ્ણાય છે અને તેને લીધે માંદા પડી જવાય છે એવું મનાય છે. ગરીબ લોકો અઠવાડિયે માંડ એક કે બે વાર શાક ખાતા હશે. તે લોકો રોટલી ને દાળ ખાય છે. કેટલાંક શાકભાજીમાં ઔષધ તરીકેનો ઘણો ગુણ હોય છે. ત્યાં તાંદળને નામની ભાજી થાય છે તેનો સ્વાદ પાલખની ભાજીને ઘણો મળતો આવે છે. વધારે પડતાં મરતાં ખાઈને આંખ બગાડનારા દરદીઓને વૈદી તાંદળની ભાજીનું સેવન કરવાનો ઈલાજ બતાવે છે.

હવે રહી ફળોની વાત. તેમનો ઉપયોગ મુખ્યત્વે ‘ફળાહારના દિવસો’એ થાય છે પણ સામાન્ય ભોજનને અંતે તે વપરાતાં હશે તોયે ભાગ્યે જ વપરાય છે. લોકો વચ્ચે વચ્ચે કોઈક વાર ખાય ખરો. કેરીની મોસમમાં કેરીનો રસ ઘણો વપરાય છે. તે રોટલી અગર ભાતની સાથે ખવાય છે. અમારે ત્યાં પાકાં ફળ કદી ઉકળવામાં કે બાફવામાં આવતાં નથી. અમે લોકો કાચાં ફળ ને તેમાંથે મોટે ભાગે કાચી કેરી ખાટી-હોય તે વખતે તેનાં મુરબ્બા કે અથાળાં બનાવીએ છીએ. આરોગ્યની હૃદિએ કાચાં ફળ સામાન્યપણે ખરાથવાળાં હોવાથી તાવ લાવે છે એવું મનાય છે. સૂકો મેવો ભાળકો ટીક. ટીક પ્રમાણમાં ખાય છે અને એમાં ખજૂર અને ખારેકની કંઈક વાત કરી લેવા જેવી ગણ્ણાય. તે શક્તિવર્ધક મનાય છે અને તેથી શિયાળામાં અમારે ત્યાં શક્તિવર્ધક વસાળાં લેવાનો રિવાજ છે ત્યારે તેમને દૂધ અને બીજી ચીજે સાથે તૈયાર કરી રોજ અધોળને હિસાબે લેવામાં આવે છે.

છેવટમાં, કાંછલિયાળાં ફળ અંગેજ મીઠાઈની વાનીઓની જરૂરાએ ખવાય છે. બાળકો ખાંડમાં આથેલાં એવાં ફળ ખૂબ ખાય છે. તેમનો ઉપયોગ ‘ફળાહારના દિવસો’એ ઘણો થાય છે. અમારે ત્યાં તેમને ઘીમાં તળવામાં આવે છે અને દૂધમાં ઉકળવામાં પણ આવે છે. બદામ મગજને માટે બહુ સારી ગણ્ણાય છે. નારિયેળનો અમે જે અનેક જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ તેમાંથી એકનો જ નિર્દેશ કરી લઉં. પહેલાં સૂકા કોપરાને છીણવામાં આવે છે. પછી તેને ઘી ને ખાંડમાં લેવાવામાં આવે છે. આ મીઠાઈનો સ્વાદ ઘણો મજાનો હોય છે: કોપરાપાકના લાડુને નામે ઓળખાતી આ વાનીનો અખતરો તમારામાંથી થોડા ઘર આગળ કરી જેશો એવી હું આશા રાખું છું. આ, બાનુઓ અને ગૃહસ્થો, હિંદના ખોરાકના વિષયની રૂપરેખા છે, ઘણી જ જાંખી, અધૂરી રૂપરેખા છે. હું આશા રાખું છું કે તેમને વિષે વધારે જાણવાનું તમને મન થશે અને મને ભાતરી છે કે તેથી તમને લાભ થશે. વળી, આ પૂરું કરતાં હું એવી પણ આશા રાખું છું કે માંસાહારી ઝંગલંડ અને ધાન્યાહારી હિંદુસ્તાન

વચ્ચેનો આહારની ટેવો અથવા તેને લગતી રૂઢિઓનો મોટો ફેર બિલકુલ દર થાય એવો વખત આવશે અને તેની સાથે બન્ને દેશો વચ્ચે ખરેખર હોવી જોઈએ તેવી એકતા અને સહાનુભૂતિના ભાવને બાધા કરનારા બીજા જે કેટલાક જેદ કેટલીક જગ્યાએ જેવાના મળે છે તે પણ ટળી જશે. ભવિષ્યમાં, મને આશા છે કે, રીતરિવાજોની અને ઉપરાંત હૃદયની એકતા તરફ આપણે વળીશું.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન મેસેન્જર, ૧-૬-૧૯૮૧

## ૧૦. લંડનની બેન્ડ એઝ્ મર્સી — જીવદ્યા મંડળીને આપેલું ભાષણ

અપર નોર્ખુડ આગળથી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે . . . બેન્ડ એઝ મર્સીની<sup>૧</sup> સભા આગળ મિસ 'સીકોમ્બના' સૌજન્યથી . . . મિસિસ મેક્કુઅલ ભાષણ કરનાર હતાં, પણ તે માંદાં હોવાથી મિ. ગાંધી (હિંદુથી આવેલા એક હિંદુ)ને વિનાંતી કરવામાં આવી અને તેમણે સભા આગળ 'ભાષણ આપવાનું કબૂલ કરવાની ફૂપા કરી. માનવકલ્યાણની દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંત વિષે તેઓ આશરે પાએક કલાક બોલ્યા. તેમાં તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે જીવદ્યા મંડળીના સભ્યો પોતાનું વર્તન તર્કશુદ્ધ રાખવા માગતા હોય તો તે સૌચે શાકાહારો થલું જોઈએ. શેક્સપિયરમાંથી એક ઉતારો, ટાંકી તેમણે પોતાનું ભાષણ પુરું કર્યું.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૬-૬-૧૯૮૧

## ૧૧. હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ

જૂન ૧૧, ૧૯૮૧

આ એક રીતે વિદાયનો ભોજન સમારંભ હોવા છતાં કયાંયે ગમળીનીની નિશાની સરંખી દેખાતી નહોતી કેમ કે સૌ કોઈને લાગતું હતું કે મિ. ગાંધી હિંદુસ્તાન પાછા ફરે છે ખરા પણ શાકાહારના સિદ્ધાંતને માટે વધારે વ્યાપક કાર્ય કરવાને જાય છે અને પોતાની કાયદાના અભ્યાસની કારકિર્દી પૂરી કરી સફળ થઈ વિદાય થતા હોવાથી તેમને ખુશીથી અભિનંદન આપવાં જોઈએ. . . .

સભારંભને અંતે ગાંધીએ કંઈક સભાકોલ અનુભવતા છતાં ઘણા આકર્ષક ભાષણમાં હાજર રહેલાં સૌને આવકાર આપ્યો, ઈંગ્લાંડમાં માંસાહાર છોડવાની ટેવ વધતી જાય છે તે જોઈને પોતાને થયેલા આનંદની વાત કરી, લંડનની 'વેજિટેરિયન સોસાયટી' [શાકાહારી મંડળી] સાથે પોતાને કેવી રીતે સંબંધ બંધાયો તેનું વર્ણન કર્યું, અને તેમાં પોતે ડૉ. ઓલદ્ફિલ્ડના કેટલા ન્યાણી છે તેની હૃદયને પિગળાવે તેવી ઢબે વાત કરવાની તક લીધી. . . .

૧. પ્રાણીઓ. પર ગુજરતી કૂરતાને અટકાવવાને કાર્ય કરતી જીવદ્યા મંડળી.

૨. ડૉ. નેશિયા એલડરીલ્ડ, ઘિ વેજિટેરિયનના તંત્રી.

શાકાહારી મંડળીઓના સમવાયી સંધનું અધિવેશન ભવિષ્યમાં હિદમાં ભરાય તો સારું એવી પોતાની આશાનો પણ તેમણે નિર્દેશ કર્યો.

[મૂળ અંગ્રેજી]

ચિ વેજિટેરિયન, ૧૩-૬-૧૮૮૧

## ૧૨. પોતે ઈંગ્લાંડ શા સારુ ગયા

[વિદ્યાભ્યાસને સારુ ઈંગ્લાંડ જવાનો ઈરાદો રાખનારા હિદુઓની સામે કેવી મુશ્કેલીઓ ખડી થાય છે તેનો અંગ્રેજોને ચોક્કસ ખ્યાલ મળે તે સારુ અને તે મુશ્કેલીઓ કેમ પાર કરી શકાય તે એવા હિદુઓને બતાવવાને સારુ ચિ વેજિટેરિયનના પ્રતિનિધિઓ ગાંધીજીને એ વિષયને લગતા થોડા સવાલ પૂછેલા અને તેમના વિસ્તારથી જવાબ આપવાને તેમને વિનંતી કરેલી. તે સવાલ ને તેમના જવાબ નીચે આપ્યા છે.]

### ૧

આહી ઈંગ્લાંડ આવી રહેવાનો વિચાર કરવાને અને વડીલાતનો ધંધો આખત્યાર કરવાને તમે પહેલવહેલા ક્યા કારણથી પ્રેરાયા એવો પહેલો સવાલ મિ. ગાંધીને પૂછવામાં આવ્યો.

એક શબ્દમાં, કહું તો મહત્વાકંક્ષા. ૧૮૮૭ની સાલમાં મેં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકનો પરીક્ષા પાસ કરી. બાદ હું ભાવનગર કોલેજમાં જોડાયો કેમ કે મુંબઈ યુનિવર્સિટીના તમે ગ્રેજ્યુએટ ન થાઓ ત્યાં સુધી સમાજમાં તમને કોઈ આબરૂદાર દરજાને મળે નહીં. એ પહેલાં તમે કોઈ નોકરી બેવા નીકળો તો તમારા ટેકામાં ઘણી સારી લાગવગ હોય તે સિવાય સારા પગારની મોભાવાળી જગ્યા તમને મળે નહીં: 'પણ મેં જ્યાં કે ગ્રેજ્યુએટ થતાં મારે કંઈ નહીં તો ઓછામાં ઓછાં ત્રણ વરસ કાઢવાં પડે. વળી, મને કાયમનો માથાનો દુખાવો રહેતો અને હમેશા નસકોરી ફૂટૂની. આનું કારણ ગરમ આબોહવા મનાતું. અને અલબજા, આખરે ગ્રેજ્યુએટ થયા બાદ સુધ્યાં મને ખાસ મોટી કમાણી થાય એવી આશા તો હતી જ નહીં. આ બંધી વાતો કાયમ મારા મનમાં ધોળાયા કરતી હતી તે દરમિયાન મારા પિતાના એક જૂના મિત્રને મારે મળવાનું થયું અને તેમણે મને વિલાયત જવાની અને બેરિસ્ટર થવાની સલાહ આપી; તેમણે જાણે કે મારી અંદર ધૂધવાઈ રહેલી આગનો ઝૂંક મારીને ભડકો કર્યો. મેં મનમાં વિચાર્યું, "હું ઈંગ્લાંડ" જાઉ તો બેરિસ્ટર થઈ થકું ઓટલું જ નહીં, કિલસૂઝો અને કવિઓની ભૂમિ અને સંસ્કૃતિનું ખુદ કેન્દ્ર એવું ઈંગ્લાંડ મને જોવાનું મળે." આ ગૃહસ્થની મારા વડીલો પર ઘણી સારી લાગવગ હતી અને તેથી મને વિલાયત મોકલવાનું તેમને સમજાવવામાં તે સફળ થયા.

ઇંગ્લાંડ આવવાનું મારે કેમ થયું તે બતાવનારાં કારણોનું મારું આ બહુ ટૂકમાં નિવેદન છે પણ તે કારણોમાં મારા આજનાં વિચારોનું પ્રતિબિબ પડે છે એવું જરાયે માનવાનું નથી.

બેશક, તમારું આવું મહત્વાકંક્ષી પ્રયોજન જાણીને તમારા બધા મિત્રો તો બહુ રાજી થયા હશે.

ના, બધા નહીં. મિત્રો મિત્રોમાંયે ફેર હોય કે નહીં? જે લગભગ મારી ઉમરના મારા સાચા મિત્રો હતા તે બધા મારા ઈંગ્લાંડ જવાની વાત સાંભળીને બહુ ખુશી થયા. બીજા

કેટલાક ઉમરમાં વૃદ્ધ મિત્રો અથવા કહો કે શુભેચ્છકો હતા. તે બધાયે ખરેખર માનતા હતા કે આ છોકરો પાયમાલ થવાનો છે અને ઈંગલંડ જઈ તે તેના કુટુંબનું નામ બોળવાનો છે. બીજા કેટલાકે જોકે કેવળ અદેખાઈના માર્યા મારી સામે વિરોધ ઊભો કર્યો. નવાઈ પમાડે એવી ભારે કમાણી કરનારા થોડા બેરિસ્ટરો તેમના જેવામાં આવેલા અને મારે પણ એવી જ કમાણી થવાની એવો તેમને ડર લાગતો હતો. બીજા વળી કેટલાક એવા હતા જેમને લાગતું કે મારી ઉમર બહુ નાની ગણ્યાય અથવા ઈંગલંડની ખૂબ ઠંડી આબોહવા મારાથી સહન નહીં થાય. ટૂકમાં અહીં આવવાની વાતમાં મને ટેકો આપનારા અથવા મારો વિરોધ કરનારામાંના કોઈ બેનાં કરાણો એક નહોતાં.

તમારો ઈરાદો પાર પાડવાને તમે શી પ્રવૃત્તિ કરી? તમને વાંધો. ન હોય તો તમને મુશ્કેલી શી પરી અને તેને તમે કેવી રીતે પહોંચી વળ્યા તે મને કહો.

મારી મુશ્કેલીઓની આખી વાતનો માત્ર પ્રયત્ન કરવા બેસું તો તમારા મૂલ્યવાન સામયિકનો આખો અંક ભરાઈ જાય. એ આખી દુઃખ ને શોકની કથની છે. એ મુશ્કેલીઓ રાવણનાં માથાં જેવી હતી. રાવણ તમે જાણો છો કે હિંદુઓના બીજા<sup>૧</sup> મહાકાવ્ય રામાયણનો રાક્ષસ છે. રામ તે મહાકાવ્યનો નાયક. રામે રાવણને લડીને આખરે માત કરેલો. એ રાવણનાં ઘણાં માથાં હતાં. કાપો કે પાછાં આવીને ગોઠવાઈ જાય! એ મુશ્કેલીઓને એકંદરે ચારે ભાગમાં વહેંચી શકાય: પેસાની, મારા વડીલોની મંજૂરી મેળવવાની, સગાંવહાલાંથી છૂટા પડવાની અને ન્યાતનાં બંધનોની.

પહેલી વાત પેસાની મુશ્કેલીની કરું. મારા પિતા એક કરેતાં વધારે દેશી રાજ્યમાં દીવાન હતા ખરા પણ તેમણે પેસો કદી સંઘર્યો નહોતો. જે કંઈ કમાયેલા તે બધું તેમણે દાનમાં અને પોતાનાં બાળકોના ભણતરમાં અને લગ્નોમાં ખરચ્યો.. નાખ્યું હતું. તેથી અમારી પાસે રોકડ નાણાં જાંસાં રહ્યાં નહોતાં. તેઓ થોડી મિલકત મૂકી ગયેલા. અમારી પાસે જે હતું તે એટલું જ. કોઈઓ તેમને પૂછેલું કે તમે છોકરાઓને સારુ પેસો બચાવી અલગ કેમ રાખ્યો નથી? તેમણે કહેલું કે મારાં બાળકો એ જ મારી સંપત્તિ છે અને હું જાઓ પેસો સંઘરીને મૂકી જાઉં તો તેમને બગાડું. એટલે, મારી સામે પેસાની મુશ્કેલી નાની નહોતી. રાજ પાસેથી સ્કોલરશિપ મેળવવાનો પ્રયાસ મેં કરી જોયો પણ તેમાં ફાયદો નહીં. એક જગ્યાએથી મને કહેવામાં આવેલું કે પહેલાં ગ્રેજ્યુએટ થઈ તમારી લાયકાત સાબિત કરી આપો ને પછી સ્કોલરશિપની આશા રાખો. અનુભવે હું જોઉં છું કે એ ગૃહસ્થનું કહેલું બરાબર હતું. આમ છતાં જરાયે હિમત હાર્યા વગર મારા મોટા ભાઈને મેં વિનંતી કરી કે આપણી પાસે જે નાખ્યું રહ્યું છે તે બધું મારા ઈંગલંડના ભણતરમાં વાપરો.

અહીં થોડું વિષયાન્તર કરીને હિંદુસ્તાનમાં ચાંલતી કુટુંબપદ્ધતિની સમજ આપ્યા વગર હું રહી શકતો નથી. અહીં ઈંગલંડમાં છે તેવું ત્યાં નથી; ત્યાં પુરુષ સંતતિ હમેશાં અને શી સંતતિ લગ્ન સુધી પોતાનાં માબાપ સુધી રહે છે. તે જે કંઈ કમાય તે બાપને મળે છે અને તેવી જ રીતે કંઈ ગુમાવે તેની ખોટ પણ બાપને જાય છે. અલબત્તા, પુરુષ સંતતિ પણ અસાધારણ સંજેગોમાં, જેવા કે મોટી તકરાર પડે તો, છૂટી થાય છે. પણ એ આપવાદ ગણ્યાય. મેઈને યોજેલી કાયદાની ભાષામાં “વ્યક્તિગત મિલકત એ પદ્ધિમનો સિદ્ધાંત છે. સહિયારી

૧. પહેલું મહાકાવ્ય મહાભારત છે.

મિલકત એ પૂર્વનો સિદ્ધાંત છે.” એટલે મારી પોતાની કંઈ મિલકત છે નહીં ને હતી નહીં. બધું મારા ભાઈના તાબામાં હતું અને અમે બધાં ભેગાં રહેતાં હતાં.

પૈસાની વાત પર પાછા વળીએ. મારા પિતા જે થોડી રકમ મારે માટે બચાવી મૂકી ગયા હતા તે મારા ભાઈના હાથમાં હતી. તેમની મંજૂરી મળે તો જ તે છૂટી થાય ને મને મળે. વળી, એટલી રકમ પૂરતી નહોતી તેથી મ દરખાસ્ત મૂકી કે આપણી જે મૂડી છે તે બધી મારા ભાણુતરને માટે વાપરીએ. હવે હું તમને પૂછું છું, અહીં કોઈ ભાઈ એવું કરે ખરો કે? હિદમાં પણ એવા ભાઈઓ ઘણા ઓછા છે. તેમને કહેવામાં આવેલું કે પશ્ચિમના ઝ્યાલો પચાવીને એ ભાઈ તરીકે નાલાયક બની જશે અને વિલાયતથી જીવતો હિદ પાછો આવશે તો જ તમારા પૈસા પાછા મળશે. અને એના પાછા આવવાનો ભરોસો શો? પણ મારા ભાઈએ ડહાપણભરેલી અને સદ્દબુદ્ધિથી આપવામાં આવેલી આ બધી ચેતવણી કાને ધરી નહીં. મારી દરખાસ્તને મંજૂરી આપવામાં તેમણે એક, માત્ર એક શરત મૂકી કે મારે મારી મા અને મારા કાકાની પરવાનગી મેળવવી. બીજા ઘણા લોકોને મારા ભાઈ જેવો ભાઈ મળો! પછી મને સાંપવામાં આવેલા પરવાનગી મેળવવાના કામમાં હું મંડયો અને તમને જણાવું કે કામ કઠણ, હુંગર ચડવા જેટલું કઠણ હતું. સારે નસીબે હું મારી માનો લાડકો દીકરો હતો. તેને મારા પર ઘણી શક્તા એટલે તેના મનમાં જે કંઈ વહેમ હતો તે મેં કાઢ્યો. પણ ત્રણ વરસ છૂટા પડવાની વાતમાં તેની પાસે મારે હા કેવી રીતે પડાવવી? ઇતાં ઈંગલિંડ જવાના ફાયદાની અતિશયોક્તિ કરી મારી વિનંતીની બાબતમાં કુમનની કેમ ન હોય પણ તેની મંજૂરી મેળવી. હવે રદ્દી કાકા. તે કાશી અને બીજાં પવિત્ર સ્થાનોની યાત્રાએ જવાને નીકળવાની તેથારીમાં હતા. ત્રણ દિવસની એકધારી સમજવથી અને તેટલો જ વખત તેમની સાથે દલીલો કરી કરીને મેં તેમની પાસેથી નીચે મુજબનો જવાબ કઢાવ્યો.

“હું તો આ જગ્ઞાએ ચાલ્યો. તું કહે છે તે વાત ખરી હશે પણ તારી અધમી દરખાસ્તની હું રાજ્યભૂષિથી કેવી રીતે હા પાડું? હું તો એટલું કહું કે તું જય તેમાં તારી માને વાંધો ન હોય તો મને તમારી વાતમાં માણું મારવાનો અધિકાર નથી.”

આનો અર્થ સહેલે ‘હા’ પાડી એવો કરવામાં આવ્યો. પણ મારે એટલાં જે જણુને થોડાં રાજ્ય રાખવાનાં હતાં? હિદુસ્તાનમાં ગમે તેટલું દૂરનું સગું હોય પણ તેને તમારા કામમાં માણું મારવાનો પોતાનો હક છે એવું લાગે છે. પણ આ બે જણુની પાસેથી મેં મંજૂરી કઢાવી (કેમ કે એમાં કઢાવવાપણું જ હતું, બીજું કશું નહોતું) એટલે પૈસાને અંગેની મુશ્કેલી લગભગ ટળી ગઈ.

બીજી બાબતને અંગેની મુશ્કેલીની થોડી વાત ઉપર આવી ગઈ છે. ત્રમને સાંભળીને કઢાય નવાઈ થશે કે હું પરણેલો છું (મારું લગ્ન મારી બાર વરસની ઉમરે થયેલું). એટલે મારી પણીનાં માબાપને, મારાં સાસુસસરાને લાગે કે કંઈ નહીં તો અમારી દીકરીને ખાતર આ વાતમાં માણું મારવાનો અંમારો. હક છે તો તેમાં તેમનો જાઓ વાંક કાઢી ન શકાય. તેની સંભાળ કોણું રાખશે? અલંકાર, તેની સંભાળ રાખવાનું કામ મારા ભાઈનું હતું. બિચારા ભાઈ! તે વખતના મારા ઝ્યાલો મુજબ તેમને લાગતા વાજબી ડરની વાત પર અને તેમની તેવી જ ફરિયાદોની વાત પર મેં જાંનું ધ્યાન આપ્યું ન હોત, પણ તે લોકોની ઈતરાજીનાં ફળ ભોગવવાનાં મારી માને અને ભાઈને આવત. રાત પછી રાત મારા સસરા પાસે બેસી તેમના વાંધાવચકા સાંભળી તે બધાનો તેમને સંતોષ થાય એવો જવાબ આપવાનું કામ સહેલું

નહોનું. હું પેલી જૂની કહેવત બરાબર શીખ્યો હતો કે “ધીરજ અને ચીવટથી માણસ દુંગરે પણ પાર કરી જય” એટલે હું કંઈ હારી ન જેઠો.

પેસા હાથમાં આવ્યા અને જરૂરી પરવાનગી મળી ગઈ એટલે મેં મનમાં ને મનમાં વિચાર્યું, “મને જે બધું વહાલું છે અને જે બધું આટલું મારી નજીક છે તેનો વિયોગ કેમ વેઠાશે?” હિંદમાં અમે લોકો એકબીજાથી છૂટા પડવાની વાતથી બહુ ભડકીએ છીએ. મારે થોડા દિવસને સારુ ઘરથી બહાર જવાનું થાય તોએ મારી મા રોવા બેસે. તો પછી આ વખતનું દિલ ચીરી નાખનારું દૃશ્ય જોઈ મારા મન પર થનારી અસરને હું કેવી રીતે રોકી શકીશ? મારા મનમાં ને મનમાં મ જે કષ્ટ વેઠયું તેનું વર્ણન કરવાનું મારાથી બને એવું નથી. વિદાય લેવાનો દિવસ નજીક આવ્યો એટલે હું લગભગ દુઃખનો માર્યો બેબાકળો થઈ ગયો. પરંતુ આ વાત મારા ઘાડામાં ઘાડા મિત્રને પણ ન કરવા જેટલું ડહાપણ મારામાં હતું. મારી તબિયત કથળતી જતી હતી તે હું જાણતો હતો. સૂતાં, જગતાં, ખાતાંપીતાં, ચાલતાં, દોડતાં ને વાંચતાં મને હંગલંડનાં અને વિદાયને અણીને દિવસે હું શું કરીશ તેનાં સ્વભાવાં આવતાં, વિચારો પણ તેના જ આવતા. આખરે તે દિવસ આવી પહોંચ્યો. એક બાજુ પર મારી મા પોતાની આંસુભરી આંખો આડા હાથ રાખી ઢાંકતી હતી પણ તેનાં દૂસરાં ચોખ્યાં સંભળાતાં હતાં. બીજી બાજુ હું પચાસેક મિત્રોના ફૂંડાળાની વચ્ચે ઘેરાયો હતો. મેં મારા મનમાં ને મનમાં કહું, “હું રીશ તો આ લોકો મને પોચો કહેશે; કદાચ તે બધા મને વિલાયત જતો રોકશે.” તેથી મારું દિલ તૂટીને કટક થઈ જતું હતું છતાં હું રોયો નહીં. મારી પત્નીની વિદાય લેવાનું છેલ્લું આવ્યું પણ છેલ્લું હતું તેથી તેનું મહાર ઓછું નહોનું. મિત્રોના દેખતાં તેમની હાજરીમાં હું તેને મળ્યું અગર તેની સાથે વાત કરું તો રિવાજનો ભંગ થાય. તેથી તેને મળવાને મારે અલાયદા ઓરડામાં જવું પડ્યું. તેણે તો બેશક ક્યારનાયે દૂસરાં લેવા માંડયાં હતાં. હું તેની પાસે પહોંચ્યો ને ક્ષણભર મૂગા પૂતળાની જેમ ઊભી. મેં તેને ચુંબન કર્યું ને તેણે કહું, “જશો નહીં.” પછી શું થયું તેનું વર્ણન કરવાની જરૂર નથી. આ પત્યું તેથી મારી ચિંતાનો ભાર ઘટયો નહોતો. આ તો માત્ર અંતની શરૂઆત હતી. વિદાય લેવાનું પણ અર્ધું જ પત્યું હતું કેમ કે મારી મા અને પત્નીથી હું રાન્ડકોટ કે જ્યાં હું ભણ્યો હતો ત્યાંથી છૂટો પડ્યો પણ મારા ભાઈ અને મિત્રો મને વિદાય આપવાને મુંબઈ સુધી આવ્યા. ત્યાં જે દૃશ્ય થયું તે કંઈ દિલ પર ઓછી અસર કરનારું નહોનું.

મુંબઈમાં મારા ન્યાતીલાઓ સાથે જે અથડામણો થઈ તેનું વર્ણન થઈ શકે એવું નથી કેમ કે મુંબઈમાં તે લોકો મોટે ભાગે રહે છે. રાન્ડકોટમાં મારી સામે વિરોધ ગણી શકાય તેવું કર્શું બન્યું નહોનું. તે લોકોની વસ્તી જ્યાં વધારેમાં વધારે છે તેવા મુંબઈની વચ્ચ્યોવચ્ચ આવેલા લતામાં કમનસીબે મારે રહેવાનું થયું. હતું અને તેથી હું ચારે કોરથી ઘેરાઈ ગયો હતો. હું બહાર નીકળ્યું કે કોઈ ને કોઈ મારી સામે તાકીને જેણું જ હોય કે મારી સામે આંગળી કરતું જ હોય. એક વખતે હું ટાઉન હોલની પાસે થઈને જતો હતો ત્યારે તે લોકો મને ઘેરી વળ્યા ને તેમણે મારો હુરિયો બોલાવ્યો અને મારા ભાઈને બિચારાને તે બધું ચૂપચાપ જોઈ રહેવું પડ્યું. ન્યાતના મુખ્ય પ્રતિનિધિઓએ મારા ન્યાતીલાઓને બોલાવીને એક મોટી સભામાં એકઢા કર્યા ત્યારે વાત છેવટની આણીએ પહોંચ્યો. ન્યાતના એકેએક સલ્યને હાજર ન રહે તો પાંચ આના દંડ ભરવો પડ્યો એવી સજાની ધમકી બતાવીને સભામાં તેડાવી મંગાવ્યો હતો. અહીં જણાવી લઉં કે આ પગલું લેવાનો નિર્ણય થયો તે પહેલાં મને તેમનાં ઘણાં પ્રતિનિધિમંડળો

મળવા આવી રંજડી ગયાં હતાં પણ તેમાં તેમનું કશું વળ્યું નહોતું. આ જંગી સભામાં મને શ્રોતાઓની વચ્ચોવચ્ચ બેસાડવામાં આવ્યો હતો. ન્યાતના પ્રતિનિધિઓ, જેમને પટેલિયા કહીને ઓળખાવવામાં આવે છે તેમણે મારી સાથે સખત દલીલો કરી અને મારા પિતાની સાથે પોતાનો કેવો સંબંધ હતો તે મને યાદ દેવડાયું. અહીં જણાવું કે મારે સારુ આ અનુભવ તદ્દન નવો ને અસાધારણ હતો. તે લોકો મને એકાંતમાંથી ખરેખર ઘસડીને લઈ આવ્યા હતા કેમ કે હું આવી વાતોથી ટેવાયેલો નહોતો. વળી, મારા અન્યાંત શરમાળ સ્વભાવને લીધે મારી હાલત વધારે કફ્ફેડી થઈ પડી. તેમની સખત દલીલોની મારા પર કશી અસર નથી થતી એવું જેઈ ન્યાતના સૌથી આગેવાન પટેલે મને (નીચેની મતલબના) આ શબ્દો કહી સંભળાવ્યા : “અમે તારા બાપના મિત્રો થઈએ તેથી અમને તારે સારુ લાગે છે. ન્યાતના આગેવાનો તરીકે અમારી કેટલી સત્તા છે તે તું જાણે છે. અમને પાકે પાયે ખબર મળી છે કે વિલાયતમાં તારે માંસ ખાવું પડશે ને દાડ પીવો પડશે; વળી, તારે દરિયો ઓળંગવો પડશે; આ બધું આપણી ન્યાતના રિવાજ અને નિયમથી વિરુદ્ધ છે તે તું જાણે છે. તેથી તારા નિર્ણયનો ફરી વિચાર કરવાની અંમારી તને આજાં છે અને નહીં તો બારેમાં બારે સજ તારે બોગવવી પડશે. આ બાબતમાં તારે શું કહેવું છે?”

એ નીચેના શબ્દોમાં જવાબ આપ્યો : “તમારી ચેતવણી માટે તમારો આભાર માનું છું. મારો નિર્ણય હું ફેરવી શકું એમ નથી તે સારુ દિલગીર છું. ઈંગલાંડ વિષે મેં જે સાંભળ્યું છે તે તમે કહો છો તેનાથી તદ્દન જુદું છે; ત્યાં માંસ ને દાડ લેવાની જરૂર પડતી નથી. દરિયો ઓળંગવાની બાબતમાં જણાવવાનું કે આપણા ન્યાતીલાઓ એડન સુધી જઈ શકે તો હું વિલાયત કેમ ન જઈ શકું? મને પાકી ખાતરી થઈ છે કે આ બધા વાંધાઓના મૂળમાં દ્રોષ રહેલો છે.”

એટલે પટેલે ગુસ્સે થઈને કલ્યું, “બહુ સારું ત્યારે; તું તારા બાપનો દીકરો નથી.” પછી સભા તરફ વળીને તેમણે આગળ ચલાયું, “આ છોકરાની બુલિદ બહેર મારી ગઈ છે અને અમારી હરેકેને આજાં છે કે કોઈએ એની સાથે કશી સંબંધ રાખવો નહીં. જે કોઈ તેને કોઈ પણ રીતનો ટેકો આપશે અગર તેને વિદાય આપવાને જરૂર તેને ન્યાતબહાર ગણાવવામાં આવશે, અને અલ્યા તું, તું ગમે ત્યારે પાછો આવશે તોપણ તને કદી ન્યાતમાં પાછો લેવામાં આવશે નહીં.”

આ શબ્દો બધાના પર બોમ્બગોળાની માફક અથડાયા. જે કેટલાક આંગળીને વેઢે ગણ્ય એટલાએ અન્યાર સુધી લીલીમાં ને સ્યૂકીમાં મને આધાર આપ્યો હતો તે પણ મને છોડી એકલો મૂકી ગયા. એ લોકોના નાદાનીભર્યા ટોણાનો જવાબ વાળવાનું મને ધાણું મન હતું પણ મારા ભાઈએ મને વાયો. આમ જોકે આ આકરી કસોટીમાંથી હું હેમઝેમ બહાર આવ્યો તોએ મારી દશા પહેલાંનાં કરતાંએ ભૂડી થઈ. મારા ભાઈ સુધ્યાં થોડા ડગી ગયા પણ તે એક કાણ પૂરતા. તેમને કોઈએ પેલી ધમકી સંભારી આપી કે તમે જે પૈસાની મદદ કરશો તેથી તમને પૈસાની ખોટ તો જરૂર જ અને વધારામાં તમારે ન્યાતબહાર પણ થવું પડશે. એટલે તેમણે જાતે મને કંઈ ન કલ્યું પણ પોતાના કેટલાક મિત્રોને મારો નિર્ણય ફેરવવાને અથવા આ વાવાઝોડું બેસી જાય ત્યાં સુધી તેનો અમલ મોકૂફ રાખવાનું સમજાવવાને વિનંતી કરી. મારી પાસેથી તો એક જ જવાબ મળવાનો હતો અને તે મળ્યો પછી તે જરાયે ડગ્યા નથી, અને હકીકતમાં તો તેમને ન્યાતબહાર પણ મૂકવામાં આવ્યા નથી; પણ વાતનો છેડો હજી

આવ્યો નહોતો. ન્યાતીલાઓની ખટપટો ચાલ્યા જ કરતી હતી. આ વખતે તો તેઓ લગભગ ફાયા પણ ખરા કેમ કે મારું નીકળવાનું એક પખવાડિયા પૂરતું મોકુદુ રખાવી શક્યા. તેમણે તેમનો હેતુ આ રીતે અમલમાં મૂકેલો. અમે આગબોટ ચલાવનારી એક કંપનીના કેપ્ટનને મળવા ગયા અને તેની પાસે તે લોકોએ મને કહેવડાયું કે દરિયો તોફાની હોવાથી ઓગસ્ટ માસની એ મોસમ દરમિયાન નીકળવામાં ઉધાપણ નથી. મારા ભાઈ બધી વાતે કબૂલ થાય પણ આવા જેખમની વાતમાં શેના કબૂલ થાય? કમનસીબે મારી પણ આ પહેલી જ મુસાફરી હતી અને દરિયો મને માફક આવશે કે નહીં તે કોઈ કહી શકે એમ નહોતું એટલે હું પણ લાચાર થયો. મારી મરજીની તદ્દન વિચુલ્લ મારે મારું ઊપડવાનું મુલતવી રાખવું પડ્યું. મને થયું કે આ તો બધી જ વાત ભાંગી પડી. મારા ભાઈ એક મિત્રને વખત આવે ત્યારે મુસાફરીના ભાડાના પેસા મને આપવાની વિનાંતીની ચિઠ્પી લખીને વિદાય થયા. છેવટની વિદાયનું દૃશ્ય ઉપર વર્ણિન કર્યું છે તેના જેવું જ હતું. હવે મુસાફરીના ભાડાના પેસા હાથમાં આવ્યા નહોતા ને મુંબઈમાં હું એકલો રહી ગયો; જે એક એક દિવસ મારે કાઢવો પડ્યો તે મને વરસ વરસ જેટલો લાંબો લાગવા માંડયો. દરમિયાન મારા સાંભળવામાં આયું કે બીજા એક હિંદી ગૃહસ્થ<sup>૧</sup> ઈંગ્લાંડ જવાને નીકળવાની તૈયારીમાં છે; આ સમાચાર જાણે ઈશ્વરે આણધારેલું વરદાન મોકલ્યું ન હોય! ચોવીસ કલાકમાં મારે બધી તૈયારી કરવાની હતી; કંઈ સૂઝે નહીં એટલો હું બેબાકળો બન્યો. પેસા વગર જાણે હું પાંખ વગરના પંખી જેવો હતો. એક મિત્ર જેમનો હું કાયમનો ત્રણી છું તે મારી વહારે આવ્યા અને મુસાફરીના ભાડાના પેસા તેમણે મને ધીર્યા. મેં મારી ટિકિટ ખરીદ કરી, મારા ભાઈને તાર કરી દીધો અને હું ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની રથી તારીખે ઈંગ્લાંડ આવવાને વહાણમાં બેસી ગયો. મારી મુખ્ય મુશ્કેલીઓ આવી હતી અને પાંચ મહિના પહોંચી. ભયંકર ચિના અને સંતાપમાં એ ગાળો ગયો. ઘડીમાં આશા અને ઘડીમાં નિરાશા વચ્ચે જોલાં ખાતાં ખાતાં પણ હમેશ મારાથી થાય તેવી બધી કોણિથ કરતાં કરતાં અને પછી મારા મનમાં સેવેલા લક્ષ્યને ઈશ્વર પહોંચાડ્યા વગર રહેવાનો નથી એવો ભરોસો રાખી મેં એ બધા દિવસો ખેંચી કાઢ્યા હતા.

[મૂળ અંગ્રેજ]

ધ વેજિટેરિયન, ૧૩-૬-૧૮૮૧

૨.

તમે ઈંગ્લાંડ આવી પહોંચ્યા એટલે અલબત્ત, તમારી સામે માંસાહારનો સવાલ આવીને ઉભો રહ્યો; તેનો નિકાલ તમે કેવી રીતે કર્યો?

મને પાર વગરની વણમાગી ફ્રેક્ટની સલાહ મળી હતી. સદ્ભાવવાળા પણ અજ્ઞાન મિત્રોએ પોતાના અભિપ્રાયો સાંભળવાનું મન ન છતાં મને પરાણે સંભળાવવા માંડયા હતા. તેમાંના મોટા ભાગનાંએ મને કહેલું કે હંડી ઓંબોહવામાં તને માંસ વગર નહીં ચાલે. તને કષ્ય થશે. ફ્લાણા ભાઈ ઈંગ્લાંડ ગયેલા અને પોતાની મૂખ્યાઈભરી મમતને લીધે-ક્ષયની બીમારીમાં જીપડાયેલા. બીજા કેટલાકે વળી સલાહ આપેલી કે માંસ ખાધા વગર તને ચાલશે પણ દાર્દી પીધા વગર તું હાલીયાલી પણ નહીં શકે. ટાઢનો માર્યો હ્રી જશે. એક જણે તો એડન

.૧. મંજુદાર; નુચ્ચો પાછળ પા. ૬.

છોડયા પછી મારે જોઈશે જ જોઈશે માટે બિસ્કીની આઠ બાટલી સાથે વેવાની મને સલાહ આપેલી. બીજાએ વળી તમાકુ પીવાની સલાહ આપી કહેલું કે ઈંગલંડમાં તેના એક મિત્રને તેમ કરવું જ પહેલું. દાખલીનો ધંધો કરનારા ઈંગલંડ જરૂર આવેલા મિત્રો પણ એ જ વાત સંભળાવ્યા કરતા હતા. પણ મારે તો કોઈ પણ ભોગે અહીં આવવું હતું તેથી સૌને મેં કહેલું કે આ બધી વસ્તુઓથી આધા રહેવાની મારાથી થાય તેટલી બધી કોણિશ કર્યા પછી મને લાગશે કે એ બધી બિલકુલ જરૂરી છે તો હું શું કરીશ તે કહી શકતો નથી. અહીં મારે કહેવું જોઈએ કે અત્યારે મને માંસની જેવી જબરી સૂગ છે તેવી ત્યારે નહોટો. જે દિવસોમાં જાતે વિચાર કરી કામ કરવાને બદલે મિત્રોને વિચાર કરવાનું સોંપી તેમને વાએ હું ચાલતો ત્યારે માંસ ખાવાની વાતમાં હું છસાત વાર ફસાયેલો પણ ખરો. પણ સ્ટીમર પર મારા વિચાર બદલવા લાગ્યા. મને લાગ્યું કે કોઈ પણ હિસાબે મારે માંસ ન જ ખાવું. હું અહીં આવવા નીકળ્યો તે પહેલાં મારી પાસે મારી માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેથી કંઈ નહીં તો તે પ્રતિજ્ઞાને ખાતર પણ માંસ ન ખાવાને હું બંધાયેલો હતો. અમારી સાથે મુસાફરી કરનારાઓ અમને (મારી જોડે હતા તે મિત્રને અને મને) માંસ ખાઈ જેવાની સલાહ આપવા લાગ્યા.

તે બધા કહેતા કે એડન છોડયા બાદ તારે તેની જરૂર પડશે જ. એ વાત સાચી ન પડી ત્યારે રાતો સમુદ્ર પાર કર્યા પછી તો તે જોઈશે જ એવી વાત ચાલી. અને તે વાત પણ ખોટી પડી ત્યારે સાથે મુસાફરી કરનાર એક જણે કહ્યું, “આ વખતે ઠંડી સખત નથી પણ બિસ્કેના અભાતમાં પહોંચશે એટલે તારે મરણ અગર માંસ ને દાર વચ્ચે પસંદગી કરવાની આવશે એટલું ચોક્કસ જાણું.” એ કટોકટી પણ હેમઘેમ પાર કરી. લંડનમાં પણ મારે એવા જ બધા વાંધા ને દલીલો સાંભળવી પડી. મહિનાના મહિના સુધી કોઈ શાકાહારી મારા જેવામાં ન આવ્યો. શાકાહાર તંદુરસ્તીને માટે પૂરૂતો છે એવી એક મિત્ર સાથે દલીલ કરી કરીને મેં કેટલાયે દિવસ ફિકરમાં ને ફિકરમાં કાઢ્યા; પણ શાકાહારની તરફેણુંમાં જીવદ્યા સિવાયની બીજી કોઈ દલીલનું મને જાણું જ્ઞાન નહોંતું તેથી હું તેની સાથે દલીલમાં હારી ગયો કેમ કે આવી ચર્ચામાં જીવદ્યાનો વિચાર વચ્ચે લાવવાની વાતને તેણે તુચ્છકારી કાઢી. આખરે મારી માને આપેલા વચ્ચનો ભંગ કરવાને બદલે હું મરણને બહેતર વેખીશ એવું જણાવી મેં તેનું મોઢું બંધ કર્યું એટલે તેણે મને કહ્યું, “ઊંઠ, નાદાની, સાવ વહેમ; છતાં અહીં આવ્યા પછી પણ તું આવી અક્કલ વગરની વાતને વળગી રહેવા જેટલો વહેમી છે એટલે હવે મારાથી તને કશી મદદ થઈ શકે એવી નથી; તું અહીં ઈંગલંડ ન આવ્યો હોત તો સારું!”

સંભવ છે કે ત્યાર બાદ એકાદ વખત મને આ વિષે તેણે દબાણ કર્યું હશે તે સિવાય ફરી એ વાત કાઢી નહીં, જોકે એ પછી તેણે મને લગભગ મૂરખમાં ગણી કાઢ્યો હોવો જોઈએ. દરમિયાન એક શાકાહારી રેસ્ટોરાં (‘પોરિન બાઉલ’) પાસેથી એક વાર નીકળ્યાનું મને યાદ આવ્યું. એક ગૃહસ્થને તેનો રસ્તો બતાવવાને મેં વિનંતી કરી પણ તેને બદલે “સેટ્રલ” રેસ્ટોરાં મારી નજરે પડ્યું. એટલે હું ત્યાં પહોંચ્યો. પહેલી વાર જવના લોટની ઘેંશ મને ખાવાની મળી. પહેલાં તે મને ભાવી નહીં પણ બીજી વાતનગી તરીકે પીરસવામાં આવેલી કચોરી મને ગમી. અહીંથી જ પહેલવહેલું મેં શાકાહાર વિષેનું થોડું સાહિત્ય ખરીદ્યું. તેમાં ઓચ. ઓસ. સોલ્ટની લખેલી એ પ્લી ફોર વેજિટેરિયેનિઝમ [શાકાહારની હિમાયત] નામની ચોપડી હતી અને તે વાંચી મેં સિદ્ધાંત તરીકે શાકાહારનો અંગીકાર કર્યો.

આ પહેલાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી હું માંસને ચર્ચિતાતો આહાર માનતો હતો. વળી, ત્યાં જ માન્યેસ્ટર વેજિટેરિયન સોસાયટી[માન્યેસ્ટરની શાકાહારી મંડળી]ના અસિતત્વની મને જાણ થઈ. પણ તેમાં મેં કથો ખાસ સક્રિય રસ નહોતો લીધો. વચ્ચે વચ્ચે હું વિ વેજિટેરિયન મેસેન્જર વાંચતો એટલું જ. વિ વેજિટેરિયનની મને જાણ થયાને તો આને દોઢ જ વરસ થયું. એલ. વી. એસ.નો.૧ પરિય મને ઈન્ટર નેશનલ વેજિટેરિયન ડોંગ્રેસ [અંતરરાષ્ટ્રીય શાકાહારી ડોંગ્રેસ]ના અધિવેશન વખતે થથો કહેવાય. મિ. જોશિયા ઓફફિલ્ડે એક મિત્ર પાસેથી મારે વિષે સાંભળેલું એટલે તેમણે મને તેમાં હાજર રહેવાને કહેવાવેલું અને તેમના માયાળું સૌજન્યથી મને તે વિષેની ખબર મળેલી. અંતમાં મારે એટલું કહેવું જોઈએ કે ઈંગ્લાંડના મારા લગભગ ગ્રાન્ડ વરસના વસવાટ દરમિયાન મેં કેટલુંથે કરવા જેવું નહીં કર્યું હોય અને કદાચ ન કરવા જેવું ગણાય એવું કેટલુંથે કર્યું હો પણ મારા દિલમાં એક ભારે સમાધાન લઈને જાઉં છું કે માંસ આગર દારુને આડકયા વગર હું વતન પાછો ફરું છું અને વિલાયતમાં કેટલાયે શાકાહારી છે તે પ્રાતનો મને અંગત અનુભવ થયો છે.

[મૂળ અંગ્રેજી]

વિ વેજિટેરિયન, ૨૦-૬-૧૮૮૧

### ૧૩. ઓડવોકેટ તરીકે નોંધાવા માટે અરજી

મુંબઈ,  
નવેમ્બર ૧૬, ૧૮૮૧

ન્યાયની વડી અદાલતના પ્રોથોનોટરી  
અને રજિસ્ટ્રાર જોગ

મુંબઈ

સાહેબ,

હાઈકોર્ટના ઓડવોકેટ તરીકે દાખલ થવાની મારી ઈચ્છા છે. ગયા જૂન માસની ૧૦મી તારીખે ઈંગ્લાંડમાં હું બેરિસ્ટર તરીકે નોંધાયો છું ઈનર ટેમ્પલમાં મેં બાર સત્ર ભર્યું હોઈ મારો ઈરાદો મુંબઈ ઈલાકમાં વકીલાત કરવાનો છે.

બેરિસ્ટર તરીકે નોંધાયાનો મારો દાખલો હું આ સાથે રજૂ કરું છું. મારા ચારિત્ર્ય અને શક્તિ માટેના દાખલાની બાબતમાં જાણવવાનું કે ઈંગ્લાંડમાં કોઈ ન્યાયાધીશ પાસેથી મેં કોઈ પ્રકારનું સર્ટિફિકેટ મેળવ્યું નથી. કેમ કે મુંબઈની વડી અદાલતમાં અમલમાં આવતા નિયમોની મને જાણ નહોતી. ઈંગ્લાંડની ન્યાયની સૌથી ઉચ્ચ અદાલતમાં બેરિસ્ટર તરીકે ધંધો કરતા મિ. ડા. ઓડવર્ડઝ પાસેથી મળેલું સર્ટિફિકેટ હું જોકે આ સાથે રજૂ કરું છું.

૧. લંડન વેજિટેરિયન સોસાયટી—લંડનની શાકાહારી મંડળી.

ઇંગ્લાંડમાં ચાલતા જમીનની મિલકતના કાયદાઓના સંગ્રહના ગ્રંથના તેઓ કર્તા છે. અને તે ગ્રંથ બેરિસ્ટર થવા માટેની છેવટની પરીક્ષા માટે મુક્રર થયેલાં પુસ્તકોમાંનો એક છે.

હું છું સાહેબ, આપનો  
આજાંકિત સેવક,  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

મહાત્મા, ભાગ ૧; અસલની છબી પરથી

## ૧૪. હિંદ ભણી વતનને રસ્તે

૧

ઇંગ્લાંડના ત્રણ વરસના વસવાટ બાદ ૧૮૮૧ની સાલના જૂન માસની ૧૨મી તારીખે હું ત્યાંથી મુંબઈ જવાને નીકળ્યો. દિવસ ધણો રણિયામણો હતો; સૂર્ય પુરબહારમાં પ્રકાશતો હતો; ઠડા વાયરાથી બચવાને ઓવરકોટ પહેરવાની જરૂર નહોતી.

બરાબર ૧૧-૪૫ને ટકેરે મુસાફરોને લઈને એક એક્સપ્રેસ રેલગાડી વિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશનથી બંદરને ધડકે જવાને નીકળી.

પી. એન્ડ ઓ. કંપનીની ઓશિયાના સ્ટીમરમાં પગ મૂક્યો ત્યાં સુધી હું હિંદુસ્તાન પાછો જાઉ છું એ વાત હું મારા મનને મનાવી શકતો નહોતો. લંડન અને તેની આજુભાજુના વાતાવરણની સાથે મારે એવી ગાંઠ બંધાઈ ગઈ હતી! અને કોને ન બંધાય? પોતાની કેળવણીની સંસ્થાઓ, પોતાના સાર્વજનિક ચિત્રસંગ્રહો, સંગ્રહસ્થાનો, નાટકઘરો, પોતાનો બહેળો વેપાર, પોતાના સાર્વજનિક બાગબગીચાઓ અને શાકાહારી રેસ્ટોરાંઓ એ બધાને કારણે વિદ્યાર્થી, પ્રવાસી, વેપારી અને વિરોધીઓ જેને 'ધૂની' કહીને ઓળખાવે એવા શાકાહારીને સારુ લંડન બહુ મજાની અને લાયક જરૂરા છે. તેથી વહાલા લંડનને છોડતાં મને ઊંડી ગમગીની થયા વગર ન રહી. સાથે હિંદમાં મારા મિત્રો અને મારાં સગાંવહાલાંને આટલે લાંબે ગાળે મળવાનું થશે એ વિચારથી હું ખુશીમાં પણ હતો.

ઓશિયાના ઓસ્ટ્રેલિયન સ્ટીમર છે અને કંપનીની મોટામાં મોટીમાંની એક છે. તેનું વજન ૬,૧૮૮ ટન છે અને તેનું અશ્વબળ ૧,૨૦૦નું છે. આ વિશાળ તરતા બેટ પર અમે પગ મૂક્યો ત્યાં અમને મજાની સર્જૂતિ આપનારી ચા આપવામાં આવી અને અમે બધાએ (મુસાફરોએ તેમ ૧૧ વળાવવા આવેલા મિત્રોએ) તે પીધી. અહીં મારે જણાવવાને ચૂકુંનું ન જોઈએ કે, આ ચા અમને કંઈ પણ દામ લીધા વિના આપવામાં આવેલી. અમે બધા જે મોજથી ચા લેતા હતા તે જોઈને કોઈ આજાણ્યાએ અમને બધાયને મુસાફરો માની લીધા હોત (અને તે બધા મળીને સંખ્યા પણ સારી હતી); પણ મુસાફરોનો મિત્રોને વહાણ હવે લંગર ઉઠાવે છે એવી ખબર આપવાને ધાંટ વાગવો શરૂ થયો તેની સાથે તે સંખ્યા ઠીક ઠીક ઘટી ગઈ. વહાણ બંદર છીડીને નીકળ્યું ત્યારે સારા પ્રમાણમાં આનંદના પોકારો સંભળાયા અને વિદાયની નિશાનીમાં રૂમાલો ફરકતા જોવામાં આવ્યા.

મુંબઈ જનારા ઉતારુઓને એડનથી ને સ્ટીમર આસામમાં આ ઓશિયાનામાંથી ઉત્તરીને બેસવાનું હતું તેની અને આની વચ્ચે આહી સરખામણી કરી લેવી સારી. ઓશિયાના પર અંગ્રેજ નોકરો હતા ને હમેશ સુધડ, સ્વચ્છ અને તમારું કામ કરવાને તૈયાર રહેતા. એથી ઉલટું આસામ પર પોર્ટુગીઝ નોકરો હતા, ને રાણીના અંગ્રેજ [શુદ્ધ અંગ્રેજ]નું ઊંઘે ને પગલે ખૂન કરતા, અને હમેશ મેલાદેલા અને વધારામાં ધૂધવાયેલા ને કામ કરવામાં ધીમા હતા.

વળી, બન્ને સ્ટીમરો પર આપવામાં આવતા ખોરાકમાં પણ ધણો તફાવત હતો. આસામમાં મુસાફરો ને ઠબે ફરિયાદમાં ગણગણતા સંભળાતા તે પરથી આ તફાવત જણાઈ આવતો. એટલેથી વાત પૂરી થતી નહોતી. ઓશિયાના પરની રહેવાખાવાની સગવડ આસામ પરની સગવડને મુકાબલે કયાંયે ચિયાતી હતી; પણ આમાં કંપનીથી બીજું કંઈ થઈ શકે એમ નહોતું; ઓશિયાના વધારે સારી હતી તેથી આસામને કંઈ કંપની રદ ગણી કાઢી નાખે એવું થોડું જ બને?

વહાલું પર શાકાહારીઓ પોતાનું કેવી રીતે સંભળાતા? આ પૂછના લાયક સવાલ ગણાય.

ત્યારે, પહેલું તો એ જણાવવાનું કે વહાણ પર મારી સાથે અમે બે જ શાકાહારવાળા હતા. બીજું કશું વધારે સારું ન મળે તો બાફેલા બટાટા, બાફેલી કોબી અને માખળથી ચલાવી લેવાની અમારી તૈયારી હતી. પણ એટલી હેઠે જવાની અમને જરૂર ન પડી. અનુકૂળ અને અમારું કામ કરવાને રજી એવા સ્ટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકે તરકારીનો મસાલેદાર કરી, ભાત અને ઉકાળીને બાફેલાં તેમ જ તાજાં ફળ અને છેલ્લી ગણાનું છું છતાં મહત્વમાં જરાયે ઓછી નહીં એવી થૂલ્લી સાથે બનાવેલી રોટી પહેલાં નંબરના સલૂનમાંથી અમને લાવી આપવાનું રાખ્યું હતું એટલે અમારે ને જોઈએ તે બધું મળી રહેતું. અલબત્તા, આ સ્ટીમર કંપનીવાળાઓ ઉતારુઓને પૂરતો અને સારો ખોરાક આપવામાં, ખવડાવવાપિવડાવવામાં ખૂબ છૂટે હાથે કામ કે છે. ઉલટું, એ લોકો વધારે પડતું કરે છે; કંઈ નહીં તો મને એવું લાગે છે.

બીજા નંબરના સલૂનમાં પીરસવામાં આવતી વાનીઓનું અને મુસાફરોને કેટલી વખત ભોજન આપવામાં આવતું તેનું વર્ણન કરવું અસ્થાને નથી.

શરૂઆત કરવાને ખાતર સૌથી પહેલું સવારમાં એક સામાન્ય મુસાફર એક કે બે ઘાલા ચાના અને થોડાં બિસ્કિટ લેતો. ૮-૩૦ કલાકનો સવારના નાસ્તાની ખબરનો ધંટ ઉતારુઓને નીચે ભોજન અંડમાં ખેંચી લ્બાવતો. નિયમિતપણામાં એ લોકો એક મિનિટ પણ ચૂકતા નહોતા; કંઈ નહીં તો ભોજન માટે આપવામાં તો નહીં જ. નાસ્તાની વાનીઓમાં સામાન્યપણે જવના લોટની ધોશ, થોડી મચ્છી, જુદાં જુદાં માંસ છીણી બનાવેલી ચોપ નામની વાનગી, તરકારીની મસાલેદાર કરી, જેમ એટલે મુરબ્બો, ડબલ રોટી અને માખળ અને ચા કે કાફી વગેરે બધું જોઈએ તેટલું ભરપણે હોય.

ઉતારુઓને મેં ધણી વાર જવની ધોશ, મચ્છી અને કરી, ડબલ રોટી અને માખળ અને એ બધું ગળે ઉતારવાને ચાના બે કે ત્રેણ ખાલા પી જતા જોયા છે.

સવારનો નાસ્તો માંડ પચ્ચો ન પંચ્ચો હોય ત્યાં ટન ટન સંભળાય. એ બપોરના દોઢ વાગ્યાના ભોજનનો ધંટ. આ ભોજન પણ નાસ્તા જેવું જ પૂરું: જોઈએ તેટલાં માંસ ને તરકારી, ભાત અને તરકારીની મસાલેદાર કરી, શીરા જેવી પેસ્ટ્રી અને બીજું કેટલુંયે હોય. અદ્વારિયામાં બે દિવસ બીજા નંબરના સલૂનના ઉતારુઓને સામાન્ય ભોજન ઉપરાંત તાજાં તેમ જ કાશ્યલિયાળાં ફળ પીરસાતાં. પણ આટલુંયે પૂરતું નહોતું! બપોરના ભોજનની વાનગીઓ

પચાવવાની એટલી સહેલી કે બપોરના ચાર વાગ્યે અમારે 'સ્ક્રૂતિદાયક' ચાનો ખાલો ને બિસ્કિટ જેઈએ જ. એ ખરું પણ 'એ નાનકડા' ચાના ખાલાની બધી અસર સાંજના વાયરા એવી દૂર કરી દેતા કે સાડા છ વાગ્યે અમને 'ભારી ચા' આપવામાં આવતી. તેમાં ડબલ રોટી ને માખણ, જેમ અથવા મારમેલેડ અથવા એ બન્ને મુરબ્બા, દૂધ કે એવી કોઈક ચીજામાં લેજેલી લીલી તરકારીની કચુંબર, ચોપ, ચા, કાફી અને એવું બીજું હોય. દરિયાની હવા તંદુરસ્તીને એટલી બધી માફક આવતી લાગતી કે ઉતારુઓ થોડાં, બહુ થોડાં, માત્ર આડ કે દસ ને બહુ તો પંદર બિસ્કિટ, થોડું પનીર, અને થોડો વાઈન અથવા બીર લીધા વગર પથારીમાં સૂવાને જઈ શકતા જ નહીં. ઉપરની બધી વાત જાણ્યા પછી નીચેનું વાર્ણન ખરેખર સાચું છે એમ નથી લાગતું?

તારું પેટ તારો ઈશ્વર છે, તારી હોજરી તારું મંદિર છે, તારી દુંદ તારી વેદી છે અને તારો રસોઈયો તારો પૂજારી છે. . . રસોઈનાં વાસણોમાં તારો પ્રેમ ભડકાની જેમ જાગી ઊંઠે છે. રસોઈમાં તારો શક્કા જગહળી ઊંઠે છે, અને માંસની વાનગોઓમાં તારી બધી આંશા છુપાયેલી પડી છે. . . વારેવાર ભોજન આપનાર, સારી સારી જફ્ફતો આપનાર, અને દારૂની ખાલી લઈ તંદુરસ્તી ઈચ્છવાને ભાષણો કરવામાં પાવરધા ગૃહસ્થના કરતાં તને કોઈનેથે માટે આદર છે ખરો કે?

બીજા નંબરનું સલૂન બધી જતના ઉતારુઓથી ખાસું ભરેલું હતું. તેમાં લશકરના સિપાઈ, પાદરીઓ, હજામ, ખારવા, વિદ્યાર્થી, અમલદારો અને સંભવ છે કે સાહસ ઝડનારા હતા. ત્રણ કે ચાર છીંદ્રો હતો. અમારો વખત અમે મોટે ભાગે ખાવાપીવામાં ગાળતા. બાકીનો વખત કાં તો ઊંઘી કાઢવામાં, અથવા ગણ્યાં મારવામાં અને કોઈક વાર ચર્ચાઓમાં અને રમત-ગમત વગેરેમાં નીકળી જતો. બે કે ત્રણ દિવસ પછી જોકે ચર્ચાઓ, અને ગંભીરની રમતો અને લોકોની વાતો એ બધું કરવા છત્તાં વખત કેમે કર્યો જાય નહીં.

અમારામાંથી થોડાકને ઉત્સાહ થઈ આવતાં તેમણે જલસા ગોઠવ્યા, દોરડું ઝેંચવાની હરીકાઈ ઊભી કરી, અને ઈનામો કાઢી દોડવાની શરૂતો કાઢી. એક સાંજ આખી જલસા અને ભાષણોમાં ગઈ.

મને લાગ્યું કે હવે મારે માથું મારવાનો વખત આવ્યો છે. આ બધી વાતોની વ્યવસ્થા સંભાળનાર કમિટીના મંત્રીને મેં વિનંતી કરી કે શાકાહારના સિદ્ધાંત પર ટૂંકું ભાષણ કરવાને મને પા કલાક કાઢી આપો. મંત્રીએ ઊંઘું હલાવી મારી વિનંતીને મંજૂર રાખવાની મહેરબાની બતાવી.

એટલે પછી હું ભારે મોટી તેથારી કરવામાં પડ્યો. મારે જે ભાષણ આપવાનું હતું તે પહેલું મેં મનમાં વિચારી કાઢ્યું, પછી લખી કાઢ્યું, અને ફરી એક વાર સુધારીને લખી કાઢ્યું. હું બરાબર જાણતો હતો કે મારે વિરોધી વલણવાળા શ્રોતાવર્ગની સાથે કામ લેવાનું છે; અને મારા ભાષણથી તે લોકો ઊંઘી ન જાય તેની મારે સંભાળ રાખવાની હતી. મંત્રીએ મને કથ્યું કે જરા હુમરસ [વિનોદ] થણે. મેં તેને કથ્યું કે મારાથી હુમરસ તો નહીં થવાય, કદાચ નરવસ થવાશે [સભા-કોભથી હું કદાચ ગભરાઈ જાઉ ખરો].

હવે, ધારો જોઉ એ ભાષણનું શું થયું હશે? બીજો જલસો થયો જ નહીં. અને તેથી ભાષણ પણ રહી ગયું નથી મને બહુ હીછું લાગ્યું. આનું કરણ મને લાગે છે એવું થયું કે

આગલી સાંજે કોઈનેયે મજા પડી નહોતી કેમ કે બીજા નંબરના સલૂનમાં પડ્યો જેવા કોઈ ગાનારા કે ગ્લેડસ્ટન<sup>૧</sup> જેવા કોઈ ભાષણ કરનારા નહોતા.

આમ છતાં બે કે ત્રણ ઉતારુઓ સાથે શાકાહારના સિદ્ધાંતની ચર્ચા કરવામાં હું ફૂલ્યો. તેમણે મારી દલીલ ધીરજથી સાંભળી. પછી આ મતલબનો જવાબ આપ્યો: “તમારી દલીલ સાચી હો. પણ જ્યાં સુધી અમને અમારા આજના ખોરાકથી સમાધાન છે (કોઈક વાર અમને મંદારિન થઈ આવે છે એ વાત બાજુઓ રાખો) ત્યાં સુધી શાકાહારનો અખતરો અમે કેમ કરી કરીએ!”

તેમાંના એક જણે જોયું કે મારા શાકાહારી મિત્રને અને મને રોજ મજાનાં ફળ મળે છે એટલે તેણે વી. ઈ. એમ. નોંઢ અખતરો કરી જેયો પણ છીણેલા માંસના ચોપનું આકર્ષણ તેને એટલું બધું હતું કે તે તેનાથી છોડાયું નહીં.

બિચારો ભલો આદમી!

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૮-૪-૧૯૬૨

## ૨

વળી, પહેલા નંબરના સલૂનના ઉતારુઓ બીજા નંબરના સલૂનના ઉતારુઓને પોતે ગોઠવેલા નાટ્યમનોરંજન અને નૃત્યમનોરંજનના જલસાઓમાં વારંવાર બોલાવતા તે એ ઉતારુઓના મળતાવડાપણાનો અને પહેલા નંબરના સલૂનના ઉતારુઓનો વિવેકનો દાખલો છે.

પહેલા નંબરના સલૂનમાં કેટલાંક મજાનાં બાનુઓ અને ગૃહસ્થો હતાં. પણ હમેશ આનંદ-પ્રમોદનું વાતાવરણ રહે અને કદી ટંટોતકરાર હોય જ નહીં. એવું થોડું જ ચાલે? એટલે કેટલાંક ઉતારુઓને પીને છાકટા થવાનું સૂઝ્યું. (માફ કરણે એડિટર સાહેબ, એ લોકો લગભગ રોજ રાત્રે પીતા પણ આ એક રાતે તેમણે પીધું એટલું જ નહીં, તેઓ છાકટા બની એલફ્ફેલ વર્તવા લાગ્યા). એવું લાગે છે કે એ લોકો વિહસ્કી પીતા પીતા ચર્ચને રંગે ચડયા હતા તેમાં થોડાએ અસભ્ય ભાષામાં બોલવા માંડયું. એમાંથી પહેલાં શબ્દોની લડાઈ જમી અને પછી વાત વધીને મુક્કામુક્કીની લડાઈ ચાલી. આ બનાવની સ્ટીમરના કઝ્તાનને ખબર આપવામાં આવી. પેલા મુક્કામુક્કીના શોખીન ગૃહસ્થોને તેણે ઠપકો આપ્યો એટલે ત્યાર પછી અમારામાં એવો બંદોફ્રી દેખાયો નહીં.

આમ થોડો વખત ખાવાપીવામાં તો થોડો આનંદપ્રમોદમાં કાઢતા કાઢતા અમે આગળ વધ્યા.

બે દિવસની મુસાફરી પછી સ્ટીમર નિયોંગટર પાસેથી પસાર થઈ પણ ત્યાં રોકાઈ નહીં. અમારામાંથી કેટલાંકને એવી આશાં હતી કે આહીં સ્ટીમર લંગર નાખશે તેથી એકંદરે અને ખાસ કરીને તમાકુ પીનારાઓમાં ઘણી નિરાશા ફેલાઈ કેમ કે નિયોંગટરમાં વગર વેરાએ મળતો તમાકુ લેવાની તેમની ખૂબ મરજી હતી.

૧. તે જમાનાનો મશહૂર ધયાલિયન ગાયક.
૨. છાંડનો નામાંકિત વડો પ્રધાન ને અસાધારણ કોઈનો વક્તા હતો.
૩. પા. ૧૮ પરની ફૂટનોટ નેવી.

તે પછી અમે જે જગ્યાએ પહોંચ્યા તે માલ્ટા. એ કોલસો ભરી લેવાનું મથક હોવાથી ત્યાં સ્ટીમર લગભગ નવ કલાક રોકાય છે. લગભગ બધા ઉતારું કંઠે ઉતરી પડ્યા.

માલ્ટા રણિયામણો બેટ છે અને ત્યાં લાંડનનો ધુમાડો નથી. ત્યાંનાં મકાનોની રચના જુદી જતની છે. અમે ગવર્નરનો મહેલ જોઈ વળ્યા. ત્યાંનું શખાગાર જેવા લાયક સ્થળ છે. આહી નેપોલિયનની ઘોડાગાડી પણ બતાવવામાં આવે છે. ત્યાં કેટલાંક સુંદર ચિન્તો પણ જેવાનાં મળે છે. બજાર ત્યાંનું ખોટું નથી. ઇણ સસ્તાં છે. અને ત્યાંનું દેવળ આલીશાન છે.

અમે ઘોડાગાડીમાં નારંગીના બગીચાઓ સુધી છબેક માઈલનો મજાનો ફેરો મારી આવ્યા. એ બગીચાઓમાં તમને હજારો નારંગીનાં જાડ અને સોનેરી માઇલીવાળાં નાનાં તળાવડાં જેવાનાં મળે છે. આ ફેરો બહુ સસ્તો છે; માત્ર એક શિલ્બિંગ ને છ પેન્સ.

બિભારીઓને લીધે માલ્ટા કેવી ભૂતી જગ્યા બની ગઈ છે! રસ્તા પર નીકળો કે મેલાધેલા દેખાતા બિભારીઓનું ટોળું તમને રંજડવાને આવ્યું જ જાણો અને તમે નિરાંતે આગળ ગઈ શકો જ નહીં. તેમાંના કેટલાક તમને કહેશે કે અમે તમારા ભોમિયા થઈએ તો બોજ વળી કહેશે કે અમે તમને સિગાર મળે એવી અને માલ્ટાની જાણીતી મીઠાઈ નૌગેટ મળે એવી દુકાનોએ લઈ જઈએ.

માલ્ટાથી નીકળેલા અમે બ્રિન્ડિસી પહોંચ્યા. તે બંદર સાંચું છે પણ તેથી વિશેષ ત્યાં કંઈ નથી. ત્યાં મનોરંજનમાં એક દહાડો પણ તમે ન કાઢી શકો. અમારી પાસે ખાસા નવ કે તેથીયે વધારે કલાક ફ્રાન્ઝ હતા પણ એક કલાકનો સુધ્યાં ઉપયોગ ન થઈ શક્યો.

બ્રિન્ડિસી મૂક્યા બાદ અમે પોર્ટ સૈયદ પહોંચ્યા. ત્યાં અમે યુરોપ અને ભૂમધ્ય સમુદ્રની છેવટની વિદાય લીધી. અલબટા, સમાજના ઉતાર<sup>1</sup> જેવા માણસોને જેવાનો તમને શોખ હોય તો વાત જુદી છે બાકી પોર્ટ સૈયદમાં જેવા જેવું કંઈ નથી. ત્યાં ઠા ને બદમાસોનો<sup>2</sup> પાર નથી.

પોર્ટ સૈયદથી આગળ સ્ટીમર બહુ આસ્તે આસ્તે આગળ વધે છે કેમ કે ત્યાંથી આપણે માં. દ લેસેપ્સની સુઅ૱ઝેની નહેરમાં દાખલ થઈએ છીએ. નહેર સત્યાસી માઈલ લાંબી છે. પણ એટલું અંતર વટાવતાં આગામોટને ચોવીસ કલાક થયા. આહી આપણે બાન્યુ ડિનારાની જમીનની ખૂબ નજીક હોઈએ છીએ. પાણીની નાળ એટલી સાંકડી છે કે કેટલીક ચોક્કસ જગ્યા બાદ કરતાં બે સ્ટીમરો પણ જેડાનેડ ચાલી શકતી નથી. રાતે દેખાવ બહુ રણિયામણો હોય છે. બધાં વહાણને મોખ્યરે વીજાળીની બત્તી કરવાનું ફરમાન હોય છે અને તે બહુ જેરાવર હોય છે. બે વહાણો ઓકબીજાની પાસેથી પસાર થાય ત્યારે દેખાવ બહુ મજાનો થાય છે. સામેના વહાણ માંથી દેખાતી વીજળીની બત્તી આંખને આંજી નાખે છે.

અમે ગેન્જિસ પાસે થઈ પસાર થયા. અમે તેને આવકારવાને ત્રણ હર્ષના પોકાર કર્યા અને ગેન્જિસ પરના ઉતારુઓએ પૂરા ઉત્સાહથી તેનો સામો જવાબ વાળ્યો. સુઅ૱ઝ કસબો નહેરને બીજે છેડે છે. ત્યાં સ્ટીમર માંડ અધી કલાક રોકાય છે.

હવે અમે રાતા સમુદ્રમાં પેઠા. એ ત્રણ દહાડાની સફર હતી પણ ભારે તાવણી કરનારી હતી. સહન ન થાય તેવી ગરમી પડતી હતી. સ્ટીમરની અંદરના ભાગમાં રહેવાનો તો સવાલ જ નહોતો પણ તૂતક પર સુધ્યાં ગરમી અતિથય હતી. આહી પહેલી વાર અમને ખ્યાલ આવ્યો કે અમે હિંદ જઈએ છીએ ત્યાં પણ અમારે ગરમ આબોહવામાં રહેવાનું છે.

૧. આ ઉલ્લેખ દેખીતી રીતે ત્યાંના રહેવાસીઓના એક ભાગ પૂરતો છે.

એડન પહોંચ્યા ત્યારે કંઈક પવન નીકળ્યો. આહી અમારે (મુંબઈના ઉતારુઓએ) ઓશિયાના-માંથી ઉતરી આસામમાં ચડવાનું હતું. જાણે લંડન છોડી કોઈ કંગાલ ગામડામાં જઈ પડ્યા! આસામ ઓશિયાના કરતાં અર્ધુંયે નથી.

આઈત એકલદોકલ આવતી નથી; જાણી એકઠી મળીને આવે છે. આસામ પર ચડવા તેની સાથે દરિયો તોફાને ચડયો કેમ કે વરસાદની મોસમ હતી. હિંદી મહાસાગર સામાન્યપણે શાંત રહે છે તેથી કેમ જાણે તેનું સાટું વળવાને ચોમાસામાં તોફાને ચડે છે. મુંબઈ પહોંચતાં પહેલાં અમારે બીજા પાંચ દલાડ પાણી પર કાઢવાના હતા. બીજી રાત ખરેખરું તોફાન લઈને આવી. કેટલાયે માંદા પડી ગયા. હું તૂતક પર નીકળું, એટલે પાણીની છોળથી તરબોળ થઈ જાઉં. એ પેલો કંઈક કડકો થયો! કંઈક નૂટી પડ્યું લાગે છે! કેબિનમાં તમને નિરાતે ઊંઘવાનું ન મળે. બારણાં અફળાતાં હોય. તમારા સામાનની પેટીઓ નાચતી હોય. તમે પથારીમાં ડાલમ-ડોલમ થયા કરો. કેટલીક વાર તમને લાગે કે વહાણ ડૂબે છે. જમવાના ટેબલ પર પણ એવું જ. ત્યાંથે ચેન નહીં. સ્ટીમર ડોલમડોલ કરતી તમારી બાજુ ઢેણે. તમારા કાંટા ચમચા ટેબલ પરથી ઊંઘળી તમારા ખોળામાં આવી પડે, મસાલાની શીશીઓ અને દાળની ખેટ સુધ્યાં; તમારો નોપક્કિન પીળો રંગાઈ જાય અને એવું તો બીજું કેટલુંયે બને.

એક દિવસ સવારે મેં વહાણના સટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકને પૂછ્યું કે આને તમે ખરું તોફાન કહો ખરા કે? તેણે કહ્યું, “ના સાહેબ, આ તો કંઈ જ નથી.” પછી પોતાના હાથ વીજી તેણે મને ખરા તોફાનમાં વહાણ કેવું ડાલમડોલમ થાય તે બતાવ્યું.

આમ ઊંઘેનીચે અફળાતા, પડતા, આખડતા અમે જુલાઈ માસની પંદરમી તારીખે મુંબઈ પહોંચ્યા. વરસાદ ધોખમાર પડતો હતો તેથી કિનારે ઊતરવાનું મુશ્કેલ હતું. છતાં અમે હેમઝેમ કિનારે પહોંચ્યા અને આસામની વિદાય લીધી.

ઓશિયાના અને આસામ પર માણસોરૂપી કેવો તરેહવાર માલ ભર્યો હતો! કેટલાક મોટી મોટી આશા બાંધી ઓસ્ટ્રેલિયા મોટી દોલત કમાવા જતા હતા, બીજા વળી ઈંગલિયામાં પોતાનું ભાણતર પૂરું કરી સારી આબરૂદાર રોજી કમાવાને હિંદુસ્તાન પાછા ફરતા હતા, કેટલાક ફરજના માર્યા બહાર નીકળી પડ્યા હતા, તો કેટલાક વળી કાં તો હિંદુસ્તાનમાં કે કાં તો ઓસ્ટ્રેલિયામાં પોતાના પતિઓને મળવા જતાં હતાં અને કેટલાક સાહસિકો વતનમાં નાસીપાસ થવાથી ઈશ્વર આણે કચાં પણ બીજે કચાંક પોતાનાં પરાકર અજમાવવાને નીકળી પડ્યા હતા!

એ બધાની આશા ઇણી હશે કે? એ જ ખરો સવાલ છે. માણસનું મન કેવું આશાળું હોય છે અને કેવું વારંવાર નિરાશા અનુભવે છે! આપણે આશામાં ને આશામાં જ જીવતા નથી કે?

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૧૬-૪-૧૯૮૨

## ૧૫. પટવારીને<sup>૧</sup> પત્ર

મુખ્ય,  
સપ્ટેમ્બર ૫, ૧૯૮૨

મારા વહાલા પટવારી,

તમારા પત્રને માટે અને મને આપેલી સલાહને માટે તમારો આભારી છું.

મારા છેલ્લા પોસ્ટ કાર્ડમાં મેં કલ્યું હતું તેમ વકીલાતનો ધંધો કરવાને પરદેશ જવાનું મારે મુલતવી રાખવું પડયું છે. મારા ભાઈ તે વાતની બહુ વિશુદ્ધ છે. તેમને એવું લાગે છે કે કાઠિયાવાડમાં<sup>૨</sup> અને તે પણ સીધી રીતે ખટપટમાં પડયા વગર ગુજરા માટે આબરૂદાર કમાણી કરવાની બાબતમાં મારે નિરાશ થવા જેવું નથી. એ જે હોય તે પણ તેઓ આટલા બંધા આશા-વાન છે અને મારા તરફથી તેમની લાગણીને માટે આદરના હરેક રીતે હક્કાર છે એટલે હું તેમની સલાહે ચાલીશ. અહીં પણ મને થોડાં કામનાં વચન મળ્યાં છે. એટલે કંઈ નહીં તો હું અહીં લેએક મહિના સાડુ રોકાવા ધારું છું.

સાહિત્યને લગતા કામની જગ્યા લેવાથી મારા કાયદાના અભ્યાસેમાં ખાસ વાંધો આવે એવું લાગતું નથી. બીજી બાજુથી એવા કામથી વકીલાતમાં આડકતરી રીતે કામમાં આવ્યા વગર રહે નહીં, એવો મારા જ્ઞાનમાં વધારો થશે. વળી, એથી હું વધારે એકાગ્ર ચિત્તથી ચિત્તથી મુક્ત થઈને કામ કરી શકું. પણ એવી જગ્યા છે કયાં? એકાદ મળી જવી સહેલી નથી.

રાજકોટમાં હતો ત્યારે તમે મને આપેલા વચનને આધારે અલબર્ત મેં થોડા પૈસા મને ધીરવાની માગણી કરી છે. તમારા પિતાને એની ખબર પડવી ન જોઈએ એ વાતમાં હું તમારી સાથે તદ્દન સંમત છું. હમણાં એ વિષે ફિકર ન કરશો. હું બીજે કચાંક કોશિશ કરી જોઈ છું. એક વરસના ધંધાની કમાણીમાંથી તમે જાણું ફણલ પાડી ન શકો એ હું સહેજે સમજી શકું છું.

મારા ભાઈને સચીનમાં સચીનતાના નવાબના મંત્રી તરીકે રોકી લેવામાં આવ્યા છે. તેઓ રાજકોટ ગયા હોઈ થોડા દિવસમાં પાછા આવશે.

ન્યાતીલાઓનો વિરોધ જેવો ને તેવો સખત છે. બધી વાતનો આધાર એક જ જણ પર છે અને તે મને ન્યાતમાં પાછો દાખલ ન થવા દેવાને થાય તે બધું કર્યા વગર રહેશે નહીં. મને આમાં મારી એટલી બધી દયા નથી ચાંચતી જેટલી એક જ માણસની સત્તાને ઘેટાંની જેમ સ્વીકારી લેનારા ન્યાતીલાઓની આવે છે. એ લોકોએ જે કેટલાક અર્થ વગરના હરાવ કર્યા છે અને બીજું જે વધારે પડતું કરવા માંડયું છે તે પરથી તેમના દિલમાં રહેલો દ્રોષ ચોખ્ખો દેખાઈ આવે છે. તેમની દલીલોમાં અલબર્ત, ધર્મની વાત કચાંયે આવતી નથી. આવા લોકોમાંનો હું એક ગણ્યાઉ તેટલા ખાતર તેમની ખુશ્યામત કરી તેમના ગુણ ગાવા કરતાં તેમની સાથે કથો સંબંધ ન રહે તે લગભગ વધારે સારું નથી શું? છતાં મારે જમાનાની સાથે ચાલવું રહ્યું.

ગુજરાતભાઈ ગુજરાતમાં કચાંક કરબારી નિમાયા છે તે સાંભળીને હું ધારો રજુ થયો.

૧. જેને સંબોધને આ પત્ર છે તે રાજકોટના રહુણેડલાલ પટવારી.

૨. કાઠિયાવાડ સૌરાષ્ટ્ર નામથી પણ એળખાય છે.

તમે એવા સારા અક્ષર કાઢો છો કે અધૂરું અધૂરું પણ તમારું અનુકરણ કરવાનું મને મન થયું છે.

હદ્યથી તમારો,  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

ગાંધીજીના અક્ષરમાં લખાયેલા અસલ પરથી.

## ૧૬. એળખનો સવાલ

પ્રિટોરિયા,  
સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૩

શ્રી તંત્રી  
ધિ નાતાલ એડવર્ટાઇઝર  
સાહેબ,

મિ. પિલ્લેએ ધિ નાતાલ એડવર્ટાઇઝરને મોકલેલો પત્રી તમારા અભિભારમાં 'ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે બીના તરફ મારું ધ્યાન જેંચવામાં આવ્યું છે. ડરબનમાં આવનાર અને હાલ ને પ્રિટોરિયામાં છે તે કમનસીબ હિંદી બેરિસ્ટર-એટ-લો હું છું; પણ હું મિ. પિલ્લે નથી કે હું બી. એ.ની ડિગ્રી પણ ધરાવતો નથી.-

હું છું ૧.  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

ધિ નાતાલ એડવર્ટાઇઝર, ૧૮-૮-૧૯૬૩

## ૧૭. હિંદી વેપારી

પ્રિટોરિયા,  
સપ્ટેમ્બર ૧૮, ૧૯૬૩

શ્રી તંત્રી  
ધિ નાતાલ એડવર્ટાઇઝર  
સાહેબ,

નીચેના લખાણને માટે તમારા અભિભારમાં જગ્યા કરશો તો હું તમારો ધણો આભારી થઈશ.

ધિ ટ્રાન્સવાલ એડવર્ટાઇઝર પર મોકલેલા પોતાના લખાણને કારણે 'ધૂણાસ્પદ' દરેલા મિ. પિલ્લેના અહીંના કેટલાક ગૃહસ્થોએ અને ત્યાંનાં અભિભારોએ ટુકડે ટુકડા કરી નાખ્યા છે. 'શિયાળ જેવા ખંધા એણિયાઈ વેપારીઓ', 'કોમનાં ખુદ મર્મિય અંગોને કોતરી ખાનારી બીમારી',

૧. પોતાને (પિલ્લેને) ફૂટપાથ પરથી હડસેલી દેવામાં આવેલા તે ખાખતની ઇરિયાદનો.

‘અધિકારીનું હબે જીવન જીવનારા પરોપજીવીઓ’ વિષેનો તમારો અગ્રલેખ સખત શબ્દોની હરીફાઈમાં મિ. પિલ્લેના પત્રની સામે મેદાન મારી જાય કે શું એવું મને લાગે છે. પણ શૈલીની બાબતમાં રુચિ ભિન્ન ભિન્ન હોય છે અને કોઈનીએ લખાણની શૈલી વિષે તુલના કરવાનો મને આધિકાર નથી.

પણ જિચારા એણિયાઈ વેપારીઓ પર આ બધો રોષ થા સારુ ઠલવાય છે? કોલોનીનું અક્ષરશઃ સત્યાનાશ વળી જવાનું જોખમ કેવી રીતે ઊભું થયું છે તે સમજયું મુશ્કેલ છે. ચાલુ માસની પંદરમી તારીખના તમારા અગ્રલેખ પરથી મને જે કારણો સમજાયાં છે તેનો સાર નીચેના શબ્દોમાં દર્શાવી શકાય: “એક એણિયાઈ વેપારીએ દેવાળું કાઢ્યું છે અને એક પાઉંડની પાંચ પેની ચૂકવી છે. એણિયાઈ વેપારીનો આ સારો નમૂનો છે. તેણે બજરમાંથી નાના યુરોપિયન વેપારીને હાંકી કાઢ્યો છે.”

હવે, માની લો કે મોટા ભાગના એણિયાઈ વેપારી દેવાળું કાઢે છે અને પોતાના દેણદારોને દેવા પેટે જાંનું ચૂકવતા નથી (જે વાત બિલકુલ સાચી નથી) તો એ શું તેમને કોલોનીમાંથી અને દક્ષિણ આંક્રિકમાંથી હાંકી કાઢવાને વાજબી કારણું છે કે? ઊભટું, એ બીના માણસ પોતાના વેણુદારોને પાયમાલ કરી શકે તે રીતે તેને પોતાનું દેવનું ચૂકવવાને અશક્ત એટલે કે દેવાળાની સ્થિતિમાં હોવાનું જહેર કરનારા કાયદામાં કંઈક ખામી હોવી જોઈએ. એવું બતાવતી નથી કે? એવો વહેવાર કરવાને માટે કાયદાથી કંઈક છૂટ મળી જતી હોય તો લોકો તેનો લાભ લીધા વગર રહે નહીં. અને યુરોપિયનો શું માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જહેર કરનારી આદાલતનું રક્ષણ નથી શોધતા કે? અલભતા, તમે પણ કયાં સીધા છો એવી દલીલ કરીને હું હિંદી વેપારી-ઓનો બચાવ કરવા માગતો નથી. હિંદીઓ આવા વહેવારનો આક્રાય લે છે તેથી મને ખરેખર દિલગીરી થાય છે. એક જમાનામાં જ્યાં માનઆબરુનો ઘ્યાલ એટલો ઊંચો હતો કે વેપારમાં અપ્રામાણિક વહેવારમાં કોઈ પોતાનું નામ ફૂલ આવવા ન હે, તેમના દેશને એથી નીચું જોવાનું થાય છે. હિંદી વેપારીઓ માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જહેર કરનારા કાયદાનો લાભ લે છે એટલી જ હકીકતના જે પર તેમને હાંકી કાઢવાની દલીલ ઊભી થતી નથી એવું જોકે મને ચોક્કસ લાગે છે. કાયદો એકલો જ નહીં, જથ્થબંધ માલનો ધંધો કરનારા વેપારીઓ પણ જરા વધારે સાવધ રહે તો આવા દાખલાઓ વારંવાર બનતા આટકાવી શકે. અને બીજું, ખુદ યુરોપિયન વેપારીઓ આ વેપારીઓને શાખ પર માલ ધીરે છે તે જ હકીકત પણ શું એવું નથી બતાવતી કે તે બધા સરવાળે તમે ચીતર્યા છે તેવા ભૂડા તો નથી?

નાનો યુરોપિયન વેપારી બજરમાંથી ધકેલાઈ ગયો હોય તો તે માટેનો વાંકનો ટોપલો શું હિંદી વેપારીને માથે ઢોળવાનો છે? એથી તો ઊભટું એવું લાગે છે કે હિંદી વેપારી પોતાના ધંધામાં વધારે કાબેલ છે અને તેની કુશળતા એ જ તેને અહીંથી હાંકી કાઢવાનું કારણ છે! હવે હું તમને પૂછું છું સાહેબ, કે આં ન્યાય છે? એક તંત્રી પોતાના છાપાનું સંપાદન પોતાના હરીફના કરતાં વધારે આવડતથી કરે અને પરિણામે હરીફને એ ક્ષેત્ર છોડી દેવનું પડે તો તમે શું તે સફળ તંત્રીને કહેવા જશો ખરા કે તમે વધારે આવડતવાળા છો માટે તમારે તમારા માતં થયેલા હરીફને તમારી જગ્યા આપી દેવી જોઈએ? ઊભટું, બીજા લોકો પણ પોતાની આવડત કેળવી ઊંચા આવવાની કોણિશ કરતા થાય તેટલા ખાતર વધારે આવડત પ્રોત્સાહન આપવાનું ખાસ કારણ નથી શું? નરવી હરીફાઈને ગુંગળાવી મારવી એ સાચી નીતિ છે કે? ઓછે ખરયે કેમ વેપાર ખેડવો, સાદાઈથી કેમ જીવનું એ બધું હિંદી વેપારી પાસેથી પોતાના મોભાને આશ્રયાજતું

ન લાગતું હોય તો યુરોપિયન વેપારીઓ શીખવા જેવું નથી શું? “બીજ તમારી સાથે નેમ વર્તે એમ તમે ઈચ્છતા હો તેવું વર્તન તમારે તેમની સાથે રાખવું.”

પણ તમે કહો છો કે આ ભૂંડા એશિયાઈઓ અર્ધનંગલી ઢબે જીવે છે. અર્ધનંગલી જીવન વિપેના તમારા ઘ્યાલો જાણવા મળો તો તેમાં ખરેખર રસ પડે. એ લોકો કેવી ઢબે જીવે છે તેનો મને થોડો ઘ્યાલ છે. મજાની કીમતી શેતરંજી અને શાળગાર માટેના પડદા વગરનો ભોજનખાંડ, જેના પર શોભા વધારવાને ફૂલ ગોઠવેલાં નથી, જેના પર ભાતભાતના દાડુ અને હુક્કરના ને ગાયના માંસની જેટલી જોઈએ તેટલી વાનીઓ પીરસવામાં આવેલી નથી એવું ઉપર પાથરવાના મોંધા કાપડ વગરનું (અને સંભવ છે કે વાર્નિશ કર્યા વગરનું) જમવા માટેનું ટેબલ એ અર્ધનંગલી રહેણી હોય; મારા સાંભળવા પ્રમાણે ઉનાળાની અકળાવનારી ગરમીમાં જેને સારુ ઘણા યુરોપિયનો તેમની અદેખાઈ કરે છે એવો ગરમ આબોહવાને ખાસ માફક આવતો સફેદ, સગવડવાળો પહેરવેશ અર્ધનંગલી રહેણી હોય; બીર ન પીવો, તમાકુ ન વાપરવો, હાથમાં છટાદાર લાકડી લઈને ન ફરણું, સોનાનો ધડિયાળનો છેદો ન લટકાવવો, રાચરચીલાંધી સજાવેલું દીવાનખાનાંનું ન હોવું એ બધાં અર્ધનંગલી રહેણીનાં લક્ષણ હોય; ટૂંકમાં સામાન્યપણે જેને સાદી, કરકસરભરી જિંદગી સમજવામાં આવે છે તે અર્ધનંગલી જીવનપદ્ધતિ હોય તો હિંદી વેપારીએ તે આશોપ સ્વીકારી લેવો જોઈએ અને સંસ્થાનની સર્વેચ્ચ સંસ્કૃતિમાંથી તે અર્ધનંગલી રહેણીને જેટલી વહેલી નાબૂદ કરવામાં આવે તેટલું બેશક સારું થાય.

સુધરેલાં રાજ્યોમાંથી એ કોમને બહાર હાંકી મૂકવાના કારણમાં જે તત્ત્વોને સામાન્યપણે સમાવવામાં આવે છે તે બધાંયનો આ લોકોના દાખલામાં તદ્દન અભાવ છે. એ લોકો તરફથી સરકારને રાજકીય દૃષ્ટિથી જોખમ નથી એવું હું કહું તો તમારે તે વાતની સાથે સંમત થણું જોઈએ કેમ કે એ લોકો રાજકારણમાં માથું મારતા હશે તોયે નહીં જેવું જ મારે છે. એ લોકો નામીચા લૂંટાડું નથી. હું માનું છું કે ચોરી, લૂંટ, અથવા એવા જ બીજ નીચ ગુનાઓ કર્યાનો, આરે, હિંદી વેપારી પર તેવો આશોપ મુકાયાનો એક પણ દાખલો જાણવામાં નથી. (આ વાતમાં ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું.) તેમની દાડ જેવાં કેદી પીણાં મુદ્દલ ન વાપરવાની આદતને લીધે તે બધા આસાધારણ શાંત નાગરિકો હોય છે.

પણ જેની ચર્ચા ચાલે છે તે અગ્રલેખમાં કલ્યું છે કે એ લોકોને કશો ખર્ચ હોતો નથી, એ લોકો પૈસો વાપરતા જ નથી. નથી વાપરતા? મને લાગે છે કે એ લોકો હવા ને લાગણીઓ પર ગુજરો કરતા હોવા જોઈએ. કેનિટી ફોર નવલકૃથાનું પાત્ર બેકી બિલકુલ વગર ખરચે આખું વરસ્થ ગુજરો કર્યાની. અને અહીં આખો ને આખો પ્રજાનો એક વર્ગ તેવું કરતો જડો આવ્યો છે. દુકાનભાડામાં, કરવેરામાં, ખાટકીને, કરિયાણાવાળાને, અનાજના વેપારીને, ગુમાસ્તાના પગારમાં, અને એવી બીજી બાબતોમાં તેમને કશું ચૂકવવાનું હોતું નથી એમ જ માનીને ચાલવું જોઈએ. આખો દુનિયામાં વેપારધાંધાની સ્થિતિ જે, કટોકટીએ પહોંચી છે તે જેતાં ખાસ કરીને આવા દુશ્વરના આશીર્વાદ, પામેલા વેપારીઓના વર્ગમાં જ આપણે પણ હોઈએ તો કેવું સારું!

સાદાઈ, કેદી પીણાં ને ચીંઝેના વંપરાશનો સદંતર ત્યાગ, સુલેહશાંતિભરી રહેણી, અને સૌથી વધારે તો વ્યવસ્થિત કામકાજ કરવાની અને કરકસરની કેળવણી, એ બધું બિચારા હિંદી વેપારીઓને વખાણું લાયક હરાવવામાં કામ આવવું જોઈએ તેને બદલે ખરેખર તેમના તરફના આ બધા તુચ્છકાર અને વેરના મૂળમાં હોય એમ ઓકંદરે લાગે છે. અને વળી એ બધાયે બ્રિટિશ

રાજ્યની પ્રજા છે. તો આ શું ઈશુના અનુયાયીઓને છાને છે? આ શું વાજબી વહેવાર છે? આ શું ન્યાય છે? આ શું સુધારો છે? આ સવાલોના જવાબને સારુ હું થોભી જઈ છું. આને તમારા અખભારમાં સમાવશો તે માટે આગળથી તમારો આભાર માની લઈ,

હું છું, ૧.  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

ઘિ નાતાલ એડવર્ટાઇઝર, ૨૩-૮-૧૯૬૩

## ૧૮. નવા ગવર્નરને આવકાર

ટાઉન હોલ,  
ડરબન,  
સપ્ટેમ્બર ૨૮, ૧૯૬૩

નેક નામદાર

સર વોલ્ટર હેલી-હિચિન્સન, કે.સી.એમ.જી., ૧.

આપ નેક નામદારની સેવામાં —

નેક નામદાર રાણી, હિદનાં શહેનશાહભાનુના પ્રતિનિધિ તરીકે આપ નામદાર આવી પહોંચો છો તે પ્રસંગે અમે, નીચે સહી કરનારા નાતાલ સંસ્થાનની મુસલમાન અને હિદી કોમના સભ્યો અત્યંત આદરપૂર્વક આપ નામદારને આવકારવાની રજા લઈએ છીએ.

અમને વિશ્વાસ છે કે આ સંસ્થાન એને તેની સાથેના સંબંધો આપ નામદારને અનુકૂળ થશે અને નાતાલમાં રાજવહીવટની નવી પલ્લતિ દાખલ કરવાનું કર્યું આપ નામદારને સારુ જેટલું રસભર્યું તેટલું મુશ્કેલી વગરનું નીવડ્યો.

નાતાલમાંની હિદી કોમનાં ખાસ કામકાજ અંહીં વિસ્તરતી જતી હિદી અસરને કારણે આપ નામદારનું હમેશા ધ્યાન રોકશે; આપ નામદારની રજાથી અમારી કોમને વિષે ઘટતો વિચાર કરવાની અમે વિનાંતી કરીએ છીએ અને નેક નામદાર શહેનશાહભાનુના પ્રતિનિધિ આપ નામદાર તે મંજૂર રાખશો એવો અમને વિશ્વાસ છે.

આ મુલકમાં આપનું રોકાવાનું થાય તે દરમિયાન આપ નામદારને અને લેડી હેલી-હિચિન્સનને બધી જાતની આબાદી ઈચ્છવાની અમે રજા લઈએ છીએ. અને અમે છીએ આપ નામદારના અત્યંત આજાંકિત સેવકો,

દાદા અબદુલ્લા

ઓમ. સી. કમરુદીન ..

આમદ તિલ્લી

એ. સી. પિલ્લે

દાઉદ મહમુદ

આમદ જીવા

પારસી રૂસ્તમજી

[મૂળ અંગ્રેજ]

ઘિ નાતાલ મકરૂરી, ૩૦-૮-૧૯૬૩

## ૧૬. હિંદીઓના મત

પ્રિટોરિયા,  
સપ્ટેમ્બર ૨૮, ૧૯૯૩

શ્રી તંત્રી  
બિ નાતાલ એંડ વર્ટાઇઝર  
સાહેબ,

નીચેનું લખાણ તમારા અભિભારમાં લેવાની મહેરબાની કરવા વિનંતી છે.

ચાલુ માસની ૧૮મી તારીખના તમારા પત્રના અંકમાં નવા સ્થપાનારા એશિયાઈ વિરોધી સંઘ[એન્ટિએશિયાટિક લીગ]ના તમે આંકેલા કાર્યક્રમનો જીણામાં જીણું વિગતે જવાબ આપવાનું કામ ભગીરથ હોઈ એક અંભબાર પરના પત્રની મર્યાદામાં સમાવવાનું માથે લેવા જેવું નથી. તેમ છતાં તમારી રજાથી તેમાંની બે જ બાબતોની ચર્ચા કરું: એક, “કુલીઓના મતોમાં યુરોપીયનોના મતો ઘસડાઈ જવાના” ડર વિષે અને બીજી, હિંદીઓની મત આપવાને લગતી માની લેવામાં આવેલી બિનલાયકતા વિષે.

શરૂઆતમાં હું તમારી ભલી લાગણી અને બ્રિટિશ રાણીના ચારિત્રયનું લક્ષણ મનાતી ન્યાય-પ્રિયતાને અપીલ કરું છું. તમે અગર તમારા વાચકો એ સ્વાવાની એક જ બાજુ તરફ જોવાનો નિશ્ચય કરી બેઠા હશો તો ગમે તેટલી હકીકતો અગર દલીલો મારા વિવેચનના વાજબીપણાની પ્રતીતિ તમને અગર તેમને નહીં કરાવી શકે. આખા સવાલને સાચી દૃષ્ટિ જોવાને શાંત ચિત્તથી નિર્ણય બાંધવાની શક્તિની અને રાગદ્રોષરહિત નિષ્પક્ષ ચકાસણીની અત્યંત આવશ્યકતા છે.

હિંદીઓના મત કોઈ કાળેયે યુરોપીયનોના મતોને ઘસડી જઈ શકે એવો જ્યાલ અત્યંત વધારે પડતો તાણીનૂંથીને બાંધીલો નથી. લાગતો? છેક ઉપર ઉપરથી પરિસ્થિતિ જોનાર પણ એવું કદી બને નહીં એમ જોઈ શકશો. યુરોપીયનોના મતો પર સરસાઈ મેળવવાને સર્મદ્ધ થવાને પૂરતી સંખ્યામાં હિંદીઓ મતાધિકાર મેળવવાને જરૂરી મિલકત ધરાવવાની લાયકાત સુધી કદી પહેંચી શકે એમ નથી.

એ લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે — વેપારીઓ અને મજૂરો. મજૂરો ધણી મોટી વધુમતીમાં છે અને તેમને સામાન્યપણે મત આપવાનો અધિકાર નથી. ગરીબીના માર્યા માંડ ખાવાનું મળી રહે તેટલી રોજ પર તેઓ નાતાલ આવે છે. મત આપવાના અધિકારને માટે જરૂરી મિલકત મેળવવાની તેઓ કદીયે આશા રાખી શકે ખરા કે? અને કંઈક કાયમનો વસવાટ કરીને રહેવાવાળા હોય તો એ લોકો છે. વેપારી પૈકી માત્ર કેટલાકની પાસે મતાધિકાર માટે જરૂરી મિલકતની લાયકાત છે; પણ, એ વર્ગના લોકો કાયમ નાતાલમાં વસવાટ કરીને રહેતા નથી, અને કાયદેસર મત આપી શકે એવામાંના ધણી મેત આપવાની ભાગ્યે જ પરવા રાખે છે. સામાન્યપણે ખુદ પોતાના મુલકમાં પણ હિંદીઓ કદી પોતાના બધા રાજકીય અધિકારોનો ઉપયોગ કરતા નથી. પોતાના આત્માનું કલ્યાણ કરવામાં તેઓ એટલા રચ્યાપચ્યા રહે છે કે રાજકારણમાં સહિય ભાગ લેવાનો વિચાર સરખો તેમને આવતો નથી. તેમને એવી ભારે રાજકીય મહત્વાકાંક્ષા પણ હોતી નથી. એ લોકો આહી રાજકીય કોત્રમાં કાર્ય કરવાને આવતા નથી પણ પ્રમાણિકપણે રોજ કમાવાને

આવે છે અને તેમનામાંના થોડા તંદુન પ્રમાણિકપણે રોજ નહીં મેળવતા હોય તો તે બીના દિલગીર થવા જેવી છે. એટલે હિંદીઓના મતનું પ્રમાણ નુકસાન કરી નાખવાની હદ સુધી વધી જય એવી બીક રાખવાની વાત પાયા વગરની છે.

અને હિંદીઓમાંના થોડા પાસે મત છે તે પણ કોઈ રીતે નાતાલના રાજકોણ પર અસર કરે એટલા નથી. હિંદીઓને માટે પ્રતિનિધિત્વ મેળવવાનું બુમરાણ મચાવનારા હિંદી પક્ષની બધી વાતો કાલ્પનિક હોઈ મિથ્યા છે કેમ કે પસંદગી આખરે બે ગોરાઓમાંથી એકની કરવાની રહે છે. એટલે થોડા હિંદીઓ પાસે મતનો અધિકાર છે તે વાતનું મહત્ત્વ જાંઝું ખરું કે? એ થોડા મતથી વધારેમાં વધારે એટલું થાય કે હિંદીઓને પૂરેપૂરો ગોરો પ્રતિનિધિ મળે અને તે પોતાના વચનને વફાદારીથી પાળે તો એસેમલી[પારાસભા]માં તેમને સારું કામ આપે. અને આવા એક કે બે સભ્ય મળીને હિંદી પક્ષની રચના કરે એ વાતની કલ્પના કરી જુઓ! અને, તેઓ અથવા ખરું પૂછો તો તે એક જણ પણ અરણ્યરુદ્ધન કરવાવાળો કોઈક જોન<sup>૧</sup> હદ્યપરિવર્તન કરવાની વીજળિક અથવા મારે કહેણું જેઈએ કે દિવ્ય શક્તિ વગરનો હશે. જુદાં જુદાં લઘુમતી હિતોનું પ્રતિનિધિત્વ ધરાવનારા મજબૂત નાના નાના પક્ષોનું પણ સામ્રાજ્યની પાર્વ-મેન્ટમાં જાંઝું કંઈ વળતું નથી. કોઈક પ્રધાનને એ પક્ષો બહુ તો થોડા આડાઅવળા સવાલો પૂછો મૂલ્યની કે હેરાન કરી શકે અને બીજા દિવસનાં સવારનાં છાપાંમાં- પોતાનાં નામ છાપાયેલાં જેવાનું સમાધાન લઈ શકે.

બીજનું, તમે એવું માનો છો કે તેઓ (હિંદીઓ) મત આપવાને. લાયક ગણ્ય તેટલા સુધરેલા નથી; અને સુધારાના દરજામાં યુરોપિયનોની સાથે બેસી શકે. એવા તો હરગિજ નથી. નહીં હોય, સંભવ. છે. પણ એ. વાતનો બધો આધાર તમે ‘સુધારો’ શબ્દનો અર્થ શો કરો તેના પર છે. આ બાબતની ચકાસણી કરવાની વાતમાંથી ઉભા થતા બધા સવાલોની પૂરી ચર્ચામાં ઉત્તરવાનું બની શકે એવું નથી. પણ એટલો નિર્દેશ કરવાનો હું રજ લઉં કે હિંદુસ્તાનમાં તેઓ આ અધિકારો ભોગવે છે. ૧૮૮૮ની સાલનો રાણીનો ઢંઢેરો જેને યોગ્ય અને સાચી રીતે હિંદીઓનો મેળના કાર્ટ [વહું હક્કનામું] કહેવામાં આવે છે તે આ પ્રમાણે છે :

અમારાં બીજાં બધાં પ્રજાજનોની સાથે ફરજનાં જે બંધનોથી અમે બંધાયેલાં છીએ તેવી ફરજનાં બંધનોથી અમારા હિંદુસ્તાનના પ્રદેશના વતનીઓ સાથે અમારી જતને અમે બંધાયેલી માનીએ છીએ અને સર્વસમર્થ ઈશ્વરની રહેમથી અમે એ ફરજે ધર્મબુદ્ધિથી અને વફાદારીથી આદા કરીશું. અને બની શકે ત્યાં સુધી ગમે તે જતિનાં અગર ગમે તે ધર્મનાં અમારાં પ્રજાજનોને પોતાની ડેળવણી, આવડત અને પ્રમાણિકતાથી જેની ફરજે બજાવવાની લાયકત હોય તેવી અમારી નોકરીઓમાંની જગ્યાઓ પર છૂટથી તેમ જ નિષ્પક્ષપણે બેવાની અમારી વધારાની ઈચ્છા છે.

હિંદીઓને વિષેના આવા બીજા ઉતારા પણ હું ટાંકી શકું. પણ તમારા સૌજન્યનો અન્યાર સુધીમાં મેં, વધારે પડતો ઉપયોગ કરી લીધાનો મને ઊર છે. એટલું જેકે ઉમેરી લઉં કે, એક હિંદીએ કલકત્તાની વડી આદાલતના હંગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું છે; સામાન્યપણે અહીંના હિંદી વેપારીઓ જેમના ધર્મબંધુઓ છે તેવા એક હિંદી અલ્લાહાબાદની વડી આદાલતના ન્યાયાધીશ છે; અને એક હિંદી બિટનની પાર્વમેન્ટમાં સભ્ય તરીકે બેસે છે. વળી, સોળમી

<sup>૧</sup>. ઈશુના પુરોગામી બેચિસ્ટ જેનનો ઉલ્લેખ છે.

સદીમાં થઈ ગયેલા અને હિંદમાં હકૂમત ચલાવી ગયેલા જે મહાન આકબરને પગલે હિંદુસ્તાનની વિટિશ સરકાર ઘણી બાબતોમાં ચાલે છે તે હિંદી હતો. આત્યારે હિંદુસ્તાનમાં જમીન ધારણ કરવાની અને જમાબંધીની જે પદ્ધતિ અમલમાં છે તે એક મોટા નાણાશાખી અને હિંદી ટોડર-મલે ચલાવેલી પદ્ધતિની જૂજ સુધારાવવારાવાળી નકલ છે. આ બધું સુધારાનું નહીં પણ અર્ધ-જંગલી દશાનું રૂંડું ફળ હોય તો સુધારાનો અર્થ હજી મારે શીખવાનો બાકી છે.

ઉપર જણાવેલી બધી હકીકતો તમારી સામે પડેલી હોવા છતાં અંદર અંદર વિખવાદ જગાડી કોમના યુરોપિયન વિભાગને હિંદી વિભાગની સામે કાર્ય કરવાને તમે ઉલ્લો કરી શકો તો તમે ખરેખર મહાન છો.

હું દું, ૧.  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

ઘિ નાતાલ એડવર્ટિઝર, ૩-૧૦-૧૯૮૩

## ૨૦. શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય

પ્રિટોરિયાથી એક અંગત પત્રમાં મિ. એમ. કે. ગાંધી લખે છે:

“એક શાકાહારી બાગબાનને સારુ કાર્ય કરવાને અહીં દક્ષિણ આદ્રિકામાં મજાનો અવકાશ છે. અહીંની જમીન અત્યાંત રસાળ હોવા છતાં જેનીની ઘણી ઉપેક્ષા થઈ છે.

“મને જણાવતાં આનંદ થાય છે કે અમારાં ધરેમાલિક જેઓ એક અંગ્રેજ બાનું છે તેમને શાકાહારી થવાનું સ્વીકારવાનું અને પોતાનાં બાળકોને શાકાહાર પર ઉછેરવાનું સમજવવામાં હું સફળ થયો છું, પણ મને બીક રહે છે કે તે પાછાં માંસાહાર પર લપસી જશે. જોઈએ તેવાં શાકભાજ અહીં મળતાં નથી. જે મળે છે તે બહુ મોંધાં પડે છે. ફંળ પણ ઘણાં મોંધાં છે; દૂધનું પણ એવું જ. તેથી એમને શાકાહારની વાનગીઓની પૂરતી વિવિધતા બતાવવાનું ઘણું કઠણ થાય છે. અને એ જો વધારે ખરચાળ જણાશો તો તો તેને ચોક્કસ છોડી દેશો.

“પ્રાણપોષક આહાર<sup>૧</sup> વિષેના મિ. હિલ્સના વેખમાં મને બહુ રસ પડ્યો. હું તરતમાં જ તેનો બીજો અખતરો કરવા ધારું છું. તમને યાદ હશે કે મુખીભાં હું હતો ત્યારે મે એનો અખતરો કરી જેયો હતો. પણ તેને વિષે અભિપ્રાય આપવાનો દાવો કરી શકાય એટલો લાંબો વખત તે ચાલ્યો નહોતો.

“આપણા બધા મિત્રોને મારું સમરણ કરાવવા વિનાંતી છે.”

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૩૦-૬-૧૯૮૩

૧. પ્રાણપોષક આહારના સિદ્ધાંતનું મૂળ પ્રતિંપાદન વેજિટેશિન સોસાયટી(શાકાહારી મંડળી)ના પ્રમુખ મિ. એ. એન્ડ. હિલ્સે ૧૯૮૮ની સાલના ફેબ્રુઆરી માસની ૪થી તારીખે થયેલી મંડળીની પહેલી ત્રિમાસી સભામાં કરેલું. પ્રાણશર્કિત, મૂર્તિ, સ્થૂર્યનાં કિરણો વગેરેનો કંઈક અશે ધ્યાન ખેંચે એવા સિદ્ધાંત તેમણે કંઈક વિસ્તારથી રલ્લું કરેલો. નીચે જણાવેલા આહારના પદાર્થોમાંથી એ બધાં મળે છે : ઇણો, અનાજ, કાળિલયાળાં કણ અને કણોળ, જે બધાં કાચાં લેવાનાં હોય. હિલ્સસ : ઘિ ફર્સ્ટ ડ્રેયેટ ઓફ પોરેડાઇન્સ (સ્વર્ગનો પહેલો આહાર). ગાંધીજીના ‘પ્રાણપોષક યોરાકના અખતરાને માટે આ પણનો લેખ જેવો.

## ૨૧. પ્રાણપોષક ખોરાકનો અભતરો

આને અભતરો કહી શકાય તો તેનું વર્ણન આપતાં પહેલાં મારે જણાવી બેનું જોઈએ કે મેં પ્રાણપોષક આહાર મુંબઈમાં એક અઠવાડિયા સુધી અજમાવી જેથો હતો; તે ગાળામાં મારા ધણા મિત્રોને ભોજન વગેરે માટે બોલાવવાનું થયેલું તેથી અને બીજાં કેટલાંક સામાજિક કારણોસર મારે તે છોડી દેવો પડેલો; તે વખતે મને પ્રાણપોષક ખોરાક ધણો માફક આવેલો; અને તે વખતે હું તે ચાલુ રાખી શક્યો હોત તો ધણો સંભવ છે કે મને ફાવી જત.

પ્રયોગ કરતો હતો તે દરમિયાન રોજ રોજ રાખેલી નોંધ હું આપું છું.

ઓગસ્ટ ૨૨, ૧૮૯૩. પ્રાણપોષક આહારના અભતરાની શરૂઆત કરી. પાછલા બે દિવસથી મને શરદી થઈ છે અને તેની થોડી આસર કાન પર પણ વરતાય છે. ભોજનના ટેબલ પર પીરસવાને માટે વપરાતા બે ચમચા ધઉના, એક વટાણાનો, એક ચોખાનો, બે સૂકી લાલ દ્રાક્ષના, આશરે વીસ જેટલાં નાનાં કાંછલિયાણાં ફળ, બે નારંગી, અને કોકોનો એક ખાલો એટલું સવારના નાસ્તામાં લીધું. કઠોળ અને અનાજ આગલી રાતે પલાળી રાખ્યાં હતાં. નાસ્તો રૂપ મિનિટમાં પૂરો કર્યો. સવારમાં ધણી સર્વોત્તમ જણાયેલી, સાંજે સુસ્તી લાગવા માંદેલી, અને સાથે થોડું માથું દુખેલું. ભોજનમાં રોટલી, શાક વગેરે હમેશની ચીજો હતી.

ઓગસ્ટ ૨૩મી. ભૂખ લાગવાથી રાત્રે થોડા વટાણા લીધેલા. તેથી ઊંઘ સારી ન આવી અને સવારે ઊઠયો ત્યારે મોહું બેસ્વાદ જણાયું. નાસ્તો અને ભોજન ગઈ કાલનાં જેવાં જ હતાં. આખો દિવસ વાદળાં ઘેરાયેલાં હતાં અને થોડો વરસાદ થયો છતાં મને માથાના દુખાવાની કે શરદીની આસર જણાઈ નહીં. બેકર<sup>૧</sup> સાથે ચા લીધી. તે બિલકુલ માફક ન આવી. પેટમાં દુખાવો થયો.

ઓગસ્ટ ૨૪મી. સવારે ઊઠતાં બેચેની જણાઈ અને પેટ ભારે લાગ્યું. સવારનો નાસ્તો પહેલાંના જેવો જ હતો; માત્ર વટાણા એક ચમચાને બદલે અર્ધો જ ચમચો લીધેલા. ભોજન રોજના જેનું જ. સારું ન લાગ્યું. આખો દિવસ આપચો થયો હોય એવી લાગણી થયા કરી.

ઓગસ્ટ ૨૫મી. સવારે ઊઠયો ત્યારે પેટમાં ભાર લાગતો હતો. દિવસ દરમિયાન પણ સારું ન લાગ્યું. ભોજનને માટે રુચિ નહોતી. છતાં લીધું તો ખરું. ગઈ કાલે ભોજનમાં વટાણા કાચા હતા. પેટમાં ભાર લાગવાનું કારણ કુદાચ એ હોય. દિવસ નમતાં માથું દુખું. ભોજન પછી થોડું કિવનાઈન લીધું. સવારનો નાસ્તો ગઈ કાલના જેવો જ.

ઓગસ્ટ ૨૬મી. સવારે ઊઠયો ત્યારે પેટ ભારે હતું. સવારના નાસ્તામાં અર્ધો ચમચો વટાણા, અર્ધો ચોખા, અર્ધો ધાઉં, અઢી ચમચા સૂકી લાલ દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. આખો દિવસ મોહું બેસ્વાદ રહ્યું. સારું પણ ન લાગ્યું. ભોજન હમેશના જેનું. સાંજે સાત પ્રાજ્યે એક નારંગી અને કોકોનો એક ખાલો લીધો. અત્યારે ભૂખ જેનું લાગે છે (આઠ વાગ્યે સાંજે) અને છતાં ખોલાની ઈચ્છા નથી. પ્રાણપોષક આહાર માફક આવતો લાગતો નથી.

૧. વકીલ અને ઉપદેશક, પ્રિસ્ટી ધર્મની ચર્ચા કરતારા અને પ્રિટારિયામાં પ્રિસ્ટી મિત્રોનો પરિચય કરાવી આપતારા ગાંધીજીના। મિત્ર એ. ડાલ્સ્ટ્યુ. બેકરનો ઉલ્લેખ છે.

ઓગસ્ટ ૨૭મી. સવારમાં કક્કિને ભૂખ લાગેલી પણ સારું લાગતું નહોતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ધઉંનો, બે મોટી સૂકી કાળી દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. (વટાણા અને ચોખા નથી એ ધ્યાનમાં રાખવા જેવું.) દિવસ નમતાં સારું લાગવા મંદેલું. કાલે સુસ્તી લાગવાનું કારણ કદાચ વટાણા ને ચોખા હોય. બપોરના એક વાગ્યે પલાળ્યા વગરના એક ચમચો ધઉં, એક ચમચો ભરીને કાળી દ્રાક્ષ, અને ચૌદ કાછલિયાળાં નાનાં ફળ એટલું લીધેલું. આમ હમેશના ભોજનને બદલે ગ્રાણપોષક આહાર આવ્યો. મિસ હેરિસને ત્યાં ચા લીધી (જેમાં રોટી, માખણ, મુરબ્બો અને કોકો એટલું હતું). આ ચા મને બહુ ભાવી અને મને થયું કે જાણે લાંબા ઉપવાસ પછી રોટી ને માખણ ખાઉં છું. ચા લીધા બાદ બહુ ભૂખ લાગી આવી અને નબળાઈ જણાઈ. તેથી ઘેર પાછો આવ્યો ત્યારે કોકોનો એક ખાલો અને એક નારંગી લીધા.

ઓગસ્ટ ૨૮મી. સવારમાં મોઢામાં સ્વાદ સારો નહોતો. દોઢ ચમચો ભરીને ધઉં, બે ચમચા સૂકી કાળી દ્રાક્ષ, વીસ કાછલિયાળાં ફળ, એક નારંગી અને કોકોનો એક ખાલો એટલાનો નાસ્તો કર્યો; ભૂખ જેવું અને નબળાઈ જેવું લાગતું હતું તે સિવાય તદ્દન સારું લાગતું હતું. મોઢું પણ સુધર્યું હતું.

ઓગસ્ટ ૨૯મી. સવારમાં ઊઠ્યો ત્યારે સારું હતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ધઉંનો, બે લાલ સૂકી દ્રાક્ષના, એક નારંગી, વીસ કાછલિયાળાં નાનાં ફળ, એટલું લીધું. ભોજનમાં ત્રણ ચમચા ભરીને ધઉં, બે બોર, વીસ કાછલિયાળાં ફળ અને બે નારંગી એટલું લીધું. સાંજે તૈયબને ત્યાં ભાત, સેવ અને બટાટાનું ભોજન લીધું. મોડી સાંજે અશક્તિ જણાયેલી.

ઓગસ્ટ ૩૦મી. સવારના નાસ્તામાં ધઉંના બે ચમચા, કાળી દ્રાક્ષના બે ચમચા, વીસ અખોડ અને એક નારંગી એટલું લીધું. ભોજનમાં પણ એ, એ, પણ સાથે વધારામાં એક નારંગી. અશક્તિ ખૂબ લાગી. હમેશની માફક ફરવા જવામાં થાક જણાયા વગર ન રહ્યો.

ઓગસ્ટ ૩૧મી. સવારે ઊઠ્યો ત્યારે મોઢું, ધાણું મીહું થઈ ગયેલું. અશક્તિ ધાણી લાગતી હતી. સવારના નાસ્તામાં અને ભોજનમાં આહારની વાનીઓનું પ્રમાણ એક જ હતું. સાંજે એક ખાલો કોકો અને એક નારંગી લીધાં. આખો દિવસ નબળાઈ ધાણી જ લાગી. ફરવા જવાનું પણ મુશ્કેલીથી થાય છે. દાંત પણ નબળા થતા જતા લાગે છે અને મોહું વધારે પડતું ગણ્યું થઈ ગયું છે.

સપ્ટેમ્બર ૧લી. સવારે ઊઠ્યો ત્યારે થાકીને લોથ થઈ ગયેલો. નાસ્તો ગઈ કાલના જેવો જ લીધો. ભોજન પણ તેવું જ. અશક્તિ ધાણી લાગે છે; દાંત દુખે છે; આ અભતરો છોડી દેવો પડ્યો. બેકરની વરસગાઈ હતી એટલે તેની સાથે ચા લીધી. ચા પછી સારું લાગ્યું.

સપ્ટેમ્બર ૨જી. સવારમાં તાજે થઈને ઊઠ્યો. (ગઈ કાલ સાંજની ચાની અસર). પહેલાંનો ખોરાક લીધો (જવની ધેંશ, રોટી, માખણ, મુરબ્બો). ધાણું જ સારું લાગ્યું.

આમ ગ્રાણપોષક આહારનો અભતરો પૂરો થયો.

વધારે અનુકૂળ સંઝેગોમાં પ્રયોગ નિષ્ફળ ન નીવડત. જ્યાં આપણો બધી વાત પર કાળું ન હોય અને વારંવાર ખોરાકમાં ફેરફાર કરવાનું ન બને એવી વીશી સફળતાથી ખોરાકના પ્રયોગ કરવાની જરૂરા ભાગ્યે જ કેખી શકાય. વળી તાજું લીલું ફળ જે મળી શકતું હતું તે એટલું સંતરું હતું એ ભીના પણ ધ્યાનમાં આવશે. ટ્રાન્સવાલમાં એ વખતે બીજાં ફળ મળતાં નહોતાં.

ટ્રાન્સવાલનો જમીન ઘણી ફળદૂપ હોવા છતાં ફળની જેતી તરફ કોઈનુંએ બિલકુલ ધ્યાન નથી એ ઘણું દિલગીર થવા જેવું છે. વળી મને દૂધ પણ મળતું નહોતું. તે આહી ઘણું મોદું મને છે. દક્ષિણ આફ્રિકામાં સાધારણ રીતે ડબાના દૂધનો [કન્ટેન્સડ મિલકનો] વપરાશ છે. તેથી પ્રાણપોષક આહારનું મૂલ્ય સાબિત કરવાની દૃષ્ટિથી આ પ્રયોગ તદ્દન નકારો છે એ વાત સ્વીકારવી જેઈએ. માત્ર અગિયાર દિવસ અને તે પણ પ્રતિકૂળ સંજોગમાં ચલાવેલા આખતરા પરથી પ્રાણપોષક ખોરાક પર કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપવા નીકળી પડવું એ કેવળ ધૂષ્ટતા કહેવાય. વીસ વરસથીએ વધારે વખત સુધી રંધેલા ખોરાકથી ટેવાયેલી હોજરી પાસે એકાઓક એકે સપાટે કાચો ખોરાક પચાવવાની અપેક્ષા રાખવી અત્યાંત વધારે પડતી ગણ્યાય અને છતાં મને લાગે છે કે એ આખતરાની પણ કંઈક કિમત છે. આવા આખતરા કરવા નીકળનારા બીજ જે લોકો તેમના તરફ તેમાં રહેલા ગુણોથી આકર્ષયા હોય પણ જેમની પાસે તેમને સફળ અંત સુધી લઈ જવાની શક્તિ, અથવા સાધન, અથવા સંજોગો, અથવા ધીરજ, અથવા જ્ઞાન ન હોય તેમને માટે તે માર્ગદર્શક થાય. મારે કબૂલ કરવું, જેઈએ કે મારામાં ઉપરની એક પણ લાયકાત નહોતી. પરિણામો પર આસ્તે આસ્તે ધ્યાન રાખવા જેટલી ધીરજ મારામાં નહોતી તેથી મેં મારા ખોરાકમાં એકાઓક અટપટ ફેરફાર કર્યા. શરૂઆતથી જ સવારના નાસ્તામાં પ્રાણપોષક આહારની વાનીઓ હતી અને ચાર કે પાંચ દિવસ માંડ-ગયા હશે કે ભોજનમાં પણ તે જ આહાર લેવા માંડયો. પ્રાણપોષક આહારના સિદ્ધાંત સાથેનો મારો પરિચય પણ ખરેખર ઘણો ઉપરછલો ગણ્યાય. મિ. હિલ્સનું લખેલું એક નાનકડું ચોપાનિયું અને તેમની કલમે લખાયેલા ‘ધિ વેજિટેરિયનમાં તાજેતરમાં આવેલા’ એક કે બે લેખ એટલી જ તે વિષયના મારા જ્ઞાનની સામગ્રી હતી. તેથી જે કોઈની પાસે જરૂરી લાયકાત ન હોય તે હું માનું છું નિષ્ફળતા વહોરી કે એટલું જ નહીં, જે કાર્યનો આભ્યાસ કરવાને અને આગળ વધારવાને કોશિશ કરે છે તેને અને પોતાની જતને પણ ‘નુકસાન કર્યા વગર ન રહે.

અને આખરે એકંદરે સાધારણ શાકાહારીને સારુ, જે શાકાહારી તંદુરસ્ત છે અને જેને પોતાના આહારથી સમાધાન છે તેને સારુ આવી પ્રવૃત્તિઓમાં ધ્યાન રોકવું લાભ કરનારું ખરું? જે નિષ્ણાતો આવા પ્રકારનાં સંયોધનોમાં પોતાનું જીવન સમર્પણ કરે છે તેમને સારુ તે છોડી દેવી વધારે સારી નહીં? જે શાકાહારી પોતાના આચારનો ધર્મ ભૂતદ્યાના મહાન આધાર પર રહ્યે છે, જે શાકાહારી પોતાના આહારને માટે પ્રાણીઓની કંતલ કરવી એ ખોટું છે, એરે, પાપ છે એમ માને છે તેમને ખાસ કરીને આ વાત લાગુ પડે છે. સામાન્ય શાકાહારનો સિદ્ધાંત અમલમાં મૂકી શકાય એવો છે, તે આરોગ્યને પોષક છે એ વાત રસ્તે ચાલતા માણસને પણ દેખાય એવી છે. તો પછી આપણને જેઈએ છે શું? પ્રાણપોષક આહારની ભવ્ય શક્યતાઓ ઘણી હશે; પણ તેના સેવનથી આપણાં નાશવંત શરીર અમર થોડાં જ થઈ જવાનાં છે? માણસોનો ઘણો મોટો ભાગ રંધ્વવાનું કદીયે સમૂળગું છોડી દે એ વાત બને એવી લાગતી નથી. પ્રાણપોષક ખોરાક એકલો પોતાની મેળે આત્માની ભૂખને સંતોષે નહીં, સંતોષી શકે નહીં. અને આ જીવનનો ઊંચામાં ઊંચ્યો ઉદ્દેશ, એરે તેનો એકમાત્ર આશય આત્માને ઓળખવાનો હોય તો મારું નમ્રપણે કહેવું છે કે આત્માને ઓળખવાને માટે આપણને મળેલા અવસરમાં ઘટાડો કરે તેવી બધી વાતોથી, અને તેથી પ્રાણપોષક આહારના અને એવા બીજા આખતરાઓની રમત કરવાથી પણ જીવનનો એકમાત્ર ઈંડ ઉદ્દેશ પાર પાડવાને મળેલી સંધિ તેટલા પૂરતી એળે જાય છે. જેનાં આપણે સૌ છીએ તેના પશને માટે જીવવાને આપણે આહાર લેવાનો હોય તો

તેની કુદરતને જેની સૂઝ છે અને જે મેળવવામાં નાહક લોહી રેખાય છે તેવો કોઈ પણ આહાર મેંમાં ન મૂકીએ એટલું પૂરનું નથી શું? પણ એ દિશામાંના મારા અભ્યાસની હું માત્ર શરૂઆત કરું છું ત્યારે આવી વાતો આટલેથી જ પૂરી કરું. અત્યારે તો એ અભતરો હું ચલાવતો હતો ત્યારે મારા મનમાં જે વિચારો રમતા હતા તે બીજાં કોઈ સમાન હેતુને કારણે સ્વજન જેવાં ભાઈ અગર બહેનને આમાં પોતાના વિચારનો પડ્યો ઉઠ્ઠો સંભળાય તેટલા ખાતર પ્રગટ કરું છું.

પ્રાણપોષક આહારનો અભતરો કરવાને હું તેની અત્યંત સરળતા જોઈને પ્રેરાયો હતો. રાંધવાની કડાકૂટમાંથી હું ધૂટીશ, મારે જ્યાં જવાનું થાય ત્યાં મારો ખોરાક સાથે લઈને ફરવાનું બની શકેશે, વીશીની માલિક બાઈ અને મને ખોરાક પૂરો પાડનાર સૌની અસ્વચ્છ આદતો મારે ચલાવી લેવાની રહેશે નહીં, દક્ષિણ આદ્રિકા જેવા મુલકમાં મુસાફરી કરતી વખતે પ્રાણપોષક ખોરાક બધી રીતે આદર્શ આહાર છે, એવાં તેનાં આકર્ષણો એટલાં બધાં હતાં કે હું તેમને વશ થઈ ગયો. પણ જે એક સ્વાર્થી હેતુ છે અને જે સર્વથી ચિયાતા હેતુની સરખામણીમાં કુટ્ટલોયે અધૂરો છે તેને પાર પાડવામાં વખતની અને મહેનતની કેવી બરબાદી! આવી બધી વાતોને સારુ જિંદગી બહુ ટૂંકી છે.

[મૂળ અંગ્રેજ]

ઘિ વેજિટેરિયન, ૨૪-૩-૧૯૮૪

## ૨૨. ઇંગ્લાંડમાં રહેતા હિંદીઓને

નીચે આપવામાં આવેલો પત્ર મિ. એમ. કે. ગાંધીએ ઇંગ્લાંડમાં રહેતા હિંદીઓમાં ફેરલ્યો છે અને ધાર્યું મોટું અંતર તેમને આપણાથી દૂર રાખનું હોવા છતાં ખુદ આપણી વચ્ચમાં તેમણે પ્રત્યક્ષ કાર્ય હજી પણ કેવું ચાલુ રાખ્યું છે તે બતાવવાને તે અમે આહી ઉતાર્યો છે. અને છતાં આપણા વિરોધીઓ કહે છે કે શાકાહારી હિંદીઓમાં “પ્રામાણિક જોન બુલ” [પ્રામાણિક બ્રિટિશ પ્રજા]નાં સંતાનો જેવી કામ યાર પાડવાની ચીવટ નથી! — તંત્રી વેજિ.

[પ્રિટોરિયા]

શ્રી તંત્રી

ઘિ વેજિટેરિયન

મારા વહાલા ભાઈ,

તમે શાકાહારી હો તો મને લાગે છે કે લંડને વેજિટેરિયન સોસાયટી[લંડનની શાકાહારી મંડળી]માં જેડાવાની અને હજી સુધી ન ભર્યું હોય તો લવાજમ ભરી ઘિ વેજિટેરિયનના ઘરાક બનવાની તમારી ફરજ છે.

તમારી આ ફરજ છે કેમ કે

(૧) તેમ કરવાથી તમે જે સિદ્ધાંતને માનો છો તેને મદદ થશે અને પ્રોત્સાહન મળશે.

(૨) જે મુલકમાં શાકાહારીઓની સંખ્યા બહુ નાની છે તેમાં તમારું કાર્ય એક શાકાહારી અને બીજા શાકાહારી વચ્ચે સહાનુભૂતિની જે ગાંડ હોવી જોઈએ તે દર્શાવનારું નીવડશે.

(૩) શાકાહારના પ્રચાર માટેની પ્રવૃત્તિ પરોક્ષ રીતે હિંદને રાજકીય દૃષ્ટિ પણ મદદરૂપ થશે કેમ કે અંગ્રેજ શાકાહારીઓ હિંદીઓની આકંક્ષાઓ, સાથે સહજ તત્પરતાથી સહાનુભૂતિમાં રહેશે (આ મારો અંગત અનુભવ છે).

ગા.-૫

(૪) કેવળ સ્વાર્થની દૃષ્ટિથી આ સવાલ વિચારથો તોપણ સમજશે કે તમારા કાઢ્યી તમને શાકાહારી મિત્રોનું મંડળ આવી મળશે, જે મિત્રો બીજાઓના કરતાં તમને વધારે સ્વીકાર્ય હશે.

(૫) જે મુલુકમાં તમારી સામે અનેક પ્રલોભનો આવીને ખડાં થાય છે અને જ્યાં ઘણા દાખલાઓમાં માણસો તેમની સામે ટકી શકયાં નથી તે મુલુકમાં શાકાહાર વિષેના સાહિત્યના જ્ઞાનથી તમે તમારા સિદ્ધાંતોના પાલનમાં દૂઢ રહી શકશો અને એ સોસાયટીમાં જોડાવાથી ને તેના પત્રના ધરાક બનવાથી જે શાકાહારી દાક્તરોને અને નિરામિષ દવાઓને તમે સહેલાઈથી ઓળખી શકશો તેમની તમે માંદગીમાં મદદ લઈ શકશો.

(૬) એથી હિંદમાંના તમારા જેવા ભાઈઓને ઘણી મદદ થશે. વિલાયતમાં શાકાહાર પર જીવી શકાય એમ છે કે નહીં તે બાબતમાં આપણાં માબાપોના મનમાં જે વહેમ હજી રહે છે તેને દૂર કરવામાં પણ એ સાધનરૂપ બનશે અને એ રીતે બીજા હિંદીઓનો વિલાયત આવવાનો રસ્તો ઘણો મોકળો થશે.

(૭). ચિ વેજિટેરિયનને પૂરતી સંખ્યામાં હિંદી ધરાક મળે તો તેના તંત્રીને એક પાનું અથવા એક કટાર હિંદ વિષે અલગ રાખવાને સમજવી શકશે અને તેથી, તમે પણ સ્વીકારશો કે, હિંદને લાભ થયા વગર નહીં રહે.

શાકાહારી મંડળીમાં તમારે શા સારુ જોડાવું જોઈએ અને ચિ વેજિટેરિયનના ધરાક શા સારુ થવું જોઈએ તે બતાવવાને બીજાં ઘણાં કારણો આપી શકાય, પણ મારી દરખાસ્તને અનુકૂળ રીતે વિચારવાને તમને સમજવવામાં આટલાં પૂરતાં થશે એવી મને આશા છે.

તમે શાકાહારી ન હો તોપણ જોઈ શકશો કે ઉપર ગણુવેલાંમાંનાં ઘણાં કારણો તમને પણ લાગુ પડશે; અને તેથી તમે ચિ વેજિટેરિયનનું લવાજમ ભરી તેના ગ્રાહક બની શકો અને કોને ખબર છે કે આખરે પોતાના જેવાં જ પ્રાણીઓના લોહી પર જે લોકો પોતાની હ્યાતીનો જરાયે આધાર નથી રાખતા તેમની હરોળમાં સામેલ થવાનો લહાવો લેવાનું તમને પણ મન નહીં થાય !

અલબન્ના, વિલાયતમાં મેન્ચેસ્ટર વેજિટેરિયન સોસાયટી પણ છે અને તે તેના પત્ર ચિ વેજિટેરિયન મેસેન્જર મારફતે કાર્ય કરે છે. મેં એલ. વી. એસ. [લાંડન વેજિટેરિયન સોસાયટી] અને તેના પત્રની હિમાયત એટલા પૂરતી જ કરી છે કે તે લાંડનમાં કાર્ય કરતી હોવાથી નજર સામે છે અને તેનું પત્ર અઠવાડિયે અઠવાડિયે નીકળો છે.

મને ચોક્કસ વિશ્વાસ છે કે મંડળીમાં જોડાવાની અને તેના પત્રના ધરાક થવાની વાતમાં તમે કરક્સરનું બહાનું નહીં કાઢો, કેમ કે મંડળીમાં જોડાવાને માટેની ફી અને પત્રનું લવાજમ ઘણું ઓછું છે અને તમારાં નાણાંનું અનેકગણું વધારે વળતર તે બન્ને મળીને અવશ્ય આપશે.

આને તમે તમારી વાતમાં મેં નાહક માથું માર્યું છે એવો અવિવેક નહીં જ માનો એવી, આશા રાખતો,

તમારો સ્નેહાંકિત ભાઈ  
મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજ]

ચિ વેજિટેરિયન, ૨૦-૪-૧૯૬૪

## ૨૩. શાકાહાર અને બાળકો

મિ. ઓમ. કે. ગાંધી એક અંગત પત્રમાં લખે છે:

“તાજેતરમાં રેવરન્ડ ઓન્ડયુ મરેના પ્રમુખપદે કેસ્ટિવક ખ્રિસ્તીઓનો એક ભવ્ય સમારંભ વેલિંટનમાં થયો હતો. કેટલાંક પ્રિય ખ્રિસ્તી મિત્રોની સંગાથે હું પણ તેમાં હાજર રહ્યો હતો; તેમનો એક છ સાત વર્ષનો બાળક છે. તે અરસામાં તે મારી સાથે એક દિવસ બહાર ફરવા નીકળ્યો. હું માત્ર તેની સાથે પ્રાણીઓ પર દ્યા રાખવા વિષે વાત કરતો હતો. તે વાતમાં અમે શાકાહારના સિદ્ધાંતની ચર્ચાએ ચડી ગયા. મને જણાવવામાં આવ્યું છે કે ત્યારથી તે બાળકે માંસ ખાધું નથી. ઉપર જણાવેલી વાતચીત અમારે થઈ તે પહેલાં ભોજનના ટેબલ પર કેવળ નિરામિષ વાનીઓ મને લેતો તે જોયા કરતો અને હું માંસ કેમ નથી ખાતો તે મને પૂછતો. તેનાં માબાપ જાતે શાકાહારી નથી છતાં શાકાહારના ગુણ સમજે છે અને તેમના બાળક સાથે તેની વાત હું કરું તેમાં વાંધો લેતાં નહોતાં.

“શાકાહારના મહાન સત્યની પ્રતીતિ બાળકોને કેટલી સહેલાઈથી કરાવી શકાય છે અને તેમનાં માબાપને ફેરફાર કરવાની સામે વાંધો ન હોય તો તેમને માંસ છોડી દેવાને કેટલી સહેલાઈથી સમજાવી શકાય છે તે બતાવવાને હું આ લખું છું. એ બાળક અને હું હવે ઘાડા મિત્રો બન્યા છીએ. હું તેને ઘણો ગમી ગયો હોઉં એવું લાગે છે.

“પંદરેક વરસની ઊમરનો બીજો છોકરો જેની સાથે મારે વાત થઈ તેણે મને કહ્યું કે હું કદી પક્ષીને મારતો નથી અથવા તેને હલાલ થતું જોઈ શકતો નથી પણ તે ખાવામાં મને વાંધો લાગતો નથી.”

[મુણ અંગ્રેજ]

ધ વેજિટેરિયન, ૫-૫-૧૯૮૪

## ૨૪. ધર્મ વિષે સવાલો

[ગાંધીજીને શ્રી રાજચંદ્ર રવજીભાઈ મહેતા ઉદ્દે રાયચંદ્રભાઈને વિષે ઘણો આદર હતો. તેઓ એક જેન તત્ત્વચિતક હતા અને સત્યના પ્રયોગો અથવા આત્મકથાના બીજા ભાગનું પહેલું પ્રકરણ આખું ગાંધીજીએ તેમને વિષે લખ્યું છે. ૧૯૮૪ની સાલના જૂન માસ પહેલાં પ્રિટોરિયાથી લખેલા પત્રમાં તેમણે રાયચંદ્રભાઈને ધર્મને લગતા કેટલાક સવાલ પૂછ્યા હતા. મુણ પત્રનો પત્રો અમે મેળવી શક્યા નથી તેથી ગાંધીજીએ પૂછેલા સવાલો રાયચંદ્રભાઈના ભાઈ શ્રી મનસુંખલાલ રવજીભાઈ મહેતાએ સંપાદિત કરેલા ગુજરાતી પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રની ૧૯૧૪ની આવૃત્તિમાં ૨૮૨ અને તે પછીનાં પાનાંઓ પર પ્રસિદ્ધ થયેલા રાયચંદ્રભાઈના જવાબમાંથી ઉત્તરવામાં આવ્યા છે. અસલ લખાણ બતાવે છે કે પુછાયેલા બીજા થોડા સવાલ છોડી દેવામાં આવ્યા છે અને તેથી તેમનું લખાણ મળી શકતું નથી.]

આત્મા શું છે? તે કંઈ કરે છે? અને તેને કર્મ નડે છે કે નહીં?  
 ઈશ્વર શું છે? તે જગતકર્તા છે એ ખરું છે?  
 મોક્ષ શું છે?  
 મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય?  
 એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરે  
 પણ થાય, જાડ પણ થાય; આ બરાબર છે?  
 આર્થ ધર્મ તે શું? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?  
 વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું?  
 ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી? જો તેમ હોય તો તેનો કંઈ પુરાવો?  
 પણ આદિના યત્થથી જરાય પુણ્ય છે ખરું?  
 જે ધર્મ ઉત્તામ છે એમ કહો, તેનો પુરાવો માણી શકાય ખરો કે?  
 ખ્રિસ્તી ધર્મ વિષે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો?  
 તેઓ એમ કહે છે: બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો  
 છે ને હતો.  
 જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે?  
 આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા  
 તેની?  
 પડી શકે તો કોને?  
 મોક્ષ પામેલાનાં નામ આપ આપો છો તે શા આધાર ઉપર? બુદ્ધદેવ પણ મોક્ષ નથી  
 પામ્યા એ શા ઉપરથી આપ કહો છો?  
 દુનિયાની છેવટ શી સ્થિતિ થશે?  
 આ અનીતિમાંથી સુનીતિ થશે ખરો?  
 દુનિયાનો પ્રલય છે?  
 અભાણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?  
 કૃષ્ણાવતાર એને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત્  
 ઈશ્વર હતા, કે તેના અંશ હતા? તેમને માનીને મોક્ષ ખરો?  
 „બ્રહ્મા, વિષણુ ને મહેશ્વર તે કોણું?  
 મને સર્વ કરડવા આવે ત્યારે તેને મારે કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજુ રીતે  
 દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.